

वार्षिक लयाजम रु. १५०/-

वर्ष : ४३मं
साटेम्बर - २०१८
अंक : ४८४

मंगल मंदिर ० साटेम्बर-२०१८ ० १
(कुल पाला : ८०)



मंगल मंदिर

श्री कच्छी जैन सेवा समाज - अमदावादनुं मासिक मुख्यपत्र

मिद्यामी
दक्षडम्

Happy
Janmashtami



क्षमा विरह्य भूषणम्
खागेन्मी सत्वे जीवा
सत्वे जीवा खमंतू मे,
मितती मे सत्वे भूषु
वेदं मण्डा न केणाइ



: मुख्य कार्यालय :


श्री कच्छी जैन सेवा समाज - अमदावाद
मातुश्री साकरबहेन रवजु मोरारजु लालन (कोठाय-सुभीमवाला)

श्री कच्छी जैन भवन

४३-४४, ब्राह्मण भिरमंडળ सोसायटी, पालडी, एलिसब्रीज, अमदावाद-३८० ००६
फोन : (079) 2657 8892, 2658 1501, 2657 9469 फैक्स : (079) 2658 2060
Email : kjssmangalmmandir@gmail.com • website : www.kuthijainahd.org

A  initiative

"KIDS ALWAYS WANTED TO BECOME PILOTS, NEVER PARROTS"



E-LEARNING PRODUCT FOR
GUJARAT STATE BOARD
&
CBSE BOARD
Class 1 to 10

CIN : U72200MH2008PTC181531

* Conditions apply



Syllabus based Content
in 2D & 3D animation
for each chapter



Artificial intelligence
based Assessment
Software



Detailed based
Analytics Report



Available : Online / Offline

Pendrive for video
SD card for android

Stop mugging,start learning



TOPScorer App

24 x 7 Usage on TOPScorer App

Toll Free Number:

1800 266 6676




www.facebook.com/topscorer.com

Available on HIRE

- Gas Engine Driven Generators
Range : 50 KVA to 10 Mega Watts
- Gas Engine Driven Gas Compressors
Range : 10 HP to 8000 HP
- Oil & Gas Processing Equipments Readily Available
- Work Over Rig 100 Ton, 50 Ton & 30 Ton Capacity
- 120 kg/cm² Air Compressors

We Provide

- Complete equipment Readily Available
- Spare Parts
- Operation & Maintenance
- Engineering Consultancy



Corporate Office :

Deep Industries Limited

6th Floor, N.G. Tower, Opp. Fun Republic Cinema,

S.G. Highway, Ahmedabad - 380 015.

Tel # 91-79-26862076/78

Fax # 91-79-26862077

Registered Office :

Deep Industries Limited

Opp. Suryanarayan Bunglows,

State Highway, Motera,

Dist. Gandhinagar.

Phone # 91-79-27571128

Fax # 91-79-27502464

Email info@deepindustries.com



આપના ગૃહપુસ્તકાલય માટે વિવિધ ઈનામવિજેતા પુસ્તકો

નવલક્ષ્ય


| | | |
|--------------------|------------------------------|-----|
| અકૂપાર | ધૂવ ભડુ | 250 |
| એક ડાળ મીઠી | ધીરુબહેન પટેલ | 250 |
| છાવણી | ધીરેન્દ્ર મહેતા | 150 |
| રાજગઢી | રમચંદ્ર પટેલ | 200 |
| ભીતર પ્રગટ્યા દીવા | બકુલ દવે | 200 |
| વડમામી | અમૃત કે. બારોટ | 125 |
| મૂળિયાં અને પાંખો | રેમંડ આર. પરમાર | 150 |
| દ્રેન દુઃપાકિસ્તાન | ખુશવંતસિંહ, અનુ. જ્યે મકવાણા | 350 |

નવલિકાસંગ્રહો

| | | |
|------------------------|------------------|-----|
| અસારે ખલુ સંસારે | વિજય શાસ્ત્રી | 35 |
| હારોહાર | ઉજભશી પરમાર | 170 |
| ખાલી ફેમ | કંઈર્પ. ટેસાઈ | 110 |
| હાઈટ હોર્સ | સુધીર દલાલ | 90 |
| હું મજાની બિસકોલી | સ્રિમતા ભાગવત | 110 |
| ફરી પાછા પૃથ્વી પર | પ્રાગછભાઈ ભાંભી | 100 |
| અંતિમ ગાન | અનુ. અનિલા દલાલ | 170 |
| શ્રેષ્ઠ ઉદ્ઘાય વાર્તાઓ | અનુ. રેણુકા સોની | 100 |

લેખસંગ્રહો

| | | |
|--------------------------|---------------------|-----|
| વ્યક્તિગતર | શાધર વાલેસ | 100 |
| આવકાર | મોહમ્મદ માંકડ | 110 |
| શ્રીકૃષ્ણલીલારહસ્ય | સ્વામી સચ્ચિદાનંદ | 200 |
| જિંદગી ના મિલેજી દોબારા | રોહિત શાહ | 100 |
| માણસાઈની કેળવણી | મનસુખ સલ્લા | 160 |
| સંતાન સ્કૂલમાં અને ઘરમાં | ઉર્મિલા શાહ | 160 |
| ગીતા નવનીતમ્ | સ્વામી અધ્યાત્માનંદ | 125 |



હાસ્યસાહિત્ય

| | | |
|-----------------------------|---------------------|-----|
| એન્જોયગારી | રતિલાલ બોરીસાગર | 70 |
| ફાઈ અશ્વર હાસ્યકા | નિરંજન નિવેદી | 60 |
| ગાંધીજી, ચેલિન અને હું | જ્યંતિ પટેલ 'રંગલો' | 125 |
| હાસ્યકલરવ | પ્રદ્યુમન આચાર્ય | 100 |
| વાચક ક્યાંય નથી ગ્રંથાલયમાં | કિશોર અંધારિયા | 125 |

આત્મકથા/જીવનચરિત્રસાહિત્ય

| | | |
|--------------------|-------------------|-----|
| મારા અનુભવો | સ્વામી સચ્ચિદાનંદ | 100 |
| તુલસીક્યારાના દીવા | મનસુખ સલ્લા | 130 |
| ધરાનાં ખમીર | શિવદાન ગઢવી | 140 |
| જિલ્સીની ડાયરી | કેટન નરેન્દ્ર | 350 |

બાળ-કિશોર સાહિત્ય

| | | |
|--|------------------|-----|
| જીવનઘડતરની વાતો (પુ. ૪) | ધૂમકેતુ | 120 |
| અપંગનાં ઓજસ | કુમારપાળ દેસાઈ | 125 |
| અપંગ નહિ અશક્ત (પુ. ૫) | યશવંત મહેતા | 150 |
| મોટા જ્યારે હતા નાના : પુ. ૫ | યશવંત મહેતા | 375 |
| સોનાનો પુડલો | શ્રદ્ધા નિવેદી | 60 |
| ગ્રામવિકાસ કથામાળા ૧-૪ | પીતાંબર પટેલ | 90 |
| ચંબલના કોતરોમાં | સુભદ્રા ગાંધી | 25 |
| શિશુ અભિવાદન ગ્રંથાવલિ પુ. ૫ક્ષેયાલાલ જોશી | 200 | |
| અંદેરીંગારે પુ. ૫ | રતિલાલ સાં. નાયક | 250 |
| દીવાથી પ્રગટે દીવા (બાળનાટકો) | પ્રકાશ લાલા | 100 |
| જિશાસા અને કોતુક ૧-૫ | હરસુખ થાનકી | 200 |
| શાન્દિજિશાસા શ્રેણી પુ. ૧૩ | રશ્મિન મહેતા | 360 |
| ભારતરાન વિકમ સારાભાઈ | ઉષાબહેન જોશી | 70 |
| અમૃતની પરબ ૧-૫ | દેવીબહેન મહેતા | 200 |
| બાપુના જીવનમાંથી (પુ. ૪) | મનુબહેન ગાંધી | 120 |
| કિશોર ચરિત્રમાળા ભા. ૧થી ૫ | અશોક હર્ષ | 550 |



ગુર્જર
ગ્રંથરળન
કાર્યાલય

ગુર્જર સાહિત્યભવન

રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ - 380 001

ફોન : 079-22144663.

e-mail : goorjar@yahoo.com

ગુર્જર સાહિત્ય પ્રકાશન

102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, થાઈટેનિયમ સ્ટીલેસેન્ટર પાસે, સીમા હોલની સામે,
100 ફૂટ રોડ, પ્રદ્યુમનાનગર, અમદાવાદ-15 ફોન : 26934340, મો. 9825268759

ઈમેલ : gurjarprakashan@gmail.com

છેલવા છુર વર્ષથી દર મહિનાની પ તારીખે
નિયમિતપણે પોસ્ટ કરવામાં આવતું
“શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ”નું
મુખ્યપત્ર

“મંગલ મંદિર”

મુખ્ય કાર્યાલય

શ્રી કચ્છી જૈન ભવન,
૪૩-૪૪, શ્રી પ્રાણા મિત્રમંડળ સોસાયટી,
પાલડી, એલિસાબિલ્ડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૬.
ફોન : (૦૯૬) ૨૬૫૭૮૮૨૨, ૨૬૫૮૧૫૦૧
ફેક્સ : (૦૯૬) ૨૬૫૮૨૦૬૦
ઈ-મેઇલ : kutchijainam@gmail.com
વેબ-સાઇટ : www.kutchijainahd.org

તંત્રી

પ્રતાપ નારાણાજી દંડ

અંકુમાં પ્રસિધ્ય થયેલ લેખો તથા અન્ય
વિભાગની માહિતીઓ સાથે તંત્રીમંડળ
સહમત છે તેમ માની લેટું જરૂરી નથી. રજૂ
થયેલ વિચારો જે તે વ્યક્તિના હોય છે, તેની
નાંખ લેવા વિનંતી.

લેખકોને નામ વિનંતી

‘મંગલ મંદિર’માં પ્રગાટ કરવા
માટે વિપુલ પ્રમાણમાં લેખ સામગ્રી
અમને મળતી રહે છે અને એટલે
સ્વીકૃત ફુતિઓને પ્રગાટ કરવાનું પણ
સ્વાભાવિક રીતે વિતંબાય. મંગલ
મંદિરના ધોરણાને ધ્યાનમાં લઈ,
પોતાની રચના મોકલતી વખતે લેખક
સ્વવિવેક દાખવે તેવી વિનંતી છે.

એક સાથે એકથી વધુ ફુતિઓ
ન મોકલવા વિનંતી.

ભાષાદોષ અને લાંબા લેખો
અસ્વીકાર્ય બનશે તેની નાંખ લેવા
વિનંતી. લેખમાં એકની એક વાતમાં
પુનરાવર્તન (રિપેટેશન) ટાપું
જરૂરી છે. ફુતિની છસ્તપ્રત સ્વચ્છ
અને સુવાચ્ય હોવી જોઈએ. આશા
છે કે, આ બાબતમાં લેખક મિત્રોનો
સહકાર અમને મળી રહેશે.

- મુખ્યપત્ર

આનુક્રમણિકા

તંત્રી લેખ :

- જૈન ધર્મમાં વિશ્વધર્મ બનવાની ક્ષમતા છે ૭
- આગામી કાર્યક્રમોની એક ઝલક ૮

લેખ વિભાગ

કચ્છની રસધાર

- રા'ની રોજરી દુલેરાય કારાણી ૯

કચ્છી કથા

- પૂજો શેઠ સ્વામી સચિદાનંદ ૧૨

ધારાવાહિક નવલકથા

- છોરાંવધોર - (૨૩)
લગ્ન વખતે બાળકોની યાદ હંસરાજ સાંખા ૧૫

કચ્છ વિશોષ

- કચ્છને જાણો અને માણો નિશાંક્ર જગ્યાલન શાહ (ભૂ)

કચ્છી કલા

- બશીના સિણીયાંડો ગામના મડવર્કના નમૂના
‘એમેઝોન’ આંતરરાષ્ટ્રીય સ્તરે વેચે છે ૧૮

વાત્ર

- રષા માયજુ મહેશરી ૧૯
- એક છેલ્લી વિનંતી અર્જુનસિંહ કે. રાઉલજી ૨૧
- કિંદળનો નિયોડ ગુલાબચંદ ડી. સાવલા ૨૩
- કેમ છો માસ્તર સાહેબ? ભાસ્કરભાઈ ભાવસાર ૨૫

પ્રેરક કથા

- પાંપણના પ્રદેશમાં ડૉ. શરદ ટાકર ૨૭

ચિંતન

- ગુનો અને ગરીબી ડૉ. ગુણવંત શાહ ૨૮
- વૃદ્ધાશ્રમો કેમ વધે છે? રણાંદો શાહ ૩૧
- વરિષ્ઠ નાગરિક : જૂની અંખે નવા તમાશા દિનકર જોખી ૩૩
- અંધારાં ઉલેચાવાં શાંતિલાલ ગઢિયા ૩૬
- આ નિશંકુ પરિસ્થિતિમાં તમે હો તો શું કરો?
॥ નૈતિક ધર્મસંકટ ॥ ભરત‘કુમાર’ પ્રા. ટાકર ૩૭
- જગ્યો ભાઈઓ જગ્યો : સફળ જીવન પ્રાપ્ત કરો મહાવીરસિંહ શેખાવત ૩૮
- યુવાનોને સંદેશ વિજયભાઈ પટેલ ૩૯

મંદિર

- ન્યાયિક સક્રિયતા : વાસ્તવિક મૂલ્યાંકન ડૉ. કમલેશ પી. જોશીપુરા ૪૧

| | |
|--|---|
| <p>શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના “પદાધિકારીશ્રીઓ”</p> <p>મેળજિંગ ટ્રસ્ટી શ્રી પ્રતાપ નારાણજી દંડ ઘર : ૦૯૮- ૨૬૪૦૫૦૪૭ મો. ૯૮૨૬૭ ૨૫૬૧૮</p> <p>ઉપમુખ-૧ શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહ ઘર : ૨૬૪૪ ૬૪૧૩, ઓ. ૨૬૪૦ ૧૧૫૦ મો. ૯૮૨૫૦ ૩૧૫૨૮</p> <p>ઉપમુખ-૨ શ્રી શાંતિલાલ મુળજી સાવલા ઘર : (૦૨૭૧૭) ૨૩૪૪૫૫ મો. ૯૮૨૫૦ ૪૮૬૪૫</p> <p>માનદ મંગી શ્રી હસમુખ બાબુભાઈ શાહ (ખાંડવાલા) ઘર : ૨૬૪૦૩૪૪૮, ઓ. : ૨૬૪૦૫૪૫૩ મો. ૯૮૨૫૦ ૪૦૬૬૬</p> <p>સહંમંગી શ્રી પ્રદીપ સૂરજલાલ મહેતા ઘર : ૨૬૬૧૨૦૮૮ મો. ૯૮૨૫૦ ૬૧૧૬૦</p> <p>ખજાનચી શ્રી ચંદ્રકાંત દામજી શાહ ઘર : ૨૬૪૦૫૨૪૨</p> <p>સહુ ખજાનચી શ્રી રમણિકલાલ કુંવરજી ગોસર ઘર : ૨૬૬૫૦૨૮૮, મો. ૯૮૨૮૩ ૫૧૩૯૦</p> <p>શ્રી કચ્છી વિશ્વામ ગૃહનં સરનામું : શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત શ્રી કચ્છી વિશ્વામ ગૃહ અર્થિતનગર દોસરની સામે, ગાંધી વિદ્યાલયની ગલીમાં, દરના સ્કૂલની પાછળ, રાજ્યસ્થાન હોસ્પિટલ પાસે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : ૦૯૮-૨૮૮૪૫૪૭</p> <p>સેવા ભવનનં સરનામું : શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત માતુશ્રી કંકુલાલ કાળજીભાઈ રવજી (નાની ખાખરવાળા) સેવા ભવન, એસ. ટી સ્ટેન્ડ પાસે, સાટકાર ગેસ્ટ હાઉસની તામે, રંગનાથપુરા, અમદાવાદ-૩૮૦ ૦૨૨. ફોન : ૦૯૮-૨૪૪૬૧૨૭૦</p> <p>‘મંગલ મંદિર’ના અંકો સમાજની વેબસાઈટ www.kutchhijainahd.org ઉપર... ઉપરિાંસ્ટ... www.hellokutchis.com ઉપર વાંચી શકાય છે.</p> | <p>સંસાર</p> <ul style="list-style-type: none"> ● પ્રેમ અને સંકોચ..... જયવદન પટેલ ૪૩ <p>વિવિધ</p> <ul style="list-style-type: none"> ● એક રલાસ દૂધ! સંકલન : અરુણ શાહ ૪૫ <p>સંસ્કૃતિ</p> <ul style="list-style-type: none"> ● દ્વારકાનાં નવા સંશોધનો નરોતામ પલાણ ૪૬ <p>ધર્મ સંસ્કાર</p> <ul style="list-style-type: none"> ● ઘર અને ઘરની નારીને બચાવી લો શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ ૪૮ <p>સમાજ સિંતન</p> <ul style="list-style-type: none"> ● સંબંધનું સાફિલ્ય ઇલા કે. શાહ ૫૦ <p>આરોગ્ય</p> <ul style="list-style-type: none"> ● માનસિક સ્ટ્રેસની શરીર પર અસર. ડૉ. મહિલાલ ગડા, ડૉ. દિપી શાહ (ગડા) ૫૨ ● ડોક્ટરનો ઈલાજ કરનારા બાળદર્દીઓ રદ્દા મનીઆર ૫૪ ● કોષ : નિવારણ રોહન પટેલ ૫૬ <p>ઓષ્ઠધ</p> <ul style="list-style-type: none"> ● સરગવો વૈધ નિપુણ પી. ભૂય ૫૭ <p>સંસ્થા પરિચય</p> <ul style="list-style-type: none"> ● ગુંડાલાનું ‘વડીલ વંદના’ : પરિચય અને અનુભવ જેટાલાલ વી. ગંગાર ‘મંગલમ’ ૬૦ <p>નિયમિત વિભાગો</p> <ul style="list-style-type: none"> ● બાલું જ્યું ગાલિયું ગુલાબચંદ ધારશી રાંભિયા ૬૨ ● <i>Nano Nine</i> શેફ્ટ ૨મત-૧૪૪ સંકલન : રજીનીકાંત પારેખ ૬૩ ● <i>Nano Nine Sudoku</i> (કમાંક : ૧૧૦૧) સંકલન : રજીનીકાંત પારેખ ૬૫ ● જાણવા જેવું સંકલન : રજીનીકાંત પારેખ ૬૬ ● વલોવતન સંકલન : દિનેશચંદ્ર જગ્યાવન શાહ ૬૮ ● સમાજ દર્પણ ૬૯ ● સંસ્થા સમાચાર ૬૯ ● ઉડતી નજરે ૭૦ |
|--|---|

તંત્રી લેખ



જૈન ધર્મમાં વિશ્વધર્મ બનવાની ક્ષમતા છે

જગતના ધર્મોમાં સૌથી જૂના અને સૌથી વ્યાપક વિચાર સમૃદ્ધિવાળા બે જ ધર્મ છે : જૈન ધર્મ અને સનાતન હિંદુ ધર્મ. કેટલાક સંશોધકો જૈન ધર્મને સનાતન ધર્મની જ સુધારેલી આવૃત્તિ માને છે. બેઉમાં ઘણું સાચ્ય પણ છે. પરંતુ કેટલીક બાબતોમાં જૈન ધર્મ એકદમ અલગ તરી આવે છે. જૈન ધર્મમાં ‘અનેકાન્તવાદ’ – સ્યાદ્વાદનો સિદ્ધાંત છે. ફક્ત આપણે માનીએ એ જ સાચું, એવો દુરાગ્રહ નહીં. સામા માણસની વાત પણ સાચી હોઈ શકે. બધા જ ધર્મ સંપ્રદાય આખરે તો સત્યનો જ પુરસ્કાર કરે છે, નીતિની જ વાત કરે છે. એટલે જૈન ધર્મ તમામનો સ્વીકાર કરે છે. અમે અમારી રીતે સાચા છીએ, પણ તમે પણ તમારી રીતે સાચા હોઈ શકો. જૈન ધર્મમાં અહિસા અને ક્ષમાનો મહિમા છે. અહિસાની એટલી સૂક્ષ્મતાપૂર્વક છણાવટ જૈન ધર્મમાં સાંપડે છે એટલી અન્ય કોઈ જ ધર્મ સંપ્રદાયમાં નથી મળતી. સૂક્ષ્મતાસૂક્ષ્મ જીવોની આ ધર્મ ખેવના કરે છે. એની ચરમસીમા તો એ છે કે ધર્મચાર્યો અને મુનિઓ પ્રવચન માટે માઈકનો ઉપયોગ નથી કરતા. ટેલિફોન પર વાત કરવાનું ટાળે છે. પંખાનો ઉપયોગ વજ્ય ગણે છે. વીજળીક ઉપકરણોથી વેગળા રહે છે. ક્ષમાપના એ પર્યુષણ મહાપર્વનું હાઈ છે. ‘મિશ્રભિ દુક્કડમ્’ – દુઃખદાયક એવું કંઈ પણ બોટ્યાચાલ્યા હોઈએ તો બહુ જ નપ્રતાપૂર્વક એકમેકની ક્ષમા માગી લેવી. પોતાને દુઃખ પહોંચાડનારને ક્ષમા આપવી અને તે પણ એના પર ઉપકાર કરી રહ્યા છીએ એવા અહેસાસ વગર. ક્ષમા વીરનું ભૂષણ ગણાયેલ છે. કાયર માનવી કોઈને ક્ષમા કરે તો તે એની મજબૂરી છે. ભગવાન મહાવીરે એમને કારમી પીડા પહોંચાડનારા તમામને કરુણાસભર ક્ષમા આપી હતી. એમણે કાનમાં ખીલા ઠોકનારથી લઈ ચંડ કૌશિક નાગ સુધ્યાંને સહજ અને સ્વસ્થ રહી માફ કરી દીધા હતા.

પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહી અનું ગૌરવ કરાયું છે તે સર્વથા ઉચિત છે. ચાતુર્માસની મધ્યમાં આવતા આ મહાપર્વ નિમિત્તે જૈન શ્રાવકો અણ્ણાઈ તપ કરે છે. સાધુ ભગવંતોનાં ઠેર ઠેર પ્રવચનો યોજાય છે. જૈન ધર્મના સિદ્ધાંતો અને આગમોની ચર્ચા થાય છે. કાળચકના ભાગરૂપે ચોમાસાની ઝતુ વિશ્વાંતિની ઝતુ છે, તપની ઝતુ છે. એક રીતે એ ઈશ્વરીય કરુણાની ઝતુ છે. વરસાદ થતાં સૃષ્ટિમાં ચેતનાનો સંચાર થાય છે. ત્યારે લીમાં તૃણાંકુરોને પણ પીડા ન પહોંચે એટલો ખ્યાલ રાખી ચાલવાનું હોય છે. સંતો સ્થિરતા કરે છે અને ધર્મની પ્રભાવના વધારતાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપે છે.

અહિસા, ક્ષમા અને અનેકાન્તવાદના ત્રિવેણી સંગમ સમો જૈન ધર્મ જગતના અન્ય તમામ ધર્મો કરતાં ચારિયાતો એ કારણસર છે કે તે જીવ માત્રને જીવવાનો અધિકાર આપે છે અને માનવી એના મનુષ્ય જન્મમાં જ ભગવાનનું પદ પામી શકે છે એવી અવધારણા ધરાવે છે. વિશ્વનો બીજો કોઈ ધર્મ મનુષ્યને આ કક્ષાએ ઊંચકી શક્યો નથી.

જૈન ધર્મના સિદ્ધાંત મુજબ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ધર્મની આરાધના કરીએ તે સાથે જગતના સર્વ જીવોની ખરા અંતઃકરણપૂર્વક ક્ષમા માંગીએ અને ક્ષમા બક્ષીએ.

વિશ્વના સર્વે જીવોને “મિશ્રભિ દુક્કડમ્.”



આગામી કાર્યક્રમોની ઓક જલક....

| તારીખ - સમય | સ્થળ | કાર્યક્રમ - આયોજનકર્તા | કાર્યક્રમની વિગત |
|--|---|--|---|
| ● રવિવાર, તા. ૨૩-૯-૨૦૧૮ સવારે ૬.૩૦ થી ૧.૦૦ | ટાગોર હોલ, પાલડી | શ્રી કંઠી જૈન સેવા સમાજ - અમદાવાદ | વાર્ષિક સેહ ભિલન, ક્ષમાપના તથા સ્વામિવાત્સલ્યનો કાર્યક્રમ |
| ● રવિવાર, તા. ૨૩-૯-૨૦૧૮ | ટાગોર હોલ, પાલડી | યુવા વિકાસ સમિતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ | મનોરંજન કાર્યક્રમ. |
| ● રવિવાર, તા. ૨૩-૯-૨૦૧૮ | ટાગોર હોલ, પાલડી | મહિલા ઉત્કર્ષ સમિતિ | બાહેનો માટે મેમોગ્રાફી ટેસ્ટ રજિસ્ટ્રેશન કેન્દ્ર. |
| ● સોમવાર, તા. ૧-૧૦-૨૦૧૮થી સોમવાર, તા. ૧૫-૧૦-૨૦૧૮ રોજ સવારે ૬.૩૦થી ૭.૩૦ | શ્રી કંઠી જૈન ભવન - પાલડી | શ્રી કંઠી જૈન સેવા સમાજ - અમદાવાદ | વિનામૂલ્યે યોગ શિબિર |
| ● મંગળવાર, તા. ૨-૧૦-૨૦૧૮થી (ત્રણ મહિના માટે) | નવનીત ભવન આવાસ યોજના, બહેરામપુરા, અમદાવાદ | શ્રી કંઠી જૈન સેવા સમાજ - અમદાવાદ | બાહેનો માટે વિનામૂલ્યે સીલાઈ તાલીમ (સર્ટિફિકેટ કોર્સ) |
| ● બુધવાર, તા. ૩-૧૦-૨૦૧૮ ગુરુવાર, તા. ૪-૧૦-૨૦૧૮ | બેક્સ સ્ટુડિયો By હેના શાહ ૫, કેમ્પસ કોર્નર-૧, સેલ્સ ઇન્ડિયાની સામે, પ્રહલાદ નગર. | મહિલા ઉત્કર્ષ સમિતિ | લેટેસ્ટ વાનગીઓનું ડેમોન્સ્ટ્રેશન હેલ્સી બેકિંગ (Healthy Baking) (રજિસ્ટ્રેશન સ્વામિવાત્સલ્યના ટિવસે કરાવું જરૂરી) |
| ● તા. ૧૧-૧૨-૨૦૧૮થી તા. ૨૨-૧૨-૨૦૧૮ | શિખરજી, પંચતીર્થી ભાગલપુર, બનારસ | યુવા વિકાસ સમિતિ | સમેત શિખરજીની યાત્રાનું આયોજન. |
| ● દર મહિનાના બીજા રવિવારે સવારે ૬ થી ૧૨ | શ્રી કંઠી જૈન ભવન - પાલડી | શિક્ષણ તથા સર્વાંગી વિકાસ સમિતિ | કરિયર કાઉન્સેલર પ્રો. જ્યરાજ પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી કરિયર કાઉન્સેલિંગ |

પ્રભુનો પત્ર

પરમદ્વાપાણું પરમાત્માએ સ્વર્ગમાંથી સૂચિ પરનાં માનવને એક પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે, “હે વહાલા માનવ... તારી દરેકે દરેક હિલચાલ પર મારી નજર છે! હું સદાય તારી સાથે જ હોઈ છું. તારો ધબકાર એ જ હું! તું મને જ્યાં શોધે છે ત્યાં હું નથી. મને હુઃખ તો એ વાતનું છે કે મારો જ સહારો લઈને તે મારા નામનો વ્યાપાર ચાલુ કર્યો. જો કે મેં મારા પ્રચાર માટે કોઈ અધિકૃત એજન્ટ નીચ્યો નથી. તને માફક આવ્યું તેવું મંદિર બનાવીને તે ને મૂર્તિ કે પદ્ધી છબીમાં કેદ કરી દીધો. સમગ્ર સૂચિનું સંચાલન કરતો એવો હું તારા છાપનભોગ કરતા વધારે તારી લાગણી, તારો પ્રેમ, સ્નેહ, ભાવનાનો ભૂખ્યો છું! તું જ્યારે પણ મારા મંદિરમાં આવે છે, ત્યારે તું ફક્ત યાચક બનીને જ શા માટે આવે છે! અરે, યાર કયારેક તો મને થેંકું બોલ. મેં તને શું નથી આખ્યું? હું તો કણ કણમાં એવમું ચેતન્ય સ્વરૂપ છું. તેમ છતાં હું તને માત્ર મૂર્તિ કે પદ્ધી છબીમાં જ કેમ દેખાઈ છું...?? કોઈ વાર-તાહેવાર અથવા તો ખાસ તિથિએ તું મને જરૂર યાદ કરે છે, પરંતુ એ સિવાય યાદ ના કરે તો શું હું તારાથી નારાજ થવાનો...??? હરળીજ નહીં. અરે ગાંડા, મારું કામ તો

તારી રક્ષા કરવાનું છે. કિન્તુ તારા આડંબર, હોંગ, અહં, દંભ, ઇધ્યાં કે પછી ખોટો દેખાડો મને બિલુકુલ પસંદ નથી. મારી ઇચ્છા તો ફક્ત એટલી જ છે કે મેં ઘડેલા આકારમાં ક્યારેય પણ વિકાર ના આવે. જો કે મને તો અફ્સોસ એ જ વાતનો છે કે મને જ દૂર હડસેલીને તું જ ભગવાન બની બેઠો. અરે મૂર્ખ, તારા કરતા તો ચાર પગવાણું મૂંગું પ્રાણી સારું કઢેવાય કરણ કે એ બધાને ઉપયોગી તો થાય છે! હે માનવ... ભલે તું બોલતો હોઈશ, કિન્તુ તને તો મારો જરા પણ ડર નથી. એ તો તારા ફૂકમોરી જ આપોઆપ ચાડી ખાય છે. નહીં તો તું મારા જ સોગંદ લઈને અનીતિ, ઇધ્યાં, બદ્ધાચાર, કાવાદાવા, પ્રપંચ, અદેખાઈ કરે જ નહીં. કેમ દોસ્ત, બરાબર કે નહીં? માણાના મહાકામાં હું તને દેખાઈ છું, તો પછી જીવનમાં ખોટા કાર્યો કરતી વખતે હું કેમ વિસરાઈ આઈ છું...?? છે આનો જવાબ તારી પાસે? જો સાંભળ, તારે મારા આશિયાદ લેવા હોય તો ફક્ત મને રોજવાથી નહીં ચાલે, બલકે તારે તારા જીવનમાં સારા કાર્યો કરવા પડશે. મારે તો માત્ર ને માત્ર નરસીંહ મહેતા, તુકારામ, સૂરદાસ, મીરા, પ્રહલાદ ને રાધા જેવા ભાવ જોઈએ છે. નહીં તો મને બીક છે કે મારી નાપસંદગીનું કોઈ પણ કાર્ય તારો વિનાશ કરશે!”

દિનેશકુમાર બાગીયા - જૂનાગઢ

રા'ની રોજડી

કચ્છની રસધાર

દુલેરાય કારાણી

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલી, કચ્છડો બારે માસ.

આવો કચ્છ પ્રદેશ એની અનેક પ્રકારની વિશિષ્ટતાઓ વડે વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરી રહે છે. લાંબા વાંકા તુંબડાના આકારવાળો આ કચ્છડો સાગર અને રણસાગરની બેલડીઓના બંધનમાંથી હવે મુક્ત થયો છે એ એનાં સદ્ગ્રામ્ય છે. એની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અથાગ અરબી સમુદ્ર ધૂઘવે છે. પૂર્વે અને ઉત્તરે બિયાબાન રણપ્રદેશ પથરાઈ રહેલ છે. આ રણપ્રદેશ પર જ્યારે પાણી ફરી વળે છે ત્યારે કચ્છ એક બેટ બની જાય છે.

કચ્છની ઉત્તર તરફના રણને ઓળંગતાં થરપારકરનો રેતાળ પ્રદેશ આવે છે. ત્યારબાદ સિંધની શરૂઆત થાય છે. થરપ્રદેશના સોઢા રાજ્યપુતો અને મોટી ધોળી પાણીથી એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધારણ કરે છે. આ સોઢા રાણાની કુંવરીઓ કચ્છના જાઝેજા કુમારો સાથે લગ્નગ્રંથિથી જોડાય છે.

આજથી એક હજાર વર્ષ પહેલાં જ્યારે કચ્છ - કેરાકોટમાં કચ્છના પ્રતાપી રાજવી લાખા કુલાણીનો અમલ હતો ત્યારે થરપારકરના રાજનગર અમરકોટની રાજગાદી પર રાણો ચાંદ બિરાજમાન હતો. આ રાણો ચાંદ એક મહાન શિવભક્ત હતો. તે પોતાનો મોટાભાગનો સમય અમરકોટના શંખેશર મહાદેવની સેવાપૂજામાં વ્યતીત કરતો. થરનો પ્રદેશ રણની ક્ષારવાળી ભૂમિ પર આવેલો હોવાથી ત્યાં ફૂલજાડ ભાગ્યે જ જોવા મળતાં. પરંતુ રાણ ચાંદ શિવપૂજન માટે ધારણ પ્રયાસો અને મોટા ખરચે કુશળ માળીઓની દેખરેખ નીચે એક વિશાળ પુષ્પવાટિકાની રચના કરી હતી. અહીં અનેક પ્રકારના ફૂલના છોડવાનો ઉછેર થતો. આ ફૂલો ભગવાન શંકરના પૂજન - અર્થનમાં વપરાતા.

આ સમયે કચ્છ કેરાના ગાદીપતિ જામ લાખાની ઘોડાહારમાં એક રૂપાળી રોજડી હતી. આખી ઘોડાહારમાં તે ધૂટથી ફરતી. આ રોજડી જામ લાખાની માનીતી હતી. રોજડાં ફૂલોની કળીઓ ખાવાનાં ખૂબ શોખીન હોય છે. આ રોજડી પણ રાત પડે એટલે દરરોજ કેરાકોટથી દૂરદૂર નીકળી જતી અને આજુબાજુની ફૂલવાડીઓ સાફ કરી આવતી. આખી રાત મુક્ત મને ચરી ફરીને સુવાર પહેલાં તે પોતાના સ્થાન પર હાજર થઈ જતી. દરરોજના

આ પ્રકારના કાર્યક્રમથી આસપાસની પુષ્પવાટિકાઓને તેણે ઉજ્જવ બનાવી દીધી. પુષ્પકળીઓનું નામ-નિશાન પણ આ રોજડીએ ક્યાંય રહેવા દીધું નહીં. આ પ્રદેશમાં જ્યારે ફૂલની કળીઓ એને મળતી બંધ થઈ ત્યારે તેણે પોતાની પવનવેગી ગતિની સહાયથી દૂરદૂરની ભૂમિમાં ભટકીને ફૂલોના બગીચા શોધવા માંડ્યા. દૂરદૂર ભટકતાં તેને થરપારકરના રાણા ચાંદનો વિશાળ પુષ્પબાગ મળી આવ્યો. તે દિવસથી રાણા ચાંદની ફૂલવાડીનાં ફૂલો શંકરના પૂજનમાં જવાને બદલે રા' લાખાની રોજડીના ઉદ્દર્મંદિરમાં પદ્ધરાવા લાગ્યાં. થોડો વખત તો આમ ચાલ્યું પણ આખરે રાણાના શિવપૂજન માટે પુષ્પો મળતાં બંધ થઈ જવાથી તેણે કાચી કળીઓના આ ચોરને શોધવા માટે પોતાની પુષ્પવાટિકામાં અંદર ચોકી બેસાડી.

એક દિવસ મધરાતના સમયે આ કાબેલ ચોર પર રાણાના ચોકીદારોની દણ્ણ પડી. પણ પવનપુત્રી જેવી આ રોજડીને પકડી પાડવાનું કામ મુશ્કેલ હતું. બાગના ચોકીદારો જ્યારે આ ચોરને પકડવામાં નિષ્ફળ નીવડ્યા ત્યારે રાણો ચાંદ પોતે પોતાના પાણીદાર અશ્વ પર સવાર થઈને એ ચાલાક ચોરને ઝડપી લેવા માટે આખી રાત ખડે પગે રહ્યો. આમ છતાં આ ગગનગામી ગતિવાળી રોજડીની સરખામણીમાં રાણાનો ઘોડો પાછળ પડી ગયો.

રાણાની ઘોડાહારમાં 'નવલખા' નામનો એક પાણીપંથો અશ્વ હતો. આ અશ્વ પર આરૂઢ થઈને બીજે દિવસે રાત્રિ સમયે રાણો ચાંદ પોતાની પુષ્પવાટિકામાં પહોંચી ગયો. બરાબર તૈયાર રહીને તે આ રોજડીની રાણ જોવા લાગ્યો.

મધરાત થતાં પવનના સુસવાટા જેવી આ રોજડી અહીં આવી પહોંચી. રાણાની વિશાળ વાડીમાં મનગમતી ફૂલની કળીઓ વીજાનીબાળીને ખાવા લાગી. અશ્વારૂઢ થઈને બાગમાં ફરતા રાણ ચાંદની એના પર દણ્ણ પડી. રોજડી નજરે ચડતાં જ રાણાએ અશ્વને એડી મારી. એ જ વખતે આ રોજડી ગરુડ ગતિએ ઊડતી - છલાંગો મારતી નાસવા લાગી. રાણાએ પણ પોતાના નવલખા અશ્વને રોજડી પાછળ મારી મૂક્યો. ઘોડો વંટોળિયાની પેઠે ધસતો રોજડી પાછળ પડ્યો. રોજડી તો વીજળીની જેમ એકશાસે સપાટાબંધ દોડતી ભાગતી હતી. ઘડીકમાં નજીક અને ઘડીકમાં દૂર એમ જાણે આકાશમાં ઊડતી જતી હતી. જરાવારમાં જાણે હમણાં જ ઘોડાના દાબલા નીચે કચડાઈ જશે એમ લાગે અને બીજી જ કાણે બેચાર

ખેતરવા દૂર નીકળી જતી નજરે પડે. આમ આગળ રોજડી અને પાછળ રાણાનો નવલખો ઘોડો પોતપોતાની ગતિની હરીફાઈ પર આવી ગયા હતા. આખરે વહેલી સવારે રાણાનો ઘોડો કેરાકોટના દરવાજા પાસે રોજડીને બેઠોભેટ થઈ ગયો. રોજડી તે જ ક્ષણે ધરતી પર પટકાઈ પડી. તેના પ્રાણ પરવારી ગયા.

રોજડીને જમીન પર પટકાઈ પડેલી જોઈને રાણાએ પોતાના અશ્વને થંભાવ્યો. એ જ વખતે કપિલકોટનો દરવાજે પણ ખોલવામાં આવ્યો. દરવાજા પરના ચોકીદારે જામ લાખાની માનીતી રોજડીના પ્રાણ હરનાર રાણા ચાંદને બંદીવાન તરીકે જાહેર કર્યો. રાણાને હવે જ ભાન થયું કે પોતે રાતની રાતમાં પોતાની રાજ્યાની અમરકોટથી કેટલાયે ગાઉ દૂર કેરાકોટમાં આવી ચડ્યો છે. અહીં આ પારક મુલકમાં તેનું કંઈ ચાલી શકે તેમ ન હોવાથી તે ચોકીદારની આજ્ઞાને આધીન થયો.

સવાર થતાં પહેરેગીરોએ રાણા ચાંદને જામ લાખાની રાજક્યેરીમાં હાજર કર્યો. રોજડીને મારનાર તરીકે તેને ઓળખાવ્યો. પોતાની માનીતી રોજડીના મૃત્યુના સમાચાર સાંભળીને જામ લાખો દિલગીર થયો. રોજડીને મારી નાખવાનું કારણ તે રાણા ચાંદને પૂછવા લાગ્યો. રાણા ચાંદે પોતાની ઓળખાણ આપી. તેણે સંઘળી ઘટનાથી જામ લાખાને વાકેફ કર્યો. જામ લાખાને આ વાતમાં વિશ્વાસ બેઠો નહીં. એક જ રાતમાં રોજડી છેક અમરકોટથી કેરાકોટ પાછી વળી આવે એ વાત જામ લાખાને તદ્દન અસંભવિત લાગી. પોતાની વાત સાબિત કરી આપે તો જામ લાખાએ તેને સગપણ આપવું અને જો તેમ ન કરી શકે તો રાણા ચાંદે તેને સગપણ આપવું.

હવે રાણાને તેની વાતની સત્યતા સિદ્ધ કરી બતાવવાની રહી. રાણાએ જામ લાખાને જગ્યાવ્યું કે ‘આ રોજડીએ મારા બાગનાં ફૂલોનાં જૂમખેઝુમખાં ખાંધાં છે. આખે રસ્તે અને શાચી લેવા જેટલો સમય પણ નિરાંતરનો ન મળેલ હોવાથી એ ફૂલો હજમ થયા વગરનાં જ રોજડીના પેટમાં જેમનાં તેમ પડી રહ્યાં હશે. માટે ખાતરી કરીને જોઈ લ્યો!’

રાણાની શરત જામ લાખાએ મંજૂર કરી. ખાતરી માટે રોજડીનું પેટ ચીરવામાં આવ્યું. તપાસ કરતાં વાત અક્ષરશ: સાચી માલમ પડી. જામ લાખાની આંતરિક ઈચ્છા રાણા ચાંદને સગપણ આપવાની ન હતી. પણ વચ્ચનથી તે બંધાઈ ગયો હતો. એટલે નાછૂટકે પોતાની બહેનનું વેવિશાળ રાણા ચાંદ સાથે નક્કી તો કર્યું, પણ તેના અમલ માટે વિચિત્ર શરતો રજૂ કરવામાં આવી.

એક શરત એ હતી કે રાણાએ એક જ દિવસમાં અમરકોટથી

કેરાકોટ પહોંચી આવવું. બીજી શરત એ કે દરેક જાનેયાએ પોતાની સાથે સો-સો કાતળીવાળી એક એક લાકડી લાવવી. અને ત્રીજી શરત એ હતી કે ઘઉંના શીરાનો એક આખો પેડો ખાઈ જાય એવા સો માણસ જાનમાં લાવવા.

આવી વિલક્ષણ પ્રકારની ગણ શરતો પૂરી કરવાનું કાર્ય મુશ્કેલ હતું. છતાં રાણા ચાંદે આ શરત કબૂલ કરી લીધી. અમરકોટ પહોંચીને આ શરતો પૂરી કરવાનો રસ્તો શોધવાની તેણે તજવીજ કરવા માંથી. રાણાએ આખા થરપારકરમાં દાંડી પિટાવીને જાહેર કર્યું કે આ ગણ શરતો પૂરી કરી આપનારને મનમાનતું ઈનામ આપવામાં આવશે. અમરકોટના એક બુદ્ધિશાળી વૃદ્ધ માણસે આ બીજું જરૂરી લીધું.

અમરકોટમાં પાલણીઓ નામનો એક સુતાર હતો. આ સુતારે બે રોજડાનો એક રથ તૈયાર કર્યો હતો. આ રોજડાં એક જ દિવસમાં અમરકોટ પહોંચી જાય એવી જરૂરી ગતિ ધરાવતા હતાં. એક શરત તો આ રીતે પૂરી થઈ જતી હતી. તે સિવાય બીજી બે શરતો કેરાકોટમાં પૂરી કરવાની હતી.

યોગ્ય સમયે રાણા ચાંદની જાનનો કાફલો સો સપડતા બેલી સાથે અમરકોટથી ચાલતો થયો. કપિલકોટની નજીદીક આવતાં પેલા બુદ્ધિશાળી વૃદ્ધે નદીની બેખડમાંથી દાભના મૂળની એક એક સોટી કાઢીને દરેક જાનેયાના હાથમાં આપી લીધી. દાભના મૂળની સોટીમાં નાનીનાની કાતળીઓ હોવાથી દરેક જાનેયાએ સો સો કાતળીવાળી સોટી પોતાના હાથમાં રાખી લીધી. બીજી શરત પણ આ રીતે પૂરી કરવામાં આવી. હવે શીરાનો એક એક આખો પેડો ખાઈ જવાની ગીજ શરત સૌનાં મનમાં ચિંતા ઉપજાવી રહી હતી. પેલો વૃદ્ધ આ છેલ્લી શરત માટે સૌને ધીરજ આપતો કેરાકોટના પાદરે આવી પહોંચ્યો.

આ તરફ બચાબદ લગ્નના દિવસે રાણો ચાંદ પણ પાલણિયા સુતારના રથમાં બેસીને એક જ દિવસમાં અમરકોટથી કપિલકોટ આવી પહોંચ્યો. જાનને આવી પહોંચેલી જોઈને જામ લાખાએ પોતાની શરતોનું બચાબદ પાલન થયું છે કે કેમ, તેની તપાસ કરવા કર્મચારીઓને મોકલ્યા. તપાસ કરતાં તેમણે જોયું કે દરેક જાનેયા પણ સો સો કાતળીવાળી એક એક લાકડી હાજર છે. રાણો ચાંદ પણ રોજડાના રથમાં એક જ દિવસમાં અમરકોટથી કપિલકોટ આવ્યો છે. રાણા ચાંદ વિશેષ ખાતરી માટે જગ્યાવ્યું કે “જામ લાખાને જો ખાસ પુરાવાની જરૂર હોય તો અમારો પાલણિયો સુતાર તેને એક જ દિવસમાં અહીંથી અમરકોટ લઈ જવા તૈયાર છે.”

With Best
Compliments From



43 YEARS OF CIVIL ENGINEERING EXCELLENCE
We undertake Civil Works in Gujarat, Maharashtra & All Over India

M/s. NARENDRA SHAH & ASSOCIATES

Admn. Office : 16, Shanti Bhuvan, 3rd Floor, Above McDonald's, Opp. Railway Station,
Mulund (West), Mumbai-400 080. Tel. : 25647572 E-mail : narendra_shah2006@yahoo.co.in

M/s. D.N.D. Enterprises

આમ બે શરતો પછી હવે એક ત્રીજી શરત પૂરી કરવાની બાકી હતી. એ માટે પેલા વૃદ્ધે રાજના કર્મચારીઓને જણાયું કે “તમે શીરાના સો પેડો રંધીને તૈયાર રાખો! અમારા સૌ જાનેયા સો પેડો ખાઈ જવા તૈયાર છે.”

વૃદ્ધની આ વાત સાંભળીને જાનેયા તો પોતપોતાના મનમાં મુંજાવા લાગ્યા. આપસ આપસમાં કહેવા લાગ્યા કે આ ડેસો આપણો છુબ લેવા માંગે છે કે શું? શીરાનો એક પેડો એક માણસ આરોગી જાય એ વાત તો તદ્દન અશક્ય હતી.

રસોઈની તૈયારી ચાલવા લાગી. સો-સો ચૂલા પણ મંડાઈ ગયા. દરેક ચૂલા પર એક એક માટીનો પેડો ચડાવી દેવામાં આવ્યો. આ જોઈને પેલા જાનેયાઓ અકળાવા લાગ્યા. ક્યાં એક જબરો પેડો અને ક્યાં એક માનવીનું નાનકું પેટ! પેલો વૃદ્ધ તો તદ્દન નિશ્ચિત ભાવે આ બધું નિહાળી રહ્યો હતો.

જ્યારે શીરાનો એક પેડો રંધાઈને તૈયાર થઈ ગયો ત્યારે પેલા વૃદ્ધ જાનના તમામ માણસોને એક હારમાં બેસાડી દીધા. એક પેડામંથી બધાને થોડો થોડો શીરો વહેંચી આપ્યો. જાનેયા તો જરાવારમાં જ આ પ્રસાદી ચટ કરી ગયા. બીજા પેડાની રાહ જોવા લાગ્યા. બીજો પેડો રંધાઈને તૈયાર થઈ ગયો એટલે તેમાંથી પણ બધાને થોડો ભાગ મળી ગયો. ત્યાર પછી ત્રીજો, ચોથો એમ એક પછી એક શીરાના પેડા ઉત્તરતા આવ્યા અને એક પછી એક સાફ થતા આવ્યા. જ્ઞાને દેવની પ્રસાદી ખાતા હોય તેમ સૌ વિના તકલીફ પોતપોતાને ભાગે આવતો થોડો શીરો આરોગતા આવ્યા. આ રીતે એક પછી એક શીરાના સો પેડા ક્યાં ચાલ્યા ગયા તેની કોઈને ખબર પણ પડી નહીં. સૌ કોઈ પેલા વૃદ્ધની અદ્ભુત બુદ્ધિ પર આફરીન થવા લાગ્યા. આજે પણ બુદ્ધિની કસોટીનું આવું કોઈ કાર્ય કરતાં કચ્છના લોકો ‘લાખે વારા પેડા’ એ ઉક્તિને યાદ કરવાનું ચૂકતા નથી.

જમ લાખાએ મૂકેલી ત્રણ શરતો આ રીતે પૂર્ણ થઈ જવાથી રાણા ચાંદની જાન વાજ્તે-ગાજ્તે કપિલકોટમાં દાખલ થઈ. લગ્નની તૈયારીઓ ચાલવા લાગી.

જમ લાખાને પાલણિયા સુતારનો બે રોજડાંવાળો રથ ખૂબ ગમી ગયો હતો. આ રથ તેણે રાણા ચાંદ પાસેથી પડાવી લેવાની તજવીજ ચલાવવા માંડી. પાલણિયા સુતારના કાને આ વાત આવી જતાં તેને પોતાના રથની ચિંતા થવા લાગી. આથી તે છાનોમાનો જાનના ઉતારાવાળા બગીચામાં જ્યાં એ રથ રાખવામાં આવ્યો હતો ત્યાં પહોંચી ગયો અને તરત જ રથમાં રોજડાંને જોઈને નાસવા લાગ્યો.

આ વખતે એક વિચિત્ર ઘટના ઘટી હતી. થોડા જ સમય પહેલાં સ્વર્ગસ્થ થયેલા જમ લાખાના પિતા ફૂલ જામની એક મેરાંદે નામની રખાત એ જ બાગમાં ફરી રહી હતી. મેરાંદે ગર્ભવતી હોવાથી જરા થાક લાગતાં પાલણિયા સુતારના રથમાં થોડી વિશ્રાંતિ લેવા બેઠી. સમય રાત્રિનો હતો. બાગમાં સુખકારક શીતળ હવાની લહેરો આવતી હતી. મેરાંદે રથ પર જરા આડે પડ્યે પડી. હવાની લહેરોમાં તે નિદ્રાધીન થઈ ગઈ.

પાલણિયા સુતારને આ વાતની કશી ખબર ન હતી. એ તો ઉતાવળો ઉતાવળો રથ જોઈને ચાલી નીકળ્યો. રથનાં રોજડાં પંખી ઊડતાં હોય તેમ રથને લઈને વાયુવેગે અમરકોટ ભણી ધસવા લાગ્યા. રથ જ્યારે રણમાં દાખલ થયો ત્યારે મેરાંદેની આંખ ઊંઘી. પોતાને જપાટાંબધ દોડતા રથમાં પહેલી જોઈને તેને નવાઈ લાગી. હવે તેને પોતાની ભૂલ સમજાઈ. રથની અંદર તે મોટે સાઢે બૂમાબૂમ કરવા લાગી. રથની અંદર થતી બૂમો સાંભળીને પાલણિયો તો ગભરાઈ ગયો. તેને બીક લાગી કે ચાલતા રથમાં આ ભૂત ક્યાંથી જાગ્યું? તેણે તરત રથને ઊભો રાખ્યો. તપાસ કરતાં તેને જણાયું કે એ તો સ્વર્ગસ્થ જમ ફૂલની પ્રેયસી મેરાંદે છે. મેરાંદે પોતાને કેરાકોટ પહોંચાડવા માટે કાલાવાલા કરવા લાગી. પરંતુ આ પાલણિયો હવે પાછો ફરે તેમ ન હતું. અને મેરાંદે અહીંથી એકલી કેરાકોટ પહોંચે એમ પણ ન હતું. આથી પાલણિયો સુતાર તેને પોતાના રથમાં છેક અમરકોટ લઈ ગયો. ત્યાં તેણે મેરાંદેને પોતાની પુત્રી તરીકે ઘેર રાખી.

આ તરફ પાલણિયો પલાયન થવાના અને મેરાંદે ગુમ થવાના સમાચાર જ્યારે જમ લાખાના કાન પર આવ્યા ત્યારે તેના કોધનો પાર રહ્યો નહીં. તેણે રાણા ચાંદને સ્પષ્ટ જણાવી દીધું કે જ્યાં લગી તમે પાલણિયા સુતારને અને મેરાંદેને અહીં હાજર નહીં કરો ત્યાં લગી લગ્નની કાર્યવાહી આગળ ચાલવાની નથી.

આ અપમાનથી રાણા ચાંદને પણ ગુસ્સો ચડ્યો. આ વખતે એની પાસે યુદ્ધનો કશો સરંજામ ન હોવાથી તેને ન છૂટકે અપમાનિત દશામાં પાછા ફરવું પડ્યું. અમરકોટ પહોંચીને રાણા ચાંદ પોતાના અપમાનનો બદલો લેવા મેરાંદેને અમરકોટમાં જ રોકી રાખી.

મેરાંદેએ પોતાનું શેખ જીવન અમરકોટમાં જ સમામ કર્યું. તે અહીં આવી ત્યારે ગર્ભવતી હતી. યોગ્ય સમયે તેણે એક અતિ સ્વરૂપવાન પુત્રીને જન્મ આપ્યો. આ બાળકી ખૂબ જ સૌંદર્યવતી હોવાથી તેનું નામ માહરૂઈ અર્થત્ ચંદ્રમુખી રાખવામાં આવ્યું. આ માહરૂઈનું નામ ‘સતી મારઈ’ તરીકે ઈતિહાસમાં મશહૂર છે. ■

હરીભાઈ બીમારી પેઇન્ટર

જૈન ધર્મના કેન્વાસ પેઇન્ટિંગ, તીર્થપટ, માર્બલ કાર્વિંગ ટીર્થપટ - તીર્થ રચના બનાવનાર

★ તળાવ એરીયા, પ્રાઈમરી સ્કુલ સામે, પાલીતાણ-૩૬૪ ૨૭૦. ★ ૧૩, બાલમંદિર શોપીંગ સેન્ટર, તળોટી રોડ, પાલીતાણ.

Tel. : (02848) 252454 • Mo. 94262 46176, 99240 36761

પૂજો શેઠ

કથી કથા

સ્વામી સચ્ચિદાનંદ

ક્ષુ - કાઠિયાવાડનાં રાજકીય ક્ષેત્રોમાં માત્ર રાજપૂત રાજા-મહારાજાઓનો જ ઈતિહાસ નથી રચાયો, પણ તેમના દીવાનો, કામદારો વગેરેનો પણ સમાનાંતર ઈતિહાસ રચાતો રહ્યો છે. ઘણીવાર તો એવું બનતું રહ્યું છે કે રજવાડનાં રાજા ભલે ગમે તે હોય, પણ ખરી રાજ્યસત્તા તો દીવાન કે કામદાર જ ભોગવતો હોય. રાજ્યની ચડતી-પડતીમાં આવા દીવાનો મહત્વનો ભાગ ભજવતા રહ્યા છે.

દીવાનપદું મોટાભાગે નાગર બ્રાહ્મણો, વાણિયાઓ અથવા ઠક્કરો ભોગવતા રહ્યા છે. નાગર બ્રાહ્મણો મોટા ભાગે વ્યાપારી કોમ નથી. તે શિક્ષિત, સંસ્કારી અને નીતિમત્તાવાળી કોમ ગણાય છે, પણ વાણિયા અને ઠક્કરો મુખ્યત: વ્યાપારી કોમ ગણાય છે. બંનેના વ્યક્તિત્વમાં કેટલીક ભિન્નતા રહેલી છે. રાજગાડી મોટા ભાગે આનુવંશિક ચાલતી રહે છે, પણ દીવાનપદું લગભગ આનુવંશિક નથી હોતું. તેથી દીવાનપદું બદલાતું રહે છે.

ભુજમાં ત્યારે દીવાનપદે જીવણ શેઠ હતો. જ્યારે કથ્યના મહારાવશ્રી લખપતજી દેવ થયા ત્યારે જીવણ શેઠ પોતાની કુનેહથી અનૌરસ પુત્ર ગોડજને મુંદ્રાથી તાબડતોબ બોલાવીને ગાદીએ બેસાડી દીધા હતા. દીવાનો અને ભાયાતો વારસદારો નક્કી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે. કેટલીક વાર તેઓ સાચાને ખોટું અને ખોટાને સાચું પણ કરી મૂકૃતા હોય છે. એટલે રાજના આશ્રિતો અને કુંવરોએ દીવાનો અને ભાયાતો વગેરેને રાજ રાખવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો આ બધા વિરોધી થઈ જાય કે વીફરે તો ઘણો અનર્થ કરી શકે છે. રાજ ભલે સર્વસત્તાધીશ હોય, પણ તેની સત્તાના તાણા-વાણા દીવાનો અને ભાયાતોમાં વણાયેલા રહેતા હોય છે. આ બધાની સતત ઉપેક્ષા કરી શકાય નહીં.

જીવણ શેઠ જ્યારે દીવાનપદે હતો ત્યારે ભુજની એક કરિયાણાની નાની હાટી ચલાવનાર દેવકરણ શેઠનો દીકરો પૂજો હતો. તે રોજ જીવણ શેઠની પગચંપી કરવા આવતો. “સેવા કરે તે મેવા ખાય.” એ કહેવત પ્રમાણે જે લોકો મોટા લોકોની મન મૂકીને સેવા કરતા હોય છે તેઓ કોઈ વાર મેવાના હક્કદાર પણ થઈ જતા હોય છે. જે લોકો નાના છે પણ કદી કોઈ મોટાની સેવા કરતા જ નથી તેઓ યોગ્ય હોય તો પણ આગળ વધવામાં તેમને મુશ્કેલી નડતી હોય છે. આગળ વધવું હોય તેણે મોટાની સાચી સેવા કરવી જ જોઈએ.

એક વાર પૂજો જીવણ દીવાનના પગ દબાવતો હતો ત્યારે જીવણ શેઠ હળવાશથી પૂછ્યું, “અલ્યા પૂજિયા, માન કે તું કાલે દીવાન થાય તો પહેલું કાર્ય શું કરે?”

ગંભીર માણસોનાં જીવનમાં પણ હળવાશની પળો આવતી હોય છે. આવી પળોમાં તેઓ હળવી વાતો કરીને મનોરંજન કરતા હોય છે. હળવી પળો વિના હળવાશ ન મળે અને તેના વિના ભારથી હલકા ન થવાય.

પગ દબાવતાં-દબાવતાં પૂજાએ તરત જ જવાબ આપ્યો : “તો-તો પહેલું કામ તમારી સંપત્તિ લુંટી લેવાનું જ કરું.” પૂજાએ હળવાશથી જવાબ આપ્યો. મહત્વાકંક્ષી નોકર-ચાકરો માલિકની અઢળક સંપત્તિને સહન કરી શકતા નથી. તેઓ મનમાં ને મનમાં હૃદ્ય કરતા રહે છે. મોકો મળતાં જ તેઓ ખોટો ભાગ ભજવતાં વાર નથી કરતા. એટલે ડાહા માણસે કદી પણ બહુ બુદ્ધિશાળી મહત્વાકંક્ષી માણસને અંગત નોકર ન રાખવો.

કહેવત છે કે :

ચાકર, યાર અને નાર, એ ત્રણે કાચાં ભલાં,
પાન, પટેલ અને પ્રધાન, એ ત્રણે પાડાં ભલાં.

પછી તો સમય વીતવા લાગ્યો. આગળ જતાં પૂજો, પૂજો શેઠ થયો અને દીવાનપદા માટે જીવણ શેઠનો હરીફ પણ થયો. દીવાનપદાની હરીકાઈમાં પૂજો શેઠ સફળ ન થાય તે માટે જીવણ શેઠ તેને ભુજમાં - કથ્યમાં પેસવા જ ન દીધો. પૂજો શેઠ કથ્ય બહાર રહીને જીવણ શેઠ પાસેથી દીવાનપદું કેવી રીતે પડાવી લેવું તેની ખટપટો કરવા લાગ્યો. સત્તા કદી ખટપટો વિનાની હોય જ નહીં. આ નિયમ માત્ર રાજ્યસત્તા માટે જ નહીં, પણ ધર્મસત્તા કે સમાજસત્તા - કોઈ પણ સત્તા હોય ત્યાં ખટપટો રહેવાની જ. જ્યારે બધા ઉપાયો વ્યર્થ ગયા ત્યારે પૂજા શેઠ છેવટેનો નીચ ઉપાય અજમાવવા પ્રયત્ન કર્યો. તે સિંહ ગયો. ત્યારે સિંહમાં ગુલામશાહ કલ્લોરાનું રાજ્ય ચાલતું હતું. ગિધુમલ્લ લોહાર તેનો દીવાન હતો. બંનેને ચઢાવીને - ઉકેરીને કથ્ય ઉપર ચઢાઈ કરવા તેણે તૈયાર કર્યા.

સિતેર હજારની મોટી સેના લઈને ગુલામશાહ કલ્લોરા કથ્ય જતવા નીકળી પડ્યો. આ બાજુ મહારાવ ગોડજાએ પણ પૂરા કથ્યમાંથી રાજપૂતોને ભેગા કર્યા. કથ્યી સેનાની સરદારી વિજાણા વીર ઠાકોર લખાજ અને દીવાન જીવણજના હાથમાં

હતી. કચ્છી સેનાએ પણ પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. તેમણે પહેલેથી જ સિંધી સેના માટેના પાણીના બધા કુવા પૂરી નાખ્યા હતા. જેથી સેના આખી રાત તરસી રહી. કુશળ સેનાપતિ સર્વપ્રથમ પુરવઠાના સ્વોતનું રક્ષણ કરતો હોય છે. પુરવઠામાં સૌથી વધુ મહત્વ જળનું હોય છે. જો જળ બંધ થઈ જાય તો સેના લાંબો સમય લડી શકે નહીં. કચ્છી સેનાપતિએ સિંધી સેનાનો જળ પુરવઠો બંધ કરી દીધો. આ પ્રથમ કુશળતા કહેવાય. આવા થાકેલા - તરસ્યા લશ્કર ઉપર તાબડતોબ હુમલો કરી દીધો હોત તો વિજય નિશ્ચિત હતો. પણ જીવણ શેઠ વેપારી હતો, સેનાપતિ ન હતો. તેણે પોતાની સેનાને ધીરજ રાખવા કહ્યું.

સિંધી સૈન્યે આખી રાત જારાની તળેટીમાં થાક ઉત્તાર્યે હતો. હવે પૂજા શેઠ ચાલાકી કરી જીવણ શેઠ સાથે સંઘિવાતો કરવામાં સમય વિતાવ્યો. બીજી તરફ સિંધી સેના ચૂંપચાપ બીજી તરફ જારાના તુંગર ઉપર ચઢવા લાગી. વહેલા પ્રભાતે સિંધીઓ તુંગર ઉપર ચઢી આવ્યા અને ગફલતમાં રહેલા કચ્છી સૈન્ય ઉપર તૂટી પડ્યા. ભયંકર યુદ્ધ થયું. બંને પક્ષના હજારો યોદ્ધાઓ ખપી ગયા. વિઝાણનો રણવીર લખાજ મહાપરાકમ બતાવીને વીરગતિને પ્રામ થયો. આ મહાવિનાશક યુદ્ધમાં દીવાન જીવણજ, હજારો જેઠેજાઓ, મિયાણાઓ વગેરે શહીદ થઈ ગયા. કચ્છનો ઈતિહાસ જારાના યુદ્ધથી પૂરેપૂરો રંગાયેલો છે. પાણીપતના યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ. હજારો સ્કીઓ વિધવા થઈ અને હજારો બાળકો અનાથ થયા. માત્ર ને માત્ર પૂજા શેઠની ખટપટથી આ બધું થયું.

કચ્છી સેના હારી ગઈ. ગુલામશાહ જીતી ગયો. હવે તે ભુજ તરફ વળ્યો. તેની ઈચ્છા રાજકન્યાને પરણીને પછી સિંધ જીવાની હતી. રાજમાતાને ચિંતા થઈ. તેણે પોતાનો ધોળો વાળ દાબીમાં ભેટ મોકલીને ગુલામશાહને સંદેશો મોકલ્યો કે હવે ધોળાની લાજ રાખ. ગુલામશાહ પાછો વળી ગયો. પણ તે પૂજા શેઠને કચ્છનો દીવાન બનાવતો ગયો.

હવે પૂજા શેઠનું જોર વધી ગયું. તેણે આજુબાજુના પ્રદેશો લૂંટવા માંડ્યા અને તે રાજકન્યાને ગુલામશાહ સાથે પરણાવવા રાજમાતા ઉપર દબાણ - કનૃગડ કરતો રહ્યો. અંતે રાઓશીએ તેને કેદ કરીને જોર આપીને મારી નાખ્યો. આ રીતે અપકીર્તિ સાથે પૂજા શેઠનો અંત થયો.

જ્યારે ગુલામશાહને આ વાતની ખબર પડી ત્યારે તેણે ફરી પાછા કચ્છ ઉપર ચઢાઈ કરી. ફરી પાછા અનેક રાજપૂતોએ

પોતાનાં બલિદાન આય્યાં. તુકમાતા પાસે ભયંકર યુદ્ધ થયું. રાજકન્યાની જગ્યાએ ખાખરના જેઠેજાની કન્યાને પરણાવીને ગુલામશાહને જેમરેમ પાછો કાઢ્યો.

સિંધ જઈને તેણે સિંધુનદીનો મીઠો ફાંટો જે કચ્છમાં આવતો હતો તે બંધ કરાવી દીધો. જેથી કચ્છ સૂકાઈ ગયું. પહેલા સિંધુનદીની એક શાખા કચ્છમાં પણ આવતી હતી તેની ખબર ઘણાને નહીં હોય! પૂજા શેઠના મરણ પછી તેનો પુત્ર દેવજ દીવાન થયો. પણ તેનું પણ મોત કરી દેવામાં આવ્યું. આમ ભારે અંધાર્યુંધી ફેલાઈ ગઈ.



કચ્છનું રાજકારણ રાઓશીએ અને દીવાનોની વચ્ચે હાલકડોલક થઈ રહ્યું હતું. ત્યારે પ્રબળ સત્તા મેળવનાર પૂજા શેઠના જીવનમાં એક ધોર કલંકિત ઘટના બની ગઈ. કેટલાક લોકો બહુ જીવે ચઢીને પણ કલંકિત જીવન જીવતા હોય છે, તો કેટલાક ઉપરાઉપરી યશસ્વી જીવન મેળવતા રહે છે.

બન્યું એવું કે કચ્છી - સિંધી ઠક્કરોના ગોર સારસ્વત બ્રાહ્મણો હતા. આ બ્રાહ્મણોની લગ્ન-મરણ-પ્રસંગની કિયા કરાવવામાં ભારે જોહુકમી ચાલતી. યજમાનોનાં મોઢાં બાંધીને તે દક્ષિણા-લાગો વસૂલતા. તેથી તેમનો ભારે ત્રાસ હતો. વિશ્વના ઘણા ધર્મના ધર્મચાર્યો કોઈને કોઈ રીતે ધાર્મિક વિધિ કરવા - કરાવવામાં શોષણ કરતા રહ્યા છે. શ્રદ્ધાળુ લોકો નડતર-ભય વગેરેના કારણે આવું શોષણ સહન કરી લેતા હોય છે.

પૂજા શેઠ સારસ્વત બ્રાહ્મણોની જોહુકમી સામે વાંધો ઉઠાવ્યો. તેણે ભુજમાં સારસ્વત ગોરોની સભા કરી અને ઠરાવ કરાવ્યો કે હવે પછી ગોરલોકો દક્ષિણા કે લાગામાં યજમાનોને પજવશે નહીં. આ ઠરાવમાં સારસ્વતોની રોજનો પ્રશ્ન હતો. રોજ કપાઈ જતી હતી તેથી બધા ગોરોએ આઈ દિવસનો સમય માણ્યો. આઈમે દિવસે ફરી પાછી સભા મળી. આ વખતે ગોરોએ ત્રાગું કરવાનું નક્કી કર્યું હતું.

કચ્છ કાઠિયાવાડાના ચારણ, બારોટ, ગઢવી, બ્રાહ્મણ વગેરે કોમ યાચકવૃત્તિ ઉપર જીવનારી પ્રજા ગણાતી. આ યાચનાને તેઓ પોતાનો હક્ક સમજતા. યજમાનોએ તે આપવો જ જોઈએ, ન આપે તો ત્રાગું કરે. ત્રાગું એટલે આત્મવિલોપન કરી નાખવું. પોતે જ પોતાનો નાશ કરી નાખે. આ બધી કોમ પવિત્ર ગણાતી અને તે જ્યારે કોઈના આંગણે પોતાનું આત્મવિલોપન કરે ત્યારે

હાહાકાર થઈ જાય, મહાપાપ લાગે. તેથી લોકો ઉરતા - ફફડી ઉડતા.

તે દિવસે ગોરોની સભામાં ગાગું કરવાનું નક્કી કરીને ગોરો આવ્યા હતા. દીવાલમાં એક લાંબો ભાલો ખોસવામાં આવ્યો હતો. સભામાંથી એક વીસ વર્ષનો બ્રાહ્મણ યુવાન ઉડ્યો અને દોરીને પેલા ભાલામાં પરોવાઈ ગયો. લોહીનો હુવારો ઉડ્યો. ત્યાં તો બીજો જુવાન ઉડ્યો. તે પણ પરોવાઈ ગયો. આમ એક પછી એક બ્રાહ્મણના સાત જુવાનો પોતાની મેળે ભાલામાં પરોવાઈ ગયા. ચારે તરફ લોહી લોહી થઈ ગયું. આટલું થયા પછી પણ પૂજો શેઠ બદલાયો નહીં. તેણે પોતાનું ધારેલું પાર પાડ્યું. આ બ્રહ્મ હત્તાઓને કારણે પૂજા શેઠની ભારે બદભોઈ થવા લાગી. ઊંચા પદ ઉપર બેસનારા જ્યારે ખોટા નિર્ઝયો કરીને પ્રજાની આંતરરી કક્ષાવતા હોય છે ત્યારે તેમની કારકિર્દી મેળી થઈ જતી હોય છે.



પૂજા શેઠને બીજું કલંક ગીધા જોશીએ લગાડ્યું. ગિરધર જોશી અંજારનો સાવજ ગણાતો. તેની હાક વાગે. પણ ગીધા જોશી સાથે પૂજા શેઠને કાંઈ વાંકુ પડ્યું. બંને દુશ્મન થઈ ગયા. સત્તા મિત્રો વધારવામાં પણ નિમિત્ત બને અને દુશ્મનો વધારવામાં પણ નિમિત્ત બને. સત્તાનો મદ દુશ્મનો વધારતો હોય છે.

પૂજો શેઠ ગીધા જોશીનો પાઇળ પડી ગયો. ગીધાના દીકરાની જાન અંજારથી અબડાસા જવાની હતી. તેને રસ્તામાં જ લૂંટાવી લેવા માટે પૂજા શેઠ ચાલીસ મિયાણાઓને તૈયાર કર્યા. નનામા કુંગરની તળેટીમાં જેવી જાન પ્રવેશે કે તરત મિયાણા તૂટી પે અને જાનને લૂટી લે તેવો કારસો પૂજા શેઠ રચ્યો હતો. ગીધા ગોરના દીકરાની જાનમાં ૫૦૦ બ્રાહ્મણ જાનેયા થઈને જઈ રહ્યા હતા. યોજના પ્રમાણે નનામા કુંગરની તળેટીમાં મિયાણા ગાઠક્યા, પણ બ્રાહ્મણો ભાગ્યા નહીં, સામા થયા. ભારે વિંગાળું જામ્યું. બંને પક્ષના ઘણા લોકો મરાયા, પણ મિયાણા ફાવ્યા નહીં. આ વિંગાણામાં ગીધા જોશીનો જુવાન ભત્તીજો માર્યો ગયો. ગીધો જોશી પણ ભયંકર રીતે ઘાયલ થયો. તેણે ગાગું કરવાનું નક્કી કર્યું. નવપરિણીત પુત્ર-પુત્રવધૂને ગાડામાં બેસાડીને તે અંજાર જવાની જગ્યાએ ભુજ પહોંચ્યો. ગાડામાં કપાસિયા ભર્યા. તેમાં તેલ રેખ્યું. તેના ઉપર વરકન્યાને બેસાડીને પોતે પણ બેઠો. ગાડાને આગ ચાંપી દીધી. સળગતું ગાડું ભુજમાં દાખલ થયું. ‘હરહર મહાદેવ!’ના જ્યકાર સાથે ભરબજારમાં વરવધૂ અને ગીધો સળગી ગયાં. પૂજા શેઠના દરવાજે ગ્રાણાં કરુણ મોત થઈ ગયાં.

ચારે તરફ પૂજા શેઠ માટે ફિટકાર થવા લાગ્યો. આમ, ઊંચા સ્થાને પહોંચીને પણ પૂજો શેઠ અનેક કલંકોથી ખરડાઈ અંતે વિષપ્રયોગથી મરણ પામ્યો. ■

॥ કલાપૂર્ણાસ્તુ મંગલમ् ॥

કલાપૂર્ણ ઘી

દેશી ગાય અને ભેંસનું શુદ્ધ અને તાજુ ઘી

૧ લીટર ઘી : રૂ. ૫૦૦/- • ૫ લીટર ઘી : રૂ. ૨૩૫૦/-
 ૧૫ કિલો ઘી : રૂ. ૬૭૦૦/-

૧. અમે ઘી ની કંપનીઓનો સર્વે કર્યો છે. ૮૮% કંપનીઓ પાસે દેશી ગાયો છે જ નહીં.
 ૨. શું તમે તમારા ધરે કર્યાનું શુદ્ધ ઘી વાપરવા માંગો છો?
 ૩. પ થી ૧૦ દિવસ પહેલા બનેલું તાજુ ઘી.
 ૪. ૧૦ મહિના સુધી ઘી ખરાબ ના થાય તેની ગેરંટી.
 ૫. કલાપૂર્ણ ઘી હોમ પ્રોડક્ટ છે. કોઈ ડેરી કે કંપનીનું નથી.
 ૬. દેરાસર (જિનાલય) માટે ગાયનું શુદ્ધ ઘી ૧૫ કિલો
 MRP ૭૦૫/- વાળું ફક્ત રૂ. ૬૫૦૦/-માં મળશે.

અમદાવાદ
 M : 9374885169
 M : 8238297560
મુંબઈ
 M : 9321922282
 M : 9867890759

સુરત
 M : 6354584053
 M : 7046664053
હેઠ ઓફિસ
 M : 9773787952

સંપર્ક : ધીરજલાલ બી. શાહ (ચંદ્રા) : ૯૩૭૪ ૮૮ ૫૧૯૬, ૮૨૩૮ ૨૬ ૭૫૬૦

છોરાંવધોઇ - (૨૩)

ધારાવાહિક નવલકથા

હંસરાજ સાંખલા

લગ્ન વખતે બાળકોની યાદ

સમય પસાર થતાં ક્યાં વાર લાગે છે?

લગ્નની તૈયારીઓ ચાલુ થઈ.

એમ કરતાં લગ્નના દિવસો નજીક આવી ગયા.

રતન આમ તો જે કંઈ પણ કરતી તે પોતાના નેચરલ સ્વભાવથી કરતી. તેની નિખાલસતા અને તેનું ભોળપણ જ તેનું જીવન હતું. ઇતાં હમણાં હમણાં ક્યારેક એને એમ થતું 'જ્યોતિકાનાં લગ્ન ઈ મારી પરીક્ષા હે. મને થોડું ધ્યાન તો રાખવું જ પડ્શે. નેં તો કોક કે'શે 'હે તો ઓરમાન મા ને?'

એ ક્યારેક આ બાબતે ચિંતા કરતી. ત્યારે દીકરી જ (જ્યોતિકા જ) એને આશ્વાસન આપતી. એ કહેતી, 'મા, જશોદા મા કદીયે તમારી જેમ ચિંતા નો'તાં કરતાં. ઈયે ઓરમાન મા જ હતાં. તમે મારાં એવા જ ઓરમાન મા હો. મારી જશોદા મા હો.' એને રતનને નિરાંત થઈ જતી.

આ દિવસોમાં રતનને એનાં આગલ્યાં ઘરનાં બાળકો બહુ યાદ આવતાં. એમાંય એની જ્યોતિ અને કોકલાની યાદ તો આટલાં વર્ષો પછીયે એવી ને એવી આવતી. કેટલીયે વાર એને રોવરાવી દેતી, એકલી હોય ત્યારે.

હમણાં હમણાં એને એમ થતું 'હવે મારી જોતિ (જ્યોતિ) પણ મોટી થૈ રી હશે. એનાં હગપણનીયે વાતું થતીયું હશે. ગામડા-ગામને હિસાબે કદાચ એનાં લગ્ન પણ થૈ જ્યાં હશે. બિચારીને કેવું ઘર મલ્યું હશે?'

લગ્નમાં કેણે એની માનું સ્થાન શોભાવ્યું હશે? ઈતાં લીલા વઉં જ એની મા ભની હશે. પણ મા કહેવાથી કાંય મા થોડું ભની જવાયર્યું. મા તો એક સાધના હે, તપ હે, એક સિદ્ધ હે. એ બધું સિદ્ધ કરવાથી જ મા ભનાયર્યું.

એને યાદ આવ્યું એક કથામાં બાવજીએ ગીતાના શલોક ટાંકીને કવ્યુંતું કોઈ સ્થાન, કાર્ય કે દરજજો સાર્થક તો જ થાય કે તેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય થાય. એનો પ્રત્યક્ષ દાખલો દરેકના ઘરમાં જોવા મળેયો અને એ માના પાત્રમાં જોવા મળેયો. સાચી મા થવા માટે તેના હદ્યમાં મા બનવાનું જ્ઞાન જોઈએ. મા તરીકેનું કર્તવ્ય અને મા બનવા માટે ભાવ-લાગણી એટલે કે ભક્તિ જોઈએ. નહિતો બાળકને જન્મ દેવો એ એક

કુદરતી ઘટના હે. બચ્ચાને જન્મ દે એટલે કોય પણ જનાવર પણ મા ભની જાયર્યું પણ સાચી મા આદર્શ મા એમ પોતમાં થોડું ભની જવાયર્યું?

લીલાવહુ તો મારી છોરીયુંની કાકિયે નો'તી ભની હક્તી ઈ મા કેવી ભની હકી હશે? ઈ તાં હું 'જાણુંચી.' એને લીલા વહુનું છોરીયું હાથેનું તે વખતનું વર્તન યાદ આવતાં એની આંખ ભીની થઈ ગઈ. 'એના હુખ હારું કેણે જીવ બાબ્યા હશે? કેણે એનાં અરમાનનાં જતન કર્યા હશે? કેણે એની લાગણીનો ખ્યાલ રાખ્યો હશે? કેણે એના હૈયાના કોડ પૂરા કર્યા હશે? એને હાહરે મોકલાવતી વખતે ભાવથી ભેટીને કેણે વિદાય આપી હશે? બાપ તો હાજર યોં હશે કે કેમ હ્યે ભગવાન જાણે' એની આંખમાં ફરી ફરી પાણી આવી જતાં...

આવામાં તો લગ્ન પછીના પ્રસંગોમાંય બિચારીયુનાં શું....! એ યાદ કરતાં એના કરતાં એના હદ્યમાં એક પ્રકારની રીતસરની વેદનાનો અહેસાસ થયો અને એ ફરી આંસુ ન રોકી શકી.

જ્યારે જ્યારે એને આવા વિચારો આવતા, જૂની યાદો આવતી ત્યારે એ નર્વસ થઈ જતી. ઉદાસીનતા એને ઘેરી વળતી. એની આંખમાં ઘડી ઘડી આંસુ આવી જતાં.

એણે આવી અનેક વાતો અને વિચારો હૈયામાં ભંડારી રાખ્યા હતા. એને ઘણી વાર એમ થતું કોઈકને મારી વીતક અને વેદના કહી દિલનો ભાર ઘટાડવો ખપે. એને વર્ષોથી એના હદ્યમાં સંઘરાયેલી વેદનાનો ધોધ વહાવી દિલ હળવું કરવું હતું; પરંતુ એ કોઈને આ બધું કહેતાં શરમ-સંકોચ અને બીક અનુભવતી. એને એમ થતું આમ કરવાથી ન જાણતાં માણસો પણ મારા ભૂતકાળની વાત જાણશે. પછી મારા વિશે શું વિચારશે? અને કેવું કેવું ધારશે એટલે એ કોઈને ન કહી શકતી. એ પોતાના ભૂતકાળને ભૂલવા સતત પ્રયત્ન કરતી. આમ તો એને આ બધું કાયમ માટે ભૂલી જવું હતું. કારણ એના ભૂતકાળ સાથે કેટલીયે હદ્યક્રાવક ઘટનાઓ જોડાયેલી હતી. તેથી એને ભૂલવા એ સતત પ્રયત્ન કરતી. પણ એના શરીરનું અથું કોઈક તત્ત્વ અને આ બધું ભૂલવા ન'હું દંતું. ઊલટાનું જેટલા બળથી એ ભૂલવા પ્રયત્ન કરતી, તેનાથી બમણા બળથી એને બધું યાદ આવતું.

આમ કરતાં ઘેર લગ્નનો પ્રસંગ આવી ગયો.

મહેમાનો આવવા લાગ્યા.

લગ્નની ચહેરાપહેલ અને ધામધૂમ ચાલુ થઈ.

આ લગ્નમાં બે મામેરાં આવવાનાં હતાં.

આજે બે મામેરાં આવશે. એનાં સામૈયાંની તેયારી થવા લાગી.

મામેરા'નો આવશે પણ કોણ જાણે કેમ રતનને આજે સવારથી મજા નહોતી આવતી. એને પોતાની લાડકી દીકરીના લગ્નનો ઉમંગ હોવો જોઈએ તે આજે એના ચહેરા પર નહોતો.

રતને ખુદ મોં ઉપર ઉત્સાહ લાવવા પ્રયત્ન કર્યો પણ એ એમાં સફળ ન થઈ. એની ઉદાસીનું મૂળ અંતરના ઉદાશભાં હતું. એના મોં ઉપરની ઉદાસીનતા એની દીકરી પારખી ગઈ. 'મા તમારી તબિયત બરાબર નથી કે શું?'

'ના બેટા મને કાંચ તકલીફ નથી.' રતને મોં ઉપર કૃત્રિમ પ્રસ્ત્રતા લાવતાં કહ્યું.

'તો પછી તમારું મોં મને ન ગમે અવું કાં થે જ્યું હૈ?' જ્યોતિકાએ કહેતાં, એની રતનમાં આંસુ ન રોકી શકી. એ રડી પડી. ચહેરા ઉપર હાથ ઢાંકી રોધું રોકતી રોઈ પડી.

ચાલાક દીકરી બધું સમજ ગઈ. એ એની લાગણીશિલ રતનમાને પૂરેપૂરી જાણતી હતી ને! એને થયું આજે મારી માના હદ્યના જૂના જખમ પર મારે લાગણીનો મલમ લગાવવો જ પડશે. એને છેલ્લાં ચાર વર્ષ મને આપેલ લાગણી અને પ્રેમની આજે પરીક્ષા છે. આજે મારે એને સંભાળવી પડશે.

એણે રૂમમાંથી બધાંને બહાર નીકળી જવાનો ઈશારો કર્યો. બધાં બહાર જતાં, રૂમ બંધ કરી એની માને કહ્યું, 'મા મારી સામે તો જુઓ. આજે કેનાં લગ્ન હે? તમારી જ્યોતિનાં લગ્ન હે. તમારી દીકરી જ્યોતિનાં.' આટલું કહેતું રતન જ્યોતિને બેટીને એટલી રડી, એટલી રડી કે એને જોઈને જ્યોતિકા પણ રડી પડી.

જ્યોતિકાએ થોડીવાર એની રતન માને રોવા દીધી. પછી એણે એની માની પીઠ ઉપર હાથ ફેરવતાં કહ્યું, 'મા તમે મને તમારી દીકરી માની હેને? તો મારા લગ્ન પ્રસંગે તમે રોવો તો મને કેમ થશો?' અને જ્યોતિકાની આંખમાં ફરી આંસુ આવી ગયાં.

'મા તમારી આગલી જિંદગી વિશે આટલા વર્ષો સુધી મેં કર્દી પૂછ્યું નથી. હું એ પૂછ્યીને તમારા હૈયાના જખમ તાજી કરી દુખાવવા નો'તી માગતી. પણ આજ હું તમારી કને એ જાણવાની રજા લઉરી. તમને આજે નહીં પણ પછી એકદી એ બધું કહેવું પડશે. તમારી જે લાગણી દુભાણી હશે, એનો હું એક દી જરૂર ઈલાજ કરીશ.' જ્યોતિકાએ આટલું કહેતાં એની રતનમાં ઝૂસકે ચરી ગઈ.

'મા આજે મારા બે મામા પરિવાર જો તમારી આંખમાં આંસુ જોશે તો એને શું લાગશે?' કહેતાં જ્યોતિકાએ રતનમાની આંખમાંથી વહેતાં આંસુ લૂધજાં. 'મા મને વચ્ચન ઘો હવે તમે નઈ રૂવો.' જ્યોતિકાને એ ક્યાં ખબર હતી, એ પણ રોવા નહોતી માંગતી; પરંતુ એનાથી રોવાઈ જવાતું હતું. રોવાઈ જ જવાયને. એના દિલની

હાલત તો એના જેવી કોઈ 'છોરાંવણોઈ મા' જ જાણી શકે!

દીકરીએ રતનમાને પાણી આપ્યું. એ સ્વસ્થ થઈ. દીકરીએ માનાં કપડાં ઠીકદાક કર્યા અને જ્યોતિકા માને લઈ બહાર આવી. અને મામાના સામૈયા માટે ગોતિડો ખણવા ગઈ.

(કમશા:)

શું આપણે આવું કરીએ છીએ?

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ પાસે એક સુંદર હાથીદાંતના બનાવટની પેન હતી. સહેજે તે તેમને ઘણી પ્રિય હતી. એક વખત નોકર પાસેથી એ પેન મંગાવતા તેના હાથેથી પડી જવાથી તૂટી ગઈ. ડૉ. રાજેન્દ્રપ્રસાદ ત્યારે તેને ખૂબ ગુસ્સાથી ધમકાવ્યો. 'તારી પોસ્ટ બદલી દઈશ' વગેરે કટુ શબ્દો સંભળાવ્યા. પણ પછી મન શાંત થતાં ગુસ્સો ચાલ્યો ગયો. પણ રાતે તેમને નીંદ આવતી નથી. એ વિચારે તેઓ બ્યાકુળ બની ગયા કે આ જગ્યાએ હું હોત તો? મારાથી જ પેન તૂટી ગઈ હોત તો? નશર પદાર્થના નશામાં મેં બિચારાને આટલું શા માટે સંભળાવ્યું? આ વિચાર બ્યાકુળતાએ રાષ્ટ્રપતિ તે રાતે જ નોકરના ઘરે ગયા અને કહ્યું કે પેન તૂટી જવાના મારા ગુસ્સા બદલ હું તારી પાસે મારી માગું છું. નોકર સત્ય થઈ જવાથી કર્દી બોલી શકતો નથી. ડૉ. રાજેન્દ્રપ્રસાદ ફરી કહે છે, 'તું મને મારી આપી હે.' એટલું કહીશ તો જ મને શાંતિ થશે. તો જ મારી રાત આરામથી જગે. આખરે નોકર તે પ્રમાણે બોલ્યો ત્યારે જ રાષ્ટ્રપતિ પોતાને આવાસે ગયા. બોલો, કેવું ઉમદાભર્યું આ વર્તન કહેવાય?

આના વિરોધમાં કહીએ તો ઘરમાં વહુ અથવા સાસુએ રસોડામાં કર્દી કાચની વસ્તુ તોરી તો તરત જ એકબીજા પર આકોશ ઢોળશે પણ ત્યારે જો મનને શાંત રાખે અને બે મિનિટ માટે વિચારે કે જો મારાથી જ આ વસ્તુ તૂટી ગઈ હોત તો? જો આવા સદ્વિચાર બધાને આવે તો ઘરમાં ઘણાબધા આવા નાના કંકસો બંધ થઈ જાય અને સંયુક્ત કુટુંબો તૂટતા અટકોશે.

એવી જ રીતે ઓફિસ અથવા દુકાનમાં પણ આપણે નોકરો સાથે પણ નોકર જેવો (તુચ્છપણાનો) વ્યવહાર નહીં કરતા, એ પણ એક આત્મા છે અને એના કર્મચારી એ નોકર બન્યા છે અને આપણે આપણા કર્મચારી માલીક (શેઠ) બન્યા છીએ — જો આવો વિચાર આવે તો ઓફિસ / દુકાનના વાતાવરણમાં ઘણો જ ફરક પડી જશે અને કામના રિઝલ્ટ એટલા બધા સારા આવશે કે આપણે વિચારી ન શકીએ કે ખાલી આપણા નોકર સાથેના કૂણા વ્યવહારથી આટલો ફરક પડશે. મિત્રો, ખાલી ઘર અને ઓફિસની જ આ વાત નથી.

આ વ્યવહાર આપણી દિનચર્યામાં ઘણાબધા નાના લોકો સાથે થઈ શકે. જેમકે ઘરનો કામવાળો, સહ કાર્યકર, શાકભાજીવાળો, રિક્ષાવાળો, દુકાનદાર વગેરે. જો બધાની સાથે પ્રેમથી કામ લેશો તો દરેક મુશ્કેલ કામ પણ આસાનીથી થઈ શકશે.

સંકલન : યંકરાંત દામજી શાહ (કે.ડી. શાહ) - અમદાવાદ

કચ્છને જાળો અને માણો

કચ્છ વિશેષ

દિનેશાંદ્ર જગાજીવન શાઠ (ભુજ)

● કચ્છની જળ વિરાસત : પુરાણા પ્રસિધ્ધ નારાયણ સરોવર, ભુજનું હમીરસર તળાવ, દેશલપર, પ્રાગપર, માંડવીનું ટોપણસર, અંજારનું સવાસર, અરપરાનું જગસર, ગાંધીધામ - આદિપુરનું આદિસર, શ્રીજી મહારાજે જેમાં સન્માન કરેલું તે દહીસરાનું શ્રી હરિ સરોવર, ભચાઉનું બટિયા તળાવ, મુંદ્રાનું જેરામસર, હાજુપીરનું સોદ્રાણા તળાવ, કચ્છની બીજા નંબરની જાગીર તેરાના તાવ, રાપરનું નગાસર, વાંઢાયનું ઈશ્વરસાગર જેવા જળ મંદિરો કચ્છ અને કચ્છી પ્રજાને પાણીને લગતી જરૂરિયાતો, સંગ્રહ ક્ષમતા અનુસાર પૂર્ણ કરે છે.

● કલાપૂર્જક ભૂમિ : કલા જગતના તમામ આયામો દ્વારા ભાતભાતના કલાકારોએ કચ્છને હંમેશાં ઉજળું અને વિશ્વપ્રસિદ્ધ બનાવ્યું છે. કચ્છની બેનમૂન બાંધણી, કચ્છનું મીનાકારી કામ, ચાંદીકામ, કમાંગરી કલા, બાટીક ભરતકામ, નિરોણાની રોગન કલા, ઉત્તમ કલાકૃતિશી બનતી ધરકી કલા, અજરખ - બાટીક કામ, સૂરી-ચાપુ પરનું નકશીકામ, ચામડા પર ભરતકામ કરતી ચર્મકલા, જરદોશી કલા, લાકડામાંથી આકર્ષક સાધનો બનાવતી અનુપમ કાણ કલા, ભીત પર લીપણ કામ કરી ધરને સુશોભિત કરવાની લીપણ કલાએ કચ્છને જ્યાતનામ કરી આગવી ઓળખ આપી છે.

● પ્રવાસીઓ કચ્છ પર આફરીન : કચ્છનું બેમિસાલ રણ, સિંહુસંસ્કૃતિનું વિશ્વવિદ્યાત પુરાતન્ત્વિય સ્થાન ધોળાવીરા, રા'લાખેશ જાની એટલે સુરખાબ (ફ્લેમિંગો) જ્યાં વસે છે તે સુરખાબ નગર, માંડવીનો રમણીય દરિયાકાંઠો અને તેના પર આવેલો રાજ ધરાનાનો સોહામણો વિજય વિલાસ પેલેસ, ઐતિહાસિક વિરાસત ધરાવતું લખપત અને તેનો ડિલ્વો તથા શીખ ગુરુદ્વારા, ભુજનો રાજવંશનો આઈના મહેલ, ચુલ્લિયમ, પટેલ ચોવીસીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરો તેમજ ટાવર, રખોત્સવ જેવા અનેકવિધ પ્રવાસન ધામો કચ્છમાં છે જે હંમેશાં પ્રવાસીઓને આકર્ષે છે.

● સર્વે કચ્છી સન્તું નિરામયામાં વધારો : કચ્છના આરોગ્યની મહત્વની કહી શકાય એવી સગવડો સાથે અન્ય તમામ નાના-મોટા ગામોમાં ઉપલબ્ધ છે. સરકારી રાહબરી હેઠળ ચાલતા ૪૩૫ પ્રાથમિક આરોગ્ય પેટા કેન્દ્રો, ૬૪ પ્રાથમિક આરોગ્ય દવાખાના, ૧૫ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૧૮ ફરતા દવાખાના, ૨૦ જેટલા કુદરતી આયુરોદિક પદ્ધતિથી સારવાર કરતા દવાખાના તેમજ ૭૦ જેટલા એલોપેથીક દવાખાના લોકોની સેવા માટે હાજર છે.

● કચ્છકડાના પડે કચ્છના કામણા : કચ્છમાં શૂટિંગ થઈ

હોય તેવી પહેલી ફિલ્મ ૧૮૭૨માં જેસલ તોરલ હતી. ઉપેન્દ્ર નિવેદી અને અનુપમા અભિનિત આ ફિલ્મ સાથે કચ્છી લોકગાયક વેલજીભાઈ ગજજરે પણ ફિલ્મી હુનિયામાં પ્રવેશ કર્યો હતો. રેફ્યુઝ, હમ દિલ દે ચૂકે સનમથી માંડી હમણાં સુધી કચ્છનું રણ, ઐતિહાસિક સ્થળો પર લાઈટ - કેમેરા - એક્શન થતા રહ્યા છે. લગાને તો કચ્છને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. તો કચ્છના લેખક ડૉ. જ્યંત ખગીની વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘ધાડ’ નોંધપાત્ર ઘટના છે.

● કચ્છની રાજનીતિમાં પ્રથમ : જિલ્લા પંચાયત અસ્તિત્વમાં આવી. જેના પ્રથમ પ્રમુખ તરીકે કાંતિપ્રસાદ અંતાણી વરાયા. રાજ્યસભાના સર્વપ્રથમ સભ્ય તરીકે પ્રેમજીભાઈ ઠક્કર ચૂંટાયા. ૧૮૮૪માં કચ્છની સર્વપ્રથમ મહિલા સાંસદ ઊથાબેન ઠક્કર ચૂંટાયા. કચ્છના સર્વપ્રથમ મહિલા ધારાસભ્ય (મુંબઈ રાજ્ય) તરીકે તિલોતમાબહેન ધોળકિયા. ગુજરાત રાજ્યની વિધાનસભાના અધ્યક્ષપદે પહેલીવાર કચ્છના ધારાસભ્ય કુંનલાલભાઈ ધોળકિયા ૧૮૭૫માં વરાયા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે સર્વપ્રથમ કચ્છ માંડવીના સુરેશભાઈ મહેતા ૧૮૮૯માં એક વર્ષ રહ્યા.

● બંદર માર્ગ વિકાસની હરણાકાળ : દેશ અને ખાસ કરીને વિદેશના મહત્વના વિશાળકાય બંદરો સાથે વ્યાપારી રીતે હવે કચ્છ જોડાઈ ગયું છે. વિશેષ કરીને અદાળી શ્રુપ દ્વારા વિકસિત થયેલા અને અત્યાધુનિક સ્વયં સંચાલિત મશીનરીઓથી સજજ એવા મુંદ્રા બંદરે કચ્છને નવા સીમાચિક્લ પર લાવી ઊભું કર્યું છે. સિદ્ધિના અનેક શિખરો સર કરી બંદરીય વ્યાપારમાં કચ્છને મહત્વનું કેન્દ્રસ્થાન બનાવનાર હિન્દુયાણ પોર્ટ ટ્રસ્ટ (કંડલા બંદર) પણ અનેક કીર્તિમાનો સ્થાપિત કરી કચ્છનો ડંકો વિશ્વમાં વગાડ્યો છે.

● લાજવાબ કચ્છી વંજનો : કચ્છના આંગણેથી તૈયાર થયેલી કંઈ કેટલીયે રસમુખર વાનગીઓ દેશ અને વિદેશના સીમાડા પાર કરી ભારતીય અને બિન ભારતીયનું રસરંજન કરી રહી છે. પરંપરાગત અને માટીની સુગંધ સાથે ભણેલો બાજરાનો રોટલો અથવા માની (રોટલી), માખણ, સાથે ખાવડાથી આવેલો ધીમાં તરબતર મેસુક, ગુલાબની પાંદડી અને કાજુથી ભરપૂર ગુલાબ પાક, બશીનો ગરમાગરમ મીઠો માવો, અંજરના પ્રસિધ્ધ ગુબીત અને ચિક્કી, મોહનથાળ, બુંદીના લાડુ, ગામડાંમાં બનતા પેડા તો વર્ષોથી મોહું મીઠું કરતા આવ્યા છે.

સાભાર : ‘કચ્છમિંગ’ શર્મો જન્મદિન પૂર્તિ

પ્રેષક : દિનેશાંદ્ર જ. શાઠ (ભુજ) - અમદાવાદ

બનીના સિણીયાડો ગામના મડવર્કના નમૂના

“એમેઝોન” આંતરરાષ્ટ્રીય સ્તરે વેચે છે

કચ્છી કલા

બની એટલે કાળો બેનંબરી કોલસો જ નહીં ભેંસો, દૂધ, ટેમ્પા અને ધૂળની ડમરીઓ જ નહીં પણ બની એટલે સફેદ રણનું બારું. બની એટલે હસ્તકણા અને કારીગરોની ધરતી, દુનિયાના શોખીનો માટે એક નયનરમ્ય પ્રદેશ અને હવે નાના એવા સિણીયાડો ગામમાં માજુખાન ઈલમખાન મુતવાના મડવર્કની ભૂમિ પણ આ બની જ છે. જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ અને ‘એમેઝોન’ પર ધૂમ મચાવી રહી છે અને ધોરણ-૧૦ પાસ કસબી માજુખાન કલાપ્રેમીઓના હૃદયમાં ઘર કરી રહ્યા છે.

ગોરેવાલીથી ઉગમણે પાંચેક ડિ.મી.ના અંતરે અને ભુજથી ૮૦ ડિ.મી. દૂર ઉત્તરે આવેલા બનીના સિણીયાડો ગામના ધોરણ-૧૦ પાસ માલધારી યુવાન માજુખાન મુતવાને એકાએક પરંપરાગત કળાથી ‘જરા હટકે’ કંઈક નવો પ્રયોગ કરવાનો વિચાર આવ્યો અને એ માટીકામ તરફ વળ્યો. જ્યાં મહેબૂબખાન અને શેરખાન જેવા કલાકારોની મદદ મળી અને મડવર્કના નાના-મોટા નમૂના બનાવવા મંડ્યો. ૨૦૧૩થી આ મડવર્ક ક્ષેત્રમાં પ્રવેશેલા યુવાને માજુખાન આઈ ગેલેરી મુતવા મડવર્કના નામે ફેસબુક પેજ ખોલ્યું અને પાંચ વર્ષ નાના ભાઈ અસકખાને મોબાઇલમાં વીડિયો ઉતાર્યો જેને લઈને માજુખાન યુ-ટ્યુબમાં પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની કળાના વિશિષ્ટ પાસાઓ વીડિયોના માધ્યમથી સમજાવીને એ ઓનલાઈન મૂક્તો ગયો.

મડવર્કમાં આભલાને જોડીને તથા જીણી જીણી ડિઝાઇન પસંદ કરીને વીડિયો અપલોડ કરી રહેલો આ કલાકાર જોતજોતામાં વિશ્વની નજરે ચડવા મંડ્યો અને ‘એમેઝોન’ કંપનીએ તેની સાથે કરાર કર્યો. જરા ધ્યાનથી વાંચજો. આ માજુખાનને હવે એમેઝોન આંતરરાષ્ટ્રીય બજાર પૂરું પાડી રહ્યું છે. ૨૮ દિવસમાં ૧૭૬૮ જરો દુનિયાના કોઈ ખૂઝે બેઠે માજુખાનની કળા નિહાળી છે અને ઓર્ડર આપ્યા છે.

ભુજના પંકજભાઈ શાહના માધ્યમથી માજુખાને પોતાના વીડિયોમાં જાતે જ કોમેન્ટરી અને કામ આપ્યા છે. જે કામ કોનની

મદદથી થાય છે, એ કામ એ બે આંગળીઓના ટેરવા વાટે કરી રહ્યો છે. તેનો વીડિયો નિહાળી મુંબઈના વાલકેશ્વર સ્થિત સાગર મહેલમાં સી.કે. શૂપે ૮૦ ફૂટનો ઓર્ડર આપ્યો જે તૈયાર કરવા તે જ્યારે વાલકેશ્વર પહોંચ્યો અને વોલપીસ બનાવીને આચ્યું ત્યારે કંપની એટલી ખુશ થઈ કે વધુ ૮૦ ફૂટનું કામ ત્યાં જ આપી નિર્ધારીત રકમ કરતાં પણ વધુ વળતર ચૂકયું.

બનીની માટી, મુતવા ભરતકામની ડિઝાઇન અને આગવી સૂઝથી મડવર્કના નમૂનાઓમાં વિવિધ ભાત આપતો આ માજુખાન આઈ બાય આઈ કે દસ બાય દસની ફેમથી લઈને નેમ પ્લેટ, કી હોલ્ડર, લેટર બોક્સ, કલોક પણ બનાવી આપે છે. એક ફૂટ બાય એક ફૂટનો એક મડવર્કનો નમૂનો તે ચાર કલાકમાં તૈયાર કરે છે.

એમેઝોન કંપનીના પ્રતિનિધિએ સિણીયાડો આવીને તેની સાથે કરાર કર્યો છે. આ કંપનીની વિશેષતા વર્ણવિતા કલાકાર કહે છે કે મારી કૃતિ જો એક હજારની કિમતની હોય તો તેઓ મૂળ કિમત ઉપરાંત પેંડિંગ અને ડિલીવરી ચાર્જિસ આપે અને પછી મૂળ કિમત પર ૮ ટકા નફો ચારીવીને વેચે. કચ્છમાં કલાકારને આ રીતનું વળતર કયાંય કોઈ આપતું નથી.

ઉત્તમોત્તમ નમૂના પાણીના ભાવે લઈને શો રૂમ જેવી હુકાનોમાં સોનાના ભાવે વેચાય છે પણ વચેટિયાઓને જ ફાયદો છે, જ્યારે એમેઝોનમાં એવું નથી.

આ કારીગર મુંબઈ, બેંગલોર, હૈદ્રાબાદ, કચ્છના વિવિધ ભાગો ઉપરાંત મસ્કત, દુબઈ અને યુરોપના દેશોમાંથી થતી હિન્કવાયરોઓ અને મળતા ઓર્ડરથી ખુશ છે અને વતનની માટીને યશ આપે છે. સાથોસાથ કારીગરોને પણ અપીલ કરે છે કે અત્યાધુનિક ઢબે ઓનલાઈન વેપારમાં આવો, વૈશ્વિક બજાર આપણાને અને કળાને આવકારે છે.

સાભાર : “કચ્છ મિત્ર”

DEEP JYOT
STATIONERY MART
MFG. OF : EXERCISE & ACCOUNT BOOKS &
ALL TYPES OF OFFICE FILES

JAYESH S. PAREKH
M. : 98241 06623

FACTORY : Plot No. 4601,
G.I.D.C., Ankleshwar-393 002.
Ph. : 253137

૨૬

વાતાં

માવજી મહેશ્વરી

સૂરજ ખાસ્સો ઉપર ચડી આવ્યો. ભૂંગાને ફરતે બનાવેલ વેંતેક ઊંચા ઓટલાની ધારનું લીપણ ઊખડી ગયું હતું. ભૂંગાની ગળકબારી જેવા બારણા પાસે બેઠેલી યુવાન સ્વી ક્ષિતિજમાં જોઈ રહી. દૂર નમકના થર તડકામાં ચમકતા હતા. તેણે ડાબા હાથે જમણા હાથમાં પહેરેલી બંગડીઓ ગોળગોળ ફેરવી. કાચની બંગડીઓનો અવાજ તેને જ સંભળાયો.

તેની કીકીઓમાં દરિયો સ્થિર થઈ ગયો. ધસમસતાં મોંજ રેતીના ઢગલામાં ફેરવાઈ ગયાં. જોરજોરથી પવન ઝૂંકાવા લાગ્યો. રેતીનાં વાદળ ચડ્યાં. આકાશ રેતીનાં વાદળ પાછળ સંતાઈ ગયું. રણ વિસ્તરવા લાગ્યું. જયાં નજર પહોંચે ત્યાં રેતી જ રેતી. દિવસે તપતી, રાતે છરતી, ઉમરીમાં ઊંચે ચડતી, અહીંથી તહીં ફંગોળાતી રેતી. દૂર સુધી નમકના થર. ક્યાંય ન કોઈ ઝડ કે ન જાંખું. રેતી બધીય લીલાપ પી ગઈ. ધરતીના પેટાળમાં ઊંટ ગાંગરતાં રહ્યાં. રણ ક્યારેક દિવસો સુધી મૂંગું પડ્યું રહે તો ક્યારેક અચાનક તેમાં સળવળાટ થાય અને આંધી ચડે. ઉમરીની આઈ જવનિકા પાછળ માંદલો સૂરજ ડોકાયા કરે. આખરે પવન હાંફિને બેસી પડે ત્યારે સૂરજનો તીખો તડક ભોંકાય, જાણે ધાબડીમાં લાંપના કાંટા ભરાઈ ગયા હોય. ચામડી ચસક્યા કરે. બપોરે લૂના સપાટા આંખનાં પોપચાં બાળી નાખે.

રોજ આંખો સામે ફેલાયેલું રણ અને સળવળતી રેતી જોયા કરવાની!

ક્યાં ગયો પેલો ઘૂઘવતો દરિયો? પવનની પાંખે સવાર થઈને ચડતાં મોંજાં? ગરજતાં વાદળ? હવે તો રેતી ભૂલી પડી ગયેલી સાંદ્રણીના અસવારની આંખોમાં ઉચાટનેય પી ગઈ છે. આ રેતીની આરપાર જોવું, રોજ-રોજ જોવું.

યુવાન સ્વીએ આંખો પટપટાવી.

‘આસુ જ્યો?’ વૃદ્ધ સ્વી કારણ વગર બોલી.

વૃદ્ધ સ્વીનો પ્રશ્ન સાંભળી રણ સળવયું. રેતી જરા આધીપાછી થઈ. જોરથી ફેંકાયેલો પથ્થર રેતીમાં ખૂંપી જાય અને ઉપર નાનો ખાડો બની જાય એવો વૃદ્ધ સ્વીનો પ્રશ્ન પડ્યો રહ્યો. યુવાન સ્વીએ નેજવું કરી ક્ષિતિજ આરપાર જોતી હોય તેમ જોયું. કમરથી ઝૂકેલી વૃદ્ધ સ્વી યુવાન સ્વી સામે ઊભી રહી. યુવાન સ્વીના આગલા દિવસના ધોવાયેલા સુંવાળા વાળ સરી ગયેલી ઓદણીમાં અટવાઈ રહ્યા હતા. વૃદ્ધ સ્વીએ યુવાન સ્વીની આંખોમાં

જોયું. તેને એ આંખોમાં આંધી ચડતી દેખાઈ. ઊંચે ચેદેલી રેતીની ઉમરીમાં લાલ કપડાં અને મૂળસોતો ઉશેટાઈ ગયેલો મેંદીનો છોડ ગોળગોળ ફરતો દેખાયો. વૃદ્ધ સ્વીએ એક નિસાસો નાખ્યો. બાવળિયામાં બાંધેલી બકરી બેં-બેં કરતી હતી.

‘આ બકરી, મૂર્ઢ અભાગણી ધરાતી જ નથી.’ કહેતી વૃદ્ધ સ્વીએ ઝૂકેલી કમર પર હાથ મૂકી ભૂંગાથી દૂર ચાલ્યા જતા ઊંટનાં પગલાંને જોઈ રહી. યુવાન સ્વીના હોઠ જરા પહોળા થયા. તેણે વૃદ્ધ સ્વીની પીઠ પર નજર નાખી. વૃદ્ધ સ્વીનો ઓઢણી સાવ ગળી ગઈ હતી. ઓઢણીમાં રણ દેખાતું હતું. એ રણ કોઈ નાના બાળકની જેમ વૃદ્ધ સ્વીની પાછળ-પાછળ ફરતું હતું. ભૂંગાની ઉત્તરાદિ ભીત પાસે છાંખાનો ટુકડો પડ્યો હતો. સવારે જેમાં ચા ઉકાળી હતી એ તપેલીમાં ચાની ભૂકી સૂકાઈને ચોંટી ગઈ હતી. કૂતરો ઊંટનાં પગલાં સુંઘતો થોડે દૂર સુધી ગયો પછી થાકીને પાછો આવી વડના પડખે હાંફિતો બેસી ગયો.

વૃદ્ધ સ્વી કશા કારણ વગર જાંપા સુધી ગઈ અને પાછી આવી યુવાન સ્વી સામે જોઈ માંદલા અવાજે બોલી : ‘હજુ કેટલી વાર બેસી રહેવું છે? આ બધું પડ્યું છે તે કોણ સરખું કરશે?’ કહેતાં તેણે ભૂંગામાં ખાટલા પર રાતે કરેલ પથારી અને સવારનાં એંઠાં વાસણો સામે હાથ લાંબો કર્યો.

યુવાન સ્વીએ પોતાની પાણીદાર આંખો ચારેય તરફ ફેરવી. આકાશમાં એક સમડી ચક્રવાસ લેતી હતી. તેણે થોડીવાર સમડીને જોયા કરી. કોરાકું આકાશમાંથી ખરતો તડકો એની આંખોમાં પડ્યો. તે સાથે જાણે રણના પેટાળથી પ્રગટ્યું હોય એમ એક વાદળ સરસાટ ઉપર ચડ્યું અને યુવાન સ્વીની આંખો ઉપર વરસી પડ્યું. વૃદ્ધ સ્વીની કમર જરા વધુ ઝૂકી ગઈ. તેણે ગોબાયેલી તપેલીમાં ઘડો નમાવીને પાણી ભર્યું અને બકરી આગળ મૂક્યું. પાણી પીને બકરી ફરી બેં-બેં કરવા લાગી.

યુવાન સ્વી હળવેથી ઊંચી ભૂંગાની અંદર ગઈ. ભૂંગામાં આગલા દિવસે કરેલા લીપણની તાણ વાસ ભરાયેલી હતી. અંદરના આધા અજવાળામાં વચ્ચ્યોવચ્ચ પડેલા ખાટલા પર ધાયલ રાત કણસતી હતી. ખાટલા પર પાથરેલી ગોદિની રંગીન ભાતમાંથી ફૂલ-પાંડાં છૂટાં પડી લીપણ પર વેરાઈ ગયાં હતાં. ખાટલા પર દશ્યો સજીવન થતાં જોઈ યુવાન સ્વીની કૂખમાં સબાકો ઊપડ્યો. તેણે પોતાના પેટ પર હાથ ફેરવ્યો. રાતે તાજ લીપણ

પર ઢોળાઈ ગયેલા પાણીનું ધાબું અલગ પડી જતું હતું. તેણે ઓફવાની પાતળી ગોદરીની ધાર પકડી ઉંચી કરી. એક સિગારેટ નીચે પડી. ભૂખરા રંગના લીપડા ઉપર પડેલી સિગારેટનો સફેદ રંગ સાવ નોખો પડી જતો હતો. યુવાન સ્વીની આંખો ચમકી. તેના હોઠ ઉપર ન પરખાય તેવું સ્મિત આવ્યું. તેણે ગોદરી ખાટલા પર જ મૂકી દીધી અને નમીને સિગારેટ ઉપાડી.

સિગારેટના છેઠેથી થોડી તમ્બાકુ નીકળી ગઈ હતી. ત્યાંથી કાગળ ફાટી ગયો હતો. અને બે-ચાર સણ પડી ગયા હતા. ગમ્મત પડી હોય તેમ યુવાન સ્વીએ પોતાના મેંદી રંગા ટેરવાથી સિગારેટના સણ સરખા કરી તેને સીધી કરી. નખ વડે આગળનો કાગળ ફાટી નાખ્યો. પછી સિગારેટ નાક પાસે રાખી ઉંડો શાસ લીધો. તેના ફેફસાંમાં કેફ્લિ રાત ભરાઈ ગઈ. તેણે હોઠ પર જીબ ફેરવી. રણની ખારાશ જેવો સ્વાદ આવ્યો. નાકમાં હજુ સિગારેટની તીક્ર વાસ ભરાયેલી હતી. તેણે બીજી વાર સિગારેટ સુંધી. નશો ચડ્યો હોય તેમ ડેક આમતેમ ફેરવી. તેના હોઠ બિઝાયા. તે બહાર આવી જ્યાં બેઠી હતી ત્યાં ફરી બેસી ગઈ.

હવે તડકો ચડવા મંડચો હતો. દૂર ક્ષિતિજ પાણીમાં તરતી હોય એવું લાગતું હતું. ભૂંગામાં બારણાની બરાબર સામે ભૂંગા ફરતે કરેલ વાડનો ખુલ્લો જાંપો હતો. એ ઝાંપામાંથી નીકળતી એક કેડી દૂર જટી દેખાતી હતી. એ કેડીમાંથી આગળ જતાં બીજી કેડી, ત્રીજી કેડી એમ કેડીઓનું જાણું રચાતું હતું. એ કેડીઓ ક્યાં-

ક્યાં જતી હતી તેની એ સ્વીને ખબર ન હતી. તે આંગળીઓમાં પકડેલી સિગારેટ સામે એકીટશે જોઈ રહી. જાણે ફૂલ સુંધતી હોય તેમ આંખો બંધ કરી સિગારેટને સુંધી. ભૂંગાની પાછળથી અચાનક પ્રગટી હોય તેમ વૃદ્ધ સ્વી યુવાન સ્વી સામે ઊભી રહી ગઈ. વૃદ્ધ સ્વીની આંખો થોડી પહોળી થઈ અને તે કરાંજતી હોય તેમ બોલી : ‘એય નભાઈ, ગાંડી થઈ ગઈ છો કે શુ?’

યુવાન સ્વીની આંખો ચમકી. તેને યાદ આવ્યું કે બહાર ચૂલા પાસે બાકસ પડ્યું છે. તે ઊંઠી. એના પગમાં પહેરેલી ચાંદીની જેર જરા રણકી. તે ચૂલા પાસે ઉભડક બેસી ગઈ.

‘અરે! આ શું માંડચું છે તેં? શું કરે છે તું?’

યુવાન સ્વી બડખડાટ હસી પડી. તેણે સિગારેટનો છેંડો નાકને અડાડચો અને જોરથી સુંધી. પછી સિગારેટનું ફિલ્ટર પાંચેય આંગળીમાં પકડી વૃદ્ધ સ્વીને બતાવતાં બોલી : ‘હુઈ, આનાથી નશો ચડે નશો. તેં કદી પીધી છે? પડી પડી ચોળાયા કરે એના કરતાં ભલે આખીય બળી જાય. જોઉં તો ખરી સિગારેટના ધુમાડામાં એવું તે શું હોય છે?’

યુવાન સ્વીનું સ્મિત જરા પહોળું થયું. તેણે બાકસમાંથી દીવાસળી કાઢી અને ઘસરડો કર્યો. આગળ વધતી વૃદ્ધ સ્વીના પગ અટક્યા. તેની કમર જૂકી ગઈ. હોઠ જરા પ્રૂજ્યા.

વાડ પાસે હાંફિતો કૂતરો આવીને ચૂલા પાસે બેસી ગયો.

JETHABHAI DOONGARSHI TRANSPORT Co.

J. D. LOGISTICS



H.O. : 708/18, Bhavani Peth, Near Gurunanak Telephone Exchange, Pune-411 402.
Tel. : (020) 26434611 / 08425818000 • Fax : (020) 26434525 • E-mail : jdtcompany@gmail.com
Admn. O. : 313/315, Narshi Natha Street, Khajurwala Chamber, Masjid Buunder, Mumbai-400 009.
Tel. : (022) 23426818, 23400597 • Fax : (022) 23451950 • E-mail : jdadminoff@yahoo.co.in

**DAILY PARCEL & FULL TRUCK LOAD SERVICES
FROM MUMBAI & GUJARAT TO PUNE & SOLAPUR AND RETURN**

MUMBAI OFFICE

| | |
|------------|-------------|
| ANDHERI | 09323963410 |
| BHAT BAZAR | 09323963409 |
| BHIWANDI | 08425818022 |
| VASAI | 09323320952 |
| VASHI | 08425818023 |
| TARapore | 09322407169 |
| ULHASNAGAR | 09324495236 |
| BHAYANDER | 09820283922 |

PUNE & OTHER MAHARASHTRA OFFICE

| | |
|-----------------|----------------|
| PUNE (BOOKING) | 08425818009 |
| PUNE (DELIVERY) | 08425818012-16 |
| CHINCHWAD | 08425818011 |
| WAGHOLI | 08425818020 |
| FURSUNGI | 08425818014 |
| TALEGAON | 08425818021 |
| SOLAPUR | 08425818030 |
| KOLHAPUR | 08425818027 |

GUJARAT OFFICE

| | |
|-----------------------------|--------------|
| AHMEDABAD | 08866858858 |
| SURAT | 09377763408 |
| VAPI | 09377763409 |
| RAJKOT | 09327774777 |
| UTTAR PRADESH OFFICE | |
| VARANASHI | 09336939327 |
| VARANASHI | 0542-2454585 |
| MAUNATH BHANJAN | 09335015165 |

એક છેલ્લી વિનંતી

વાતાં

અર્જુનસિંહ કે. રાહિલજી

આજો પ્રાર્થના હોલ ખીચોખીચ ભરાઈ ગયો છે. કેટલાક વિદ્યાર્થીઓ તો પાછળ પાથરણું ના હોવા છતાં પણ નીચે જમીન ઉપર બેસી ગયા છે. ગામના કેટલાય નાગરિકો પણ જ્યાં જ્યાં મળી ત્યાં વચ્ચોવચ્ચ બેસી ગયા છે. પ્રાર્થના હોલનું સ્ટેજ શાશ્વતારાઈ ગયું છે. બરાબર વચ્ચે મા સરસ્વતીનો મોટો ફોટો મૂકેલો છે જેને ગુલાબનાં ફૂલનો હાર પહેરાવેલો છે. મોટાભાગના મહેમાનો પણ આવી ગયા છે — માત્ર મુખ્ય મહેમાન એવા જિલ્લા શિક્ષણાધિકારી સાહેબના આવવાની રાહ જોવાઈ રહી છે. ત્યાં હાજર રહેલા દરેકને જાણે કે આ પોતાના ઘરનો અંગત પ્રસંગ હોય એવું લાગી રહ્યું છે. અને કેમ ના લાગે? દલાલ સાહેબ દરેકને પોતાના અંગત વડીલ હોય એમ રાખતા હતા અને આ તેમનો વિદાય સમારંભ હતો. હવે આવતીકાલથી આ હોલની દીવાલો, આ સ્કૂલની દીવાલો પણ દલાલ સાહેબનાં દર્શન માટે તરસવાની હતી. સ્ટેજ ઉપર મૂકેલા ટેબલના એક ખૂણા ઉપર દલાલ સાહેબ નિરાશ વદને માણું મૂકી બેઠા છે અને ચારે બાજુ એક તરસી નિગાહોથી જોઈ રહ્યા છે. તેમને પણ મનમાં એમ થતું હશે કે આવતીકાલથી આ ચહેરાઓ જોવા તેમની આંખો તરસ્યા જ કરવાની છે. આવા હસતા-રમતા ચહેરા હવે ફરી કદી તેમને જોવા મળવાના નથી...!

દલાલ સાહેબ એટલે એક એવું વ્યક્તિત્વ જેના માનમાં આ ગામ અને આજુબાજુના ગામનાં માણસો જ નહીં પણ ચકલાઓ પણ માનથી માણું નમાવી દેતાં...! દલાલ સાહેબ પોતાની જિંદગીમાં લગભગ પાંત્રીસ વરસ આ શાળામાં ગુજરાઈ હતા. તેમણે આ શાળાને નોકરીનું સ્થળ નહીં પરંતુ પોતાનું ઘર અને પરિવાર માણું હતું. આ સંસ્થાને બેઠી કરવામાં તેમણે લોહી-પસીનો એક કર્યા હતા. કોઈપણ પ્રકારની વળતરની ભાવના વિના તેમણે આ શાળાને આગળ લાવવા તનતોડ પ્રયત્નો કર્યા હતા. નવા નવા ભણીને આચ્યા ત્યારે તો તેઓ યુવાન હતા અને યુવાનીમાં તેઓ ધારત તે કરી શકત. પાછા તેમના વિષયો પણ કેવા હતા? રૂપિયાની ટંકશાળ પારી શકે તેવા...! ગણિત, વિજ્ઞાન અને આંકડાશાસ્ક...! તેઓ ધારત તો પોતાના ઘરમાં રૂપિયાનો વરસાદ વરસાવી શકત — આ વિષયોની મદદથી...! પણ ના... તેમણે તો સેવાનો ભેખ લીધો હતો. તેમને રૂપિયા કમાવવામાં રસ નહોતો. તેઓ અંગત રીતે માનતા હતા કે જીવન જીવવા માટે પૈસાની જરૂર છે પણ તે માત્ર જીવન નિર્વહ પૂરતા જ...! વધારાના પૈસા ઉચ્છૃંખલ બનાવી દે છે - વ્યક્તિને પોતાને

અને તેના સંતાનોને પણ...! સંતાનો બાપના પૈસે તાગડવિના કરતાં થઈ જાય છે...! અને જીવન નિર્વહ માટે તો સરકાર જે પગાર આપે છે તે પૂરતો જ છે — વધારાનાં નાણાંની જરૂર નથી...! તેઓ આ શાળાનાં અને પોતાના વર્ગના વિદ્યાર્થીઓમાં પોતાના સંતાનોનું જ પ્રતિબિંબ જોતા હતા. ક્યારેય ટ્રયુશનો કરીને પૈસા કમાવાનો તેમણે મોહ રાખ્યો નહોતો. માત્ર એટલું જ નહીં પણ પોતાના વર્ગના વિદ્યાર્થીઓને પણ સલાહ આપતા કે તેઓ જે વિષય ભણાવે છે તેમાં ના સમજ પડે તો ગમે ત્યારે પૂછી શકો છો. ગમે તેવો અધરો દાખલો કેમ ના હોય — દલાલ સાહેબ તેને ચપટી વગાડતામાં ગણાવી દેતા અને એટલું જ નહીં, સામે બેઠેલા વિદ્યાર્થીઓ પણ જાતે જ તે દાખલો ચપટી વગાડતામાં ગણી શકે એવી રીતે સમજાવતા પણ ખરા! એટલે તો શાળાના વિદ્યાર્થીઓ તેમને દાદા તરીકે જ ઓળખતા. અને હીકીતમાં તેઓ ગણિતના દાદા હતા. અરે! નવા આવવાનાર વિદ્યાર્થીઓને પણ જૂના વિદ્યાર્થીઓ સલાહ આપતા કે જો તમારા વગમાં દાદા ગણિત લેતા હોય તો બીજે કોઈ જગ્યાએ ટ્રયુશન પણ જવાની જરૂર નથી. દાદાની તેમાં માસ્ટરી છે. તેમના જેવું ગણિત આખા ગામમાં તો શું પણ શહેરમાં પણ કોઈ નહીં ભણાવે — તેની ગેરન્ટી. એટલે તો જૂન મહિનામાં જ્યારે નવું ટાઈમટેબલ બનનું હોય ત્યારે દાદાને પોતાના વર્ગમાં બેંચી જવા માટે વિદ્યાર્થીઓમાં પડાપડી થતી. બધા જ વર્ગના વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ સાહેબ પાસે દાદાને પોતાના વર્ગનું ગણિત આપવા માટે રજૂઆત કરતા. પણ પ્રિન્સિપાલ સાહેબ પણ શું કરી શકે? દલાલ સાહેબને વધુમાં વધુ તો સાત વર્ગનું ગણિત આપી શકે. તેનાથી વધારે આપવા જાય તો દલાલ સાહેબનો વર્કલોડ વધી જાય! તો પણ દલાલ સાહેબ જાતે વિદ્યાર્થીઓની વિનંતી ધ્યાનમાં રાખી એકાદ કલાસનું ગણિત વધારે લઈ લેતા — કહેતા કે મારા બાળકોનું ગણિત સુધરતું હોય તો હું ફી પીરિયડ નહીં લઉં. મા સરસ્વતી મને સતત ભણાવ્યા કરવાની શક્તિ અવશ્ય આપશે જ...! શિક્ષકોમાં તો ચણભણ થતી જ કે બહુ દોઢ ડાખ્યો અને ચોખલિયો છે. ફી પીરિયડ જતા કરવાની મૂખર્યમી શું કરવા કરવાની? સરકાર, શાળા કે વિદ્યાર્થીઓ કાંઈ વધારાનો પગાર થોડા જ આપી દેવાના છે? અને સરકાર તો જો એક પૈસો પણ વધારે ચુકવાઈ ગયો હશે તો રીકવરી કાઢશે. અરે... પેન્શન અટકાવશે! તે વખતે કોઈ એવું નહીં વિચારે કે દલાલે વધારે કામ કર્યું છે તો એ પૈસો જતો કરીએ...!

માત્ર એટલું જ નહીં, પણ દલાલ સાહેબ રીસેસમાં પણ પોતાની સેવાઓ આપતા. પીરિયડમાંથી આવીને તેઓ સ્ટાફરુમમાં બેઠા હોય, રીસેસનો ટાઈમ હોય અને જો કોઈ વિદ્યાર્થી પોતાની રિફિકલ્ટી લઈને આવે તો તેઓ હોંશે હોંશે તેની રિફિકલ્ટી સોલ્વ કરી આપતા. અરે... શાળાના વિદ્યાર્થીઓ માટે તો તેઓ પોતાના પારિવારિક જીવનને પણ હોડમાં મૂકી દેતા. સાંજે સ્કૂલેથી છૂટીને ઘેર ગયા હોય, સાંજે ફેશ થઈને ફેભિલી સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય અથવા ફરવા જવાના હોય કે પછી કોઈક પિક્ચર જોવા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હોય અને નીકળવાના ટાઈમે જ જો કોઈ વિદ્યાર્થી પોતાની રિફિકલ્ટી લઈને આવે, તો બીજો કોઈ હોય તો કાઢી મૂકે અથવા પછી આવજે એવું કહે. પણ દલાલ સાહેબ તો તરત જ તેને દાખલો ગણાવવા બેસી જાય અને પાછા ચહેરા ઉપર કોઈપણ પ્રકારના અણગમા વગર જ...! તેમના પત્ની અને બાળકો નિરાશ થઈ જાય, તેમના પત્નીનું મોં છાશિયું થઈ જાય તો પણ દલાલ સાહેબ તો તરત જ કહે — એ આપણાં જ બાળકો છે, તેમને મુશ્કેલીમાં આપણે મદદ ના કરીએ તો કોણ કરે... ભગવાન તેમાં રાજુ ના જ રહે...!

આવા દલાલ સાહેબ...! તેમના હાથ નીચે ભણેલા અસંખ્ય વિદ્યાર્થીઓ આજે તો ઉચ્ચ હોદા ઉપર બેઠેલા હતા. કેટલાય ડોક્ટરો અને એન્જિનિયરો તેમના હાથ નીચે તૈયાર થયા હતા. પણ દલાલ સાહેબ તેમનો પણ પોતાના સામાજિક જીવનમાં દુરુપયોગ ના કરે... એક વખત તેમની સાસરીના કોઈક સગાને તેમના જ ગામમાં ડો. પરીખના દવાખાનામાં દાખલ કર્યા હતા. ડો. પરીખ તેમની પાસે જ ભણેલા હતા. દલાલ સાહેબનું માન જાળવતા હતા. ગામમાં અને આજુભાજુના પંથકમાં ડો. પરીખની નામના હતી. પણ તે ખૂબ જ મોંઘો ડોક્ટર હતો. પેલા સગાનું બીલ વધારે મોટું હતું એટલે તેમણે દલાલ સાહેબનો સંપર્ક કર્યો કે બીલમાં કાંઈક રાહત કરાવી આપો. પણ દલાલ સાહેબે પોતાની પત્નીના મોંઘે તો કહી જ દીધું કે એ તો ખમતીધર માણસ છે, પેસેટકે સુખી છે. તેને બીલમાં રાહતની શું જરૂર છે? હા... કદાચ કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિ હોય તો હું ડોક્ટરને તેનું આપું બીલ છોરી દેવાનું કહું. અરે! તેના બદલે હું બીલ બરી દઉં. બાકી આ વ્યક્તિ માટે તો હું મારો બોલ નાખવા તૈયાર નથી જ. તેમની પત્ની આ કારણથી તેમનાથી રીસાઈ ગઈ હતી. ચાર-પાંચ દિવસ સુધી તો તેમની સાથે અબોલા લીધા હતા. તો પણ તેમણે ગણકાર્યું નહોતું. આવા શિક્ષક પ્રત્યે ગામના કૂતરાને પણ માન હોય તેમાં શી નવાઈ??

અનો અર્થ એવો નહીં કે દલાલ સાહેબ દીલા હતા અથવા બીક્ષણ હતા. તે કોઈથી ગભરાય નહીં તેવા સિદ્ધાંતવાદી અને સત્ય વક્તા હતા. તે સમયે બોર્ડના પેપરો ઘરે તપાસવા માટે મોકલાતા હતા. એક વખત તેમની પાસે એલિસબ્રિજ કેન્દ્રના પેપર આવ્યા હતા અને તે સમયના રાજ્યના ગૃહપ્રધાનની ચિહ્ન લઈ એક પાર્ટી તેમના ગામના પી.એસ.આઈ. પાસે આવી જેમાં

દલાલ સાહેબના નામનો ઉલ્લેખ હતો. એટલે પી.એસ.આઈ. તેમની પાસે આવ્યા અને કોઈક વિદ્યાર્થીના માર્ક વધારી આપવાની ભલામણ કરી. સાથે સાથે દલાલ સાહેબ માગે તેટલા પૈસા આપવાની પણ તૈયારી બતાવી. પણ માર્ક પેલી વ્યક્તિ કહે તેટલા કરી આપવાની વિનંતી કરી. પણ આ તો દલાલ સાહેબ...! એમ પૈસાની લાલચમાં થોડા આવી જાય. તેમણે આવો અન્યાય કરવાની ચોખ્ખી ના પાડી દીધી. તે વિદ્યાર્થીને જો માર્ક વધારી આપે તો તેના કારણે તેના કરતાં વધારે હોશિયાર વિદ્યાર્થીને તો અન્યાય જ થાય ને? તેમણે ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે આવું કામ તેમનાથી નહીં થાય. મારે પૈસા જોઈતા નથી...! એટલે પી.એસ.આઈ.એ પોતાના હોદાનો દુરુપયોગ કરી તેમને ધાક્કામકી આપી. એ પણ બિચારો શું કરે? ગૃહ પ્રધાનની ભલામણ ચિહ્ની હતી. દલાલ સાહેબે સાફ સાફ કહી દીધું કે તમારે જે કરવું હોય તે કરજો. સરકાર મારી સામે કોઈપણ પ્રકારના પગલાં ભરશે તો પણ મને વાંધો નથી. પણ મારાથી આ ખોટું કામ ક્યારેય થશે નહીં. આ વાત જ્યારે ગામલોકોએ જાણી ત્યારે તેમની પાસે ભણી ગયેલા વિદ્યાર્થીઓનું મસ્તક ગર્વથી ઊંચું થઈ ગયું કે... ના... આપણે એક સિદ્ધાંત માટે માથું પણ આપી શકે તેવા શિક્ષક પાસે ભણી ગયા છીએ...!

એક વખત તેમણે પોતાના વર્ગના એક વિદ્યાર્થીને પકડ્યો. તે વિદ્યાર્થી દરરોજ રીસેસ પછી સ્કૂલમાંથી ભાગી જતો. આ વાત તેમના ધ્યાન ઉપર આવી તેના બીજા જ દિવસે તેમણે તે વિદ્યાર્થીને બોલાવ્યો. અને તેને પ્રેમથી પૂછ્યું કે તું વારંવાર સ્કૂલમાંથી કેમ નાસી જાય છે? જવાબમાં તે વિદ્યાર્થી પ્રૂસકે પ્રૂસકે રડી પડ્યો. દલાલ સાહેબ તેને પોતે જાતે ઉભા થઈને પાણી આપ્યું. તેના બરડે હાથ ફેરવીને પૂછ્યું કે તું ગભરાયા વિના જે હોય તે સાચું કહી દે. હું તને ન તો પ્રિન્સિપાલ પાસે લઈ જઈશ કે ના કોઈપણ પ્રકારની શિક્ષા કરીશ. અને તે વિદ્યાર્થીએ જે વાત જણાવી તેનાથી તેમનું હેઠું પણ દ્રવી ગયું. તેના પણ નહોતા અને તેની મા મજૂરી કરીને તેને ભણાવતી હતી. પણ જ્યારે વધારે મજૂરી ચાલતી હોય - ખાસ કરીને કપાસ વીજાવાની કે જેમાં વીજેલા કપાસને વજન ઉપર મજૂરી મળતી ત્યારે તે તેને પણ સાથે લઈ જતી. દલાલ સાહેબે તેને કહી દીધું કે જ્યારે એવો સમય હોય ત્યારે તે દિવસે તને જેટલી મજૂરી મળતી હોય તેટલા પૈસા હું તને આપી દઈશ, પણ તારે સ્કૂલથી ભાગવાનું નહીં...! પછી તો એ વિદ્યાર્થી ભણીગણીને મોટો સાહેબ થયો. હજુ પણ તે જ્યારે ગામમાં આવે ત્યારે દલાલ સાહેબને મળવા અચ્યુક આવે જ છે. અરે! પહેલી વખત આવ્યો ત્યારે તો સાહેબને રોકડા રૂપિયા પણ આપવાનો પ્રયાસ કર્યો હતો પણ દલાલ સાહેબે તેના એ પૈસા પ્રેમથી પાછા આપી દીધા હતા એવું કહીને કે — મેં તારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો. મારી ફરજ હતી અને મેં તે બજાવી છે. માટે મારાથી તેનું વળતર

જિંદગીનો નિચોડ

વાતાં

ગુલાબયંદ ડી. સાવલા

નિવૃત્તિકાળ ગમગીનીભર્યો હોય છે. એ જીવન સમાપ્તિ તરફ લઈ જતો ભાસે છે. સોહનલાલને જ્યારે ઓફિસ તરફથી ગ્રેજ્યુએટી અને પ્રોવિંટ ફિઝની રકમ કલેઇમ કરવાના ફોર્મ મળ્યા ત્યારે થોડી પણો માટે એ આનંદમાં આવી ગયા. બસ, હવે તો ત્રણ મહિના જ આ ફસરડો કરવાનો. પછી તો એક મોટી રકમ હાથમાં આવી જશે. એ રકમને કોઈ બેંક કે સારી કંપનીમાં રોકી, એના વ્યાજમાંથી એય મજાનું શાંતિભર્યું જીવન જીવીશું. ઓફિસ પહોંચવા ન વહેલા ઉઠવાનું કે ન કોઈ દોડધામ કરવાની. શાંતિથી મોડા ઉઠીશું, કલાક - દોઢ કલાક સુધી છાપું વાંચીશું, મોડે મોડે બીજો એક કપ ચાનો ચડાવીશું, જમીને સરસ મજાની ઊંઘ બેંચી કાઢીશું ને...ને... અને પછી શું?

પછીનો સમય કેમ પસાર કરવો? બપોરે ઊંઘા પછી રાતે વહેલી ઊંઘ આવશે ખરી? આ વિચારમાત્રથી સોહનલાલને નિવૃત્તિ જીચી નહીં. પણ થાય શું? નોકરીના નિયમાનુસાર એ સાઈ વર્ષ પૂરા કરતા હતા. હવે એમણે ખુરશી ખાલી કરવી પડે. એ ખુરશી એક દિવસ ખાલી પણ થઈ ગઈ. સોહનલાલે એના વિદાય સમારેબમાં પ્રશંસાના શબ્દો મેળવ્યા, પુષ્પગુંધો પ્રામ કર્યા. મોટા સાહેબે એમના હાથમાં મોટી રકમનો ચેક આપ્યો. ચેક, વિદાયના પ્રતીક સમી બેટ અને પુષ્પગુંધ લઈ એ વેર આવ્યા. એ રાત આનંદમાં વિતાવી. કાલથી હવે ઓફિસના વેતરામાંથી છૂટવ્યા!

નિવૃત્તિ પછીના પંદર દિવસમાં કંટાળી ગયા. હવે એમનો સમય પસાર થતો ન હતો. ઘરમાં એમની હાજરીથી પુત્રવધૂની સ્વતંત્રતામાં કાપ મૂકાઈ જતો એને લાગ્યો. એમને પોતાને પણ આખો દિવસ ઘરમાં બેસી રહેવાનો કંટાળો આવ્યો. અને થયું કોઈ પાર્ટ ટાઇમ કામ તો હોવું જોઈએ. બપોરના બારથી ચાર સુધીના સમયની કોઈ નોકરી મળી જાય તો મન રોકાયેલું રહે. એમણે હવે નોકરી શોધવાનું શરૂ કરી દીધું. પણ સાંઘિક વટાવી ગયેલાને કોણ નોકરીએ રાખે? ચાર કલાકમાં સાત કલાક જેટલું કામ બેંચાવવાનું હોય ત્યાં વૃદ્ધ નહીં, કોઈ યુવાન જ ખપમાં આવે. ચાર પાંચ મહિના એ આમથી તેમ રખડ્યા. છેવટે એક સેવાભાવી સંસ્થામાં એમને આવી નોકરી મળી આવી. જે કે એ ધારતા હતા એટલો પગાર તો અહીં મળવાનો નહોતો. સોહનલાલ નિરાશ થઈ ગયા. પછી એમણે જાતે જ વિચાર્યું કે આ સેવાભાવી સંસ્થા આટલોય પગાર તો આપે છે! બે જ વ્યક્તિની બનેલી આ ઓફિસ ચલાવવાની છે. કામ તો ખાસ

કંઈ છે નહીં. રક્તદાતાઓની યાદી તૈયાર કરવાની. જેને રક્ત જોઈતું હોય એમનું સરનામું નોંધી લેવાનું. બ્લડશ્રૂપ પ્રમાણે રક્તદાતાને ફોન કરવો. સ્વેચ્છા રીતે રક્તદાન કરવા આવનારે બાજુની હોસ્પિટલમાં લઈ જઈ રક્ત લેવાની વ્યવસ્થા કરવાની, ચક્ષુદાન માટે પણ ફોર્મ ભરાવવાના.

સોહનલાલે આ કામ સ્વીકારી લીધું. એ દરરોજ બપોરે બાર વાગે ઓફિસમાં પહોંચી જતા. એમની મદદનીશ યુવતી પટાવાળાની મદદથી ઓફિસ ખોલતી. પત્રો ટાઇપ કરતી, રજિસ્ટરોમાં ઉતારા કરતી. એ દરમિયાન સોહનલાલ આવી જતા.

સોહનલાલને શરૂ શરૂમાં આ કામમાં જરાય મજા ન આવી. ચાલીસ વર્ષ સુધી નોકરી કરી હતી એના કરતા આ કામ કોઈ જુદા જ પ્રકારનું હતું. લોહી, મૂતરેહની આંખ, દર્દી, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ — આ શબ્દો જ હૃદયમાં રલાનિ ઉભા કરી દેતા. પણ આ સિવાય બીજો છૂટકો ન હતો. ભલું થજો ટ્રસ્ટીઓનું કે એમના જેવા વૃદ્ધને કામ આપ્યું, નહિંતર આ જમાનામાં કામે રાજે પણ કોણ?

ચાર-છ મહિનામાં એ ગોઠવાઈ ગયા. ઘણા બધા રક્તદાતાઓના, રક્તની જરૂરિયાતવાળા કુટુંબોના એમના પર ફોન આવતા. ફોન પર થતી મૂછુ વાતો, ઉપકારના શબ્દો અને પુણ્ય પ્રામ કરનારા આશિર્વચનો સાંભળી એમનું અંતઃકરણ પ્રકૃતિલિત થવા લાગ્યું. ચાલીસ વર્ષની સરકારી નોકરીમાં એમને જે શબ્દો સાંભળવા નહોતા મળ્યા એ આ ચાર મહિનામાં સાંભળવા મળ્યા. સોહનલાલને પહેલી વખત થયું કે એમની સંસ્થા દ્વારા એ કેટલા ઉપયોગી માણસ છે! એમનો ઉત્સાહ વધવા લાગ્યો. હવે એ નોકરીને માત્ર બારથી ચારની પાર્ટટાઈમ નોકરી નહોતા સમજતા, જતી ઉમરે પુણ્ય કમાવવાની એક પ્રવૃત્તિ સમજતા હતા.

એક દિવસ રજિસ્ટર તપાસતા સોહનલાલ બેઠા હતા ત્યારે એમના મનમાં એક વિચાર આવ્યો. રક્તદાતાઓની જેટલી સંખ્યા હોવી જોઈએ એટલી સંખ્યા રજિસ્ટરમાં નથી. કેટલાક રક્તદાતાઓ દર ત્રણ મહિને સ્વેચ્છાએ રક્તદાન કરવા આવે છે. એમની પાસેથી ટ્રૂક સમયમાં ફરીવાર રક્ત લઈ શકાય નહીં. વળી આર.એચ. નેગેટીવ પ્રકારના રક્તની અધ્યત છે. કોઈ વખત એવો કેસ આવી જાય તો શું કરવું?

વધુ રક્તદાતાઓ કઈ રીતે ઊભા કરવા? એ વારંવાર હોસ્પિટલમાં આવતા-જતા રહેતા. ઘણી વખત હોસ્પિટલમાં જુદા જુદા વોર્ડમાં દર્દીને, અન્ન કુટુંબીજનોને મળવા જવાનું થતું. હોસ્પિટલની વારંવારની આ વિઝિટ્સમાંથી એમને એક વિચાર આવ્યો. જે જે દર્દીઓને એમની સંસ્થા દ્વારા રક્તની બોટલ પહોંચાડાઈ હતી એમની પાસે આ સેવાભાવી પ્રવૃત્તિ વિશે કશુક ટૂંકમાં લખાવવું. સંસ્થાને ઉદ્દેશીને લખાયેલા ટૂંકા પત્રો એકઠા કરવા. પછી એ પત્રોની ચાર-છ પાનાની નાનકડી પત્રિકા છપાવી, કોલેજના વિદ્યાર્થીઓમાં ફરતી કરી હોય તો? એમાંથી કદાચ નવા રક્તદાતાઓ મળી આવે. સોહનલાલે ટ્રસ્ટીઓને વાત કરી. બધાને આ વિચાર પસંદ પડ્યો. હોસ્પિટલના ડોક્ટર સાથે મસલત કરી, એમની મદદ વડે એ દર્દીઓના જ હસ્તાક્ષરોમાં કેટલાક પત્રો મેળવી શક્યા. એ પત્રોની પાંચેક હજાર જેટલી નાનકડી પત્રિકા છપાવી.

હવે સોહનલાલ એ પત્રિકાઓને થેલામાં નાખી બેન્કમાં ઉપડ્યા, જ્યાં એમનું ખાતું હતું. એમના આશ્ર્ય વચ્ચે પહેલા જ પ્રયાસમાં એમને વીસ-પચ્ચીસ રક્તદાતાઓ મળી ગયા. એ પછી એક કોલેજના પ્રિન્સિપાલને મળ્યા. ત્યાંથી પણ ઘણો સારો પ્રતિભાવ મળ્યો. સાઈ વર્ષ વટાવી ગયા પછી સોહનલાલની શારીરિક શક્તિઓ મંદ થઈ ગઈ હતી. પણ છતાંય દરરોજ બપોરે ચાર વાગે એ નવા રક્તદાતાઓની શોધમાં જુદીજુદી કંપનીઓ, એની શાખાઓ, કોલેજો, શાળાઓ, બેંકોમાં ફરવા લાગ્યા.

જ્યારે કોઈ પુણ્યનું કામ કરવા નીકળે છે ત્યારે એને નિરાશ થવું પડ્યું નથી. ઈશ્વરે ખરાબ માણસોની સાથે સારા માણસોનું પણ સર્જન કર્યું છે એવું સોહનલાલને હવે લાગવા માંડ્યું. કેટલાય સેવાભાવી સર્જનોનો પરિચય થયો. ડોક્ટરોના માયાભર્યા ચહેરાઓની ઓળખાણ થતી, નવા નવા ચહેરાઓની પહેચાન થતી, જે પાછળથી સ્વજન જેવા થવા લાગ્યા. આ કામમાંથી પરવારી સોહનલાલ રાત્રે ઘરે જતા ત્યારે પણ ઘરે એમના પર ફોન આવતા. આજ સુધીમાં એમના પર ભાગ્યે જ ઘરે ફોન આવતા. સોહનલાલનો નિવૃત્તિકાળ હવે સંપૂર્ણપણે પ્રવૃત્તિમય બની ગયો. હવે તો એ અગિયાર વાગે ઓફિસે પહોંચી જતા એને ઘણીવાર મોડી રાત્રે પાછા આવતા.

એક સવારે એ રેડિયો સાંભળતા સાંભળતા સવારનું છાપું વાંચતા હતા ત્યારે એમણે સમાચાર સાંભળ્યા : માહુંગા રેલવે સ્ટેશન પાસે એક બહુ જ મોટો ટ્રેન અક્સમાત થયો છે. કેટલાય માણસો મૃત્યુ પામ્યા છે, કેટલાય ઘવાયા છે. સોહનલાલે છાપું

પડતું મૂકી કાનને રેડિયોસેટ સામે ધરી દીધા. થોડીવારે એક બીજી અપીલ આવી. ડોક્ટરો, નર્સો, સેવાભાવી કાર્યકરો તાત્કાલિક રેલવે સ્ટેશન પર પહોંચી જાય. સોહનલાલ સ્નાન કરવા પણ ન રોકાયા. જરૂરથી કપડા બદલાવી, ઓફિસની ચાવી લઈ ઘરમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળતા પહેલા એની મદદનીશ યુવતીએ આપેલા કેર ઓફ નંબર પર એને પણ સંદેશો પાઈવી દીધો. ઓફિસ ગયા પછી એમણે હોસ્પિટલના ડોક્ટરોને ફોન કર્યા. એમની પાસેથી સુચના મેળવી, એ રક્તદાતાઓને ફોન કરવા લાગી ગયા. બે કલાક પછી એમની ઓફિસ માણસોથી ઉભરાવા લાગી.

સોહનલાલની જિંદગીનો એ ઉત્તમ દિવસ હતો. રાતે બાર વાગે એ ઘરે પહોંચ્યા ત્યારે સ્નાન કરી એમણે ઈશ્વરની છબી સામે દીવો કર્યો અને એનું સ્મરણ કરી બોલ્યા, ગ્રભુ, આટલા વરસો સુધી હું ક્યારેય કોઈનું સારું કર્યું નથી. આજે મારા હાથે થોડુંધણું સારું કામ કરાવી મારી જિંદગીને સાર્થક કરાવવા બદલ હું તારો આભાર માનું છું....

સોહનલાલાલે આ સંસ્થામાં પૂરા પંદર વર્ષ કામ કર્યું. મૃત્યુ પર્યંત એ આ સંસ્થામાં કામ કરતા રહ્યા. એમણે ટ્રસ્ટીઓ પાસે ક્યારેય પગાર વધારો માંયો નહીં. એ અહીં નોકરીએ રહ્યા ત્યારે નોકરીના ભાગરૂપે એમણે ટ્રસ્ટીઓ સાથે એક શરત કરી હતી. એ શરત એવી હતી કે પગાર ઉપરાંત ઘરથી ઓફિસે આવવા જવા માટે એમને ઓફિસ તરફથી રેલવેનો પાસ આપવામાં આવે. ટ્રસ્ટીઓએ એમની આ શરત મંજૂર રાખી કર્યું હતું કે દર મહિને વાઉચર પારી પેટીકેશમાંથી પાસના પૈસા લઈ લેવાના. એમણે પંદર વર્ષની આ નોકરીમાં શરૂઆતના સમયમાં માત્ર અગિયાર જ વાઉચર પાડ્યા હતા. પછી તો એમણે પાસના પૈસા લેવાના પણ બંધ કરી દીધા હતા.

જીવનની આથમતી સંધ્યાએ સોહનલાલ કોઈની પાસે બોલ્યા હતા : જિંદગી આખીમાં બે નોકરીઓ કરી. એક સરકારી અને બીજી સંસ્થાની. સરકારી નોકરી જિંદગીનો ઘસડબોળો હતો પણ આ બીજી નોકરીમાં ખરેખર આનંદ હતો. દિલથી મેં આ કરી છે. એનો આનંદ એટલો બધો છે કે જિંદગી જીવવા જેવી લાગે છે...

સારા કામ કર્યાનો પણ એક સંતોષ હોય છે. એ સોહનલાલના જિંદગીના સરવૈયાનું એક વાક્ય છે. એમાં સોહનલાલની જિંદગીના પંચોતેર વર્ષનો નિચોડ છે.

મા. ૧૦૧૬૧ ૪૪૬૩૬

PRAKASH METAL CRAFT PVT. LTD.

E-56/57, Sarvoday Nagar, 1st Panjrapole Lane, Mumbai-4.

Tel. : 2242 7461 Telefax : 2242 6636

E-mail : prakashmetalcraft@rediffmail.com • Website : www.prakashmetalcraft.com

MFG. ST. STEEL UTENSILS

Prakash®

કેમ છો માર્સ્ટર સાહેબ?

વાતાં

ભારકરભાઈ ભાવસાર

નાનું એવું ઠળિયા ગામ. પણ સ્વચ્છતામાં શ્રેષ્ઠ ગામ. દરેક વર્ગની વસતિ. એમાં પાછી ગામના પાદરમાં સ્કૂલ, રણિયામણું ફળિયું, આગળ જુદા જુદા પ્રકારના ફૂલ છોડો તો ઘટાઘૂમ લીમડાઓ. લીમડાની ડાળીએ બાળકોને જુલવા માટેના હિંચકાઓ. વહેલી સવારે ખાખી જભ્બો-પેન્ટમાં અને આગળ આઈકાર્ટ લટકાવેલ રમેશ પણ્ણાવાળો વટ સાથે સ્કૂલમાં પ્રવેશે. સૌથી પહેલા વૃક્ષોને પાણી પાય. આખા ફળિયામાં સાફ્સૂફી કરે. પછી સ્કૂલનો દરવાજો ખોલે. સૌથી પહેલા જ્વેક બૉર્ડ સાફ્ કરે, ડસ્ટર અને ચોકપણી પણ મૂકે. બસ, આ રમેશની ફરજ અન્ય માટે ઉદાહરણીય. પછી તો સમય થતા બાળકો આવવા માંડે. સર્વે સર્વેના વર્ગખંડમાં ગોઠવાતા જાય. પ્રાર્થના થાય, ત્યાં તો હેડમાસ્ટર ગુણવંતભાઈ પાઠક ઉઝે ગુરુજી આવે. દરેક કલાસ રૂમમાં આંદો મારે. પછી પોતાની સાદગીવાળી ચેમ્બરમાં ખુરશી પર ગોઠવાઈ જાય. ચેમ્બરમાં માત્ર સરસ્વતી માનો ફોટો. બધા જ શિક્ષકો જે તે વિષયના નિષ્ણાત, પણ સમય પહેલા હાજર થઈ જાય અને પોતાના વર્ગખંડમાં પહોંચ્યો જાય.

શિક્ષક રચિકાંત કોઈ વખત મુડમાં હોય તો શિક્ષણ સાથે સુંદર અવાજમાં ‘શિવાજુને નીદરદુન ન આવે... માતા જીજાબાઈ પારણું જુલાવે...' ગાય. બાળકો ચકિત થઈ જાય. પછી શિવાજુનો ઈતિહાસ સમજાવે. વળી પાણું લહેકામાં ગાય ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના વૈનમાં કોણ જાણો...' વાહ રચિકાંતભાઈ બાળકોને ભણાવતા પહેલા પોતે ભાડીને આવે. શિક્ષણ જગત કેટલું વિશાળ છે?

કોઈ કોઈ વખત આચાર્ય પાઠક સાહેય પીરિયડ લેવા આવે. દરેક દીકરી પર વારાફરતી નજર ફેરવે. કોણ જાણે, શું શોધથા હશે. પીરિયડ પૂરો થતાં પાછા ચેમ્બરમાં જાય અને ધુસકે ધુસકે રડી પડે. આવો શિક્ષિત માણસ કેમ રડતો હશે? એ પણ રહસ્ય...

વર્ષો પહેલાની વાત છે. પતિ, પત્ની અને વહાલી પુન્ની રૂચિને દિલ્હી પાટનગરના વિવિધ સ્થળો ફેરવવા ટ્રેનમાંથી ઉત્તર્ય. પતિ-પત્ની સામાન ટ્રેનમાંથી ઉત્તરતા હતા. સામાન ઉત્તરાને પ્લેટફોર્મ પર જોયું ત્યાં રૂચિ ન દેખાણી. ઘણી શોધખોળ કરી પણ રૂચિ ન મળી. પોલીસમાં ફરિયાદ કરી પણ પત્તો ન લાગ્યો. એક અઠવાડિયું હોટલમાં રહ્યા. વિવિધ રીતે રૂચિની શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો. પતિ-પત્ની વિલા મોઢે ઠળિયા ગામ પરત ફર્યો. પણ દર્દને દિલમાં છુપાવ્યું.

આ બાજુ કસ્તુરચંદ શેઠ અને કંચનબેને છોકરીને જોઈ. અકળાયેલા હોય એ રીતે છોકરીને પૂછ્યું, ક્યાં જવું છે? કાંઈ જવાબ ન આપી શકી... પછી, દીકરી તાંતું નામ શું? તો કહે, ‘રૂચિ.’ બસ, આગળ ગામનું નામ કે અન્ય કાંઈ માહિતી આપી ન શકે. કસ્તુરચંદ શેઠ અને કંચનબેને છોકરીને પોતાની સાથે રાખી. ખાવા-પીવાનું રૂચિ પ્રકારનું આપે. દિવસો અને વર્ષો વીતતા જાય છે. ભણવામાં રૂચિ નાનપણથી હોશિયાર. જોતજોતામાં એમ.એ., એમ.ફિલ. થઈ ગઈ. એટલી દેખાવડી કે ન પૂછો વાત... જાણો સ્વર્ગલોકની સુંદરી... એની સુંદરતા એટલી આકર્ષે કે યુવાવર્ગ તીરછી નજરે જોવાનું ચૂકે નહીં. વિશાળ કપાળ, સુંદર નયન, નાકની નરમાશ, ભરાવદાર ગાલ, તો ફૂલની પાંખડી જેવા હોઠ... રૂચિ સ્કૂટર-મોટર પ્રાઈવિંગમાં પણ એકસપર્ટ.

શેઠ - શેઠાણીએ અનેક વખત રૂચિને કહેલ, તું દિલ્હી રેલવે પ્લેટફોર્મ પરથી મળી છી. રૂચિની આંખો ભીની થઈ જાય. એ પણ જંબે પોતાના મા-બાપને મળવા. પણ હવે ઘણું મોડું થઈ ગયું. જે શક્ય નથી. રૂચિ બહારથી આવે છે, કસ્તુરચંદ શેઠ રૂચિને એક પરબીડિયું આપે છે. ખોલે છે તો ઠળિયા ગામના આચાર્યનો ઓર્ડર હતો. થોડી ક્ષાળ રૂચિ આનંદિત થઈ, તો થોડી લાગણી હુભાણી... કારણ કસ્તુરચંદ શેઠ અને કંચનબેનને છોડવા પડશે. તેઓ ટેકા વગરના થઈ જશે. પણ કસ્તુરચંદ શેઠ બુદ્ધિશાળી હતા. તેમણે જ સામે ચાલીને કહ્યું, રૂચિ તારે નોકરી કરવાની છે અને શિક્ષણ ક્ષેત્રે નામના મેળવવાની છે. તારી અંદરની અંદરની ઈચ્છા પણ છે કે તું ગ્રામ્ય કક્ષાના બાળકોને ભણાવે-ગણાવે, જે દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરે છે. શેઠ શેઠાણી રૂચિને દિલ્હી રેલવે સ્ટેશને મૂકવા જાય છે. ટ્રેનમાં બેસાડ છે... ટ્રેન બીસલ મારે છે. રૂચિ બારીમાંથી હાથ હલાવતી રહે છે અને શેઠ શેઠાણી પણ દાણ જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધી હાથ હલાવે છે. શેઠ શેઠાણી ઘરે આવી પોકે-પોકે રડી પડે છે. બંને જુદી જુદી ખુરશીમાં ક્યાંય સુધી બેઠા રહે છે... જાણે દીકરી રૂચિ સાસરે વળાવી...

રૂચિ સવાર પડતા ઠળિયા સ્ટેશને ઉત્તરે છે. ત્યાં ગુણવંતભાઈ પાઠક રીસિવ કરવા આવેલ. રૂચિ ટ્રેનમાંથી ઉત્તરે છે. પાઠક સાહેબ આવકારે છે અને કહે, દીકરી મારે ત્યાં ચાલ... થોડા દિવસ પછી તને ગમે ત્યાં રહેવા જજે... પાઠક સાહેબ રૂચિને

પોતાના ઘરે લઈ આવે છે. રૂચિ સ્તબ્ધ થઈ ગઈ. ક્યાં શેઠ શેડાણીનો આલીશાન બંગલો અને અહીં ત્રણ રમ... ત્રણ રુમમાં કાથીવાળા ખાટલા... ઉપર ઉત્તમ પ્રકારના ગાંદલા. રૂચિ આરામ કરે છે. એક ટેબલ પર પાઠક સાહેબ, તેમના પત્ની અને એક નાની છોકરીનો ફોટો હતો. રૂચિ એકીટસે ફોટો સામે જોઈ રહી.

રૂચિનો સ્કૂલમાં આચાર્ય તરીકેનો પહેલો દિવસ હતો. દરેક શિક્ષક અને કર્મચારીઓને તેણીને આવકારી. રૂચિનું શિક્ષક રચિકાંત દ્વારા પુષ્પગુંઘથી સ્વાગત કરવામાં આવ્યું. રૂચિએ બધા જ બાળકો સાથે સ્નેહભર્યો સ્પર્શ આપ્યો. શિક્ષકોએ દરેક બાળકોને અને સ્ટાફને પેંડા વહેંચ્યા. પાઠક સાહેબે રૂચિના મુખમાં પેંડો મૂકી સ્વાગત કર્યું. રૂચિએ પાઠક સાહેબને પાયલાગણ કર્યું. પાઠક સાહેબે એટલું જ કહ્યું, ઈશ્વરના આશિવર્દિ પ્રામ થાય. તારા દરેક ધ્યેયને સિદ્ધિ મળે. આટલું બોલતા પાઠક સાહેબની આંખમાં જળજળિયા આવી જાય છે. શાળાનો સમય પૂરો થાય છે. પાઠક સાહેબ કહે, રૂચિ તમારા માટે નવા મકાનનો પ્રબંધ કરું? રૂચિ કહે, નહીં સાહેબ. આપને વાંધો ન હોય તો હું તમારી સાથે રહીશ. દીકરી, મને વાંધો ન હોય.

રૂચિ સવારના વહેલી ઉઠે, ત્રણ જણાના કપડા ધોવે. ઘર સાફ-સુફ કરે, રસોઈ કરે અને પછી સ્કૂલે જાય અને કહેતી જાય, સર તમે કાંઈ કામ ન કરતા. તમો પતિ-પત્ની રીયાર્ડ લાઈફને મોજથી માણો. રૂચિ, મનોમન વિચારે કે, આ પતિ-પત્ની ઉપર મને અંદરથી કેમ લાગણી થાય છે? મારે તેમની સાથે જ રહેવું છે. પાઠક સાહેબના પત્ની સવિતાબેન સ્કૂલનો સમય પૂરો થાય ત્યાં રૂચિ માટે ચા બનાવી રાખે. રૂચિ નિયત સમયે ઘરે આવી જાય અને ગરમા-ગરમ ચા પીવે. આજે રૂચિના મુખે શબ્દ સરી પડ્યા, બા, તમારી મારી કાંઈ ચિંતા ન કરવી. હું સાંજની રસોઈ બનાવી નાખીશ.

સવિતાબેન, રૂચિના મુખે બા શબ્દ સાંભળતા પોતાની વહાલ પુત્રી રૂચિ યાદ આવી ગઈ, જે વર્ષો પહેલા દિલ્હીના પ્લેટફોર્મ પરથી છૂટી પડી ગઈ હતી. એક સવારના પાઠક સાહેબ રૂચિ સામે એકીટસે જોઈ રહ્યા... રૂચિ કહે, શું વિચારી રહ્યા છો? પાઠક સાહેબ કહે, મેં પણ રૂચિ નામે મારી પ્રિય પુત્રીને દિલ્હી સ્ટેશનમાં પ્લેટફોર્મ પરથી ગુમાવી હતી. આજદિન સુધી એનો કાંઈ પત્તો નથી. ઘણ વખત એક ખૂણામાં બેસી ધુસકે ધુસકે રોઈ પડું છું. ક્યાં હશે, શું કરતી હશે, કુદરતને ખબર... રૂચિ કહે, પપ્પા શાંત થાઓ. ઈશ્વર બધું જ સારું કરશે. રૂચિને હવે ખાગી થઈ ગઈ કે પાઠક સાહેબ અને સવિતાબા બંને મારા માતા-પિતા છે. મારા શરીરમાં એક શિક્ષકનું લોહી છે, જેણે શિક્ષણ ક્ષેત્ર આગળ વધાર્યું છે. આજે રૂચિ ખાદીની સાડી, બ્લાઉઝમાં સજજ હતી. જાંજર સુંદર લાગતા હતા. આજે પંદરમી ઓગસ્ટ... સ્કૂલના પટાંગણમાં મોટાપાયે તૈયારી થયેલ. બાળકો અને વાલીઓ, શિક્ષકગણ, કર્મચારીગણ વગેરે ઉપસ્થિત થયેલ. સૌપ્રથમ માજ પ્રનિષ્પાલ શ્રી પાઠક સાહેબના વરદુ હસ્તે

ધજવંદન થયું. પવનના સુસવાટા સાથે તિરંગો જંડો ફરકાવા માંડ્યો. હાજર રહેલ સર્વે કોઈએ એટેન્શન સાથે સેલ્યુટ કર્યું અને રાખ્યાન શરૂ થયું : ‘જન ગણ મન...’

રાખ્યાન પૂરું થતાં આચાર્ય રૂચિએ પોતાનું ઉદ્ભોધન શરૂ કર્યું. પ્રિય બાળકો, ઉપસ્થિત સર્વે કોઈ...આજ પવિત્ર દિવસે ‘ભારત માતા કી જ્ય’ હું બોલવાનું છું. તમે સર્વે બોલવશો... સર્વે ઉપસ્થિતે ઊંચે અવાજે ‘ભારત માતા કી જ્ય’ બોલવાનું શરૂ કર્યું, જે ગામના સીમાડા સુધી સંભળાયું.

હવે, રૂચિ આગળ જતા બોલે છે દિલ્હી પ્લેટફોર્મ પરથી ગુમ થયેલ નાની છોકરી રૂચિ તે હું જ છું અને પૂ. પાઠક સાહેબ અને માતા સવિતાબેન એ જ મારા માતા-પિતા છે એમાં કોઈ બેમત નથી. ગ્રામવાસીઓ, હું તમારા ગામની જ દીકરી છું અને બાળકોને ભણાવવાની મારી ફરજ નહીં પણ મારું નિષાપૂર્વકનું કર્તવ્ય છે અને તે કરીશ જ. હું ખાત્રીપૂર્વક કહું છું કે, આ બાળકોમાંથી કોઈ વૈજ્ઞાનિક થશે, કોઈ ડોક્ટર થશે, કોઈ સત્યપ્રિય વકીલ, તો કોઈ સાહિત્યકાર થશે. વધુમાં કહું તો દેશના ભવિષ્ય ઘડતરમાં બાળકો જ મોટો ભાગ ભજવે છે. અસ્તુ.

વાચક મિત્રો, રૂચિ એક આદર્શ શિક્ષિકા છે તો માતા-પિતાની લાડકી દીકરી છે. રૂચિનું જીવન અન્ય દીકરીઓ માટે દીવાંડી સમાન છે. ■

પેન્સિલ પર એચ., એચ.બી.વન, એચ.બી.ટુ. વગેરે લખ્યું હોય છે તેનો શો અર્થ થાય?

પેન્સિલ પર તેના એક છેતે એચ., એચ.બી. વન વગેરે સંકેત અંગ્રેજુમાં લખેલા હોય છે. સામાન્ય રીતે ચિત્રકારો અને આર્કિટેક્ટો પેન્સિલના વપરાશમાં ખૂબ ચીવટ રાખતા હોય છે. તેમને ચોક્કસ પ્રકારના કામ માટે અમુક જ જાતની પેન્સિલની જરૂર પડે છે, જેથી તેઓ પેન્સિલ બરીદાતી વખતે તેની પર લખેલી સંજ્ઞા વાંચીને પછી જ પેન્સિલ પસંદ કરે છે.

સામાન્ય રીતે પેન્સિલમાં કાર્બનની પાતળી લીડ ગોઠવેલી હોય છે. આ લીડમાં કાર્બનનું પ્રમાણ વધુ હોય તેમ એ વધુ હાઈ ગણાય. અક્ષર એટલા ઘાટીલા (ડાઇ) આવે છે. આમ પેન્સિલની લીડમાંના કાર્બનનું પ્રમાણ વધતું જાય તેમ તેની સંજ્ઞામાં હાઈનેસનો કમ વધતો જાય છે. ખૂબ જાંખા અક્ષર આવે એવી પેન્સિલનો હાઈનેસ નંબર ઓછો હોય છે. એચ (H) મૂળાક્ષરની આગળનો નંબર પેન્સિલની લીડ કેટલી કણણ છે તે સૂચવે છે, જ્યારે મૂળાક્ષર બી (B) પેન્સિલની લીડ કેટલી કાળી (ધેરી કાળી) હોય તે સૂચવે છે.

આ લીડ ગ્રેફાઈટની બનેલી હોય છે અને તેમાં અમુક અંશે માટી ભણેલી હોય છે. જેમ ગ્રેફાઈટનું પ્રમાણ વધુ હોય તેમ પેન્સિલ લખવામાં કે ચિત્રો દોરવામાં વધુ સરળ પડે છે.

પાંપણા પ્રદેશમાં...

પ્રેરક કથા

ડૉ. શરદ ઠાકર

વિશ્વનો સૌથી ઘનવાન માણસ!

તાળ સંબંધોની સૂકી થૈ ગઈ,
યાદાનાં પંખી છતાં ટહુક્યા કરે.

‘આવો સાહેબ, ગરીબની ઝૂપડીને પાવન કરો. અંદર તો બહુ ગરમી લાગશે. અહીં ઓસરીમાં જ બેસો. થોડો પવન આવશે.’ ગજાનને સાહેબને આવકાર આપ્યો. અડધા અડધા થઈ જતાં કાથીનો ખાટલો ઢળી આપ્યો. ઉપર જૂની, ફાટેલી ગોદદી પાથરી દીધી. શિખર કચવાતા મને બેઠો. ગજાનન દેહની બાબતમાં પહેલેથી જ અડધા હતા, આવડા ‘મોટા’ સાહેબને પોતાના આંગણે આવેલા ભાજીને અડધા નાચે અડધા થઈ ગયા, દોડધામ કરી મૂકી.

‘સાંભળે છે રમા? મહેમાન આવ્યા છે. જરા બાબા જોડે પાણીનો જ્વાસ મોકલવાજે.’ અંદરના જાંખાપાંખા ઓરડામાંથી જાંજરની ધૂધરીઓ રણકવાનો અવાજ સંભળાયો. પછી કાચની બંગડીઓનો ખણકાટ અને પછી માટલાના ઢાંકણનો અવાજ. થોડીવાર પછી પિતણની થાળીમાં સ્ટીલનો જ્વાસ લઈને એક દસેક વર્ષનો છોકરો ઉઘાડા પગે બહાર આવ્યો. શિખરે એક અછડતી નજરમાં ઓરડાની અંદરનું દશ્ય કલ્પનામાં ભરી લીધું. ટ્રેને બદલે થાળી, ગંદો જ્વા, છલકાયેલું પાણી, છોકરાની ચડી ઉપર મારેલું થીગંદું, શિખરે માંડ માંડ બે ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા. હવે આ ઘરમાં બનાવેલી રસોઈ જમવી પણ પડશે? પણ એ સિવાય બીજો છૂટકો પણ ન હતો.

છેક અમદાવાદથી આખી ટુકડીને લઈને પોલ્યુશન કંટ્રોલ વિભાગ તરફથી શિખર મહેતા આ છેવાડાના શહેરમાં ‘સરપ્રાઇઝ ચેકિંગ’ માટે આવ્યા હતા. નાનકંકું સ્થળ હતું. સારી હોટેલનો અભાવ હતો. ફેક્ટરીના માલિકે ટુકડીના તમામ સત્યો માટે નોનવેજ ભોજન બનાવવાની વ્યવસ્થા કરાવી હતી, પણ શિખર માંસાહારનો જબરદસ્ત વિરોધી હતો. એના એકલા માટે અલગ શાકાહારી ભોજન બનાવવામાં આવે એ પણ શિખરને મંજૂર ન હતું.

ત્યાં જ કારખાનાના આધેડ વયના મહેતાજ ગજાનને સામેથી આગ્રહ કર્યો : ‘સાહેબ, એમ તે ચાલતું હશે? અમારા ગામમાંથી તમે ભૂખ્ય જાવ તો અમને પાપ લાગે. હુંયે બ્રાહ્મણનો દીકરો છું. ભલે પૈસાદાર નથી, પણ સાવ રોટલામાંથીયે જાઉં એટલો ગરીબ પણ નથી.’

કકડીને લાગેલી ભૂખ અને અંતરમાંથી ઉઠેલો આગ્રહ. શિખર ના ન પાડી શક્યો. સાથીદારો તંદૂરી ચિકનની જ્યાફત ઉડાવે ત્યાં સુધીમાં તો એ જમીને પાણો પણ આવી જશે એવી હૈયાધારણ આપીને એ ગજાનનની સાથે નીકળી પડ્યો.

ગજાનનનું કામ પાકું હતું. ક્યારે એ અંદર ગયો અને ક્યારે એની પત્તીના કાનમાં વાત નાખી આવ્યો એની શિખરને ખબર પણ ન પડી. માત્ર અંદરથી આવતા અવાજના આધારે એ સમજ શક્યો કે રસોઈ તૈયાર થઈ રહી છે.

‘સાહેબ, મૂળ તમે ક્યાંના?’ ગજાનન સામે પતરાની ભાંગેલી ખુરશીમાં બેસીને પૂછી રહ્યો હતો. આવા મધ્યમવર્ગિય માણસો પાસે સમય પસાર કરવા માટે અર્થ વગરની વાતો કરવાનો સારો એવો મહાવરો હોય છે.

‘અત્યારે અમદાવાદમાં રહું છું, પણ માંતું મૂળ ગામ જામનગર જિલ્લાનું ખીજડિયા. બહુ નાનું ગામ છે. તમે તો નામ પણ નહીં સાંભળ્યું હોય.’

ગામનું નામ સાંભળીને ગજાનનનો ચહેરો પૂનમના ચંદ્ર જેવો જીલી ઉઠ્યો. ‘કેમ નહીં સાંભળ્યું હોય? અરે, એમ કહો કે આ એક જ નામ સાંભળ્યું છે. અરે, મારી રમાનું પિયર ખીજડિયામાં જ છે.’ ગજાનન ગેલમાં આવી ગયા. ખુરશી પરથી ગબડવા જેવા થઈ ગયા. મોટાનું નાળયું ઓરડાની દિશામાં ફેરવીને તોપમાંથી ફેંકતા ગોળાની જેમ એમણે વાક્યો ફેંક્યા : ‘રમા, સાંભળે છે? આ સાહેબ તો તારા પિયરના નીકળ્યા!’ પછી પાછા શિખર તરફ જોઈને લવારીએ ચેડી ગયા : ‘હવે મારે કહેવું નહીં પડે. રમાના હાથની રસોઈ આમેય તે સ્વાહિદ જ હોય છે, પણ હવે તો...’

શિખર જોઈ રહ્યો, સાંભળી રહ્યો. ગજાનનનો ચહેરો જલેબી જેવો બની ગયો હતો. આંખો ગુલાબજંબુ જેવી અને શલ્ફો ચાસણી જેવા...! પણ આ રમા કોણ હશે? કોની દીકરી હશે? પોતે ઓળખતો હશે એને? ક્યારેય જોઈ હશે એને? જરૂરી નથી કે જોઈ જ હોય. ખીજડિયા ભલે નાનું હતું, પણ કોઈ ગામ એટલું બધું નાનું તો ક્યારેય નથી હોતું કે ગામની એકાદ કન્યાને સંતાડી શકે. ગજાનનની ઉમર જોતાં કદાચ રમાની વય પણ ચાલીસની આસપાસ હોય. શિખર કરતાં નાખી દેતાંય દસેક વર્ષ મોટી. તો પછી પોતે રમાને ક્યાંથી ઓળખે?

‘તમે હવે ઘરના જ માણસ છો એટલે વાત કરવામાં વાંધો નથી. મારું ઘર પૈસેટકે જરીક નબળું, એટલે ન્યાતમાં કોઈ માબાપ દીકરી આપતું નહોતું. આપણા રામનેય વળી પૈણવાની હાયવોય નહોતી. એમાં ગજબનો મેળ આવી ગયો.’

ગજનન પાછા ખુરશી ઉપર ગોઠવાઈ ગયા હતા અને સાહેબની આગળ દિલ ખોલીને એમની આત્મકથાના ટુકડા વાંચી રહ્યા હતા : ‘મારું મોસાળ બીજાદિયામાં. એમાં એક દિવસ મામાનો તાર આવ્યો. ઊભાગીબ આવી જાવ. તારું ઘર બંધાવાની વકી છે. હું તો પછી ચંપલ પહેરવાય ઊભો રહું? દોડી ગયો. ત્યાં આ રમા મરવા પડી હતી. કો'કની હારે પગ લપસી ગયો હશે. પેલો ભમરો રસ ચૂસીને ઊડી ગયો. રમાએ મોરચું ઘોળીને ગટગટાવી લીધું. ડોકટરે જીવ તો બચાવી લીધો, પણ પછી નિદાન કર્યું કે રમા બે જીવ સોતી હતી. પછી શું કહેવું, સાહેબ...?’

ગજનને માથું ધૂશાયું. અવાજને થોડો વધારે ધીમો કર્યો : ‘મામાએ મને એક જ સવાલ પૂછ્યો : ‘ગજા, ફૂલ સાથેનો છોડ છે. સ્વીકારવાની ઉદારતા છે?’ મેં જવાબ દીધો : ‘છે, મામા. ઉદારતાએ છે ને હિમત પણ છે.’ રમા જેવી ભાનમાં આવી કે તરત જ... મારા જીવનમાં આવી. આવા લગ્નમાં શરણાઈયું ને ઢોલ થોડાં વગાડવાનાં હોય? બસ આજે દસ વરસ થઈ ગયાં એ વાતને. રમાને મેં એક ક્ષણ પૂરતી સાચવી લીધી અને એણે મને, મારા ઘરને, મારી આખી જિંદગીને સાચવી જાણી. આ છોકરો જોયો ને? હમણાં પાણી લઈને આવ્યો’તો એ... એ રમાનો છે, પણ હવે અમારો... મને જ બાપ ગણે છે... જોકે તમને તો આ બધી વાતની થોડીધણી ખબર હશે જ. તમેય બીજાદિયાના અને રમાયે બીજાદિયાની એટલે...’

‘નથી ખબર.’ શિખરે ઈન્કાર કર્યો : ‘મારું ઘર બીજાદિયામાં પણ અમે જામનગરમાં રહેતા હતા. છ મહિને - બાર મહિને એકાદવાર ગામડે જઈએ. મકાન ખોલીએ, રજાઓ પૂરી થાય એટલે પાછા નગર આવતા રહીએ. જામનગરને અમારી તરફ લોકો નગર કહીને ઓળખે...’

‘જાણું છું સાહેબ, જાણું છું.’ ગજનન પાછો વાતોએ વળગ્યો. શિખર જોકે હવે ત્યાં હાજર હોવા છતાં હાજર ન હતો. સતર, અદાર વરસની ઉમરનો થઈને એ તો ક્યારનોયે બીજાદિયાના એક ખેતરની પાસે આવેલા ખળામાં પહોંચી ગયો હતો. ઊભી રાખેલી ખંપાળીના ટેકે ખાટલો આડો ગોઠવીને એની છાંયમાં બેઠાં બેઠાં એ એક અલ્લડ યુવતીનું નામ જાણવાની કોશિશમાં ખોવાઈ ગયો હતો.

‘નામ? મારું નામ તમસા છે.’

‘ખોટું. બીજાદિયા જેવા ગામમાં તમસા જેવું નામ હોય જ નહીં.’

‘કેમ ન હોય?’ તમસાએ જીભો કાઢ્યો : ‘જામનગર જેવા શહેરમાં વગર પર્વતે જો શિખર હોય તો બીજાદિયામાં તમસા

કેમ ન હોય?’

‘મારું નામ તો મારા દાદાએ પાણું છે. એ લેખક હતા.’

‘અને મારા નાના પંડિત હતા. એ કહેતા કે તમસા એક નદીનું નામ છે અને નદી તો શહેરમાંથે હોય અને ગામડામાંથે હોય. પણ છોડો બધી લમણાજીક. એ કહો કે નામ કેવું લાગ્યું?’

નમતા બપોરનો નમતો તડકો. ખાટલામાંથી પથરાતાં સૂરજનાં ચાંદરણાં અને શિખરના હોડો વચ્ચેથી સરી પડેલો જવાબ : ‘ગમ્યું. નામ પણ ને નામવાળી પણ...’ એ પછીનું દશ્ય જોઈને ખળું, ખાટલો અને ખંપાળી, ત્રણેય ધન્ય થઈ ગયા.

રજાઓ આવી ગઈ, મુલાકાતો વધતી ગઈ. મજાઓ મળતી રહી અને પછી અચાનક શિખર આગળના અભ્યાસ માટે અમદાવાદ ચાલ્યો ગયો. તમસા ક્યારેય સ્મૃતિમાંથી ઓસરી નહોતી. ગ્રેજ્યુએટ થયા બાદ એણે તમસા વિશે તપાસ કરી, પણ ક્યાંકથી અધકયરી માહિતી મળી કે એનાં તો લગ્ન થઈ ગયા હતા. શિખરે મન વાળી લીધું. પુરુષની જિંદગીમાં આવી ચડતી ક્લીઓ ક્યારેક પડાવ જેવી હોય છે તો ક્યારેક ઘર જેવી. જે એકાદ-બે રાતનો ઉતારો બનીને ચાલી જાય અનું નામ પ્રેમિકા અને જે કાયમી ઘર બની જાય અનું નામ પત્ની. એણે વધુ છાનબિન પણ ન કરી. તમસા નામની નદી નિર્જણા બની ગઈ.

‘ચાલો, ઊઠો.’ ગજનના પાણીનો લોટો લઈને સામે ઊભો હતો : ‘હાથ ધોઈ લો. જમવાનું તૈયાર છે.’ શિખરનો સમાધિભંગ થયો. એ જમવા માટે ઊઠ્યો. સામસામે પાટલા હતા. ગજનન જમતાં જમતાં હાથની આંગળીઓ ચાટ્યો જતો હતો. ‘સાહેબ, ગરીબ ઘર છે, પણ રસોઈ જોઈ લો. રમાના હાથની મીઠાશ તમને શહેરની કોઈ હોટેલમાં નહીં મળે.’ અને શિખરનો ઓડકાર સાંભળ્યા પછી પણ રમા વધારાની રોટલી પીરસવા માટે બહાર આવી. શિખર ‘ના... ના...’ કરતો રહ્યો પણ રમાએ આંખમાંથી તીર છોડ્યું : ‘મારા સમ છે જો ના પાડી તો. ચૂપચાપ ખાઈ લો અને એમ ન કહેશો કે બીજાદિયા જેવા ગામડામાં જન્મેલી છોકરીને આવી સરસ રસોઈ બનાવતા કેવી રીતે આવડી?’

વીઠીએ ડંબ માર્યો હોય એમ શિખર ચમકી ગયો : ‘તમસા, તું...? તમે...?’

‘હા.’ તમસાએ આડી નજરે જોયું તો પતિ ગજનન હાથ ધોવા માટે ઓસરીમાં ચાલ્યો ગયો હતો : ‘હું જ! અને પેલો આપણો દીકરો છે. સમયે મારી સાથે જે છણ કર્યું એ પછી બધું જ બદલાઈ ગયું. મારો વર, મારું ઘર, મારી જિંદગી અને મારું નામ પણ. હું તમસામાંથી રમા બની ગઈ. નદીમાંથી નારી બની ગઈ. કેવું લાગ્યું મારું ગરીબ ઘર?’

અશ્વ ટપકાવતી તમસાને, માત્ર તમસા જ સમજ શકે એવી રીતે શિખર કહી રહ્યો હતો : ‘ગરીબ? અરે ગાંડી! મારી નજરમાં તો વિશ્વનો સૌથી ધનવાન માણસ ગજનન છે.’ ■

ગુનો અને ગરીબી

ચિંતન

ડૉ. ગુણવંત શાહ

જાંબિયામાં ચોમા નામનું એક ગામહું છે. આફિકાના જંગલમાં ગામહું એટલે શું? વૃક્ષોની ભરચક વસતિમાં ક્યાંક થોડાંક ઘર જોવા મળે તેવી જગ્યાને ગામહું કહેવાય. મનુષ્યોની ભરચક વસતિમાં થોડાં થોડાં વૃક્ષો જોવા મળે તેવી જગ્યાને નગર કહેવાય. તો પછી મહાનગર કોને કહેવાય? જે સ્થળે વૃક્ષોનાં થઈની સંખ્યા કરતાં બતીના થાંભલાની સંખ્યા વધી જાય તેને મહાનગર કહેવાય. આ ગ્રાણે પ્રકારની વસતિમાં જે લોકો ભૂખમરો, માંદગીમરો, ગંદકીમરો અને અપમાનમરો વેઠે એ લોકો ‘ગરીબ’ ગણાય. એ ગરીબો પ્રત્યે કરુણા બતાવવામાં ઈસુ પ્રિસ્ત પ્રથમ નંબરે આવે અને બીજા નંબરે ગાંધીજી આવે. ચોમા ગામે પૂરા ચાર દિવસ રહેવાનું બન્યું ત્યારે એક ગરીબ આફિકન આદિવાસીનો પ્રસંગ સાંભળવા મળ્યો હતો.

ચોમાની કોઈમાં ન્યાયમૂર્તિ તરીકે એક ગુજરાતી સજ્જન હતા. એ સજ્જન જસ્ટિસ દિવાકર મારી સભામાં મંચ પર સાથે બેઠા હતા. તે મૂળે સૌરાષ્ટ્રના હતા. સૌરાષ્ટ્રનો કોઈ પણ માણસ હોય, પરંતુ જ્યાં કોઈ પ્રસંગ કહેવાની વાત આવે ત્યારે એની વાતમાં ડાયરાનો સ્વાદ આપોઆપ પ્રગટ થતો હોય છે. કાઠિયાવાડમાં ગરીબી ટકી શકે, પરંતુ શુષ્ણતાને ટકી રહેવાની છૂટ નથી હોતી. ગરીબીમાં પણ રંગ પૂરી શકે તેનું નામ કાઠિયાવાડી ભાયડો. જસ્ટિસ દિવાકરની કોઈમાં એક આફિકન આદિવાસીને ખડો કરવામાં આવ્યો. એ શ્યામસુંદર આદિવાસીનો ગુનો શું હતો? એણે પારકા બેતરમાં દાખલ થઈને મકાઈના ચાર-પાંચ કુંડાં ચોર્યા હતા. દિવાકરસાહેબે પૂછ્યું : ‘તેં ચોરી કરી છે?’ જવાબમાં મૂર્તિમંત નિર્દોષતાએ મોં ખોલ્યું : ‘મને કક્કિને ભૂખ લાગી હતી અને મેં કુંડાં જોયાં એટલે ખાવા માટે લીધા. બાકી મેં ચોરી નથી કરી.’ દિવાકરસાહેબે એ આદિવાસીને નિર્દોષ ગણીને છોડી મૂક્યો. આ જગતમાં સદીઓથી ચાર શબ્દો હાથમાં હાથ નાખીને ચાલતા રહ્યા છે : ન્યાય, અન્યાય, ગરીબી અને ગુનો. અન્યાયના ઉકરડા પર ન્યાયની ધજ ફરકે છે અને ગરીબીની કૂણેથી ગુનો જન્મ પામતો હોય છે. કદી અનાથ નથી હોતો.

વિકટર હુગોની અમર નવલકથા ‘લા મિઝરેબલ’ ગુનો અને ગરીબાઈ વચ્ચેનો અનુભંધ આબાદ પ્રગટ કરે છે. નાનપણમાં રાંદેરના ઓલિયા લોકસેવક નારુશંકર મણિશંકર ભરે અમારા જેવાં નાનદિયાંને રોજ રાતે વાત્તી તરીકે હમાવાર સંભળાવી હતી. એ નવલકથા પરથી તૈયાર થયેલી ફિલ્મ ‘કુંદન’માં સોહરાબ મોદીએ નાયકની ભૂમિકા અદા કરેલી. નાયક જ્યાં બ્રેન્ની ચોરી કરતા પકડાઈ જાય છે અને ગુનો જીવનભર એનો પીછો કરતો

રહે છે. નવલકથાનો સાર એટલો જ કે ગરીબી એ ગુનાની સગી માતા છે. વર્ષો પહેલાં જ્યોર્જ ફર્યુહરે કહેલું :

કોઈની પજવણીથી ચિંતાતો બીજો અત્યાચાર નથી અને ગરીબીથી ચિંતાતો એવો શરમજનક ગુનો બીજો કોઈ નથી.

આમ ગરીબી એ જ ગુનો બની જાય એવા સમાજમાં આપણે રહીએ છીએ. ગરીબી માનવજીતની શરમ છે કારણકે માણસ સહેલાઈથી ‘ગુનેગાર’ તરીકે વગોવાઈ જાય છે.

ન્યાય સત્યનો સગો ભાઈ છે. ગરીબને સાચો ન્યાય મળે ખરો? અભિનેતા સંજ્ય દત્તનો ગુનો સાબિત થયો, પરંતુ એને જામીન મળી ગયા તેથી આજે એ નિરાંતે જીવે છે. નવાબ ઓફ પટૌડી કાળા હરણનો શિકાર કરવા બદલ પકડાયા હતા પરંતુ જામીન મજા તેથી મુક્ત થઈ ગયા હતા. સલમાન ખાને નશીલી હાલતમાં કાર ચલાવી અને એક-બે માણસો કચડાઈ મૂળા. એ અભિનેતા જામીન મજા પછી મુક્ત છે. ગરીબ માણસે આવો કોઈ ગુનો કર્યો હોત તો! ગ્રાને મહાનુભાવો પૈસાને જોરે એવા સમર્થ વકીલો રોકી શક્યા, જેઓ રાતને દિવસ તરીકે સાબિત કરી શકે. આવું બને તેમાં ‘ન્યાય’ ક્યાં રહ્યો? ગાંધીજીએ તેથી કહેલું : ‘ગરીબી એ સૌથી ભૂંડી પ્રદૂષક છે.’ (પોવર્ટી ઈઝ ધ વસ્ટર્ પોલ્યુટર). નકસલવાદ આપણને પજવે છે પણ આસપાસ ટળવળતી ગરીબી કનડતી નથી. જો કનડતી હોત તો લગ્નના વરઘોડા સાથે અને પાર્ટી પ્લોટ સાથે જોડાયેલાં રીસેપ્શનમાં જે બીભત્સ ખર્ચ થાય છે તે શક્ય ન બને. માલદારનું જોઈને ગરીબને ખર્ચ કરવાની ચૂં ઉપરે છે. મારા ઘરમાં કામ કરતી કીની દીકરી પરણી તેમાં રૂપિયા પચાસ હજારનો ખર્ચ થયો. જાણીતા અર્થશાસ્ત્રી સદ્ગત વી. એમ. દાંડેકરે એક મજાક કરેલી : ‘હું માલદાર ન હતો પરંતુ એક પુરસ્ક પ્રગટ થયું અને હું ટીકીટીક પૈસા કમાયો. પુરસ્કારનું નામ હતું : ‘પોવર્ટી ઈન ઇન્સ્ટિયા’ (૧૯૬૮)’ ઘણા લોકોને ભારતની ગરીબી ફળી છે.

ગરીબ માણસ જયારે નાનો મોટો ગુનો કરીને જેલમાં જાય ત્યારે એક ઘટના બને છે. જેલમાં એને બે ટક ખાવાનું અચૂક મળી રહે છે. જેલમાં એને પહેરવા-ઓફવાનું મળી રહે છે. જેલમાં એને સ્વમાન વિનાની સલામતી મળી રહે છે. ભવિષ્યમાં કદાચ એક એવું સરધસ નીકળશે, જેમાં બેનર પર શબ્દો હશે : ‘અમને કામ ન આપો તો ચાલશે. અમારે જેલમાં જવું છે.’ આજે જે ન્યાયપ્રથા છે તે વિકમાદિત્યની કે જહાંગીરની ન્યાયપ્રથા જેટલી

જરૂરી તો નથી જ અને કદાચ પરિશુદ્ધ ન્યાય આપનારી પણ નથી. હંગલેન્ડમાં નવમી સદીમાં કિંગ આલ્કેડ (મોટો) ન્યાયપ્રીતિ માટે જાણીતો હતો. કવિ ટેનિસને પોતાના કાચ્ય 'Idylls of The King'માં એ રાજીને બિરદાવ્યો છે. રાજશાહી કરતાં લોકશાહીમાં ન્યાય વધારે શુદ્ધ હોવો જોઈએ. એમ થયું છે ખરું? એ ન્યાયપ્રથા કદાચ ગરીબ વિરોધી કે વકીલકેન્દ્રી ન હતી. આજની ન્યાયપ્રથામાં વધ્ઘાઈ ગયેલો વિલંબ સ્વયં એક ગુનો છે, જે કોર્ટમાન્ય છે.

દુનિયામાંથી ગરીબી કાયરેય નાબૂદ થશે ખરી? સામ્યવાદ, સમાજવાદ અને યુરોપીય કલ્યાણરાજીની સંકલ્પના દ્વારા પણ ગરીબી ટળી નથી. સમાજવાદમાં ગરીબીને રોમેન્ટિક અને રંગદર્શી બનાવવામાં આવી. આજે મુક્ત અને વૈશ્વિક મૂરીવાદ ગરીબી સાથે જુદા સ્તર પર કામ પાડી રહ્યો છે. માનવજીત જાણે ડિસ્કો ડાન્સ કરી રહી છે. લેટીન શબ્દ 'Dsico'નો અર્થ છે : 'હું શીખું છું.' શું ગરીબી પણ કોઈ જૂથનું સ્થાપિત હિત બની શકે? મધર ટેરેસાનું અવસાન થયું અને એમની દફનવિષિ પૂરી થઈ પછી એમનાં ઉત્તરાધિકારી સિસ્ટર નિર્મલાએ પત્રકાર પરિશદમાં કહું હતું : 'ગરીબી તો પ્રભુની ભેટ છે, જે કાયમ રહેવાની છે. જો ગરીબી મટી જાય તો અમારી નોકરી ચાલી જાય.' (ટા.ઓ.ઈ. ૧૭-૮-૧૯૮૭) કેટલાક કમ્પનિઝ લોકસેવકોની પણ આ જ મનોદશા છે.

ગરીબીને કાયમી અનિષ્ટ ગણવામાં જોખમ છે. મૂરીવાદનો માનવીય ચહેરો જટ પ્રગટ ન થાય તો ગરીબોની ધીરજ ખૂટવા આવી છે. પીવાનું પાણી ન મળે ત્યાં કોકાકોલા મળે છે. સ્નાન કરવાનું પાણી ન મળે ત્યાં સાખુ પહોંચી જાય છે. સમાજ આજે આવા વિકરાળ આંતરવિરોધ વચ્ચે જીવી રહ્યો છે. ચોમા ગામનો શ્યામળો આફિકન આદિવાસી હવે છોક અભણ નથી રહ્યો. એના હાથમાં ક્યાંકથી તફાવેલો મોબાઈલ ફોન આવી ગયો છે. એ ભોળો છે, પણ ભોટ નથી. શિક્ષણનો પ્રસાર ગ્રૂપડે ગ્રૂપડે (આફિકામાં સુભેસ સુભેસ) થાય ત્યારે એક જદુ થશે. ભણેલા માણસની છેતરાવાની શક્તિ વઠી જાય છે. અજ્ઞાન ટળે પછી જે ગરીબી બચે તેને કદી નિરાંત નથી હોતી. સૂર્યશક્તિ, પવનશક્તિ, જળવિદ્યુત અને અણુવિદ્યુત આવતા દાયકમાં ઊર્જાની અધ્યત દૂર કરે તેવી પૂરી શક્યતા છે.

ગરીબીને બાથમાં ભીડી રાખવામાં કોઈ આદર્શવાદ નથી. 'એક દિન ગરીબનું સ્વરાજ લાવીશું.' સદ્ગત જીણાભાઈ દરજને અત્યંત પ્રિય એવી કુલીન પંડ્યાની આ કાચ્ય પંક્તિમાં ગરીબી કાયમ બાબત છે એવો ઈશારો છે. ગરીબી ન ટળે તેવા સમાજમાં સ્વરાજ કદી ન સંભવે. ગરીબીથી પરેશાન એવા સમાજમાં માલદાર આદમીનું કહેવાતું સ્વરાજ પણ જોખમમાં જ હોય છે કરાણકે એવા સમાજમાં 'ન્યાય' નામની ઘટના થીજી જતી હોય છે. સામાજિક ન્યાય વિનાનો કેવળ કોઈનો ન્યાય એટલે સોનાનું ગિલેટ ચડાવેલો રૂપાળો અન્યાય. નવલકથાકાર ડી.એચ. લોરેન્સ ન્યાય, અન્યાય અને લાચારી પર કટાક કરતી વખતે હેઠે ચોંટી જાય એવી વાત કરે છે :

સિંહ અને ઘુંઠું અડખે-પડખે સૂઅ અંતું કદી પણ ન બને;
સિવાય કે ઘુંઠું સિંહના પેટમાં હોય!

એક છેલ્લી વિનંતી

(અનુ. : પાના નં.-૨૨ ઉપરથી ચાલુ)

ના લેવાય....! એ તો વિદ્યા વેચી ગણાય. અને જો વિદ્યા વેચીએ તો મા સરસ્વતી ક્રીપાયમાન થાય. તો બધી જ વિદ્યા જતી રહે. આવા દલાલ સાહેબ માટે કોને માન ના થાય....?

જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ આવી ગયા હતા. સંચાલક મંડળના સભ્યો પણ આવી ગયા હતા. ગામના પ્રતિષ્ઠિત સજજનો પણ આવી ગયા હતા એટલે કાર્યક્રમની શરૂઆત થઈ. શરૂઆતમાં સરસ્વતી વંદના, આચાર્યશ્રીનું ઉદ્ઘોષન, મંડળના પ્રમુખશ્રીનું ભાષણ અને પછી શરૂ થયો સંભાનનો સિલસિલો... દલાલ સાહેબને અને શિક્ષણાધિકારી સાહેબને ફૂલખાર પહેરાવવામાં આવ્યા. શાળા સંચાલક મંડળ તરફથી, સ્ટાફ તરફથી, ગામની કેટલીક સંસ્થાઓ તરફથી દલાલ સાહેબને ફૂલમાળાઓ પહેરાવવામાં આવી, શુભેચ્છા બેટો આપવામાં આવી. પછી છેલ્લે આવ્યો વિદ્યાર્થીઓનો વારો... વિદ્યાર્થી સમૂહ તરફથી દલાલ સાહેબને રૂપિયા સો-સોની નોટોનો લાંબો હાર પહેરાવવામાં આવ્યો. હાર પહેરતાં પહેરતાં તો સાહેબની આંખો છલકાઈ પડી. પછી તરત જ દલાલ સાહેબે હાર કાઢી નાખ્યો અને આચાર્ય સાહેબને આપતા કહું — આ પેસા શાળામાં જમા રાખજો અને તેના વ્યાજમાંથી જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને મદદ કરતા રહેજો.

વક્તાઓએ દલાલ સાહેબના ભરપેટ મન મૂકીને વખાણ કર્યા. તેમની સેવાભાવના, વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની વૃત્તિ, ગણિતમાં માર્ટરી, હુલામણું નામ દાદા... આ બધી જ વાતો વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં રજૂ કરી. છેલ્લે દલાલ સાહેબનો વારો આવ્યો — પ્રતિભાવ આપવાનો. દલાલ સાહેબ ઉભા થઈ ગયા. માઈક હાથમાં લીધું અને લગભગ પ્રૂસકે ચઢી ગયા. કોઈક પાણી આખ્યું, થોંકુક પાણી પીધું. પછી કાંઈક સ્વસ્થ થતાં બોલવાનું ચાલું કર્યું. મિનો, વડીલો અને મહાનુભાવો... અત્યારે મારી સ્થિતિ વધારે બોલી શકાય તેવી તો નથી જ... છતાં મારી એક વાત જવનમાં અવશ્ય ઉત્તરાજો, જો સુખી થવું હોય તો સ્વકેન્દ્રી થવાના બદલે પરોપકારી બનજો... કોઈએ મને શું આખ્યું એ વિચારવાના બદલે મેં તેને શું આખ્યું? એ રીતે વિચારજો... શાળાએ મને શું આખ્યું? એવું નહીં પણ હું શાળા માટે શું કરી શકું છું? મેં શાળાને શું આખ્યું? મેં દેશને શું આખ્યું? મેં સમાજને શું આખ્યું? મેં મારા માબાપને શું આખ્યું? આ રીતે વિચારશો તો ક્યારેય હુંબ નહીં થાય. અને છેલ્લે મારી એક વિનંતી. આ શાળાના સંચાલક મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબને... મને આ શાળામાંથી કાઢી ના મૂકશો. આ શાળા તો મારું મંદિર છે, મારું ઘર છે. આ શાળા સાથે મારી લાગજીઓ જોડાયેલી છે. માટે મને કાઢી ના મૂકશો. હું કોઈને નડતરરૂપ નહીં બનું, પણ આ બાળકો મારા સંતાનો છે — મને તેમનાથી દૂર ના કરશો. મારે કશું જ વળતર જોઈતુનથી પણ... કહેતાં કહેતાં દલાલ સાહેબ ફરીથી રડી પડ્યા.

આજે પણ દલાલ સાહેબ એ શાળામાં જાય છે, ભણાવે છે — મહેનતાણા વિના....!

વૃદ્ધાશ્રમો કેમ વધે છે?

ચિંતન

રણાધોડ શાહ

સજજન તરીકે જન્મવું તે એક અક્સમાત છે;
સજજન તરીકે મરવું તે એક સિદ્ધિ છે.

મનુષ્ય જીવન સદ્ગુણો અને સુટેવોથી ભરપૂર છે, તો દુર્ગુણો અને કુટેવો પણ જિંદગી સાથે વશાયેલી છે. બાળપણ, ડિશોરાવસ્થા અને તારુષ્ય સુધીમાં વ્યક્તિના જીવનનું મહત્તમ ઘડતર થઈ જાય છે. આ વર્ષો દરમિયાન પ્રામ કરેલ અનુભવોના આધારે વ્યક્તિ જીવનમાં આગળ વધતો હોય છે. આ સમયગાળામાં પ્રામ થતાં વડીલોમાં કેટલાક સગપણના નાતે જોડાતા હોય છે તો કેટલાક સંબંધોને કારણે જીવનમાં પ્રવેશતા હોય છે. સગાઓ સાતે જન્મથી લોહીના સંબંધો બંધાઈ જાય છે. જ્યારે મિત્રો, પાડેશીઓ અને સહાધ્યાધીઓ સાથે કામ અને વહાલના નાતે જન્મ બાદ સંબંધો સર્જય છે. સંબંધોની કેમેસ્ટ્રીમાં ભાવના અને લાગણી મુખ્ય ઘટકો છે.

છેલ્લા ગ્રાન્થ ચાર દાયકામાં કૌટુંબિક જીવનમાં અકલ્યનીય ફેરફારો પ્રવેશી ચૂક્યા છે. વડીલો યુવાઓ ઉપર દોષારોપણ કરે છે અને તરુણ-તરુણીઓ મોટેરાંઓનું વર્તન ભૂલ ભરેલું છે, તેમ જમાવી અરસપરસ જવાબદારીમાંથી છટકી પલાયનવાદી બની રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે. સાચા અર્થમાં સામાજિક કે કૌટુંબિક વિકાસ સહિયારી જવાબદારી છે.

‘પિતાને બાળકો હોય છે,
પણ બાળકોને સારો પિતા
ક્યારેક જ મળે છે.’

એક દિવસ રોશન વૃદ્ધાશ્રમમાં તેના મિત્ર પ્રતીકના વૃદ્ધ માતા-પિતાને મળવા જાય છે. રોશન આશ્રમમાં જઈ વડીલોનો આશિર્વાદ પ્રામ કરવા તેમને પગે લાગે છે. તેની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવતાં ફેરવતાં આશિર્વાદ આપતી પ્રતીકની વૃદ્ધ માતા એકદમ ગુસ્સે થઈ જાય છે. તે રોશનને કહે છે, ‘તું તારા મિત્રના વૃદ્ધ માતા-પિતાની બહર જોવા અહિયા આવ્યો છે. પરંતુ પ્રતીક તો અમારી સહેજ પણ કાળજી રાખતો નથી. તે તો અમારી સાથે સરેલા કૂતરા જેવો વ્યવહાર કરે છે!’ વૃદ્ધ મોટે મોટેથી બરાદા પાડીને બોલી પોતાની જાતને કણસી રહી હતી. તે સંતાનો માટે હલકા, ગંદા, અયોગ્ય અને અસભ્ય શબ્દો વાપરી રહી હતી. વૃદ્ધાનો ગુસ્સો, દુઃખ, વિકાર અને આકંદની કલ્યના થઈ શકે તેમ છે. એન્જિનિયર પુત્ર અને ડોક્ટર દીકરી

તેમની કાળજી રાખતા નથી. તેઓ ક્યારેય તેમને મળવા આવતા નથી.

રોશન બોલ્યો, ‘બા, તમે તમારા બાળકો માટે આવા અપશબ્દો ન બોલો તો સારું.’

માતા પુનઃ વેદનાસભર વાણીમાં બોલ્યા, ‘તેઓ બને મોટા બંગલામાં તેમના સંતાનો સાથે સુખયેનથી રહે છે. તેમની સેવામાં સતત નોકરો હાજર હોય છે. તેઓ મંદિરમાં જઈ લાખો રૂપિયાનું દાન કરે છે. પરંતુ થોડીક મિનિટો કે થોડાક રૂપિયા અમારા માટે વાપરવા તૈયાર નથી.’ તે ગમગીન બની, નિરાશાની ગતિમાં ધેક્લાઈ સંતાનો તરફ અત્યંત નકારાત્મક બની ગયા હતા. આ સમયે કેટલાક પાયાના ખાલો અને કડવા સત્યો તરફ ધ્યાન આપવાની ખાસ જરૂર છે.

‘બાળકોના એવા અવગુણને

મા-બાળ્યો ભાગ કરી શકતા હોય છે
— જે એમણો પોતે જ રોપેલા હોય.’

રોશન બોલ્યો, ‘બા, હું તેમને થોડાક પ્રશ્નો પૂછી શકું?’ વૃદ્ધાએ હકારમાં ડોંકું હલાવતાં રોશને પૂછ્યું, ‘તમે તમારા બાળકોને તમારા શરીરના ભાગરૂપે જન્મ આપ્યો છે. તમે તેમને તમામ સગવડો પૂરી પાડી ઉછેર કર્યો છે.’ આ સાંભળતા માતા બોલી ઉઠી, ‘હા, હા, ઘણીવાર અમે ભૂખ્યા રહીને પણ તેમને સારું સારું ખાવાનું પૂરું પાડ્યું છે.’ રોશને કહ્યું, ‘એટલે જ તો તેઓનું મન અને તન સ્વાસ્થ્યપૂર્ણ છે.’

આ સાંભળતા જ માતા બરાડી ઉઠી, ‘પરંતુ હું શાપ આપું છું કે પ્રભુ હવે તેમની જિંદગી બરબાદ કરી નાખે અને તેમનું સત્યાનાશ જાય.’

આ ઉદાહરણ શું સૂચવે છે? સમાજ સમક્ષ અનેક પ્રશ્નો મોં ફાડીને ઉભા છે. મમ્મી-પાપ્યા બાળકોને એન્જિનિયર કે ડોક્ટર બનાવવા તનતોડ પ્રયત્નો કરે છે. તેમની પાછળ ખર્ચ કરવા ચાતદિવસ મહેનત કરી પેસા કમાય છે. સંતાનો જે માંગે તે હાજર કરી દે છે. તેમની તમામ સવલતો અને માંગણીઓ પૂરી કરવામાં ગૌરવ અનુભવે છે. બાળકો ઉચ્ચ ડિગ્રી પ્રામ કરે, મોટા પગારની નોકરી મેળવે, ધનના ઢગલા ઉપર બિરાજે, સમાજમાં નામના પ્રામ કરે વગેરે જેવા ધ્યેયો જ તેમના જીવનમાં કેન્દ્રસ્થાને ગોઠવાઈ ગયા હોવાથી અન્ય પાયાની જરૂરિયાતો

બાબતે તેઓ દુર્લક્ષ સેવતા થઈ ગયા છે.

‘ખરેખર બાળકોને ઉછેરવાની યોગ્યતા
આપણે કેળવીએ ત્યાં સુધીમાં તો –
એ બાળકોને ધેર પણ
બાળકો થઈ ગયા હોય છે.’

આ સમય દરમિયાન માતા-પિતા તેમને સામાજિક રીતરિવાજો, ઉચ્ચ કૌટંબિક પરંપરાઓ, ભારતીય સંસ્કૃતિ, વરીલોને આદર આપવો, મોટેરાંઓને સન્માન આપવું અને તેમની કાળજી રાખવી જોઈએ તેવી પાયાની બાબતોનું શિક્ષણ આપવા બાબતે ધ્યાન રાખે છે ખરા? જેઓએ બાળકોને મોટાં કર્યા છે તેમની વૃદ્ધાવસ્થામાં દરકાર રાખવાની સમજ આપી છે ખરા? દીકરી ડોક્ટર થતાં થતાં સ્વાર્થી ન બને તે તરફ લક્ષ્ય આપ્યું છે? એન્જિનિયર દીકરો અયોગ્ય રસે શ્રીમંત ન બને તેવી સમજ આપવાનો મમ્મી-પપ્પાએ પ્રયત્ન કર્યો છે ખરા? મૂલ્યલક્ષી જીવન જીવવા માટે કેવા પાયાના સદ્ગુણો આત્મસાત્ર કરવા જોઈએ તેની કેળવણી આપી છે? વડીલો માને છે કે તેઓએ પેટે પાટા બાંધીને બાળકોને મોટા કરે એટલે તેમની જવાબદારી પૂર્ણ થાય છે.

અહિંયા બે મોટી ભૂલો થાય છે : (૧) જાતે તકલીફો વેઠીને બાળકોને મોટાં કરતાં વડીલો પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તરફ બેદરકાર રહે છે. વ્યક્તિ ભૂખ્યો રહે ત્યારે શરીરમાં રહેલા કરોડો કોષો અપોષિષ્ટ રહે છે. અજાણે તે જાત તરફ હિંસા આયરે છે. (૨) અર્ધજાગૃત મગજ એવી વિભાવનામાંથી આનંદિત થાય છે કે પોતે ભૂખ્યો રહીને પણ સંતાનોનો સારો ઉછેર કરે છે. આ સમાધાનવૃત્તિ અને ખુશી પ્રામ કરવાની રીત અયોગ્ય છે. સંતાનને ઉત્તમ વ્યવસાયિકો બનાવી માન મરતબો પ્રામ કરવાની લ્હાયમાં પોતાની જિંદગી વેરફી નાખવામાં ગૌરવ અનુભવે છે.

‘જ બધી બુદ્ધિશક્તિ અને
ભલમનસાઈ લઈને બાળકો જન્મે છે
તેને ઉપયોગમાં કેમ લેવી,
એટદું જ જો આપણે શીખવી શકીએ તો કેવું સારું?’

સંતાનોને આ પૃથ્વી ઉપર અવતારવા માટે તેમની પરવાનગી લેવામાં આવે છે? તેઓએ જન્મ આપવા માટે વિનંતી કરી હતી? તેમને જન્મ આપવો અને સારું વિચારશીલ મન આપવું તે તો પ્રત્યેક મમ્મી-પપ્પાનો ધર્મ છે. માતા જીજબાઈએ શિવાજીને કેવી રીતે જન્મ આપ્યો? જીજબાઈએ ગર્ભસ્થ અવસ્થામાં રામકૃષ્ણ,

યુધિષ્ઠિર, હનુમાન વગેરેની વાતો દ્વારા અન્યાય સામે લડતા શીખવ્યું. સત્યને માર્ગ ચાલવા, માનવીય વર્તણૂક કરવા અને જુલ્ભી રાજાઓ સામે લડવાનું સમજાવ્યું. આ વાતાઓએ શિવાજીને મહાન બનાવ્યા. જ્યારે બીજી બાજુએ ધર્મિય ઔરંગજેબનો ઉછેર તેની માતાએ કેવી રીતે કર્યો હશે? માણસને બદલે રાક્ષસ બનાવવામાં આવ્યો. તેણે તેના પિતા શાહજહાનને જેલમાં નાખી દીધા. અંદુલ કલામનો ઉછેર તેમની માતાએ ગરીબાઈમાં કર્યો પરંતુ એવા સંસ્કાર આપ્યા કે તેઓ અત્યંત સન્માનિત વ્યક્તિ બન્યા. બીજી બાજુએ છિટલરનો ઉછેર પણ આર્થિક સંકડામણ વચ્ચે જ તેમની માતાએ કર્યો. પરંતુ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ નજરે પડે છે.

દરેક વ્યક્તિને તેની લાયકાત પ્રમાણે જ પ્રામ થાય છે. દરેક જીણ પોતાના કર્મ માટે જવાબદાર હોવાથી તેને તેનું પરિણામ ભોગવવું જ પડે છે. પ્રત્યેક માતા-પિતા તેના બાળકોના ઉછેર માટે સંઘર્ષ કરે જ છે. તેઓ બાળકોના વિકાસ માટે મુશ્કેલીઓ અને તકલીફો વેઠે જ છે પરંતુ બાળકોને આ સિવાય પણ કેટલીક બાબતો શીખવવાની હોય છે. બાળકોને ગરીબાઈનો પણ અનુભવ કરવાવો પડે, મુશ્કેલીઓમાં રસ્તો કરતાં શીખવવું પડે અને તકલીફો કેવી રીતે દૂર કરી શકાય તેની સમજ આપવાની જવાબદારી વાલીની જ છે. માતા-પિતાએ પ્રેમના ઓથા હેઠળ પ્રતિકૂળ અનુભવોથી બાળકોને અળગા રાખવા યોગ્ય નથી. તેઓ મુશ્કેલીઓ વિશે કેવી રીતે જાણશે? તેમને ઉત્તમ વ્યવસાયીકો બનાવવા વાલીઓ અઠળક ધનનો ખર્ચ કરે છે, પરંતુ ક્યારેય તેમને ઉત્તમ માનવ બનાવવા એક રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવે છે ખરા? તેઓને માત્ર ટ્યુશન અને પરીક્ષામાં ઉત્તમ ગુણ લાવવાનું શીખવાડાય છે. નૂય અને ગીતોની સ્પર્ધામાં પ્રથમ કમ રાખવા માટે તૈયાર કરવામાં આવે છે. બાળકોને ક્યારેય દવાખાનામાં કેન્સરના વોર્ડની મુલાકાતે કેટલા મમ્મી-પપ્પા લઈ જતા હશે? તેઓને ક્યારેય અનાથ આશ્રમ બતાવવામાં આવે છે ખરા? વૃદ્ધાશ્રમના વડીલોની તકલીફોથી માહિતગાર કરવામાં આવે છે ખરા? બાળકો આ બધી બાબતો ક્યાંથી શીખશે? શું ટેલીવિઝનની સીરિયલો, મોબાઇલ મુલાકાતો કે મોબાઇલ બ્રાન્ડેડ વસ્તુઓ વેચતી દુકાનો આ માનવીય સરેદનાઓ જગાડવાનું કાર્ય કરી શકશે ખરા? તેઓ માતૃદેવો કે પિતૃદેવો ભવ ક્યાંથી જાણશે?

● આચયમન :

સંતાનોની આગળ ચાલશો નહીં, કદાચ તમને તેઓ અનુસરે નહીં.
સંતાનોની પાછળ ચાલશો નહીં, કદાચ તમને તેઓ દોરશે નહીં.
સંતાનોની પડખ ચાલો, બસ, તેમના સાથીદાર બનીને ચાલો.



K. K. MASALAWALA
31, K.N. ROAD, MASJID (W), MUMBAI-400 009.
TEL. : 2377 4209 2375 7674
TELEFAX : 2379 0883



વરિષ્ઠ નાગરિક : જૂની આંખે નવા તમાશા

ચિંતન

દિનકર જોથી

બોંટેર વરસના એક વરિષ્ઠ ભિત્રે વાતવાતમાં પોતાના તાજેતરના જ અનુભવની એક વાત કહી. આ વાત એમના જ શબ્દોમાં સાંભળીએ.

‘અમારા પરિવારમાં એક લગ્ન પ્રસંગ આવી રહ્યો હતો. આ પ્રસંગ નિભિતે કેટલીક ખરીદી કરવી જરૂરી હતી. અમે ખરીદી કરવા જેવી ચીજવસ્તુઓની યાદી બનાવી અને એ પ્રમાણે ખરીદી કરવા પણ માંડી. દરમિયાન મારા ચાલીસેક વરસના પુત્રે મને કહ્યું : ‘પણા, મારે શૂઝ લેવા જવું છે. તમારાં ચખ્પલ પણ ઘસાઈ ગયા છે અને તમારી પાસે બૂટ પણ નથી. મારી સાથે ચાલો, આપણે ખરીદી લઈશું.’

એવી વાત સાચી હતી. જ્યારે હું સરકારી નોકરીમાં હતો ત્યારે બૂટ પહેરતો પણ હવે ઘણાં વર્ષોથી ચખ્પલ જ વાપરું છું. કોઈવાર બહારગામ જવાનું થાય અને એમાંચ ખાસ કરીને શિયાળો હોય ત્યારે બૂટ સાંભરે ખરા, પણ આવું ભાયે જ બને અને મોટાભાગે ચખ્પલ પહેરવાથી પગમાં હળવાશ લાગે. એટલે લાંબા વખતથી મેં બૂટ ખરીદ્યા નહોતા. હવે ઘરમાં જ શુભ પ્રસંગ હતો એટલે મેં પુત્ર સાથે જઈને બૂટ ખરીદવાની સંમતિ આપી.

એક બહુ જ જાણીતી બ્રાન્ડની એરકન્ટિશન્ડ દુકાનમાં અમે ગયા. પુત્રે પોતાના બૂટ પસંદ કર્યો અને પછી મારી પસંદગી માટે બૂટ ખર્યો. આ બૂટની કિમત પાંચ હજાર રૂપિયા હતી. મેં આ કિમત સાંભળીને જ પુત્રને કહી દીધું – ‘મારે આવા મોંઘા બૂટની મુદ્દા જરૂર નથી. મોંઘવારી છે એટલે પાંચસો રૂપિયા સુધીની કિમતના બૂટ ભલે ખરીદીએ, પણ પાંચ હજારના બૂટ પહેરીને મારે જવું છે ક્યાં?’ દીકરાએ આગ્રહ કર્યો. કહ્યું, ‘પણા, પાંચસો-હજારના એક લઘરવઘર બૂટ પહેરીને તમે ફરો એ સારું ન લાગે. આ પાંચ હજારના બૂટ તમે લઈ લો.’ અમારી વચ્ચે રક્જક થઈ. બૂટની કિમત મારે ચુકવવાની નહોતી અને છતાં આવા મોંઘા બૂટ ખરીદવાની મને કોઈ જરૂર જ લાગતી નહોતી. દીકરાએ નારાજ થઈને કહી દીધું, ‘પણા, તમારે ક્યાં પેસા ખર્ચવા છે? પેસા તો હું ખર્યું છું, પછી તમે કંજૂસાઈ શા માટે કરો છો?’

દીકરાની નારાજગી વહોરી લીધા પછી પણ મેં બૂટ ખરીદ્યા નહીં. પાંચ હજાર જેવી રકમ ખર્ચી શકાય એટલી આવક દીકરાની છે જ. એ જ રીતે હું ધારું તો મારા બિસ્સામાંથી પણ આટલી રકમ વાપરી શકું એવી આર્થિક વ્યવસ્થા મારી પાસે પણ છે જ. પુત્રે મારા માટે વાપરેલો કંજૂસાઈનો ગુણ આમાં ક્યાં આવ્યો

એ હું સમજી શક્યો નહીં.’

ગઈકાલે જે રૂપિયો ગાડાના પૈડા જેવો લાગતો હતો એ રૂપિયો આજે સૂક્ષ્મદર્શક યંત્રથી શોધીએ તો પણ નજરે ચે નહીં એટલો સૂક્ષ્મ થઈ ગયો છે. નવી પેઢીના સંતાનોની આવક વધી છે. હજુ દસ વર્ષ પહેલાં પાંચીસ વરસની નોકરી પછી નિવૃત્ત થનારા કર્મચારીને દસ કે પંદર હજારનો પગાર હતો. એના જ સંતાનો આજે અત્યંત સરળતાથી લાખ-પચાસ હજાર રૂપિયાના પગારથી જુદી જુદી કંપનીઓમાં ગોઠવાઈ જતા હોય છે. વધતી આવક સાથે માણસ થોડી છૂટથી પેસા વાપરે અને પોતાના જીવન વ્યવહારમાં સગવડો વધારે એમાં કશું ખોટું નથી, પણ જે વડીલોએ પોતાની આખી જિંદગી કરકસર અને સાદગીથી વિતાવી છે એમને આવો કેટલોય ખર્ચ અપવ્યય જેવો લાગવા માંડે છે. જે વડીલોએ ચખ્પલની એક જોડીથી અત્યંત સહજતાથી વરસ-બે વરસ વિતાવી દીધાં હોય છે એમની નજરે પુત્ર, પુત્રવ્યુ કે પૌત્ર-પૌત્રીઓ પોતપોતાના માટે જતજતના અને ભાતભાતના મેચિંગ ડેસ તો ટીક પણ મેચિંગ પગરખાં સુદ્ધાંનો ખડકલો કરે છે ત્યારે અમને અવશ્ય આશ્રય થાય છે.

એક ભદ્ર પરિવારના બંગલે એકવાર મારે જવાનું થયું ત્યારે દરવાજા બહાર પરસાળમાં મૂકાયેલી શૂઝ રેકમાં ઢગલાબંધ જતજતનાં અને ભાતભાતનાં પગરખાંઓ ગોઠવાયેલાં મેં જોયાં. પહેલાં તો મને લાગ્યું કે એમને ત્યાં કોઈ પ્રસંગ હોવો જોઈએ અને ઘરમાં અતિથિઓ આવ્યા હોવા જોઈએ, પણ પછી થયું, બહારથી આવનારા અતિથિઓ રેકમાં શૂઝ આ રીતે વ્યવસ્થિત ગોઠવે નહીં. કોણ જાણો મને શું સૂઝયું કે મેં કોલબેલનું બટન દબાવતાં પહેલાં પગરખાંઓની આ જોડીઓની સંખ્યા ગણી કાઢી. આ સંખ્યા ૪૭ની થઈ. ઘરમાં મધ્યમવયનાં પતિ-પત્ની બે જ રહેતા હતા. આધુનિકતાનાં તેઓ એવાં આગ્રહી હતાં કે પ્રસંગે પ્રસંગે, વેશેવેશે શોભે એવા નવા-નવા પગરખાં વસાવી રાખ્યા હતા.

અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નવી પેઢી જે ખરીદી કરે છે, એ વરિષ્ઠ નાગરિકો ગઈકાલે જેને જરૂરિયાત કહેતા હતા એ મુજબની નથી. જરૂરિયાતની વ્યાખ્યા હવે બદલાઈ ગઈ છે. ગઈકાલે તમે, તમારાં માતા-પિતાએ મહુવાથી ખરીદેલી લકડાનાં રમકડાની ટોપલીથી રમતા હતા. આ રમકડાં ક્યારેય તૂટતાં નહોતાં, નકામાં થઈ જતાં નહોતાં. તમે રમી લીધા પછી બે વરસ કે પાંચ વરસે બીજા નાનાં ભાઈ-બહેનો પણ એ જ

રમકડાંથી રમતાં. આજે નવી પેઢી સવારે ખરીદેલું રમકડું બપોર સુધીમાં તોડી નાકે છે!

પરિવારના વડીલ તરીકે તમે જ્યારે આ જુઓ છો તારે મનોમન નારાજ થઈ જાઓ છો. તમારી આ નારાજગી હવે તમારા સિવાય પરિવારમાં કોઈ સ્વીકારશે નહીં. બને છે એવું કે વરિષ્ઠોને મન આ પેસાનો દુર્ઘય લાગે છે. એમાં એમને ઉછાંછાપણું, દેખાએખી અને ઉડાઉપણું પણ લાગે છે. પરિણામે એમનાથી બોલ્યા વિના રહેવાતું નથી. સાચી વાત એ છે કે હવે જીવનદિશિ, જીવનધોરણ અને જીવતરનાં મૂલ્યો સુદ્ધાં સમૂહગાં બદલાઈ ગયાં છે. વરિષ્ઠોની આંખે આ નવા મૂલ્યો, જૂની આંખે નવા તમાશા જેવા લાગતા હોય તો પણ એનો સ્વીકાર કરી લેવો જોઈએ.

આસપાસ નજર ફેરવશો તો તમારાં સ્વજનોમાંથી જ એવા કેટલાય ઉદાહરણો મળશે કે જેમાં વડીલોએ અત્યંત સહજતાથી સાદગીને જીવનમંત્ર માની હોય, પણ એ જ સાદગીને એમના સંતાનો લોભી કે કંજૂસવૃત્તિ માનતા હોય. રૂપિયાનો આકાર એટલો બધો બદલાઈ ગયો છે કે નિવૃત્તિકાળે માસિક હજાર રૂપિયાનો દરમાયો મેળવનાર પેન્શનરની વિધવાને આજે પાંચ હજાર રૂપિયા જેટલું ફેમલી પેન્શન મળતું હોય છે. જે પેન્શનર નિવૃત્તિકાળે કાશી કે ગોકુળ-મથુરાની જગ્યાએ જવાના નિષ્ફળ શમણાં સેવતો હતો એની વિધવા આ ફેમલી પેન્શનમાંથી સદ્ગત પતિની મૃત્યુ તિથિએ પાંચ હજાર રૂપિયાનું બ્રહ્મભોજન કરાવે છે.

મેટ્રિક સુધી ભાણેલા વરિષ્ઠોને અંગ્રેજીના વિષયમાં એમના પાઠ્યકમમાં સમાયેલી રિપવાન વિકલની વાર્તા કદાચ આજે યાદ હશે. આ રિપવાન રિંકલ ગામની બહાર એક ટેકરીની પાછળ વૃક્ષની છાયામાં ઊંઘી જાય છે. પૂરાં વીસ વર્ષ સુધી એ ઊંઘતો રહે છે. વીસ વર્ષ પછી જ્યારે એ ઊંઘે છે ત્યારે એને તો એવું જ લાગે છે કે જાણો એણે બે-ચાર કલાકની જ ઊંઘ કાઢી હોય. એનો ચહેરો સુદ્ધાં બદલાઈ ગયો છે એનું પણ એને ભાન હોતું નથી. એ સહજભાવે ગામમાં જાય છે ત્યારે એ કોઈને ઓળખી શકતો નથી. રસ્તામાં અનેક સ્થળો સુદ્ધાં બદલાઈ ગયાં છે અને એ જે બોલે છે એ સાંભળીને જુવાનિયાઓ એની હાંસી ઉડાવે છે. શક્ય છે કે હવે તમે કેટલીય વર્તમાન અવસ્થાને જોઈને રિપવાન વિકલની સ્થિતિમાં મૂકાઈ જતા હો.

ગઈકાલે તમે જેને કરકસર કહેતા હતા એ કરકસર શબ્દનો વ્યાપ પણ તમારે હવે વધારવો પડશો. મહાનગરોમાં જે હુદે વાહન વ્યવહાર વધી રહ્યો છે, જે હુદે લોકોની દોડધામ વધી રહી છે એ બધા વચ્ચે તમારે તમારી પેલી કરકસરની વિભાવનાને થોડીક બદલવી પડશો. તમારી કરકસર ક્યાંક કંજૂસાઈ ન બને એનો ખ્યાલ રાખવો પડશો. જો તમારી પાસે પૂરતી સગવડ હોય તો બચતો ઉપરના વ્યાજદરને સતત ગણતા રહેવાને બદલે એ વ્યાજ વપરાતું રહે એવું આયોજન કરજો. મોખવારીની વારંવાર ફરિયાદો કરતા વરિષ્ઠોએ એ વાત પણ સતત લક્ષમાં રાખવા જેવી છે કે મોખવારી અનહદ અને અસહ્ય લાગતી હોય તો પણ એ એક વૈશ્વિક પરિણામ છે.

આપણે એ સતત યાદ રાખવું જોઈએ કે સરેરાશ મધ્યમવર્ગના માણસો તરીકે પચાસ વર્ષ પહેલાં આપણે જે અને જેવું જીવન જીવતા એના કરતાં આજે સ્થળ અર્થમાં વધુ ભૌતિક પદાર્થો આપણાને ઉપલબ્ધ છે, આપણે એમનો ઉપભોગ કરી શકીએ છીએ, ગઈકાલ કરતાં આજે વધુ પ્રમાણમાં પૈસા ખર્ચ પણ શકીએ છીએ. આ સંજોગોમાં તમારા સંતાનો કે જેમની આવક તમારી ધારણા કે કલ્પના કરતાં અનેકગણી વધુ છે એમનો ખર્ચ વધુ હોવાનો જ. તમારે એમને માત્ર એટલું જ શીખવવું રહે કે ખર્ચનો વિવેક જગ્યાવવો જોઈએ.

ભાજપના નેતા સદ્ગત પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજન વિરુદ્ધ જ્યારે પોલીસ તપાસ થતી હતી ત્યારે રાહુલના મિત્રોએ એવું કહું હોવાનું અખબારોમાં પ્રગટ થયું હતું કે રાહુલ પાંચસો કે એક હજાર રૂપિયાની નોટમાં માદક પદાર્થો વીટાળીને ધૂમપાન કરતો હતો.

ધનનો અતિરેક આવી બેવકૂફી તરફ દોરી ન જાય એટલો વિવેક તો શીખવો જ જોઈએ. પણ તમારા સંતાનોને આવો વિવેક શીખવવાની તમારી પણ એક મર્યાદા છે એ સમજ લ્યો. મોહવશ અને સ્મૃતિવિભ્રમ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણો, પોતાનાથી જે શક્ય હતું એ બધી સમજણ આપ્યા પછી અંતે તો એ જ કહું છે કે હે અર્જુન, મને જે કલ્યાણકારી માર્ગ લાગે છે એ મેં તને કહ્યો. હવે તારી પ્રકૃતિ અને બુદ્ધિ અનુસાર તને જે યોગ્ય લાગે એ નિર્ણય તું કર.

આઈ કે દસ વર્ષની ઉમરે તમારા પિતા કે પિતામહે સદ્ગતન કોને કહેવાય એ વિશે એમની માન્યતા અનુસાર તમને જે કંઈ કહું કે શીખવું હશે એનો તમે એક પણ પ્રતિપ્રશ્ન કર્યા વિના સ્વીકાર કરી લીધો હશે. બાપુજી કે દાદા જે કરવાનું કહે છે એ સારું અને સાચું જ હશે એને તમે સહજ માનતા હતા. તત્પૂરતું આશગમતું કે અકારું લાગતું હોય તો પણ બાપુજીએ આમ કહું છે કે પછી ‘દાદાને આ નથી ગમતું’ એમ માનીને એમની ઈચ્છા કે આશાને વશ થઈને તમે વર્તતા હતા. આમાં કેટલીય વાર પિતા કે દાદા પ્રત્યેના પૂજ્યભાવ કરતાં વિરોધ એમનો ભય રહેતો હતો.

આજે પરિસ્થિતિ સાવ ભિન્ન છે. આઈ કે દસ વર્ષના પુત્ર કે પુત્રીના સામાન્ય રહેશીકરણીના વહેવારને બારીકાઈથી નીરખવાનો એના માતા કે પિતા પાસે સમય નથી. દાદા કે દાદી તરીકે જો તમે એમના વર્તનમાં કશુંક બેલૂંકું કે અનિચ્છનીય જોશો તો તમારાથી એમને રોક્યા વિના રહેવાશે નહીં. આ ઉપરાંત કેટલાક વહેવારો એવા હોય છે કે આ બાળકો બાલ્યાવસ્થાથી જ પારિવારિક સંસ્કાર તરીકે શીંદે તો સારું એમ તમે ઈચ્છાતા પણ હો છો. હવે અહીં, જે રીતે દાદા કે પિતાએ તમને તમારી બાલ્યાવસ્થામાં જે કંઈ કરવાનું કે નહીં કરવાનું શીખવું હતું અને તમે એનો કશોય વિરોધ કર્યા વિના સ્વીકારી લીધું હતું એવું આજે નહીં બને. એવી અપેક્ષા રાખશો તો આ બાળકોને તમે કોઈ સંસ્કારોથી રોકી નહીં શકો કે આપી પણ નહીં શકો.

આજનું આ આઈ દસ વર્ષનું બાળક તરત જ પ્રતિપ્રશ્નો

કરશે, વિવાદ કરશે, પોતે જે કરે છે એ જ સાચું છે એવું ઈસાવવા પાર વિનાની દલીલો પણ કરશે. આ બધા પાછળ એની ભૂમિકા, ટી.વી.ના પડદા ઉપર રજૂ થતી પાત્રસૂચિ, રીયાલિટી શો અને સીરીયલો હોય છે. આ બધાને વાસ્તવિક જગત માનીને એ તમારાં સલાહ સૂચનોનો અસ્વીકાર કરશે. વયને કારણે તમારી ગ્રહણ શક્તિ અને વિવાદ શક્તિ બંને કુંઠિત થઈ હશે તો તમે વાહિયાત દલીલો સામે કંટાળી જશો, ધીરજ ખોઈ બેસશો અને પછી ગુસ્સે પણ થઈ જશો. આનું પરિણામ એ આવશે કે પેલું બાળક તમારા ચુસ્સાને કારણે તમારાથી અળગું થઈ જશે. તમારી વાતનો એ સ્વીકાર તો નહીં કરે પણ એના મનમાં એવું ગૃહિત પણ પેઢા થશે કે દાદા કંઈ સમજતા નથી.

આ પરિસ્થિતિમાં તમારે જે કંઈ માર્ગ કાઢવાનો છે એ કોઈ ગાણિતિક ચોક્સાઈથી ઠરાવી ન શકાય. સ્થળકાળના સંદર્ભમાં ધીરજથી અને કુનેહપૂર્વક યથાશક્તિ - યથામતિ કલ્યાશકારી માર્ગ લેવો અને છતાં કશું ફળ પ્રાપ્ત કરી ન શકાય તો એનો ઝાંઝો માનસિક ઉચાટ વેંગલારવો નહીં. જેણે તમને સફળતાપૂર્વક સિતેર કે એંસી વર્ષ સુધી પહોંચાડ્યા છે એ જ શક્તિ આ બાળકની પણ એના કર્માનુસાર સંભાળ રાખશે એવો વિશ્વાસ રાખવો.

એ તો આપણો સહુનો સાવ સહજ અનુભવ છે કે મોટાભાગે સાઈ પછીની વયમાં આંખ, કાન, દાંત જેવા અવયવો એમની કાર્યક્ષમતા ધીમે ધીમે ખોઈ નાખે છે. પરિણામે ચશમાં, દાંતનું ચોકું કે કાનનું શ્રવણયંત્ર આવા વડીલો ઉપયોગમાં લે છે. ક્યારેક પગના ઘૂંઠણ વગેરેમાં તકલીફ થવાને કારણે લાકીનો ટેકો પણ લેવો પડે છે. આમાં કશું અસ્વાભાવિક પણ નથી. અસ્વાભાવિક માત્ર એટલું જ હોય છે કે ચશમાં હોવા છતાં આપણે ચશમાં પહેર્યા વિના સોયમાં દોરો પરોવવાની મથામણ કર્યા કરતા હોઈએ છીએ. ચશમાં પહેર્યા પછી પણ પૂરતો પ્રકાશ ન હોય તો સોયમાં દોરો પરોવવાની આવા વડીલની કસરત વર્થ જ થવાની. એ જ પ્રમાણે કુદરતી બત્તીસીએ વિદ્યાય લઈ લીધી હોય ત્યારે દાંતના ચોકઠા પાસે સોપારીનો ઢુકડો કે શેરડીની ગંડેરી આસ્વાદવાનો પ્રયોગ કરવો જોઈએ નહીં.

હવે જ્યારે કુદરતે તમારી પાસેથી કેટલીક ક્ષમતા લઈ લીધી છે અને તમે વિજ્ઞાની મદદથી આ ક્ષમતા ઉપર થીગું માર્યું છે ત્યારે થીગું ફાટી ન જાય એની સંભાળ લઈને કાર્યક્ષેત્રો પસંદ કરવા એમાં શાખપણ છે. પિતૃભક્ત શ્રવણની બાળવાત્મિં ભલે આપણને એવું શીખવવામાં આવ્યું હોય કે અંધ મા-બાપને યાત્રા કરવાની ઈચ્છા હતી એટલે પુત્ર શ્રવણ એમને ખલે કાવડમાં બેસાડીને યાત્રાએ લઈ ગયો હતો. આવી યાત્રાનું પરિણામ એ આવ્યું કે શ્રવણ રાજી દશરથના બાળનો ભોગ બનીને મૃત્યુ પામ્યો અને અસહાય માતા-પિતાએ તરફથીને પ્રાજ્ઞ ત્યજ્યા. એટલું જ નહીં, પ્રાણત્યાગ કરતી વખતે એમણે દશરથને પુત્ર વિયોગનો શાપ આપ્યો અને આ શાપને કારણે જ રામ વનવાસનો પુત્ર વિયોગ દશરથે ભોગવવો પડ્યો અને એ પણ તરફથીને મૃત્યુ પામ્યા. આ આખા ઘટનાચ્યકના મૂળમાં શ્રવણનાં અંધ માતા-

પિતાએ યાત્રાએ જવાની લાલસા રાખી હતી એને ગણી શકાય. શારીરિક રીતે અક્ષમ થઈ જતાં વડીલોએ બને ત્યાં સુધી પુત્રો કે અન્યો ઉપર પોતાની ઈચ્છાપૂર્તિ કરવા માટે અકારણ બોજો ન લદાઈ જાય એની કાળજી લેવી જોઈએ.

હું એક એવા વડીલને જાણું છું કે જેઓ બંને પગના ઘૂંઠણેથી અક્ષમ થઈ ગયા છે. લાકીના ટેકા વિના એક ડગલુંય ચાલી શકતા નથી. બેઠા હોય ત્યાંથી ઊભા થવા માટે કોઈની મદદની જરૂર પડે છે. દાદરનું એક પગથિયું સુદ્ધાં તેઓ જાતે ચડી શકતા નથી, પણ બે જાંઝો એમને ઊંચીને ચડાવવા પડે છે. યૌવનકાળમાં એમણે સંખ્યાબંધ પ્રવાસો કર્યા હતા એટલે પ્રવાસ એ એમનો શોખનો વિષય છે. પ્રવાસ કર્યા વિના લાંબો વખત ઘરમાં બેસી રહેવું એમને અકારું લાગે છે. કોઈપણ વહેવારિક પ્રસંગ હોય કે પછી કોઈપણ યાત્રા પ્રવાસે જતું હોય ત્યારે એમની સાથે જોડાઈ જવા તેઓ આતુર થઈ જાય છે.

સદ્ભાગ્ય એમને આમજનો આજાંકિત સાંપડયાં છે. એટલે તેઓ આ વડીલની ઈચ્છાને સમજીને પોતાની સાથે લઈ જાય છે, પણ આવા દરેક વખતે આ વડીલ સિવાયનાં અન્ય સહુ પરિવારજનોને પારાવાર તકલીફ થતી હોય છે. વડીલ વારંવાર થાકી જાય, પ્રવાસ અટકાવવો પડે, એમના માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવી પડે, એમને ચડવા-ઉત્તરવા કે ફેરવાવા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડે અને આ બધામાં આખા પરિવારનો ખાસ્સો સમય જાય. એટલું જ નહીં, કેટલીય વાર સમયસર નહીં પહોંચી શકવાને કારણે દર્શન કે મુલાકાત રદ પણ કરવા પડે.

આમાં ઔચિત્ય નથી. વડીલે પોતે જ સમજદારીપૂર્વક અન્ય પરિવારજનો ઉપર બોજો બનવાનું ટાળવું જોઈએ. એમણે પોતે જ સ્વેચ્છાએ આવી અગવડોથી ભરેલી અવરજવરમાંથી પોતાની જાતને મુક્ત કરી દેવી જોઈએ. માનવ પ્રકૃતિ એવી છે કે આવા વડીલનાં નિકટનાં આમજનો કોઈવાર પોતાનું કર્તવ્ય સમજીને સહાયભૂત પણ થાય, પણ જો અવારનવાર આવું બનતું રહે તો તેઓ આમાંથી મુક્તિ મેળવવા માટે એકબીજા ઉપર આવી જવાબદારી ઠેલવા માંડે છે. આમાં સ્વર્ગસ્થ કવિ હરીન્દ્રભાઈએ કહ્યું છે એમ કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. વડીલાએ આવા સંજોગોમાં માત્ર પોતાની અપેક્ષાઓ જ ઓછી કરી નાખવાની હોય છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંડરમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે આ સંસારને અશ્વત્થ કહ્યો છે. અશ્વત્થ એટલે જે પ્રતિક્ષણે બદલાતું રહે છે અને ક્ષણભંગુર હોય છે. બૌદ્ધ ધર્મમાં પણ તથાગત બુદ્ધે આ સમગ્ર વિશ્વને સતત પરિવર્તનશીલ કહ્યું છે. કશું જ એક ક્ષણ સુદ્ધાં સ્થિર નથી હોતું. બધું જ પ્રતિક્ષણ બદલાતું હોય છે. આ બદલાવને જે સમજી શકે છે, સમજીને જે સ્વીકારી શકે છે, સ્વીકારીને જે આત્મસાત્ કરી શકે છે એને માટે પાછલાં વર્ષો હળવાં થવાની સંભાવના સવિશેષ છે. દુઃખ નાશ પામે અને સર્વત્ર માત્ર સુખ જ સુખ પ્રાપ્ત થાય એવું ભલે ન બને, પણ કેટલીક સમજદારી સાથે આપણે આપણા શેષ શાસોને હળવા તો જરૂર કરી શકીએ. ■

અંધારાં ઉલેચવાં

ચિંતન

શાંતિલાલ ગઠિયા

ગાંધી વિચારના સમર્થક કેદારનાથજીએ કેળવણી વિષે તાત્ત્વિક વિચાર રજૂ કરતાં કહ્યું છે, શરીર, મન અને આત્મામાં રહેલાં સર્વશ્રેષ્ઠ તત્ત્વોને બહાર લાવવાનું કર્તવ્ય કેળવણીનું છે.

પહેલી નજરે તો એમ જ લાગે કે આ અંધારાં ઉલેચવા જેવું દુર્ગમ કાર્ય છે, મિથ્યા પ્રયત્ન છે. વિશાળ જળરાશિમાંથી જળ ઉલેચવું શક્ય છે. તેને માટે અધતન ઉપકરણો પણ કામે લગાડી શકાય, પરંતુ એક વિદ્યાર્થીમાંથી ઉત્તમોત્તમ ગુણલક્ષણો બહાર લાવવાનું શક્ય છે? હા, શક્ય છે. આ દેશમાં શિક્ષકે મનોવૈજ્ઞાનિક અભિગમ અપનાવવો રહ્યો.

ગાઈનર મરફી કહે છે : The term 'Learning' does not mean simply sitting at a desk and committing things to memory. It covers every modification of behaviour to meet environmental requirements. It is through learning that one moulds the raw stuff of human nature into the concrete individuality which one possesses.

(‘શીખવું’ એટલે માત્ર વર્ગિંડમાં પાટલી પર બેસી અમુક બાબતોને મગજમાં સંઘરવી અને યાદ રાખવી, એ ખોટો જ્યાલ છે. શીખવાની કિયા વર્તનના હરેક રૂપાંતરને, પરિવર્તનને આવરી લે છે જેથી કરીને બાબ્ય પરિસ્થિતિની અપેક્ષાઓને પૂરી કરી શકાય. ‘શીખવું’ એટલે વ્યક્તિની અપકવ પ્રવૃત્તિને વાસ્તવિક સ્થાયી ઘાટ આપવો.)

શિક્ષકે એક અભિધારણા (assumption) સતત પોતાના મનમાં રાખવી પડશે કે વ્યક્તિ - વ્યક્તિ વચ્ચે બિનની પ્રવર્ત્ત છે. વ્યક્તિવિગત બિનનાનો સિદ્ધાંત (Principle of Individual Differences) ધ્યાનમાં રાખવાથી શિક્ષક નક્કી કરી શકશે કે ક્યા બાળકને શું શીખવવું અને કઈ રીતે શીખવવું. વિદ્યાર્થીઓમાં શારીરિક તફાવતો બહારથી સ્પષ્ટ જોઈ શકત હોય છે. મનોસામાજિક (Psychological) તફાવતોની ઓળખ વિશેષ જરૂરી છે - જેમ કે

બુદ્ધિ, અભિરૂચિ, વિશિષ્ટ શક્તિ, વ્યક્તિગત લક્ષણો વગેરે. આ તફાવતો મુજબ શિક્ષણની વ્યવસ્થા વિચારી શકાય.

શિક્ષકની જવાબદારી માત્ર વર્ગિંડની ચાર દીવાલ પૂરતી સીમિત નથી. વિશાળ જનસમુદ્દરને એણે નજર સમક્ષ રાકવાનો છે. એનું કાર્ય વ્યાપક સમાજને અસરકર્તા હોય છે. જહોન જ્યુરી કહે છે કે – Just as species perpetuate themselves by renewal through reproduction, so do societies perpetuate themselves by renewal through the educative process.

(જેવી રીતે પ્રાણીજીતિ પ્રજનનકિયા દ્વારા પોતાને ચીરસ્થાયી કરે છે, તેમ સમાજો શિક્ષણ પ્રક્રિયા દ્વારા ચીરસ્થાયી થાય છે.)

ઉપરોક્ત કથન કેટલું સૂચ્યક છે! શિક્ષણ પ્રક્રિયા થકી સમાજો એટલે કે હરેક સમાજ ટકે છે, આ સત્યનાં એમાં દર્શન થાય છે. જ્યુરી renewal શર્ષ વિચારપૂર્વક પ્રયોજે છે. સમાજના વહેણ સાથે પ્રાણીજીતિમાં એકવિધતા નહીં, પણ ‘નવીનીકરણ’ નજરે પડે છે. તેવી રીતે સમાજો પણ બીબાંઢાળ ન બની રહેતાં શિક્ષણ પ્રક્રિયાના માધ્યમથી નવીકૃત થતા રહેવા જોઈએ.

આજે શિક્ષણ ક્ષેત્રે ઠીકઠીક વિધાયક પરિવર્તનો જોવાં મળે છે. શિક્ષકો નિષ્પાર્વક યથાસંભવ વિદ્યાર્થીઓનું ઘડતર કરી રહ્યા છે. તેઓ માત્ર પરીક્ષાલક્ષી નહીં, જીવનલક્ષી શિક્ષણ આપી રહ્યા છે. સાચે જ આ હરખાવા જેવી વાત છે. આ રહ્યો એનો જીવતો જગતો પુરાવો. સોલાપુર (મહારાષ્ટ્ર)ની કન્યાશાળામાં ૧૧ વર્ષની ધનશ્રી ધોરણ-૫ માં ભાણે છે. એ શિક્ષિકા પણ છે. માન્યામાં નથી આવતું ને? ધનશ્રીએ યોગમાં પ્રવીષ્ટતા પ્રામ કરી છે. ૧૫૦૦ વિદ્યાર્થીનોને યોગ શીખવે છે. આચાર્યા ગીતાબહેન સુદ્ધાં ધનશ્રીના કોશલ્યથી પ્રભાવિત છે અને તેથી અઠવાડિયામાં એક વાર એને યોગ શીખવવાની જવાબદારી સોંપી છે. એક કિશોરી જે શાળામાં વિદ્યાર્થીની, એ જ શાળામાં શિક્ષિકા પણ!

ડેસેમ્બર,

કોન : (૦૨૬૪) ૨૪૮૭૬૮૦

GIRISH ☎ 2567 5418 • MUKESH ☎ 2568 5279

203, New Anant Bhuvan, 2nd Floor,
257/65, Narshi Natha Street, Mumbai-400 009.
Tel. : (022) 23756332, 23751250 Fax : 91-22-23750452



Ramji Devshi Shah & Co.

CUSTOM HOUSE AGENT

આ ત્રિશંકુ પરિસ્થિતિમાં તમે હો તો શું કરો? ॥ નૈતિક ધર્મસંકટ ॥

ચિંતન

ભરત 'કુમાર' પ્રા. ઠાકર

મૂળ મહુવા (જિ. ભાવનગર)ના વતની અને મુંબઈ સાહિત્યપ્રેમી ઉદ્ઘોગપતિ બળવંતભાઈ કલ્યાણજી પારેખ (૧૯૨૪-૨૦૧૩) તરફથી મને ફેલ્લુઆરી-૨૦૦૫માં એમના દ્વારા જ સંપાદિત થયેલું અને વિવિધ લેખો - કાચ્યો સમાવતું ગુજરાતી - અંગ્રેજ દ્વિભાષી પુસ્તક 'ગમતાંનો કરીએ ગુલાલ' (ભાગ-૧) (૨૦૦૩) મળેલું. મૂળે આ શિર્ષક આપણા સાંઈ કવિ મકરંદ વજેશંકર દવે (૧૯૨૨ - ૨૦૦૫)ની વિષ્યાત કાવ્યપંક્તિનો એક અંશ છે.

આ પુસ્તકના વાંચનમાંથી પસાર થતો હતો ત્યાં મારી નજર પૂર્ણ-૨૨ ઉપર 'MORAL DILEMMA' મથાળે અંગ્રેજમાં મુકાયેલા એક સુંદર પ્રસંગ પર પડી. જેના મૂળ સંદર્ભ તરીકે 'રીડર્સ ડાઇજેસ્ટ' (એપ્રિલ ૨૦૦૩)નો ઉલ્લેખ થયો છે અને ડીક બ્રેઇટ દ્વારા તે રજૂ થયો છે. મને તે પ્રસંગ સ્પર્શી જતાં તેનો ગુજરાતીમાં અનુવાદ કરી પુસ્તકના શિર્ષકની જેમ વાચકો વચ્ચે વહેંચી રહ્યો છું.

તો, હવે 'નૈતિક ધર્મસંકટ' સમજવા માટે તૈયાર થઈ જાવ. આવી એક કાલ્યનિક પરિસ્થિતિની ધારણા કરો. તમે એક નિર્જન તોફાની રાતે કાર હંકારી જઈ રહ્યો છો... અચાનક એક બસ સ્ટોપ પાસેથી પસાર થાઓ છો. ત્યાં તમે કોઈ વાહનની રાહ જોતી ગણ વ્યક્તિઓને જુઓ છો, જે આ પ્રમાણે છે...

૧. એક બીમાર વૃદ્ધ સ્ત્રી, જે લગભગ મરવાની તૈયારીમાં છે.
૨. એક જૂનો મિત્ર, જેણે એક વખત તમારી જિંદગી બચાવી હતી.
૩. એક શ્રેષ્ઠ સાથીદાર, જેમના વિશે તમે સપનાં સેવો છો.

હવે તમારી કારમાં એક વ્યક્તિને જ સમાવી શકાય છે એવું જ્ઞાતાં આ 'ત્રિશંકુ કે દ્વિધાભરી પરિસ્થિતિ'માં તમે શું કરો? તમે કોને બેસાડવાની પસંદગી કરો? એક નીતિમતા તરીકે તમારે વૃદ્ધાને બચાવવી જોઈએ કે પછી એક વખત તમારું જીવન

બચાવનાર જૂના મિત્રને લેશો? આ બેમાંથી પસંદગી કરશો તો તમારી શ્રેષ્ઠ સ્વભ સુંદરી ફરી ક્યારેય નહીં મેળવી શકો!

વિદેશમાં નોકરીની એક જગ્યા માટે બોલાવાયેલા ૨૦૦ જેટલા અરજદારોને ઉપરની 'કસોટી' આપવામાં આવતા પહેલાં તો તેઓ જ મુંજવણમાં મૂકાઈ ગયેલા કે કઈ વ્યક્તિને લેવી અને કોને છોડવી?! આ ઉમેદવારોએ આપેલા જવાબોમાંથી 'સહકારી ભાવનાવાળો' શ્રેષ્ઠ ઉત્તર મળ્યો તે અહીં રજૂ કર્યો છે. પરંતુ જરા થોભો. પહેલા તમારો જવાબ મગજમાં નક્કી કરી લો... પછી જ સાચો ઉકેલ જુઓ...

આવી ધર્મસંકટ જેવી પરિસ્થિતિમાં યોગ્ય અને ઉત્તમ નિર્જય કેવો હોઈ શકે તે જુઓ : હું કારની ચાવી મારા મિત્રને આપીશ (અર્થાત્ મારી જગ્યાએ તા ગાડી ચલાવશો) અને વૃદ્ધાને હોસ્પિટલ લઈ જવા તેને જણાવીશ. પછી હું પાછળ રહીશ અને મારા સ્વભની યુવતી સાથે બસ-સ્ટોપ પર બસ માટે રાહ જોવાનું પસંદ કરીશ.

પૂર્ણાયેલ કસોટીમાં સામાન્ય રીતે વિચારાતં કોઈ પણ એક વ્યક્તિને કારમાં બેસાડતાં બીજી બે વ્યક્તિઓને છોડવી પડે એમ છે. જ્યારે ઉક્ત બુદ્ધિભર્યા ઉકેલમાં કારચાલક સહિત ચારેય વ્યક્તિઓનું નિરાકરણ આવી જાય છે.

આમ, અમુક વિકલ્યો વચ્ચે જ્યારે પસંદગી કરવાની હોય અને તેમાંનો કોઈ છોડી ન શકાય એવી સ્થિતિ હોય અથવા તો 'સૂરી વચ્ચે સોપારી' જેવી મુશ્કેલ, દ્વિધાભરી, અસમંજસપૂર્ણ, ત્રિશંકુ કે નૈતિક ધર્મસંકટ જેવી પરિસ્થિતિ જીવનમાં ઉદ્ભબે ત્યારે તેનો શ્રેષ્ઠ ઉપાય શોધી સમગ્ર સ્થિતિ (અથવા તમામ વિકલ્યો)ને કેમ સાચવી લેવા તેનો સુંદર પરોક્ષ બોધ આ નાનકડી 'ક્રિઝ'માં છૂપાયેલો છે.

'શિવય', ૪૦, વૃદ્ધાવન નગર-૧,
પ્રેશાલી સિનેમા રોડ, અંગાર, કાચ્છ-૩૯૦ ૧૧૦.
કોન : (૦૨૮૩૬) ૨૪૦૭૩૮, મો. ૯૮૨૭૨ ૨૩૧૫૦

"ROLEX" Brand



Rushabh
STEEL CENTRE

MFGR. & DEALERS IN : **Rolex** SQUARE DABBA & TIFFIN

G-77, Sarvoday Nagar,
Shri Mahendrakumar T. Shah Marg,
(1st Panjrapole Lane), Mumbai-400 004.
Tel. : 2242 2072, 3393 7310 • Fax : (022) 3008 0072

જગો ભાઈઓ જગો : સફળ જીવન પ્રાપ્ત કરો

ચિંતન

મહાવીરસિંહ શેખાવત

હંમેશાં યાદ રાખો કે હું માનવ છું, હું હંમેશાં માનવધર્મનું પાલન કરીશ, માનવ તરીકેના મારા કર્તવ્ય કર્મનું પાલન કરીશ. કદાપી માનવધર્મ વિદુદ્ધનું કાર્ય કરીશ નહીં. તે માટે મારો માનવ ધર્મ શું છે અને માનવનું કર્તવ્ય કર્મ શું છે તેની વધુ માહિતી પ્રામ કરીશ અને તેનો અમલ કરીશ. આ પ્રકારનો સંકલ્પ કરવામાં આવશે તો તે વ્યક્તિને એક તો સાચો માનવ બનાવશે તે સાથે વ્યક્તિની સાચી પ્રગતિ થશે.

પરંતુ સંકલ્પને સિધ્ય કરવાનું એટલું સહેલું નથી. થોડા સમય તેને યાદ રાખ્યા પછી તેમાં ચૂક થવાની સંભાવના રહે છે અને તેને જીવનમાં કાયમને માટે વણી શકાતું નથી. આ માટે અને એક ટેકનિક આપવામાં આવે છે જેનો અમલ કરવાથી આપ ઉક્ત સંકલ્પ ઉપરાંત કોઈ પણ સંકલ્પને સિધ્ય કરી શકો છો અને મનવાંછિત ફળ પ્રામ કરી શકો છો.

કોઈપણ સંકલ્પને સિધ્ય કરવા માટે મનની શક્તિ જરૂરી છે. આપણે આપણા મનને ચકાસીશું તો તે નબળું હોવાનું જણાશે. આપણે સામાન્ય રીતે મનની શક્તિનો ફક્ત ૧૦ ટકા જ ઉપયોગ કરીએ છીએ અને બાકીની ૮૦ ટકા શક્તિ તો વણ વપરાયેલી જ પડી રહે છે. આ ૮૦ ટકા શક્તિને જગાવવાની જરૂર છે. આપણે મનની શક્તિ જેટલી વધુ વિકસાવી શકીએ તેટલી આપણા સંકલ્પોને જલદીથી સિધ્ય કરી શકીએ છીએ. તો મનની શક્તિને સમજુએ અને નીચે દર્શાવ્યા પ્રમાણે તેને વિકસાવીએ.

વાસ્તવમાં આપણે જે મનની વાત કરતા હોઈએ છીએ તે આપણું બાધ્ય મન છે. જે ઉપરાંત એક આંતરમન પણ હોય છે જેને અચેતન મન કે સબકોન્સિયસ માઈન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મનની વાસ્તવિક શક્તિ આ આંતરમનમાં જ હોય છે અને તે શક્તિ વિકસાવવાથી બાકીની ૮૦ ટકા મનની શક્તિ પણ પ્રામ કરી શકાય છે. તે માટે આંતરમનને કઈ રીતે જાગૃત કરી શકાય તે ટૂંકમાં સમજુએ.

આંતરમનને અંગ્રેજીમાં સબકોન્સિયસ માઈન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને તે સામાન્ય સંજોગોમાં અર્ધજાગૃત અવસ્થામાં જ કામ કરતું હોય છે. બાકીના સમયમાં બાધ્ય મન જ જાગૃત હોય છે જ્યારે આંતરમન સુષુપ્ત અવસ્થામાં હોય છે. જ્યારે આપણે સવારે જાગીએ છીએ કે રાત્રે ઉંઘ આવવાની તૈયારીમાં હોય છે ત્યારે આપણે અર્ધજાગૃત અવસ્થામાં હોઈએ છીએ અને તેથી તે સમયે આ આંતરમન પણ જાગૃત હોય છે.

તેથી આ સમયે આપણે જે કાઈ વિચારીએ છીએ તે આપણા આંતરમનમાં જતું રહેતું હોય છે અને તે પ્રમાણે પછી આપણું બાધ્ય મન કાર્ય કરતું હોય છે. તેથી આ સમયમાં કોઈ નેગેટીવ વિચારો ન કરવા જોઈએ અને હંમેશાં પોઝિટીવ વિચારો આપણા આંતરમનને મળે અને તે પ્રમાણેના પોઝિટીવ કામો જ થાય. તેથી આપણે આદર્શ મનુષ્ય બનવા માટે આ બંને સમયે હંમેશાં નીચે પ્રમાણે બોલીને સાંભળીને વિચારો કરી તેને આપણા આંતરમનમાં દ્રબ્ધ કરવા જોઈએ. આપણે નીચે પ્રમાણે બોલી શકીએ કે રેકર્ડ કરેલું સાંભળી શકીએ. હિવસે પણ તે અંગે પુનઃ વિચારતા રહો.

૧. હું આદર્શ મનુષ્ય છું અને આદર્શ મનુષ્યને અનુરૂપ જ હંમેશાં કાર્યો કરું છું.
૨. હું હંમેશાં મનુષ્યને અનુરૂપ માનવધર્મનું પાલન કરવા કામ કરું છું અને તે પ્રમાણે જ વર્તણૂક કરું છું.
૩. હું કદાપી ખોટું કામ કરતો નથી.
૪. હું હંમેશાં ન્યાયને અનુરૂપ જ કાર્ય કરું છું.
૫. હું હંમેશાં મારા પોતાનામાં ગીતામાં વર્ણવેલ ગુણો વિકસાવવા પ્રયત્ન કરું છું.

થઈ ગયો

જાતથી લ્યો હું વિખૂટો થઈ ગયો,
એમ બસ લ્યો હું અનુઠો થઈ ગયો.

તેમણે આપી નહીં વિદ્યા કદી,
બાળભીલનો હું અંગુઠો થઈ ગયો.

સત્ય હું બોલ્યા કર્યો પણ તે છતાં
આખરે સાબિત હું જુઠો થઈ ગયો.

તે સતત કરતા રહ્યા ઉપયોગ મારો,
તે છતાં પણ હું અછૂતો થઈ ગયો.

જુલ્ભની હું દાસતાં તો શું કહું?
લોહીભીનો સૂસવાટો થઈ ગયો.

ના ગણ્યો માણસ મને તેમણે,
લાશ જીવતી કોહવાટો થઈ ગયો.

યુવાનોને સંદેશ

ચિંતન

વિજયભાઈ પટેલ

જિસ કે અંદર લગી રહેતી હે ધૂન,
વો બહાર કી હુનિયા મેં મચાતા હે ધૂમ.
બહાર કી અથ તક તુને બહારે સુની
You can not do it.
અથ તરે ભીતર કી સૂન.
I can do it.

“શાસ્ત્રોએ યુવાનની વ્યાખ્યા આ પ્રમાણે નોંધી છે – “યુ”
યુયુત્સા, “વ” – વાત્સલ્ય અને “ન” – નમૃતા. આ ગ્રણેય
ગુણો જેનામાં છે તે યુવાન.”

સમગ્ર વિશ્વમાં સૌથી મહાન દેશ હોય તો તે ભારત છે.
અન્ય દેશો કરતાં ભારત પાસે અનેક મહાન વિશેષતાઓ પડી
છે. ભારતની આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વના
દેશો અનુકરણ કરી રહ્યા છે. આ બધી વિશેષતાઓની સાથે
ભારત પાસે અન્ય દેશો કરતા વધારે મહત્વનું હોય તો તે
ભારતના યુવાનો છે. સૌથી વધુ યુવાનો ધરાવતા દેશ ભારતને
સો-સો સલામ ભરવા પડે. વિશ્વના મોટાભાગના દેશોમાં
બુદ્ધિજીવીઓની કક્ષાએ જે યુવાનો કાર્યરત છે એ ભારતના
યુવાનો છે. સ્વામી વિવેકાનંદજીની દાખિએ યુવાન કેવો હોવો
જોઈએ? આજનો યુવાન રાષ્ટ્રને કેટલો વફાદાર હોવો જોઈએ?
અને યુવાન કર્તવ્યનિષ્ઠ અને ચારિત્રયશીલ હોવો જોઈએ એ માટે
કેળવાયેલ તજજો પાસેથી કેળવણી આપવામાં આવે તો પૂર્વ
પ્રેસિડેન્ટ શ્રી અભ્યુલ કલામ સાહેબે જોયેલા ૨૦૨૦ના સ્વભને
સાકાર કરતા કોઈ રોકી શકે એમ નથી. “યુવાન એ છે જે
સક્રિય છે, પરિવર્તનશીલ છે, પ્રયોગશીલ છે. પોતાની પીડાઓના
અર્કમાંથી અન્ય માટે પરફિયુમ બનાવે તે યુવાન.”

“માણસ એ દુનિયાનું એકમાત્ર પાંખો વગરનું પ્રાણી છે,
જેને કુદરતે ઉડાન ભરવાનું જુસ્સો (Spirit) બક્સેલ છે.”

દુનિયામાં સર્વપ્રથમવાર ‘એવરેસ્ટ’ ચઢતાં, હાંફતા હાંફતા
પણ હિંમત હાર્યા વગર કે હતાશ થયા વગર પર્વતને પડકાર
ફેક્તા એડમન્ડ હિલેરીએ કહું હતું કે...

“તું ભલે ગમે તેટલો ઊંચો હો પણ હવે પર્વત તરીકે તું
ગુદ્ધ નહીં પામે.

U can't grow now.

હું માણસ તરીકે જરૂર ઉપર ઊઠીશ.”

ચાલો, આપણે પણ જગતની આવી બુલંદીઓ કેળવીએ

અને આપણા કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને ઊંચાઈએ બક્ષવામાં
નિમિત્ત બનીએ. જગતનું બુલંદીપણું અને સ્વભાવનું આનંદીપણું
સાતત્યપૂર્ણ રીતે ટકાવી રાખીએ તો સાચા અર્થમાં યુવાન તરીકે
સાબિત થઈ શકીએ.

“હર પાની મેં હે આગ સમાઈ,
હર આગ કા અંશ હે પાની,
તું ભી દિવ્ય કા અંશ હે જાની,
કિર કરું રહે તરી શક્તિયાં અન્નાની...”

આજના યુવાનો માટે સ્વામી વિવેકાનંદજી પોતાના વિચારો
રજૂ કરતાં કહે છે કે – યુવાનોને આંતરિક શક્તિ અને વિચારોથી
દેશને સશક્ત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. દેશનો પાયો
દેશની યુવાપેઢી જ છે. દેશનું ભવિષ્ય છે. જો દેશનો પાયો જ
મજબૂત ન હોય તો આ દેશરૂપી ઈમારત ઢળી પડે. આજની
યુવાપેઢી ઢળ આવે ત્યાં ઢળી જાય છે અને પવન આવે ત્યાં
પડી પણ જાય છે. આવું ન બને તે માટે આજના યુવાનોને
સશક્ત બનાવવાની જરૂર છે.

દેશના યુવાનો તો દેશનો આત્મા છે. આત્મા વિના આ
દેશરૂપી શરીર ચાલતું નથી. યુવાન જયારે કંઈક અયોગ્ય થાયત્યારે
તુફાનની જેમ તૂટી પડે છે, પરંતુ એક જ હવાના ઝાપાટમાં પાછા
હલબલી જાય છે, જે યોગ્ય નથી. તેમણે સતત સંઘર્ષ કરવો
જોઈએ. તેણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંયમ સાથે તટસ્થ
રહેવાની જબરદસ્ત શક્તિ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. એના માટે
યુવાનોને શાળા, સમાજ અને માતા-પિતાએ ચોક્કસ પ્રકારની
પ્રેક્ટિકલ તાલીમ આપવી જોઈએ. બાળપણથી જ યુવાન સ્વભળે
અનુશાસનથી આગળ વધે એ માટે કેળવણી આપવી જોઈએ.
બાળપણથી જ સર્વાંગી શિક્ષણને ધ્યાનમાં રાખી શારીરિક,
માનસિક, બૌધ્ધિક, સાંવેદિક તાલીમ આપી સ્વસ્થ યુવાન તૈયાર
કરવો જોઈએ. યુવાનીમાં આત્મવિશ્વાસ સાથે હિંમતથી આગળ
વધી શકે એ માટે મહાન ચરિત્રોના પરિચય તેમજ જીવનચરિત્રો
માટે વાચનાભિમુખ બનાવી વિચારવંત બનાવવા જોઈએ. સાચી
દિશામાં સફળતા પ્રાપ્ત કરવા માટે સાહસ ખૂબ જ જરૂરી છે.
બાળપણથી જ સ્વભળે આગળ વધી પોતાના જીવનના નિર્ણયો સ્વયં
કરતો થાય એ માટે જરૂરી તકો પૂરી પાડવી જોઈએ. હિંમતથી
આગળ વધનારને કોઈ મુશ્કેલીઓ રોકી શકતી નથી. યુવાનીમાં
આ સત્ય આત્મસાત્ર થાય તો ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

મહાન લેખક ડૉ. રોબર્ટ એચ. શૂલરનું હિંમત વિશેનું

પ્રયોગ વાક્ય હૃદયમાં મટવા જેવું - ફેલિંગ કરવા જેવું છે.

Courage is something you never lose it...!

Courage is something you always choose it...!

હિંમત અને આત્મવિશ્વાસ બંને 'દુપ્તિ' જેવા છે.

Courage and confidence are like Mr. and Mrs.!

ભારત દેશ પાસે મહાશક્તિ તરીકે યુવાનો છે. જો યુવાનો સમય અને શક્તિનું મૂલ્ય, માનવ જીવનનું મહત્વ અને સ્વદેશ પ્રેમની સાચી સમજ આપવામાં આવે તો યુવાન સાચા અર્થમાં માનવીમાંથી વિશ્વમાનવી બનવાની તાકાત ધરાવે છે.

સ્વામી વિવેકાનંદજી યુવાનોને સંદેશ આપતા કહે છે કે,-

'ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સીત્વને તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે. તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વર્ષિત્વારી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઈન્દ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વિકિતિગત, અંગત સુખને માટે નથી. તું ભૂલતો નહીં કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે ભારતનો નિભન્વણી, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભિષેક ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝડપ મારનાર ભંગી સુદ્ધાં તારા રક્તમાંસના સગાઓ છે, તારા ભાઈઓ છે. હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી છે અને ગર્વપૂર્વક ગર્જના કર કે 'હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.' તું પોકારી ઊઠ કે, 'અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે!' તારી કભર પર પહેરવા ભલે એક માત્ર લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે, 'ભારતવાસી મારો ભાઈ છે', 'ભારતવાસી મારું જીવન છે, ભારતના દેવદેવીઓ મારા ઈશ્વર છે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.' ભાઈ! પોકારી ઊઠ કે 'ભારતની ધરતી એ મારું સવોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.' અને અહોરાત્ર પ્રાર્થના કર કે, 'હે ગૌરીપતે, હે જગદ્રજનની અંબે! તું મને મનુષ્યત્વ આપ! હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્ભળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ! મને દર્દ મુક્ત બનાવ!' વીર યુવકો! શ્રદ્ધા રાખો કે તમારો સહુનો જન્મ મહાન કાર્યો કરવા માટે થયો છે. કુરુકુરિયાના ભસવાથી ડરી જશો નહીં; અરે, આકાશના વજપ્રહારથી પણ ભયબીત થશો નહીં. પણ ઊભા થાઓ અને કામે લાગો!

વીરતાભર્યા વચનો અને અથીયે વધુ વીરતાભર્યા કાર્યોની જ આપણને જરૂર છે. જાગો, ઓ મહાનુભાવો જાગો!

સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા અને અંતરમાં ઊંડી

શ્રદ્ધાવાળા નવયુવકોની આવશ્યકતા છે. આવા સો નવલોહિયા યુવકો મળે તો દુનિયામાં કાંતિ આવી જય!

"Give me hundred Nachiketas I can change the World."

તારી પાસે રહેલી જિજાસા, જ્ઞાન, શક્તિ, સ્વખ એ જ તારું જીવન છે. યુવાન પાસે સ્વખ ન હોય તો ગતિ ક્યાંથી? કુતૂહલ ન હોય તો જ્ઞાન ક્યાંથી? આવા પ્રશ્નો સતત તને થવા જોઈએ. આશ્ર્યો થવા જોઈએ. નવપલ્લવિત વિચારો ઊગવા જોઈએ. નવી ગતિ તરફનું પ્રયાણ એ યુવાનની સાચી ઓળખ છે. સાચો યુવાન એટલે પૂજાવિરામ નહીં, પ્રશ્નાર્થ કે આશ્ર્ય ચિહ્ન! સાચો યુવાન એટલે પ્રત્યેક ક્ષણે નિર્ભિક ઊર્જનો ઝોત અને ચેતનનો ફુવારો એવું હું સમજું છું.

જો ચણાનો કો ચટકા હે,

ખાની ઉસીકો કહતે હે.

જો દિલ પે નકશ હો જાયે,

કછાની ઉસી કો કહતે હે.

તું ક્યા માલ્યમ,

કરિશ્મા કેસા હોતા હે,

એ પલટ હે દિમાલય કો,

'યુવાન' ઉસી કો કહતે હે.

શૌર્યથી ધગધગતા યુવાનો જ દેશનું મહામૂલું ધન છે. યુવાશક્તિ એ યુગશક્તિ છે. યુવાશક્તિ એ રાષ્ટ્રોત્થાનના કાર્યમાં સહભાગી બની રહેવાનું છે.

સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોના વાંચન કર્યો બાદ મહાત્મા ગાંધીજીએ કહું છે કે, 'વિવેકાનંદને વાંચ્યા બાદ મારામાં હજાર ગણો રાષ્ટ્રપ્રેમ વધી ગયો છે.'

રવીન્દ્રનાથ ટાગોરજ કહે છે કે, 'ભારત દેશને જાણવો હોય તો સ્વામી વિવેકાનંદજીના પુસ્તકોનું વાંચન કરો.'

સુભાષચંદ્ર બોઝે કહું હતું કે, 'જો વિવેકાનંદ હયાત હોત તો મેં એમને મારા ગુરુ બનાવ્યા હોત અને હું એમનો શિષ્ય હોત.'

રોમારોલાએ સ્વામી વિવેકાનંદજીને પ્રશ્ન કર્યો હતો કે, 'હું આપને કઈ રીતે મદદ કરી શકું?' ત્યારે સ્વામી વિવેકાનંદજીએ એટલું જ કહું હતું કે, 'ભારતવર્ષને પ્રેમ કરો.' સ્વામી વિવેકાનંદજી સૌ યુવાનોને સંદેશ આપતાં કહે છે કે ભારતવર્ષને પ્રેમ કરો, હે વીર તું બહાદુર બન, હિંમતવાન થા, તમારા ભાગ્યના નિર્મિતા તમે પોતે જ છો.

યુગવંદનીય યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીના જીવન કવનનું વાંચન કરી જીવનમાં એમના વિચારો ઉતારવાનાં પ્રયત્નો કરીશું તો પણ સાચા અર્થમાં વિશ્ને સાચી દિશા આપનાર ભારતના આદર્શ નાગરિક બની શકીશું.

સ્વામી વિવેકાનંદના ચરણોમાં વંદન...

આચાર્યશ્રી, શ્રીમતી એલ.પી.ડી. પટેલ સાર્ચ. વિદ્યાલય

ન્યાયિક સક્રિયતા : વાસ્તવિક મૂલ્યાંકન

મંથન

ડૉ. કમલેશ પી. જોશીપુરા

ભારતીય સંસ્કૃતિક લોકતાંત્રિક વ્યવસ્થામાં ત્રણ આયામો કેન્દ્ર સ્થાને રહેલા છે. આ ત્રણ આયામો એટલે ધારાગૃહ, કારોબાર અને ન્યાયતંત્ર — આ ગણેય આયામોનાં કાર્યો, જવાબદારીઓ અને સીમા મર્યાદાઓ ભારતીય બંધારણમાં સુનિશ્ચિત થયેલ છે. ધારાગૃહ — સંસદ કે વિધાનગૃહો કાયદો ઘડવાનું કામ કરે છે, કારોબારીનું ઉત્તરદાયિત્વ તેના અમલીકરણનું છે અને ઘાયેલા કાયદાના અર્થઘટન કે બંધારણમાં પ્રયોગીયેલી પ્રત્યેક બાબતોનું બંધારણીય સિદ્ધાંત મુજબનું અર્થઘટન તે ન્યાયતંત્રનું કામ છે. સંસદ સર્વોચ્ચ સ્થાન ઉપર છે; કારણ કે ભારતીય બંધારણના આમુખમાં સત્તાનું આખરી મૂળ પ્રજામાં નિહિત થયેલ છે અને પ્રજા સર્વોચ્ચ સ્થાને હોવાને કારણે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બનેલા ગૃહો એટલે કે સંસદ કે અન્ય ધારાગૃહો ભારતીય સંસ્કૃતિક લોકતાંત્રિક વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાન ધરાવે તે સ્વાભાવિક છે.

તાજેતરમાં ભારતીય ન્યાયતંત્રમાં સિમાચિહ્નરૂપ કેશવાનંદ ભારતીનો ઐતિહાસિક કેસ ૪૫ વર્ષ પૂર્ણ થતાં ખાસ ચર્ચા આયોજિત કરવામાં આવી હતી. કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરાલાના ડિસ્સામાં ભારતીય બંધારણના મૂળભૂત માળખાને વિપરીત એસર કરે તેવો કોઈ કાયદો વિધાનતંત્ર ન ઘડી શકે તેવા મતલબનો સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદો આજે પણ માર્ગદર્શકરૂપ ગણાય છે. એક પ્રકારે જસ્ટિસ એચ. આર. ખનાએ નેતૃત્વ લઈ અને ઘડી કાઢેલો આ ચુકાદો ભારતીય બંધારણનો મહત્વનો સિદ્ધાંત બની ચૂક્યો છે. આ ચુકાદા અંતર્ગત બંધારણમાં સુધારો કરવા સંદર્ભે ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૬૮ અંતર્ગત સંસદ દ્વારા એવો કોઈ બંધારણીય સુધારો કરવામાં આવે કે જે ભારતીય બંધારણના મુળભૂત માળખાને વિપરીત અસર કરે એ સ્થિતિમાં સર્વોચ્ચ અદાલતને ન્યાયિક પુનરાવલોકન કરવાની સત્તા છે. અલબત્ત, આ ચુકાદો પણ સાત વિરુદ્ધ છ મતોથી બંધારણીય બંધે એટલે કે ખૂબ જ પાતળી બહુમતીથી બંધારણીય બંધે પસાર કરેલ હતો પરંતુ ચુકાદાનું સ્વરૂપ જોતાં આજે પણ આ સિદ્ધાંત ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

વર્તમાન સમયમાં ન્યાયતંત્ર ખુદ ચર્ચાની એરણે ચેલે છે. કદાચ સંસદમાં મતભેદપૂર્ણ વાતાવરણ વચ્ચે ચર્ચા થાય તેના કરતાં પણ કદાચ વધારે આપસી મનમુટાવ અને મતભેદો સરાજીને આવ્યા. એટલું જ નહીં પરંતુ ન્યાયતંત્રની આબરુના ધજાગરા થાય તે રીતે અને કઈક અંશે પ્રસ્તાવિત શિખરનાં ધોરણોના

લીચ ઉડાઠે તે પ્રકારે ચાર ન્યાયાધીશોએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી દ્વારા કેસોની ફાળવણી સામે નારાજગી વક્ત કરી અને ખરેખર તો બંધારણીય નિષ્ણાતોમાં ચર્ચાતી વિગત મુજબ આવી ગેરશિસ્ત કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં અને ખાસ કરીને કોઈ પણ આ પ્રકારે પોતાના પદની ગરિમા મુજબ કામ ન કરે અને પોતાના પદને પ્રતિબદ્ધ ન રહે તેની સામે તત્કાલ મહાઅભિયોગનો ખટલો શરૂ કરવો જોઈએ. પરંતુ સરકારના નેતૃત્વએ ખૂબ જ શાશ્વતપણ અને વૈર્ય રાખી પીઠતાના દર્શન કરાયાં છે તે ખાસ અભિનંદનને પાત્ર છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ પણ મોટું મન રાખી ખેલદિલીના દર્શન કરાવેલ છે. આ સ્થિતિમાં ભારતીય પ્રજા જેની પાસેથી સૌથી વધારે વિશ્વસનીયતાની અપેક્ષા રાખે છે તે ન્યાયતંત્રે ખૂબ જ આત્મમંથન કરવું અનિવાર્ય છે. દેશના રાજનૈતિક નેતાઓ અને લગભગ દરેક ક્ષેત્રમાં કેવી રીતે કામ થવું જોઈએ — કેવું વર્તન કરવું જોઈએ — પ્રત્યેક વર્તનની ટીકા-ટીપ્પણ — તેમજ દરેક નિર્ણયો માટે અભિપ્રાય વ્યક્ત કરનારે હવે સ્વયં પોતાનામાં ડેક્ઝિયું કરવાની જરૂર છે તેવું લાગ્યા વગર રહેતું નથી.

૨૦૧૭ના અંતમાં દેશ માટે મહત્વના એવા વિષયો ઉપર ખૂબ જ રસપ્રદ અને કંઈક અંશે આગામી સમયમાં કઈ ચર્ચા રાષ્ટ્રીય ફલક ઉપર હશે તેનો ખ્યાલ ‘રાષ્ટ્રીય કાનૂન દિવસ’ના સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો, ચાર મુખ્ય વિષયો (Subject Theme) ઉપરથી આવે છે. મહામહીમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અનુકૂમે ઉદ્ઘાટન અને પૂજારૂપુત્ર સમારોહમાં ઉપસ્થિત રહેવા ઉપરાંત સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી દીપક મિશ્રા, કાનૂનમંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, વરિષ્ઠ ધારાશાસ્કી — નાણામંત્રી શ્રી અરુણ જેટલી સહિત ટોચના બંધારણવિદો હાજર રહ્યા.

આટલા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં જે ચાર આયામો સુનિશ્ચિત કરવામાં આવેલ, તે આપણને ન્યાયતંત્ર — કારોબારીની સમય મર્યાદાઓના સંદર્ભમાં દેશમાં ચાલી રહેલ ચર્ચામાં શેની ચિંતા સેવાઈ રહેલ છે તે સૂચવી જાય છે. પ્રથમ એટલે ‘ન્યાયિક પુનરાવલોકન અને સંસ્કૃતિક લોકશાહી’, બીજું એટલે ‘ન્યાયમૂર્તિઓની નિમણૂકની પ્રક્રિયા’, ત્રીજું એટલે ‘ન્યાયના વિલંબ સંદર્ભ’ અને છેલ્લું સૌથી મહત્વનું એટલે ‘ન્યાયતંત્રની સત્તા મર્યાદા અને ન્યાયિક સક્રિયતા.’

વિષયો અને થયેલી ચર્ચામાં ન્યાયતંત્રની સક્રિયતા ક્યાં સુધી હોવી જોઈએ, આવી સક્રિયતા સરકાર કે સંસદના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ સમાન છે કે કેમ? તેમજ સવિશેષ રીતે જાહેર-અજાહેર ન્યાયતંત્રની સક્રિયતા સીમોલંઘન કરી રહેલ છે કે કેમ? તે કેન્દ્રસ્થાને ચર્ચાયેલી બાબત છે.

તાજેતરમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અને તેના પછીના કમના ન્યાયાધીશ વચ્ચે કોઈ મુદ્દો બંધારણીય (કે) બંચને સોંપવો કે કેમ? તેની સત્તા માત્ર મુખ્ય ન્યાયમૂર્તિને જ છે તે બાબત જાહેર ચર્ચામાં આવી એટલું જ નહીં દેશભરમાં ખાસ કરીને અંગ્રેજ અખબારોમાં વિસ્તૃત આલેખનો થયા.

ભારતના ન્યાયતંત્રએ ન્યાયિક સક્રિયતા દ્વારા સામાજિક ન્યાયના ક્ષેત્રમાં અનેકવિધ ઉદાહરણરૂપ અને સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી પરંતુ હવે ન્યાયતંત્રની સીમા મર્યાદા ક્યાં સુધી તે વિચાર કરવાનો સમય પાકી ગયો છે અને કારોબારી એટલે કે સરકારે કરવાનાં કાર્ય નિયમિત રીતે ન્યાયતંત્ર દ્વારા જ નક્કી કરી આપવામાં આવશે તો સરકારની ઉપયોગિતા શી?

ભારતીય બંધારણના અનુચ્છેદ-૧૪૨ અંતર્ગત સર્વોચ્ચ અદાલતને સમગ્ર ભારતવર્ષમાં પોતાના દ્વારા અપાયેલ ચુકાદાના સંદર્ભમાં તેના અમલીકરણ માટે જાહેર કે કાયદો પ્રસ્થાપિત કરવામાં આવ્યો હોય તેટલી સત્તા છે અને આ સત્તાના આધારે પર્યાવરણ રક્ષા, સમાજ કલ્યાણ, શ્રમિક કલ્યાણ સહિતનાં અનેક ક્ષેત્રોમાં ન્યાયિક સક્રિયતાના માધ્યમથી સર્વોચ્ચ અદાલતે સીમાચિહ્નરૂપે કામગીરી કરી છે તેનો ઈન્કાર ન થઈ શકે. પરંતુ જ્યાં રાજકીય નિર્ણયો કે વહીવટી બાબતો સ્પષ્ટ થવી જોઈએ ત્યાં આગળ ધારાગૃહો અને સરકાર વધુ સારી રીતે કરી શકશે તે કાયદા દ્વારા પ્રસ્થાપિત સ્વીકૃત સિદ્ધાંત છે તે ભૂલવા જેવું નથી.

ભારતમાં જસ્ટિસ ભગવતીના સમયથી સવિશેષ રીતે બાળ અધિકાર, શોષણ સામે રક્ષણથી લઈ જાહેર હિતની અનેક બાબતોમાં ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતોએ શ્રેષ્ઠ અને સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપી મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે – પર્યાવરણ રક્ષા, ફૂલોષણ સહિત ધણા બધા વિષયોમાં સર્વોચ્ચ અદાલતે મહત્વના ચુકાદાઓ આપેલ છે.

છેલ્લા દોઢ દાયકામાં આ સક્રિયતા વધતી ગઈ અને જાહેર હિતની અરજીઓની સંખ્યા વધવાની સાથે ધણા બધા વિષયો ન્યાયિક સક્રિયતાએ આવરી લીધા. મુણ્ઝૂત રીતે ભારતમાં સંસદ (ધારાગૃહ) કારોબારી અને ન્યાયતંત્ર એમ ત્રિ-આયામી વ્યવસ્થા ચુકાદાઓ આપેલ છે.

સુનિશ્ચિત થઈ છે. દરેકની સીમા અને કાર્યક્ષેત્ર સમયમર્યાદા ઓળંગી કાર્યરત થાય તો લાંબાગાળે તેની સારી-નરસી શી અસર થઈ શકે તેની ચર્ચા વ્યાપક સ્વરૂપે શરૂ થયેલ છે અને રહમી નવેમ્બરે તો ત્રણેય આયામનું નેતૃત્વ ઉપસ્થિત હતું અને તંદુરસ્ત ગંભીર ચર્ચા પણ થઈ.

ન્યાયતંત્રનું કાર્ય દેશમાં વિદ્યમાન કાયદાઓની યોગ્યતા ચકાસવી તથા સવિશેષ રીતે બંધારણની રક્ષા અને કોઈ વિષયની બંધારણની યોગ્યતા કે તેનું કાયદેસરપણું ચકાસવું અને તેનું અર્થઘટન કરવા અર્થનું છે ત્યારે ન્યાયતંત્ર, ધારાગૃહ અને કારોબારી એમ બધાનાં કાર્યો ભારતીય બંધારણમાં સુનિશ્ચિત થયેલાં છે અને જો એકબીજાનાં કાર્યોમાં ભારતીય બંધારણનું કોઈ પણ અંગ હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યો કે સીમા મર્યાદા ઓળંગશે તો આપરે તેની સીધી અસર સંસદીય લોકતાંત્રિક વ્યવસ્થા ઉપર થશે.

સરકાર કે કારોબારી દ્વારા જ રચાયેલા કાયદાની યોગ્યતા અને તેનું અર્થઘટન એ ન્યાયતંત્રનું પ્રમુખ કાર્ય છે, પરંતુ રોજબરોજના વહીવટી નિર્ણયો લેવામાં અને કાયદો ઘડવાનું કામ માત્ર સરકારનું જ છે તે પ્રકારની પરિસ્થિતિ ભારતીય બંધારણમાં સુસ્પષ્ટ છે.

'નિવૃત્તિ નિવાસ', ૭/૧, જગન્નાથ પ્લોટ, રાજકોટ-૧.

નીચ માણસ

ન ખાંડી પીણીએ નીચ માણસ
વ્યવહારવાણીએ નીચ માણસ
ભરમ ને બેદો રચેલા એમાં
સુવાંગ માને એ નીચ માણસ
ધરમના નામે ઢીલું મુકાવી
દંગા કરાવે એ નીચ માણસ
રક્ષે જે ગાયો દંભી બનીને
મનુષ મનાવે એ નીચ માણસ
ચાંચોમાં ચાંચો મૂકી વિહરતા
પંખી હણાવે એ નીચ માણસ
મતપેટીઓને છલકાવવાને
ઉઠાં ભણાવે એ નીચ માણસ
ન જાતિપાંતિએ નીચ માણસ
ન ધંધાપાણીએ નીચ માણસ

- સાહિત પરમાર

॥ ક્ષમા વીરસ્ય ભૂષણામ् ॥

રાયચંદ કાનજી ધુલ્લા પરિવાર - સુથરી

"ધુલ્લા વિલા", બંગલા નં.-૨૦, ડ્રીમ્લેન્ડ સોસાયટી, જયશાલી નગર, એન.આર. હાઈલેન્ડ પાર્ક, મુલંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૨.

ફોન : ૨૫૮૨૪૪૪૪૪, ૨૫૬૨૪૪૪૪૪, ૨૫૮૧૪૪૪૪૪, ૬૬૩૪૩૫૭૭

પ્રેમ અને સંકોચ...

સંસાર

જ્યવદન પટેલ

લગ્ન થાય છે, ત્યારે સ્ત્રી-પુરુષ બંનેને બધું જ સુંદર અને સરસ લાગે છે. આંખોમાં રંગબેરંગી સ્વખ હોય છે. અંતરમાં અવનવી આશાઓ હોય છે. ભવિષ્ય માટે તરેહ તરેહની કલ્પનાઓ હોય છે. પતિ-પત્ની આનંદથી હરતા-ફરતાં જીવતાં, હસતાં - હસતાં હોય છે. જ્ઞાણે કે મુદ્દીમાં સ્વર્ગ આવી ગયું હોય તેવો હરખ અને ઉત્સાહ હોય છે.

પણ સમય પસાર થાય છે. ત્રણ-ચાર-પાંચ વરસ વીતી જાય છે અને પતિ-પત્ની વચ્ચેનો પેલો ઉમંગ - પેલો આનંદનો ઉછાળો બધું ઓછું થવા માંડે છે. પહેલાં રોજ સાંજે પતિની રાહ જોઈને ઓસરીમાં ઊભી રહેતી પત્ની હવે ઘરકામમાં જ પરોવાયેલી રહે છે. અગાઉ તો પત્ની ઓફિસે જતા પતિને વરંડામાં ઊભા રહીને ક્યાંય સુધી જોયા કરતી હતી. હાથ ઊંચા કરી હલાવતી હતી અને હવે તો એ રસોડાના કામમાંથી નવરી જ પડતી નથી અને નવરી પડે તોય પેલું રાહ જોવાનું અને વિદાય આપવાનું હવે એને ગમતું નથી.

એક જ બાબતમાં નહીં, પહેરવા-ઓઠવાની બાબતમાં, હરવા-ફરવાની બાબતમાં, સાથે બેસી નિરાંતે વાતો કરવાની બાબતમાં પણ જે આકર્ષણ હતું તે ઓછું થતું જાય છે. પત્ની સંપૂર્ણ રીતે ગૃહિણી બની ગઈ હોય છે. ઘરના નાના-મોટા કામની એને એટલી બધી ચિંતા હોય છે કે એ પોતે કોઈની પત્ની છે, કોઈની પ્રિયતમા છે એ પણ એને યાદ રહેતું નથી. કામમાંથી એ ઊંચી આવતી નથી.

અને જો પત્નીને બહાર જવાનો પ્રસંગ આવશે તો એ બનીઈને જશે. પણ ઘરમાં તો એ ગમે તેવા ચોળાયેલા વચ્ચો પહેરશે. અસ્તવ્યસ્ત રહેશે. પહેલા એ પતિને મનગમતાં સાજ શાશગાર સજતી હતી. હવે એને એનું મહત્વ રહ્યું નથી. પતિ છે, વાત સાચી છે. એ હવે ઓછા પતિ મટી જવાના છે! એ ભાવ હવે એના મનમાં જન્મી ગયો છે. એને એમ છે કે ઘરમાં તો બધું ચાલે. કપડામાં ડિંગ-હળદરની વાસ આવતી હોય તોય શું? વાળ સરખી રીતે ઓઝ્યા ન હોય તોય શું? હાથપગના તળિયાં ફાટી ગયા હોય, ચામડી સૂકી લાગતી હોય તોય શું? પતિ હવે કાંઈ ઓછા પારકા છે? ઘરમાં તો આવું જ ચાલે.

અને એ પત્ની રાત્રે પણ એવી સ્થિતિમાં સૂવાના ઓરડામાં જશે. વર્ષના વાદળો અને રીમઝીમ વરસતા વરસાદના ફોરાંની

પણ હવે એના હદ્ય પર અસર નહીં થાય. વસંતનો કોયલનો ટહુકો એને રોમાંચિત નહીં કરે. બગીચામાં ભીલેલાં રંગબેરંગી ફૂલો પણ એના અંતરાત્મામાં કોઈ ઊર્ભિઓ નહીં પેદા કરે. જ્ઞાણે કે એ બધું અસ્ત થઈ ગયું છે. સાવ ઓગળી ગયું છે.

પણ પત્ની એ વાત ભૂલી જાય છે કે લગ્નને ગમે તેટલા વરસ કેમ થયાં ન હોય પતિ રસિકતાની અપેક્ષા રાખે છે. ધેર એની કોઈ પ્રેમપૂર્વક ઇન્ટેજરી કરી રહ્યું હોય એની એને ઝંખના હોય છે. એની પત્ની ગમે તે ઉંમરે પણ રૂપાળી હોય, શુંગારપ્રિય હોય, રસિક હોય, આનંદી હોય એવી એ ઈચ્છા રાખતો હોય. એ ગમે તેટલો કામમાં ગળાડૂબ હોય, કે આખો દલાડો કામમાંજ વ્યસ્ત રહેતો હોય, પણ એ સાંજે વેર આવે ત્યારે પત્ની પાસે રસિકતાની ચાહ રાખતો હોય છે. ગંઠી-ગોબરી કે અસ્તવ્યસ્ત પત્ની એને નિરાશ કરી નાખે છે! અને એવું જ્યારે બને છે ત્યારે પતિને પત્નીમાં રસ રહેતો નથી. એ બીજી કોઈ સ્ત્રી તરફ ઢળે છે અને કોઈ વાર સુંવાળો સંબંધ પણ બાંધી દે છે.

શીએ રસિકતા જાળવી રાખતાં શીખવું જોઈએ. નારી માટે શુંગાર અને પ્રેમદર્શનની આકર્ષક શૈલી, દાંપત્યજીવનની મધુરતા ટકાવી રાખવા માટે અને લગ્ન જીવનમાં સ્વખાને ધબક્તા રાખવા માટે જરૂરી છે અને એટલે જ તમારે ગમે તે રીતે પણ તમારા સૌંદર્યને પ્રગટ કરવાનું ચૂકવું નહીં જોઈએ. પતિ તમને જોઈને ઉમળકામાં આવી જાય અને તમને બેટી પડવાનું અને ‘તું આજે કેટલી રૂપાળી લાગે છે!’ એવું કહેવાનું મન થાય એવા તો બનવું જ જોઈએ અને એટલા માટે તમારે તમારી રસિકતા ટકાવી રાખવી જોઈએ!

તાજું જ લગ્ન થયેલું હોય ત્યારે જ પ્રેમ દર્શનની અને આકર્ષણીની જરૂર છે, એવું નથી. લગ્ન પછી વરસો વીતે, સમય પસાર થાય કે ઉંમર થતી જાય, ત્યારે પણ તમારે તમારા વ્યક્તિત્વના રૂપની અને મોહકતાની આટલી જ જરૂર છે એ તમે ભૂલતાં નહીં. તો તમારે શું કરવું જોઈએ? પતિનો તમારી પ્રત્યેનો પ્રેમ અને આકર્ષણ ટકાવી રાખવા હોય તો તમારે કેવી રીતે જીવનું જોઈએ એ સમજ લેવું જરૂરી છે.

પતિએ જ્યારે નવા વચ્ચો પહેરા હોય, પતિ આનંદના મુડમાં હોય ત્યારે એની પ્રશંસા કરવાનું ચૂકશો નહીં. ભૂલેચૂકેય બીજા કોઈ પુરુષની પ્રશંસા તમારા પતિ આગળ કરશો નહીં કે તમારા પતિની સરખામજી બીજા પુરુષ સાથે કરશો નહીં. પતિ જેવો હોય તેવો પણ તમારો પતિ છે. તમે એની સાથે

લગ્ન કર્યું છે. કોઈનીય આગળ પતિની નિંદા કરશો નહીં કે પતિને ઉતારી પાડશો નહીં. એટલું બરાબર યાદ રાખવું કે તમારા વર્તનનો પડવો પડવા વિના રહેવાનો જ નથી. તમે જેવો ભાવ રાખશો એવો જ પ્રતિભાવ સાંપણશો.

તમે રૂપાળા અને રસિક લાગતા હશો તો તમારા પતિને તમે ખૂબ ગમશો અને એના હૃદયમાં તમારા માટેનો ઉમળકો સદા જીવંત રહેશો. એ એના મિત્ર વર્તુળમાં તમારા ગુણગાન ગાશો અને તમારા જેવી પત્ની મજ્યાનું ગૌરવ અનુભવશે. તમે સારા અને સુંદર લાગો, તમે એની શોભા અને એની પ્રતિજ્ઞા વધારો એવી દરેક પતિની ઈચ્છા હોય છે. અને એ બાબતમાં જ્યારે એની અપેક્ષા સંતોષાતી નથી, ત્યારે એ કોઈને કોઈ બહાને પતિ સાથે કળ્યા કરે છે, તકરાર કરે છે. પતિ-પત્ની વચ્ચે વિસંવાદ ઊભો થાય છે. ખાસ કોઈ મોટું કારણ હોતું નથી. બસ, આ જ એક કારણથી પત્ની પતિનો પ્રેમ ગુમાવી બેસે છે.

જ્યારે પતિ બહારગામથી આવે ત્યારે દોડીને તેની સામે જાઓ. તેને આવકારો. તેના હાથમાં કોઈ બેગ - વજન હોય તો ઉંચકી લો. એને પાણીનો ગલાસ આપો. ગરમી હોય તો એને પંખો નાખવામાં પણ નાનમ નથી. પતિ-પત્ની એકબીજાના માલીક નથી, મિત્ર છે. પરસ્પર સેવા કરવામાં કે સેવા લેવામાં કશું અનુચિત કે અયોગ્ય નથી.

કેટલીક સ્થીઓને એવી આદત હોય છે. પતિ બહારથી આવે, ઓફિસેથી આવે, ઘરમાં પગ મૂકે અને ફરિયાદો શરૂ કરી દે છે. ઘરમાં ચા ખલાસ થઈ ગઈ છે, યાદ કરી કરીને થાકી તમે ખૂલી જાઓ છો. ઘરમાં ખાંડ નથી. બાબાના નવા બૂટ લાવવાનું તમને યાદ રહેતું નથી. આ રીત બરાબર નથી. પતિ ઓફિસેથી આવે એટલે તેમને સ્વસ્થ અને હળવા થવા દેવા જોઈએ અને પછી જ શાંતિથી જે વાત કરવા જેવી હોય તે કરવી જોઈએ. દરેક વાતનો એક સમય હોય છે. અમુક વાત અમુક જ સમયે કહેવી જોઈએ. તમારા પતિએ ઘરની ચિંતા કરવી જોઈએ. જરૂરી ચીજવસ્તુઓ સમયસર લાવી દેવી જોઈએ. બાળકોની સ્કૂલની ચીજે પણ લાવી આપવી જોઈએ એ બધું સાચું. કદાચ તમારો ગુસ્સો પણ બ્યાજબી હોય, તમે સાચા પણ હોવ - પણ તમારે તમારા પતિની સ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. એ ખૂલી ગયા હશે, એની પાઇણ કારણ તો હશે જ ને? એમને ખૂલી જવાનું જાણી જોઈને મન થયું હશે? ઓફિસમાં અવિકારી સાથે બોલવાનું થયું હોય અને એમાંથી એ અપસેટ થઈ ગયા હોય. એને કારણે પણ ખૂલી ગયા હોય. તમારે તમારા

પતિની સ્થિતિને પણ સમજવા કોશિશ કરવી જોઈએ. પતિ ખૂલ પણ કરે, સ્વાભાવિક છે. તમારે એથી ગુસ્સે થવું નહીં જોઈએ, પણ વાતાવરણની પ્રસંગતા જીવી રાખવી જોઈએ.

પત્ની જો રંગરૂપે રૂપાળી હોય, દેખાવડી હોય, આકષક હોય, પણ જો સ્વભાવે કળ્યાળી હોય કે ઈષ્ઠ - અદેખાઈવાળી હોય તો પણ પતિનું મન એની પરથી ઉત્તરી જ્યા છે અને બંને વચ્ચે અણગમો ઊભો થાય છાયે. પતિથી તમે અળખામણા થઈ જાવ એવી સ્થિતિ કદી પેદા કરશો નહીં. પતિને સદા મનગમતા રહેશો. એનો અર્થ એ નથી કે પતિ ખોટું કરે કે પતિનું વર્તન બરાબર હોય નહીં ત્યારે તમે સાચી વાત જરૂર કહો. પણ સાચી રહેવાની પણ એક રીત હોય છે. એ રીત તમને આવડવી જોઈએ. સાચી વાત પણ કજિયો કર્યા વિના, મીઠાશથી કહી શકાય છે, સમય જોઈને કહી શકાય છે.

પતિ એ કાંઈ પરમેશ્વર નથી કે એનાથી કાંઈ ખૂલ થાય જ નહીં. એ પણ માણસ છે, એનામાં સાસું-ખોટું બધું જ હશે. એ બધું તમારે સહન કરી લેવું અને બોલવું જ નહીં એવું નથી. તમારા પતિની ખામીઓ હોય તો જરૂર એની તરફ એની આંગળી ચીંધણે. પણ એના મિત્રો કે સંબંધીઓની હાજરીમાં નહીં. તમે બંને એકલા હોવ, અનુકૂળ વાતાવરણ હોય ત્યારે તમે જરૂર એને ઠપકો આપજો, એની ખૂલો બતાવજો. એના વર્તન વિશે ટકોર કરજો. એ જરૂર માની જશે. એને જરૂર અસર થશે. પણ તમે તમારા બાળકો કે બીજાઓની હાજરીમાં એની ખૂલો કાઢશો, કે એના દોષ બતાવશો તો એથી ઉલ્ટી અસર થશે. એને અપમાન જેવું લાગશે. એનો અદમ્બુદ્ધ ઘવાશે અને એ તમારી સાથે કજિયો કરશે. તમારી વચ્ચે કડવાશ પેદા થશે. એ સુધરશે નહીં, પણ વધારે બગડશે. પતિના તમે ગુલામ બનો નહીં, પણ પતિના મિત્ર તો બની શકો. પતિના મિત્ર બનીને એના સુખદુઃખના સાથીદાર બનો. પતિ અને તમે બંને સાચા અર્થમાં જીવનસાથી બનો.

કેટલીક પત્નીઓ એવું માનતી હોય છે કે, મનમાં પ્રેમ હોય એટલે બસ. પ્રેમનું કોઈ પ્રદર્શન કરવાનું હોય નહીં. વાત સાચી છે. પ્રેમનું પ્રદર્શન હોય નહીં, પણ હૃદયમાં પ્રેમ હોય એ જ પૂરતું નથી. પ્રેમ કોઈને કોઈ રીતે પ્રગટ થવો જોઈએ, વ્યક્ત થવો જોઈએ. વાતચીતમાં, વર્તનમાં કે પછી વ્યવહારમાં પ્રેમ અભિવ્યક્ત થવો જોઈએ. પ્રેમ વ્યક્ત કરવામાં કોઈ ઢોલવાજ વગાડવાના હોય નહીં કે વરઘોડા કાઢવાના હોય નહીં. પ્રેમ તો મર્યાદામાં રહીને નાજુક અને નમણી રીતે વ્યક્ત કરવાનો હોય અને એ કલા પત્નીને આવડવી જોઈએ. ■



છરખચંદ ગાડા (મો. ૯૮૮૮ ૪૦૦૪૦) ★ નીલેશ ગાડા ★ રીતેશ ગાડા

લગ્નપદ, ધરણપદ, લાણી તથા હોટલ કેન્ટીન વાડી ફ્રાસખાના માટેના મોટા વાસણોના હોલસેલ વેપારી

અલ/૧૦૪૦/૭, વિજય ટ્રાન્સપોર્ટ પાસે, જુ.આઈ.ડી.સી., અંકલેશ્વર. ફોન : ૦૨૬૪૬-૩૨૬૩૦૩, ૨૨૦૬૪૨

E-mail : kaykay_industries@yahoo.com

એક જ્ઞાસ દૂધ!

વિવિધ | સંકલન : અરુણ શાહ

પરદેશની આ વાત છે. હાવર્ડ કેલી નામનો એક ધોકરો અત્યંત ગરીબાઈ સાથે ભણી રહ્યો હતો. નિશાળની ફી ભરવાના પૈસા કમાવા માટે ફાજલ સમયમાં એ ફરિયાનું કામ કરતો. એક સ્ટોરની વસ્તુઓ એ એક ઘરેથી બીજા ઘરે ભટકીને વેચતો. એ વેચાણના પૈસામાંથી જે કમિશન મળે તેમાંથી શાળાની ફી ભરતો અને જે ફી ભરતાં થોડા પૈસા વધે તો ચોપડીઓ અથવા તો કપડા ખરીદતો.

એક દિવસ આમ જ ફેરી કરતાં કરતાં બપોરનો સમય થઈ ગયો. આકરો તડકો કેલીને પરેશાન કરી રહ્યો હતો. એના થેલામાં છેલ્લી થોડીક ચીજો જ બચી હતી. પણ એ દિવસે એટલી વસ્તુઓ કોને ખબર કેમ પણ કોઈ ખરીદતું જ નહોતું. ભૂખ અને તરસથી એ હેરાન થઈ ગયો હતો. તડકો પણ એની તકલીફમાં વધારો કરી રહ્યો હતો. ક્યાંક બેચાર કણ અટકીને આરામ કરવાની એને ઈચ્છા થતી હતી, પરંતુ કમિશન ઓછું મળશે એ વિચાર એને ક્યાંય બેસવા નહોતો દેતો. થોડીક વાર આમ જ રખજા પછી એને પોતાની ગરીબી અને લાચારી પર ગુસ્સો આવવા લાગ્યો. હતાણના ભાવ સાથે એણે એક ઘરનું બારણું ખખડાવ્યું. એક સુંદર યુવતીએ બારણું ખોલ્યું.

‘મેમ! મારી પાસે વેચવા માટેની થોડીક ચીજો છે. તમે કંઈ ખરીદવા માંગો છો?’ એના અવાજમાં નિરાશા, હતાણ અને થાક ભરેલા હતા.

‘હા દીકરા, કેમ નહીં?’ જાણે કે કેલીની પરિસ્થિતિનો એક પળમાં જ અંદાજ આવી ગયો હોય તેમ એ યુવતી બોલી. ઉત્સાહપૂર્વક એણે કેલીની બાકી બચેલી વસ્તુઓમાંથી થોડીક વસ્તુઓ ખરીદી પણ ખરી.

કેલીના મનને ખૂબ જ શાતા થઈ. જેવું મન શાંત થયું કે તરત જ કેલીના પેટે પોતાની ફરિયાદ શરૂ કરી. પેટમાં ગલુડિયાં બોલતાં હતાં એ યાદ આવતાં કેલી બોલ્યો, ‘મેમ! એક જ્ઞાસ પાણી મળી શકશે?’

પેલી યુવતીએ કેલી સામે જોયું. કેલીના મોઢા પર એ ખાલી તરસ્યો જ નહીં, ભૂખ્યો પણ છે એવું સ્પષ્ટ લખાયેલું હતું. એ બોલી, ‘તને ભૂખ લાગી છે બેટા?’

કેલી કંઈ બોલ્યો નહીં. ભૂખ તો એને કક્કિને લાગેલી જ હતી. એની નાની નાની આંખોમાં મોટાં મોટાં આંસુ ડોકાઈ આવ્યા. પણ એમ આંસુ પરી જવા દે તો કેલી શેનો? તરત સ્વસ્થ થઈ, બહાર નીકળે એ પહેલાં જ આંસુને પાછા ધરબને એ બોલી ઊઠ્યો, ‘ના મેમ! ફક્ત પાણી જ જોઈએ છે, મળશે?’

આટલા નાના બાળકની ખુમારી પર એ યુવતી આફરીન થઈ ગઈ. કેલી માટે એને ખૂબ જ માન થઈ આવ્યું. એ અંદર

ગઈ. થોડીવાર પછી એ પાછી આવી ત્યારે એના હાથમાં સાકર નાખેલું દૂધ ભરેલો એક મોટો જ્ઞાસ હતો. આ યુવતીએ પોતાની ભૂખ તેમજ તરસ બંનેનો ઉપાય કરી દીધો છે એ વાત કેલી તરત જ સમજ ગયો. શાંત મને એણે એ ઠંડા દૂધનો જ્ઞાસ પૂરો કર્યો. પછી પોતાના બિસ્સામાંથી પૈસા કાઢીને બોલ્યો, ‘મેમ! આ દૂધના જ્ઞાસના મારે કેટલા પૈસા આપવાના છે?’

‘એક પણ પણો નહીં બેટા! સારા કામના પૈસા થોડા લેવાય? તેલટાનો હું ભગવાનનો પાડ માનું છું કે તારા જેવા ખુમારીથી ભરેલ દીકરાનું કામ કરવાનો એણે મને મોકો આપ્યો અને ભગવાનના કામના પૈસા થોડા હોય?’ લાગણીથી ભીના થઈ ગયેલા અવાજે એ બોલી.

અંતરના ઉંડાણથી એ યુવતીનો આભાર માનીને કેલી બહાર નીકળ્યો. આ નાનકડા પ્રસંગથી એના મનની હતાણ ખંખેરાઈ ગઈ હતી. નિરાશાની જગ્યાએ એક નવો ઉત્સાહ પ્રગટી ચૂક્યો હતો. એના પગમાં નવું જોમ આવી ગયું હતું. એક અનેરા ઉત્સાહ સાથે એ આગળ વધ્યો.

ધણાં બધાં વરસો પછી પેલી સ્વીને કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો. સ્થાનિક ડૉક્ટર્સ એના રોગનું નિદાન ન કરી શક્યો. એ બહેનની તબિયત દિન-પ્રતિદિન બગડતી જ ચાલી. એને બાજુના મોટા શહેરમાં આવેલ ખૂબ જ આધુનિક હોસ્પિટલમાં મોકલવામાં આવી. ત્યાંના તબીબોએ પણ નિદાન પકડવા ખૂબ માથાકૂટ કરી. કંઈ કેટલીયે તપાસ કરાવી, પણ પરિણામ શૂન્ય જ આવ્યું. એનો રોગ કોઈ પારખી જ ન શક્યું. બધાં થાકી ગયાં પછી એમણે આ સ્વીની મંજૂરી લઈ એ શહેરના સૌથી મોંઘાદાટ તબીબને બોલાવ્યા. એમની કુનેહ તથા કાબેલિયતને કારણે રોગ તરત જ પકડાઈ ગયો. દિવસોથી રીબાઈ રહેલી એ સ્વી ઝડપભેર સાજ થવા માંડી. પરંતુ એના ચહેરા પર સાજ થવાની ખુશીના બદલે ચિંતા છવાવા લાગી. એ ચિંતા હતી હોસ્પિટલના બીલની. એને થતું હતું કે એની બાકીની જિંદગી આ બીલનું કરજ ચૂકવામાં જ વીતી જશે. કેમ કરીને એ આવી અધતન હોસ્પિટલનું આવું મોટું બીલ ચૂકવી શકશે?

આવી બધી ચિંતાઓની વચ્ચે એને હોસ્પિટલમાંથી રજ આપવાનો દિવસ આવી પહોંચ્યો. પટાવાળો બીલનું કવર લઈને આવી પહોંચ્યો. ધૂજતા હાથે એ યુવતીએ કવર ખોલ્યું. બીલની મસમોટી રકમના આંકડા પર લાલ અક્ષરે લખેલું હતું કે, ‘સંપૂર્ણ ચૂકતે! એક જ્ઞાસ દૂધ બધું જ ચૂકવી દીધું છે.’ અને નીચે સહી હતી : ડૉ. હાવર્ડ કેલી! હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ!

કેલીની સહીના શબ્દો પેલી સ્વીના આંસુથી બીજાઈ રહ્યા હતા...

દ્વારકાનાં નવાં સંશોધનો

સંસ્કૃતિ

નરોતામ પલાણા

આપણી પૌરાણિક માન્યતા અનુસાર આજથી ૫૨૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ પોતાના યાદવ પરિવાર સાથે મથુરા છોડીને આજના ગુજરાત રાજ્યના ‘દેવભૂમિ દ્વારકા’ જિલ્લાના દ્વારકા ગામે સ્થાયી વસવાટ માટે આવેલા. શ્રીકૃષ્ણ - બલરામ સહિત યાદવોએ અગાઉની ઉજ્જવલ પહેલી ‘કુશસ્થલી’ નામની નગરીનાં ખેડેરોનું પુનઃસર્જન કરી, આજુભાજુની ખાડીઓને પૂરીને આજના ‘ઓખામંડળ’ તાલુકાનું નવનિર્મિષા કરેલું.

આશરે પાંચ-સવા પાંચ હજાર વર્ષ પૂર્વની આ માન્યતાની લિખિત સામગ્રી છેલ્લા અઢી હજાર વર્ષથી આપણને મળતી થાય છે. શ્રી અરવિંદ જેવા મહાયોગી કહે છે કે શ્રીકૃષ્ણ કટ્યના નથી, ઐતિહાસિક વ્યક્તિ છે. ભારતના પ્રાચીન ઈતિહાસમાં તેમણે અતિ મહત્વનો ભાગ બજાવ્યો છે.

શ્રીકૃષ્ણ મથુરા છોડીને ગુજરાત - સૌરાષ્ટ્રમાં આવ્યા છે અને દ્વારકા નગરી વસાવી છે. — આટલી માહિતી સંખ્યાબંધ પૌરાણિક અંથોમાં મળે છે. આમાંથી ‘મહાભારત’, ‘હરિવંશ’, ‘વિષ્ણુપુરાણ’ અને ‘શ્રીમદ્ ભાગવત’ મુખ્ય છે. આ અંથોમાં પણ પ્રાચીનતમ અને પ્રથમ વિસ્તૃત માહિતી ‘મહાભારત’માંથી મળે છે. આ માહિતીના આધારે છેલ્લાં બસો વર્ષથી આપણા વિદ્વાનો ‘દ્વારકા’ની શોધ કરે છે. સમય જતાં આ વિદ્વાનોમાં સામસામી ખેંચતાણ કરતા બે વર્ગો ઊભા થઈ ગયા છે. આ મતભેદનું મૂળ મહાભારતમાં રહેલું છે. ‘મહાભારત’માં મુખ્ય બે સ્થળે દ્વારકા વિશેની માહિતી મળે છે. ‘સભાપર્વ’માં એમ કહેવામાં આવ્યું છે કે દ્વારકા ઉંગરની ગોદમાં વસેલી છે, જ્યારે ‘મૌસલપર્વ’માં એવું વર્ણન છે કે દ્વારકા દરિયા ડિનારાના એક બેટ ઉપર છે. આવાં બે જુદાં જુદાં વર્ણનોના આધારે ઘણા વિદ્વાનો આજના શિરનારની ગોદમાં વસેલા જૂનાગઢને મૂળની દ્વારકા હોવાનું માને છે અને બીજો વર્ગ ‘ઓખામંડળ’ તાલુકાના આજના યાત્રાધામ દ્વારકાને જ અસલાની દ્વારકા માને છે.

આ વાત પણ દરેક સ્થળે કહેવાયેલી છે કે શ્રીકૃષ્ણની દ્વારકા, શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ સાથે દરિયામાં રૂબી ગઈ હતી. ઉમાશંકર જોશી ‘પુરાણોમાં ગુજરાત’ (બી.આ. ૨૦૧૧, પૃ. ૧૦૦ વગેરે)માં દ્વારકાનો દાવો કરતા કુલ મુખ્ય પાંચ સ્થળોને ગણાવી, તેની સાધકબાધક ચર્ચા કર્યા પછી ‘હાલની દ્વારકાની આજુભાજુ પ્રાચીન દ્વારકા હશે’ એવું જણાવે છે.

લગ્નભગ આખી વીસમી સદી ‘દ્વારકા’ના મૂળ સ્થળ વિશે

વિમર્શ થતો રહ્યો છે. એકવિસમી સદીના આરંભે જે ‘મરીન આર્ક્યોલોજી’ અમલમાં આવી અને દરિયામાંથી જે પુરાવશેષો મળ્યા તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આજની આદ્ય શંકરાચાર્યજીની ‘શારદાપીઠ’વાળી દ્વારકા જ, શ્રીકૃષ્ણની અસલ દ્વારકા છે.

‘પુરાતત્ત્વ’ પ્રમાણમાં અર્વાચીન શાખ છે. આપણા દેશમાં તેનો આરંભ ૧૭૮૪માં કોલકતામાં સ્થપાયેલી ‘રોયલ એશિયાટીક સોસાયટી’થી થાય છે. આરંભે મૌખિક પરંપરાને લિપિબદ્ધ કરવાની કામગીરી હતી પછી મંદિર મૂર્તિ પાળિયા અને ૧૮૩૪થી શિલાલેખો, તામ્પ્રત્રો, તાડપત્રો ઉકેલવાની કામગીરીનો આરંભ થયો. ૧૮૮૮થી ખોદકામ કરીને પુરાવશેષોને પ્રકાશમાં મૂકવાનું કામ શરૂ થયું. આ પછી દરિયામાં રહેલા પુરાવશેષોની શોધખોળ ચાલી અને હવે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી દ્વારા ‘સાયબર આર્ક્યોલોજી’ અમલમાં આવી છે, જેના પરિણામે હિંદુ પૌરાણિક પરંપરાનો ‘મહેન્દ્ર પર્વત’ શોધી કાઢ્યાના સમાચાર છે!

આપણે ત્યાં દરિયાઈ સંશોધનાર્થે ગોવાનું કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા દ્વારકા, બેટદ્વારકા આદિ સ્થળે શોધખોળ ચાલે છે. ૨૦૦૪ સુધીમાં જે પુરાવશેષો નજરમાં આવ્યા તેના આધારે દ્વારકા - બેટ દ્વારકાનો વિસ્તાર અતિ પ્રાચીન અવશેષો ધરાવતો સિદ્ધ થાય છે. શ્રીકૃષ્ણના પૌરાણિક કાળ કરતાં પણ વિશેષ પ્રાચીન અવશેષો આ ડિનારેથી તેમજ દરિયામાંથી ઉપલબ્ધ થયા છે. એસ. આર. રાવ જેવા પુરાતત્ત્વવિદો તો આજની દ્વારકા જ શ્રીકૃષ્ણની અસલ દ્વારકા હોવાનું ભારપૂર્વક જણાવે છે.

૧૬૦૦ ક્રિ.મી.ના આપણા સમગ્ર દરિયાદિનારા વિશે અજબ ગજબની ઘણી રસિક વાતો છે. હાલ તો આપણે માત્ર દ્વારકા ગામ વિશેના શોધકાર્યોની ચર્ચા કરીએ.

જુદીજુદી સંસ્થાઓ અને સરકારો દ્વારા દ્વારકા વિસ્તારનાં નાના-મોટા સંખ્યાબંધ ખોદકામો થયા છે. જેમાંથી ૧૮૬૭માં તેક્કન કોલેજ - પુના દ્વારા અને ૧૮૭૭માં કેન્દ્ર સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા થયેલાં બે ખોદકામો દ્વારકા વિશેની પાયાની હકીકતો જણાવતાં મહત્વનાં - ઉત્ખનનો છે. ૧૮૮૭માં ખોદકામે એવું પુરવાર કર્યું કે આજની દ્વારકા તે મૂળના સ્થળે વસેલી સાતમી દ્વારકા છે. આની નીચેની બીજી છ દ્વારકા કુદરત સર્જિત કે માનવ સર્જિત આકમણોનો ભોગ બનીને નાશ પામેલી છે. મૂળની પ્રથમ દ્વારકા ઉપર છ-છ ફૂટનો રેતીનો થર મળ્યો હોય તે દ્વારકા ઉપર દરિયાનાં પાણી ફરી વળ્યાનું પુરવાર થાય

છે. બીજી દ્વારકા પણ દરિયાની કુદરતી આફતથી નાશ પામી છે, જ્યારે ત્રીજી, ચોથી, પાંચમી અને છઢી દ્વારકાના નાશનું કારણ જાણવા માટે વધુ વિસ્તારમાં ખોદકામ કરવું ઘટે. પ્રથમ દ્વારકાના અવશેષમાં ચિત્રિત લાલ અને કાળી ઠીકરીઓ મળી છે તેનો અંદાજિત સમય અઠી હજાર વર્ષનો થાય છે.

દ્વારકાની પ્રથમની બે વસાહતોમાં મંદિર મૂર્તિના કોઈ અવશેષો મળ્યા નથી. ત્રીજી દ્વારકા, જે આશરે દોઢેક હજાર વર્ષની છે તેમાંથી મંદિરનું આમલક (શિખર ઉપરનો ગોળ - વિશાળ પથ્થર) મળ્યું છે. ઈ.સ.ની છઢી સદીમાં અહીં મંદિર હોવાનું જગ્યાવતું એક તાત્રપત્ર પણ વલ્લભીના ખોદકામમાંથી મળેલું છે. આ ખોદકામના મુખ્ય માર્ગદર્શક ડૉ. હસમુખ સંકળિયા પોતાનો અનુભવ કહેતાં કહે છે કે ‘આ ખોદકામ માટે બહુ જ સાંકડી જગ્યા મળેલી અને ૪૫ ફૂટ સુધી જ ઊંઠું ઊતરી શકાય, પણ જે વિશાળ જગ્યામાં વિશાળ પાયે ખોદકામ થાય તો પૌરાણિક સમયની દ્વારકા વિશે વિશેષ પ્રકાશ થઈ શકે.’

૧૯૭૮માં બીજું ખોદકામ એસ.આર. રાવ દ્વારા થયું. હાલના મંદિર અને ગામ વચ્ચેના ચોકના ખૂણા ઉપર આપેલી ગ્રામ પંચાયતની કચેરી ઊભેડી નાખવામાં આવી અને તેની નીચે મોટા પાયે તથા પૂરતી તૈયારી સાથે ખોદકામ થયું. આ ખોદકામથી એવું પુરવાર થયું કે હાલની દ્વારકા તે આઠમી દ્વારકા છે અને સૌથી પહેલી મૂળની દ્વારકા હડ્પીય સભ્યતાના અવશેષો ધરાવે છે.

આ અવશેષો ઓછામાં ઓછા ચાર હજાર વર્ષ જૂના છે. પૌરાણિક ગણતરી શ્રીકૃષ્ણને પાંચ હજાર વર્ષ પૂર્વે મૂકે છે અને આ અવશેષો ચાર હજાર વર્ષના છે એટલે આ ખોદકામથી શ્રીકૃષ્ણથી વધુ નજીક પહોંચી શકાયું એમ માનવામાં આવે છે. આ ખોદકામમાં પણ પ્રથમ દ્વારકા દરિયામાં રૂબી તે ઘટના સિદ્ધ થઈ શકે છે અને મંદિરના અવશેષો પ્રથમની ગ્રામ દ્વારકામાં નથી તે પણ નજરમાં આવે છે. એસ. આર. રાવે એવી સંભાવના રજૂ કરી કે દરિયામાં શોખખોળ કરવામાં આવે તો — આ સમયથી પણ વિશેષ પ્રાચીનકાળના અવશેષો મળી શકે તેમ છે.

એસ.આર. રાવની આ સંભાવના ૨૦૦૦થી શરૂ થયેલા દરિયાઈ પુરાતાન્ત્રિક શોધ અભિયાનથી સિદ્ધ થયેલી છે. સુન્દરેશ, ગૌરે અને શીલા ત્રિપાઠી દ્વારા ‘અંડર વોટર’ જે શોધયાત્રાઓ થઈ તેનાથી આશરે આઠ હજાર વર્ષ જૂની, સિંધુ સભ્યતાથી પણ પૂર્વની સભ્યતાના અવશેષો નજરમાં આવ્યા છે. જોકે આ અવશેષો ‘દ્વારકા’ કે ‘શ્રીકૃષ્ણ’ને ઐતિહાસિક ઠેરવી શકતા નથી! શક્ય છે આ અવશેષો ‘દ્વારકા’ સિવાયની કોઈ પ્રાચીન વસાહતના હોય, તેમજ આમાંથી કોઈ અવશેષ ‘શ્રીકૃષ્ણ’નું કોણ નામ કે કામ સૂચવતા નથી! આ અવશેષો સ્વતંત્ર એવી કોઈ નગરીના છે — એટલું જ.

‘ઓખા મંડળ’ આખું પ્રાચીન છે. અહીંની લુણાઈની ધાર ઉપરથી તથા પિંડારા પાસેથી ૫૦ હજાર વર્ષ જૂના અંત્ય પાણાશ્યુગના ઓજારો મળ્યાં છે, પણ શ્રીકૃષ્ણ-બલરામ કે રુક્મિણી - રેવતીની કોઈ નિશાની અદ્યાપિ પ્રામ થઈ નથી. શ્રીકૃષ્ણે

વસાવેલી ‘દ્વારકા’ ખુદ સો વર્ષ હ્યાત રહી નથી. એટલે અહીં હોય તોય કેવું અને કેટલું હોય? આમ છતાંય આ છેલ્લા બે-અઠી હજાર વર્ષોનું હિન્દુ ધર્મનું પ્રાચીન ધર્મધામ છે તે નિશ્ચિત છે. આઠમી સદીમાં આદ્ય શંકરાચાર્યજી ખુદ અહીં પોતાની એક પીઠની સ્થાપના કરે તે પણ ઐતિહાસિક છે.

આ વિસ્તારના સૌથી મોટા વિદ્વાન અને સાહિત્યકાર કલ્યાણરાયભાઈ જોશી, શક અને ગુમ વચ્ચે બનેલો ધ્રુવ સ્વામીની ડિસ્ટો આ વિસ્તારમાં બન્યાનું નોંધે છે. ઈ.સ.ની બીજી સદીથી મળતા શિલાલેખોની કમવાર નોંધ પણ તેઓ લે છે. આ બધું ભવિષ્યના વધુ સંશોધનો શ્રીકૃષ્ણ ઉપર વિશેષ પ્રકાશ ફેંકશે એમ માનવાને પ્રેરે છે.

સાહિત્યિક અને પુરાતાન્ત્રિક સંશોધનોથી અહીંનું જે ચિત્ર ઊપરે છે તે ખાસ નોંધપાત્ર છે. અહીં ‘દ્વારકા’ ગામ આઠમી વાર સર્જન પામેલું છે, જ્યારે જગતમંદિર પ્રથમની બે કે ગ્રામ દ્વારકામાં નથી! આમ આજે ઊભેલું મંદિર પાંચમી વારનું મંદિર છે અને ‘શ્રીદ્વારકાધીશ’ તરીકે બિરાજતી પ્રતિમા ૧૫૬૦માં જામ રાવળ દ્વારા સ્થાપિત થયેલી પ્રતિમા છે. ૧૫૬૦ પૂર્વની પ્રતિમાઓનું શું થયું, તે ક્યાં ગઈ? કોણ લઈ ગયું કે કોના હાથે તેનો ભંગ થયો — આ પણ એક વિચારણીય મુદ્દો છે અને એના વિશે પણ સંખ્યાબંધ અભ્યાસો થયા છે. આ અભ્યાસોમાં બેટદ્વારકાના વિદ્વાન સાહિત્યકાર મથુરેશ પીતાંબર જોશી પ્રથમ છે. તેમણે ‘શ્રી દ્વારકા માહાત્મ્ય’ (૧૮૮૮)માં આ મુદ્દાની પ્રથમ ચર્ચા કરી છે. આ પછી ભાઈલાલ પેટેલ ‘શ્રી દ્વારકા - બેટ દર્પણા’ (૧૯૭૦), પુષ્કર ગોકાણી ‘દ્વારકા સર્વસંગ્રહ’ (૧૯૭૩), મોહનપુરી ગોસ્વામી ‘અતીતની આંખે’ (૧૯૭૮), નરોતમ પલાણ ‘વિસાવાડા’ (૨૦૦૦) અને ‘જામનગરનો પૌરાણિક ઇતિહાસ’ (૨૦૧૬) તથા ચિત્રકાર સવજી છાયા ‘દ્વારકા : ઐતિહાસિક અને સાંસ્કૃતિક’ (૨૦૧૨) છે.

એક માન્યતા એવી છે કે ૧૦૨૬માં મહમદ ગજની દ્વારા સોમનાથ ભંગ થયો તે સમયે ડરના માર્યા અહીંના પૂજારીઓએ શ્રી દ્વારકાધીશની પ્રતિમા એક ઝૂંદમાં સંતાડી દીધી હતી. આ જ પ્રતિમા ૧૫૬૦માં જામનગરની સ્થાપના કરનાર જામરાવળના હાથે પુન: પ્રતિષ્ઠા પામી અને આજનું જગતમંદિર ૧૬૦૦ સુધીમાં નવનિર્મિશ્ય પામ્યું. આજની આઠમી દ્વારકા કમશા: ૧૬૦૦ પછી વિકસતી રહી છે.

ભારતની સાત પાવન પુરીઓમાં દ્વારકા એક છે. હિન્દુ ધર્મના ચાર મુખ્યધારોમાં દ્વારકા એક છે. આખું દ્વારકા આજે દરિયાઈ વેપાર, રાજકીય સરહદી વ્યવસ્થા, ધર્મસ્પ્રદાયો, મંદિર-મૂર્તિ-પાળિયા અને તેની કલાપરંપરા તેમ જ ખાસ તો ઇતિહાસ - પુરાતાની દાણિએ અભ્યાસનું એક મહાન ક્ષેત્ર છે. ચાલો, દ્વારકા જઈએ અને એનો બિન્દ બિન્દ વિદ્વાનાખાના પરિપ્રેક્ષમાં અભ્યાસ કરીએ. ધર્મ અને ઇતિહાસ દરેક રાષ્ટ્રની કરોડરજજુ છે.

ઘર અને ઘરની નારીને બચાવી લો

ધર્મ સંસ્કાર

શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ

કહેવાય છે કે ઘર (જાત) બચે તો બીજા નંબરમાં ઘર બચાવવું જોઈએ.

'ઘર'નો ઘર સાથે ગાઢ નાતો છે. ઘરના બધા સુખ-દુઃખ ઘર આધારિત છે.

'ઘર' ની સફ્ફુલતા, દુર્ગતિ પણ 'ઘર' આધારિત છે. જો 'ઘર' બરોબર નહીં હોય, ઘરમાં કુસંપ, અસદાચાર, સ્વાર્થ, અસહિષ્ણુતા વગેરે દોષોનું પ્રાચુર્ય હશે તો 'ઘર' ઉપર તેની અસર થશે. ઘર અસ્વસ્થ બનશે, અસ્થિર થશે. આ કારણસર રામાયણ અને મહાભારતનું વાંચન કરવામાં આવે છે. ઘર કેવું હોય? ઘરમાં બધા દશરથ, સીતા, રામ, કૌશલ્યા વગેરે જ હોય. આ વાત કરે છે રામાયણ.

મહાભારત એ વાત કરે છે કે ઘરમાં કોઈ દુર્યોધન, ધૂતરાષ્ટ્ર, શકુનિ વગેરે ન હોવા જોઈએ.

આમ હકારાત્મક રીતે રામાયણ અને નકારાત્મક રીતે મહાભારત સુંદર ઘર બનાવવાની પ્રેરણા કરે છે.

ઘરના સભ્યોનું બનેલું સંયુક્ત કુટુંબ એ ઘણા બધા ગુણોનું જન્મસ્થાન બને છે. એ ઘણા બધા દોષોનું વિસર્જનકારી બને છે. સંયુક્ત કુટુંબમાં રહેનારા લોકોને સ્વાર્થ વિસર્જન, પરાર્થકરણ, સહિષ્ણુતા, નારી શીલ રક્ષણ, કરકસર, સ્નેહભાવ વગેરે ગુણો સહજ રીતે પ્રાપ્ત થાય છે.

કુટુંબ વિભક્ત થાય તો તેમાં આથી વિપરીત તમામ દોષોનો પ્રવેશ થાય છે. આથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે થોડુંક દુઃખ પડે, થોડોક પરસ્પર ચડભડાટ થાય તો પણ સંયુક્ત કુટુંબમાં વસવું. શાંતિ અને સ્વતંત્રતા મળે તોય વિભક્ત કુટુંબની પણ્ણિમની જીવનશૈલી જરાય ઈચ્છવા જેવી નથી. તેના શીલનાશ વગેરે દોષ કાતિલ હોય છે.

વિભક્ત કુટુંબની પણ્ણિમની જીવનશૈલીમાં હવે ફેરવિચાર શરૂ થયો છે. તેના ઘરક તરીકે પતિ-પત્ની અંજંપો અનુભવવા લાગ્યા છે. ખાસ કરીને તેમના સંતાનોનો, દાદા-દાદી દ્વારા સંભવિત સર્વાંગીણ વિકાસ ઝંધાતો દેખાયો છે. તેમની હૂંફ ખોઈ બેસતા તે ગુલાબો કરમાતા હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે.

શ્રી સ્વચ્છંદી બનીને પણ 'શીલ' ગુમાવવા દ્વારા પણ ઘણું બધું ગુમાવતી દેખાય છે. મૈત્રીના પાયે ઉભા થતા લગ્નેતર

સંબંધો 'મલીન' બન્યા છે. 'નારી'ને નર ફસાવી રહ્યો છે. પુરુષમિત્રો કરીને તે પોતાના પતિને પણ ચુમાવે છે. તેથી તેનો આનંદમય સંસાર ભાંગીને ભૂકો થાય છે. ભાણી ગણીને પુરુષની સમોવડી બનવા માટે ઘરનો ઉબરો છોડીને નોકરી કરતી કે ધંધો કરતી નારી કહેવા લાગી છે કે, 'મારી ઉર્મિલતા મરવા લાગી છે. હું કમાતી હોવાથી મારો અહું મારા પતિ સાથે ટકરાઈ રહ્યો છે. દરેક વખતે અહું ટકરાતા સંતાનોના જીવનને અસર પહોંચ્યો છે. અમારું કૌદુર્યબિક જીવન ભાંગી પડવાની આણી ઉપર છે.'

નારીનું એક સ્વરૂપ ખી છે, તે આપણે પણ્ણિમની જીવનશૈલીના ધક્કાથી કેવું રમણ ભમણ થાય છે તે જોયું. નારીના બીજા સ્વરૂપો દીકરી, બહેન અને બા ના છે. અહીં પણ સંયુક્ત કુટુંબની હૂંફ અને ભારતીય પરંપરાની જીવનશૈલીથી ઉત્પત્ત થતો ગુણવૈભવ ખતમ થવાથી સુગંધ વિનાના પુષ્પ જેવી સ્થિતિ જેવા મળે છે.

દરેક બોલે છે, 'મારી લાઈફ! મારો સંસાર! મારું ભાવિ... મારે જ ઘડવાનું છે. તમે બધા આધા ખસો મને ખલેલ (ડિસ્ટન્ડ) ન કરો.'

ભારતીય ભૌતિક સમૃદ્ધિનું મૂળ ધાણ-મૂત્રની ઉર્જા દેતાં પણુંઓ છે. તો આધ્યાત્મિક સમૃદ્ધિનું મૂળ પવિત્ર નારી છે.

એની પવિત્રતાનું રક્ષણ કરે છે;

દીકરીના કૌમાર્યમાં બાપ...

પત્નીના લગ્નમાં પતિ...

બા ના વાર્ધક્યમાં દીકરો...

નારીનું દરેક અવસ્થામાં રક્ષણ થાય છે. તેને સાવ છૂટી મૂકી શકતી નથી. ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના મૂળ ખોત તરીકે જેની ગણના થાય તેને રેઢી મૂકાય પણ કેમ?

પિતા રક્ષતિ કૌમાર્ય, ભર્તા રક્ષતિ યૌવને ।

પુત્રો રક્ષતિ વાર્ધક્યો, ન ખી સ્વાતન્ત્ર્યમર્હિતિ ॥

ઓને રેઢી ન મૂકવાની સંતોની વાતની ગોરાઓએ પુષ્પ મશકરી કરી છે. તેથી ગભરાયેલા લોકોએ 'નારી'ને બહાર કાઢી છે. તેને શિક્ષણ, નોકરી, ધંધે જોતરી છે. જોઈ લો, તેના પરિણામો કેટલા ગંભીર આવ્યા છે!

તેણે શીલ જ નથી ખોયું, તેણે સુખ ખોયું છે, શાંતિ

અને સ્નેહ પણ ખોયા છે.

ભૂતકળની કોઈ નારીની તરફ નજર કરજો. ભારતીય જીવનશૈલીના ઘણા બધા મીઠાં ફળો આરોગતી તે તમને શીલસંપત્તિ, આનંદ સંપત્તિ, આરોગ્ય સંપત્તિ, ગુણ સંપત્તિ જોવા મળશે. તે અનેક પુત્રોની માતા બની છતાં શરીરે ખૂબ હષ્ટપુષ્ટ હશે. ઘરનું બધું કામ કરીને તે સહુના પરમ સ્નેહને પામેલી હશે.

આજે તો નારી! ઘરના કામમાંથી તો ગઈ અને નોકરી-ધ્યાની ભારેખમ જવાબદારી તથા આખી પુરુષ જાતની આવી પડેલી ગુલામીને કારણે સાવ ‘બિચારી’ બની ગઈ.

વિદેશી જીવનસરણીએ નારીનું જીવન - નાવ ઝૂભતી જતી સ્થિતિમાં મૂકી દીધું છે.

જો ઘર બચાવવું હોય તો નારીને બચાવો. નારીને એના મુળભૂત સ્થાન ઉપર - ‘આદર્શ ગૃહિણી’ તરીકે પ્રતિષ્ઠિત કરો.

એ પતિની, સાસુ-સસરાની સેવા ચાકરી કરે, ઘરની સંભાળ લે, સંતાનોનું સંસ્કરણ કરે. સિવાય...

આવી આદર્શ નારીઓ જીણવી હોય તો આ રહ્યા નામો : ગંગા, સીતા, જીજા, અંજના, તોરલ, તારામતી, મદાલસા, અનસૂયા, મયણા, અનુપમા, સંત ગોપીયંદની બા, ચાંપરાજવાળા બહારવટિયાની બા, હાડી, પાહિની, ભામિની, નાગીલા વગેરે...

આમાં કેટલીક મહાન માતાઓ છે, કેટલીક આદર્શ પત્નીઓ છે.

ભારતીય જીવનશૈલીમાં નારી રક્ષા હતી.

પદ્ધતિમની જીવનશૈલીએ તેને ભોગ્યા બનાવી છે.

એ નારાયણી હતી, હવે એને વાંદરી બનાવાઈ છે.

ચોરીમાં પતિ સાથે હસ્તમિલાપ કરતી નારી મનોમન બોલતી, ‘આજથી આ બધી હસ્તરેખા ‘એમના’માં વિલીન. હવે એમનું ભાવિ તે મારું ભાવિ!’

નવોઢા નવા ઘરમાં પ્રવેશીને દીવાલે કંકુના બે થાપા દેતી, કહેતી કે, ‘એક થાપાથી પીયરિયાને એ ખાતરી દઉં છું કે તમારા કુળને કલંક લાગે એવું કોઈ કામ તમારી દીકરી નહીં કરે. બીજા થાપાથી સાસરિયાઓને ખાતરી દઉં કે તમારા પરિવારની અંદર એકરસ બનીને - દૂધમાં સાકરની જેમ ભળીને - રહેવાની ખાતરી દઉં છું.’ ઘર બનાવવું હોય તો ઘરના બધા ઘટકોએ પોતાના સ્વરૂપને બરોબર જાળવવું.

પરસ્પર ખૂબ સ્નેહ રાખવો, બાળકોને ખૂબ વાતસલ્ય દેવું, નારીનું સદા સન્માન કરવું. તેનો સ્વમાનભંગ કદ્દી ન થવા દેવો.

માતા-પિતાને ‘ભગવાન’ ગણવા. તેમની ઉત્કૃષ્ટ સેવા કરવી.

અરે! નોકરોને કુટુંબીજન તરીકે ગણી લેવા. ભોજનાદિમાં

કદી બેદભાવ દાખવવો નહીં. હાય! પદ્ધતિમાં જીવનશૈલીએ અમારા ‘ઘર’ અને અમારી ‘નારી’ અને અમારા ‘રસોડા’ને કાંડી લગાડી છે!

1. પેટે પાટા બાંધીને દીકરાને બાપે પરદેશ ભણવા મોકલ્યો. બાપે દીકરો ગુમાબો. એ કોઈ ગોરીને પરણી ગયો. દેવું કરીને બાપ મળવા ગયો તો લાંબો મારીને ઘર બહાર હડસેલી મૂક્યો.
2. ગામડિયા કોલેજિયન સાથે શહેરી શ્રીમંત કન્યાએ લવ મેરેજ કર્યો. ગામડું છોડવા આગ્રહ કર્યો. મા-બાપની સેવાના કારણે કોલેજિયને ઇન્કાર કર્યો. ભાઈના ઘેર જમવા બોલાવીને, પત્નીએ જેર દેવડાવીને પતાવી નાખ્યો.
3. એક્સિસન્ટમાં બે પગ કપાવવાની ફરજ પડતાં પતિએ પત્નીને હોસ્પિટલમાં જ તત્તાવી નાખ્યો. મને પૂછ્યા વિના પગ કેમ કપાવ્યા? બીજા દિવસે ડાઈવોર્સના કાગળો તૈયાર થઈ ગયા!
4. પોતાની તમામ મૂડી ઘરેણું, ઘર - દીકરાના નામે ચડાવી દીધું હતું. પરણતાની સાથે નવી વહુએ સસરાને ઘરબહાર કરી દીધા. સસરાએ ચોપાટીના દરિયે જંપલાયું. પોલીસ ભાળી જતાં ભાઈને જીવતા બહાર કાઢવા. કોર્ટમાં જુબાની થઈ. જજે દીકરાને બોલાવીને બાપને પચાસ હજાર રૂપિયા આપવાની ફરજ પાડી.

આવા કેટલા દણાંતો આપું! બધું જ પતી ગયું છે.

જગતમાં તો ઘર અને નારી મરી પરવાર્યા છે. હવે તો તમે તમારું ઘર અને તમારી નારીને ભારતીય જીવનશૈલી ઉપર ગોઠવીને બચાવી લો એ જ ઘણું છે. ■

ક્ષમાવાનની સાધના જ સાર્થક બને છે

મનુષ્યનો જીવનપથ સિદ્ધિઓ અને ભૂલોના સુમેળવાળો સંયોગ છે. પૂરી સાવધાની રાખવા છતાં પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉણાપ રહી જતી હોય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણે કોઈ અપરાધ કરી બેસતા હોઈએ છીએ. ક્યારેક કોઈના પ્રત્યે મનમાં દુર્ભાવ આવી જાય છે, તો ક્યાંક કટુવચનો કોઈના ઝજુ હૃદયને ઠેસ પહોંચાડે છે. ક્ષમાપના આ બધી ભૂલો અને અપરાદોને ધોવાનો અમોદ ઉપાય છે. પોતાની ભૂલોનો સ્વીકાર કરીને વખતો વખત સંબંધિત વ્યક્તિઓ સાથે ક્ષમાભાવ રાખી પોતાના જીવનપથને સાફસૂથરો રાખવામાં જ મનુષ્યની શ્રેષ્ઠતા છે.

ક્ષમા માગવામાં અને ક્ષમા આપવામાં સાચી સમજદારી છે. જે મનુષ્ય કોથ, અભિમાન, કપટ અને લોભને શાંત કરી ક્ષમાયાના કરે છે તેની સાધના જ સફળ થાય છે.

સંબંધનું સાફલ્ય

સમાજ ચિંતન

ઇલા કે. શાહ

કેતનભાઈ તથા નયનાબેન પરદેશની સફરે ઉપડ્યાં. બધે મુસાફરી કર્યા બાદ છેલ્લે લંડન આવવાનું હતું. લંડનથી દૂર પૂરી થતાં તેઓ ટુરવાળાથી વિખૂટાં પડ્યાં અને લંડનની એક વિશાળ હોટલમાં મુકામ હતો ત્યાં રોકાયા. હવે તેમણે હોટલ મેનેજરને બીજા દિવસના બુકિંગ માટે પૂછ્યું. તો કહે, ‘તમારું આગળના બે દિવસનું કોઈ પણ બુકિંગ થયું નથી. તમારે કાલે સવારે હોટલ છોડી દેવી પડશો.’

‘અહીં કોઈ નોંધ થઈ નથી. અમે કશું કરી શકીએ નહીં.’ હોટલ મેનેજરે તોછાઈભર્યો જવાબ આપ્યો.

બંને જણા વાત સાંભળી નવાઈ પામ્યા. ‘હવે દૂર તો ગઈ. કથ્યાં મુજબ બે વધારાના દિવસનું બુકિંગ નથી તો હવે શું કરીશું? નીકળતા પહેલાં તમારે ચેક કરી ચોક્કસ કરવું હતું ને?’ નયનાબેને કહ્યું.

‘કહેલું હતું તેથી થયું જ હશે ને, તેમ માની લીધું હતું. આગળ બે દિવસ રહેવાનાં પૈસા પણ નથી. કાલે ક્યાં ને કેવી રીતે જઈશું? હે પ્રભુ! તેં તો કસોટીની એરણ પર મૂકી દીધા.’ કેતનભાઈ ચિંતાતુર સ્વરે બોલ્યા.

રાત્રિનાં દસ વાગ્યાનો સમય હતો. હોટલના રૂમમાં બેઠા હતા. બંનેની નીદર વેરણ બની. આટલા દિવસનો આનંદ શોકમાં ગરકાવ થઈ ગયો.

‘ઈશ્વર પર ભરોસો રાખો. તે કોઈ રહ્સનો જરૂર ચીધશે. બાકી શું કરીશું? આ અજ્ઞાયા દેશમાં કોને કેવી રીતે મળી શકાય?’ નયનાબેન ચિંતિત છતાં નિશ્ચિત થવા પ્રયત્ન કરવા લાગ્યા.

‘અરે, પણ કાંઈ પ્રયાસ તો કરવો જ પડેશે ને! ચાલો, બે-ગ્રાણ એટ્રેસ, ફોન નંબર છે તો ફોન કરી જોઉં.’ એમ કહી કેતનભાઈ ફોન કરી અન્ય સંપર્ક સાધવા મથી રહ્યા.

બે પરિચિત મિત્રોને ફોન કર્યા તો જાણવા મળ્યું કે તેઓ બહુ દૂર છે. ક્રેમકુશણ પૂછીને સામેથી રીસીવર મૂકાઈ ગયું. ના આમંત્રણ, ના પ્રેમ કે કોઈ પ્રતિભાવ. હવે શું થશે?

હવે બાકી રહેલ સુમનભાઈને ફોનથી મળવા કોશિશ કરી. તેમની નાહુરસ્ત તબિયતને કારણો ખબર-અંતર પૂછીને ફોન મૂકી દીધો. કેતનભાઈને દુઃખ થયું. ઈન્ડિયા આવ્યા ત્યારે કેટલો આગ્રહ કરતા હતા. આવ્યા ત્યારે કોઈપણ મ્રકારની લાગણી જ

નહીં. ન મદદ કે ન આમંત્રણ! અત્યારે જ્યાલ આવે છે કે કોણ ક્યારે કામ આવે છે? કેતનભાઈ બોલ્યા.

‘હા, પેલા સુરભિબેન અને સુમનભાઈ કે જેમને તમે કોઈ પરિચય વગર, લાંબી ઓળખ વગર નિઃસ્વાર્થપણે મદદ કરેલી તે જ ને? ઈન્કમટેક્ષના કામથી તેમના રૂપિયા બચાવી આપેલા એ જ સુમનભાઈને?’ નયનાબેને પૂછ્યું.

‘મારા મિત્રના સગાનાં દૂરના મિત્ર થતા હતા. સુજલભાઈને ત્યાં તેમના દીકરાના સગાઈ વખતે ભેગા થયા હતા. વાતમાંથી વાત નીકળતાં તેમણે મારી મારફત ઈન્કમટેક્ષનું કામ પતાવેલું. મેં નાનકરી મદદથી અદ્ભુત સંતોષ અનુભવેલો. ને તેઓએ લંડન આવવાનું ભાવભર્યું ઈજન (આમંત્રણ) પાઠવેલું. પણ અહીં તો જાણે કોઈ પરિચિત ન હોઈએ તેવી રીતનું વર્તન કર્યું.’

વાત એમ હતી કે કેતનભાઈ સી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) હોઈને સુમનભાઈની ફિક્સ ડિપોઝિટની રકમનો વર્ષનો એક લાખ રૂપિયાનો ટેક્ષ યુનિટ ટ્રસ્ટમાં મૂકાવીને બચાવી આપ્યો હતો. કેતનભાઈ પરોપકારી, ભલા તેમજ સરળ સ્વભાવના હતા. તેઓ અનીતિનો પૈસો આવવા દેતા નહીં. સુમનભાઈ ને સુરભિબાભી બંને આવી મદદથી ગદગદિત થઈ ગયા હતા.

પરિચિત વ્યક્તિ આવી મદદ કરે તો પછી ફી પેટે કંઈક રકમ લે, પણ આ તો સાવ જ અપરિચિત. છતાં કેટલી નમતા! કાંઈ જ ન લીધું. સુમનભાઈ - ભાભીનું લંડનનું આમંત્રણ સ્વીકાર્યું. બે વર્ષ પછી વાત પણ વિસરાઈ ગઈ હતી. ને કેતનભાઈને લંડન આવવાનું થયું ને આ રીતથી મુશ્કેલી ઊભી થઈ હતી. બંને જણા મનમાં શંકા-કુશંકાના વાદળો ઘેરાયા.

માણસ સૌથી વધારે નિરાશ થઈ જાય, જાયારે તેની પરિસ્થિતિ બગડી ગઈ હોય, જીવનની અંદર હલચલ મચી ગઈ હોય ત્યારે પણ પેલી શ્રદ્ધાનો દીવો જલતો જ રહે, ભરોસો બેઠી ન જાય તે માટે પ્રભુ પ્રાર્થના કરવી પડતી હોય છે.

‘હવે અહીં ઈશ્વરની શ્રદ્ધા સિવાય કાંઈ જ બચ્યું નથી. ચાલ, ચિંતાનું પોટલું શ્રીજીબાવાને સુપ્રત કરીને સૂઈ જઈએ. કાલની ચિંતા તેને કરવી હશે તો કરશે.’ તેમ કહી કેતનભાઈએ નિદ્રાદેવીને આવિન થવા કહ્યું.

‘તમારી વાત તદ્દન સાચી છે. ઈશ્વર પરનો અટલ વિશ્વાસ જ કાંઈક કૌતુક ઊભું કરશે. પણ હવે કોના દ્વારા મદદ મળશે

તે જ સમજાતું નથી. પ્રભુ સ્મરણ કરતાં સમય પસાર કરીએ.' નયનાબેને કહ્યું. બંને આ રીતે પરસ્પર આશાસનની આપ-લે કરી વિશ્વામ કરવા પ્રયત્ન કરતા હતા.

પરંતુ, ત્યાં જ આ શું બન્યું? બરોબર અગિયાર વાગે ફોનની ઘંટડી રણકી.

'આ ફોન આપણાં માટે કઈ રીતે હોઈ શકે? કોનો હશે? અત્યારે આપણને યાદ કરે તેવું કોઈ છે જ નહીં.' એમ કહેતા ધૂજતા હથે રીસીવર ઉઠાયું. 'હલો, કોણા?'

'હું સુમનભાઈ. મારી તબિયત બરોબર ન હોવાથી હું લાંબી વાત ન કરી શક્યો. પણ સુરભિએ (તમારા ભાબીએ) જાણ્યું કે તમારો ફોન હતો, તો કહે, આ શું કર્યું? તેમને આમંત્રણ પણ ન આપ્યું? આપણને કેટલી મદદ કરેલી? અત્યારે જ બોલાવો. મેં કહ્યું, કાલે કરીશું. પણ તેણે અત્યારે જ ફોન કરવા જદ પકડી.'

'ઓહો, એમ વાત છે. પ્રભુએ જ તેમને સુઝાડ્યું. કાલે કર્યો હોત તો અમે કદાચ ન મળી શકત.' કેતનભાઈએ કહ્યું.

'તમે અત્યારે જ મારે ત્યાં કોઈપણ આનાકાની કર્યા વગર આવી જાઓ. હું ગાડી મોકલું છું. પછી તમારી બધી જ વ્યવસ્થા થઈ જશે.' સુમનભાઈએ કહ્યું.

'સારું આવી જઈશું. ખૂબ આનંદ થયો.' કહી ફોન મૂક્યો. માત્ર હોટલના નામ પરથી મેનેજરને ફોન કરી, આટલી વિશાળ હોટલનાં અસંખ્ય રૂમો હોવા છતાં રૂમ નંબર મેળવી ફોન કર્યો હતો.

'નયના, મને લાગે છે કે આ ઈશ્વરીય સંકેત થયો કહેવાય. બાકી કાલે ફોન કરત તો? આપણું કાલે શું થવાનું હતું? સુરભિભાબી દ્વારા પ્રભુએ તુરત જ સંકેત કરી આપણી ગોઠવણ કરી નિશ્ચિત બનાવી દીધા.' કેતનભાઈએ કહ્યું.

'પ્રભુમાં અટલ વિશ્વાસ હોય તો કામ સફળ થાય જ. વળી કોઈનું કરેલું કદી એળે જતું જ નથી. નાની સરખી મદદ પણ ક્યારેક ઉગ્રી નીકળે છે તે આનું નામ.' નયનાબેને કહ્યું.

પ્રભુકૃપા તો ખરી જ, પણ કશુંક કરી છુટવાનો અદ્ભુત સંતોષ થયો. પછી તો તેઓએ સુમનભાઈ-ભાબીની પ્રેમપૂર્વક મહેમાનગતિ માણી. કોઈપણ ખર્ચ તેમને ભોગવવા ન દીધો.

સંબંધોનું ગણિત ગણી શકાય જ નહીં. સંબંધો બાંધવા સહેલા છે, પરંતુ નિભાવવા અધરા છે. પારકાને પોતાનાં બનાવીને, હુખમાં અંસુ લૂછીએ, તરસ્યાને જળ અને ભૂખ્યાને અને આપીને કોઈકને નાનકરી મદદ કરીએ તો તે કેટલી રૂડી વાત ગણાય? આ માટે ચેરિટેબલ ટ્રસ્ટ ખોલવાની જરૂર જ નથી પડતી. પરંતુ થાક્યા વગર ઈશ્વરની દિશા તરફ જો ચાલવાનું રાખીશું તો એની કૂપાની જલક મળે જ છે. ■

"નીજાની ભૂલ માફ કરી દેવી સહેલી છે, પરંતુ તમારી ભૂલ કાઢનારને માફ કરવો મુશ્કેલ છે."

— રામકૃષ્ણ પરમહંસ

સંતપુરુષોના નાનકડાં સૂત્રો પણ મોટો સંદેશો આપી જતા હોય છે.

જીવનમાં દરેક માણસથી કંઈ ને કંઈ ભૂલ તો થાય જ છે. કેટલીક ભૂલો વ્યક્તિને પોતાને અસર કરે છે, કેટલીક ભૂલો બીજી વ્યક્તિને અસર કરે છે. માની લો કે તમને બીજાની ભૂલથી નુકસાન થયું, તમે મોટું મન કરીને તેને માફ કરી શકશો; પરંતુ તમારી ભૂલ કોઈ કાઢશો તો તમે તેને માફ નહીં કરી શકો.

મનુષ્ય ગજબના અહંકી પીડાય છે. તેથી તેને પોતાની ભૂલ નજરે ચડતી નથી. તેનો અહં તેને ભૂલનો સ્વીકાર કરતા અટકાવે છે. કદાચ એ પોતાની ભૂલ જાતે જ ધ્યાનમાં લે તો બની શકે, પરંતુ બીજી વ્યક્તિ તેની ભૂલ પ્રત્યે અંગૂઠીનિર્દેશ કરે તો તે તેને નહીં ગમે. સૌપ્રથમ તો એ બીજી વ્યક્તિની વાત સ્વીકારવા જ તૈયાર નહીં થાય. પછી તે તેના પર નારાજ થશે. આ નારાજગી સંબંધોમાં તનાવ પણ પેદા કરશે. તે મનથી આવી વ્યક્તિને કદી માફ કરી શકશે નહીં.

સાચી વાત તો એ છે કે આપણી ભૂલ બતાવનાર આપણો સાચો મિત્ર છે. એ આપણને ચિંતનની તક આપે છે. એ આપણને વિકાસની તક આપે છે. એણે દર્શાવેલી ભૂલ તરફ આપણે પૂર્વગ્રહરહિત વિચાર કરવો જોઈએ. સુધારણાની જરૂર હોય, સુધારણાને અવકાશ હોય તો તેમ કરવું જોઈએ; પરંતુ કોઈ પણ સંજોગોમાં ભૂલ બતાવનાર પ્રત્યે નારાજ થવું જોઈએ નહીં — જો જીવનને ઉમત બનાવવું હોય તો!

કોધ : નિવારણ

(અનુ. : પાના નં.-૫૬ ઉપરથી ચાલુ)

ઉપર કે ગમે તેટલું ખોટું છાતાંય માતાનો પ્રેમ એટલો જ રહે છે તેમ આપણને જે વ્યક્તિ ઉપર અનહદ પ્રેમ હોય ત્યાં કોધ ઓછો આવે છે. ઘણા સમયે આવે પણ ખરો, પણ એ કોધમાં પણ પ્રેમ છુપાયેલો હોય છે.

જીવનના શાંત જરૂખા જ્યારે જોશભેર જુલવા લાગે ત્યારે કોઈનું નિર્માણ થાય છે. પણ આપણે આપણા જીવનને પ્રેમ અને શાંતિથી જીવવું હશે, દુનિયાના લોકો સાથે પ્રેમથી રહેવું હશે ત્યારે કોધને તિલાંજલી આપવી પડશે. મનુષ્ય તરીકે આપણો જરૂર પ્રેમ કરવા માટે થયો છે, કોધ માટે નહીં. કોધથી થતું નુકસાનનું લીસ્ટ ખૂબ મોટું છે એ આપણને બરાબર યાદ છે. તો આવો, દુનિયામાં સર્વને પ્રેમ કરીએ, સ્વસ્થ જીવન બનાવીએ અને કોધમુક્ત માણસ બની જીવન બનાવીએ.

આશ્રિતક, પ્રાર્થના વિદ્યાલય - ભર્ત્ય
મો. ૯૮૮૮ ૪૪૫૭૦

માનસિક સ્ટ્રેસની શરીર પર અસર

આરોગ્ય

ડૉ. મણિલાલ ગડા, ડૉ. દિપ્તિ શાહ (ગડા)

તાજેતરના સંશોધનો પરથી વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)એ તારણ કર્યું છે કે વિશ્વમાં મૃત્યુનું પ્રમાણ હૃદયરોગની બીમારી, ડાયાબિટીસ કે કેન્સરની બીમારી કરતાં માનસિક સ્ટ્રેસ, ટેન્શન (તાણ)ને કારણે વધારે થશે. સ્ટ્રેસને લીધે થતી શારીરિક બીમારીઓ જેવી કે હૃદયરોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેનું પ્રમાણ વધતું જાય છે.

૨૧મી સદી (આધુનિક) સ્ટ્રેસની સદી છે. આજે સ્ટ્રેસ (ટેન્શન) આધુનિક જીવનશૈલીનો ભાગ બની ગયો છે તથા સહુ કોઈને સત્તાવી રહ્યો છે. સ્ક્રૂલે જતો બાળક હોય કે મંદિરે જતા વૃદ્ધી હોય, નાનો કર્મચારી હોય કે ઉપરી અધિકારી હોય અથવા કંપનીનો ચેરમેન હોય, નાની દુકાનમાં ધેંધો કરતો હોય યા સમાજસેવામાં પરોવાયેલો હોય, ગૃહિણી હોય કે નોકરી કરતી મહિલા હોય સહુ કોઈ એક યા બીજા કારણસર થોડા યા વધુ પ્રમાણમાં સ્ટ્રેસના શિકાર બનેલા જેવા મળે છે.

જો આ સ્ટ્રેસ અંગે સાચી સમજ કેળવીને જીવનશૈલીમાં આવશ્યક પરિવર્તન લાવવામાં નહીં આવે તો આ સ્ટ્રેસ ૨૧મી સદીનો મહારોગ બની બીજા મહારોગોને નિમંત્રણ આપવામાં નિમિત્ત બની જશે. આ બાબતને લક્ષ્યમાં લઈ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૨૦૧૭ના વર્ષને “હતાશાની બીમારી વિરો જાગૃતિ” (Depression : Let us Talk) વર્ષ તરીકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાહેર કરેલ છે.

● વ્યાખ્યા :

સ્ટ્રેસ (Stress) શબ્દ પદાર્થ વિજ્ઞાન (Physics) તથા એન્જિનિયરિંગના ક્ષેત્રથી આવ્યો છે તથા આ શબ્દનો પ્રયોગ ૧૮૩૦માં પ્રથમ વખત થયો હતો.

મનોવિજ્ઞાન તથા શરીરશાસ્ત્રમાં સ્ટ્રેસ એટલે ઘટના / પ્રસંગ હકીકતમાં બનેલ અથવા હકીકતમાં ન પણ બનેલ પરંતુ વ્યક્તિએ ધારી કે સમજ લીધેલ ઘટના / પ્રસંગ પ્રત્યે વ્યક્તિનો પ્રતિભાવ, પ્રતિક્રિયા તથા વ્યક્તિના શરીરમાં થતા ફેરફારો. આ પ્રતિભાવ, પ્રતિક્રિયા તથા શારીરિક ફેરફારો (૧) હકારાત્મક / ફાયદાકારક હોય અથવા (૨) નકારાત્મક / નુકસાનકારક હોય.

આજે સ્ટ્રેસને મોટેભાગે નુકસાનકારક કે નકારાત્મક ગણવામાં આવે છે. અત્યારની ૨૧મી સદીમાં સ્ટ્રેસ એટલે મનની, ઉર્મિતંત્રની અને / અથવા શરીરની સામનો કરવાની અસર્થતા.

હેન્સ સેલ્વે નામના વૈજ્ઞાનિકે ૧૮૫૦ના દાયકામાં “સ્ટ્રેસ” પર ઉમદા સંશોધન કર્યું હતું. એણે સ્ટ્રેસનું બે પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે :

૧. હકારાત્મક સ્ટ્રેસ (Eustress) :

ઘટના કે પ્રસંગની વ્યક્તિ પર હકારાત્મક અસર થાય છે. દા.ત. પરીક્ષાની તારીખ જાહેર થાય છે. વિદ્યાર્થી અભ્યાસ કરવામાં વધારે સમય ગાળે છે, રમવામાં સમય ઓછો અથવા નજીવો સમય પસાર કરે છે. મનના કાર્યો - એકાગ્રતા, નિર્ણયશક્તિ, ગ્રહણ શક્તિ, સ્મરણશક્તિ વધે છે, નવું નવું શીખવા મળે છે. મુડ સારો રહે છે, વ્યક્તિત્વનો વિકાસ થાય છે, તંદુરસ્તી સારી રહે છે.

૨. નકારાત્મક સ્ટ્રેસ (Distress) :

ઘટના કે પ્રસંગની વ્યક્તિ પર નકારાત્મક અસર થાય છે. દા.ત. પરીક્ષાની તારીખ જલ્દી જાહેર થાય છે તથા અભ્યાસ માટે પૂરતો સમય મળતો નથી. વ્યક્તિનો (વિદ્યાર્થનો) પ્રતિભાવ તથા પ્રતિક્રિયા નકારાત્મક આવે છે. આથી મનના કાર્યો એકાગ્રતા, નિર્ણય શક્તિ, ગ્રહણ શક્તિ, સ્મરણ શક્તિ વગેરે ઘટે છે, ઓછી થાય છે. કામ કરવાની ક્ષમતા ઓછી થાય છે, મુડ (મિશ્રજ) ખરાબ રહે છે. નકારાત્મક અસર લાંબો સમય રહેતા, શરીરના અવયવો (હૃદય, ફેફસા, પાચનકિયાના અવયવો, સ્નાયુઓ વગેરે)ના કાર્યોમાં ખલેલ પહોંચે છે, તંદુરસ્તી બગડે છે.

● સ્ટ્રેસની નોર્મલ પ્રક્રિયા (Normal Stress Reaction) :

મનુષ્ય સદીઓથી સ્ટ્રેસનો સામનો કરતો આવ્યો છે. પ્રભુએ સ્ટ્રેસનો સામનો કરવા (ભયનો સામનો કરવા) માટે યોગ્ય શારીરિક રચના કરી છે જે સંકટ સમયે ઉપયોગી બને છે. હજારો વર્ષો પહેલાં (પથર યુગમાં) જંગલના હિસ્ક પ્રાણીઓ અને એમના અવાજ, એ વખતના આદિમાનવ માટે સ્ટ્રેસ ઉત્પન્ત કરતા હતા. આ શારીરિક ભયનો (સ્ટ્રેસ) સામનો કરવા માટે બે વિકલ્પો હતા : (૧) હિસ્ક પ્રાણીનો સામનો કરવો અથવા (૨) સહીસલામત જગ્યાએ ભાગીને છૂપાઈ જવું. બને પ્રક્રિયા માટે વધારાની શારીરિક શક્તિની તાત્કાલિક જરૂર પડતી.

ભયની લાગણી ઉત્પન્ત થતાં, મગજના સંવેદનશીલ

જ્ઞાનતંત્રના તંત્રના અવયવોમાં (લિબિઝિક સિસ્ટમના અવયવોમાં) ફેરફારો થાય છે અને તાત્કાલિક સ્ટ્રેસ હોરમોન્સ ઉત્પન્ન થાય છે. આ સ્ટ્રેસ હોરમોન્સ લોહીમાં ભળી શરીરના અવયવોમાં જાય છે. આ સ્ટ્રેસ હોરમોન્સ આંતરભ્રાવી ગ્રંથિઓ (Endocrine Glands) પર અસર કરી લોહીમાં કોર્ટીસોલ તથા અન્ય રસાયણોનું પ્રમાણ વધારે છે. આ સ્ટ્રેસ હોરમોન્સ તથા સ્ટ્રેસ રસાયણોની શરીરના જુદા જુદા અવયવો પર નીચે પ્રમાણે અસરો થાય છે :

૧. સ્નાયુઓ (Muscles) સંકોચાય છે. જેથી સામે લડાઈ કરવા કે દૂર ભાગી જવા માટે શરીર તૈયાર થાય છે.
 ૨. હદ્ધના ધબકારા વધી જાય છે. જેથી લોહીનું ભ્રમજી જડપથી થાય છે. આથી જરૂરી ઓક્સિજન તથા અન્ય રસાયણો સ્નાયુને મળી રહે છે.
 ૩. ફેફસામાં શાસોચ્છવાસની ગતિ વધે છે. જેથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે.
 ૪. પદ્ધત (લીવર)માંથી ગ્લુકોઝ લોહીમાં ભળે છે જેથી વધારાની જરૂરી શક્તિ સ્નાયુને મળી રહે છે.
 ૫. લોહીના ભ્રમજીમાં ફેરફારો થાય છે. આથી લોહી પાચનક્રિયાના અવયવોમાં જવાને બદલે સ્નાયુઓમાં વધારે જાય છે. આથી સ્નાયુમાં શક્તિનો સંચાર થાય છે.
- ઉપરોક્ત ફેરફારોથી તાત્કાલિક શરીરમાં શક્તિનો સંચાર થાય છે. જેથી ભયનો સામનો થઈ શકે છે.

● સ્ટ્રેસ (ભય) દૂર થતાં :

સ્ટ્રેસ (ભય) દૂર થતાં –

- (૧) સ્ટ્રેસ હોરમોન્સનું ઉત્પાદન થતું નથી. સ્ટ્રેસ હોરમોન્સનું પ્રમાણ ઘટી જઈ શુન્ય થાય છે. નોર્મલ થાય છે.
- (૨) શારીરિક શક્તિ (સામનો કરવામાં કે સલામત જગ્યાએ ભાગી જવાથી) યોગ્ય રીતે વપરાઈ જતાં સ્ટ્રેસ હોરમોન્સ તથા સ્ટ્રેસ રસાયણોનું કાર્ય પૂર્ણ થાય છે. હોરમોન્સની માત્રા શુન્ય થઈ પૂર્વવત નોર્મલ થાય છે. શરીર નોર્મલ થાય છે.

● ૨૧મી સદી મનની દુભાયેલી લાગણીઓની સદી :

આજે ૨૧મી સદીમાં શારીરિક ભય નહિંવત છે. ટેકનોલોજીની પ્રગતિને લીધે શારીરિક ભય દૂર થયા છે પરંતુ (૧) મનની ધવાયેલી / દુભાયેલી લાગણીઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. (૨) ધવાયેલી / દુભાયેલી લાગણીઓનો સામનો કરવાની કે સહન કરવાની શક્તિનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે. જેને લીધે આ ધવાયેલી / દુભાયેલી લાગણીઓ સંવેદનશીલ વ્યક્તિમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. (૩) સંવેદનશીલ વ્યક્તિમાં મગજની શારીરિક રચનાને લીધે સ્ટ્રેસનો સામનો કરવાની શક્તિ ઓછી હોય છે. જેને લીધે સ્ટ્રેસ હોરમોન્સનું પ્રમાણ વધી જાય

છે તથા મનની અને શરીરની બીમારીઓ પેદા થાય છે અથવા શરીરની બીમારીઓનું પ્રમાણ વધી જાય છે.

શારીરિક ભય હોય કે મનની ધવાયેલી / દુભાયેલી લાગણીઓને લીધે સ્ટ્રેસ ઉત્પન્ન થાય, સ્ટ્રેસની પ્રક્રિયા તો ઉપર જગ્યાવ્યા મુજબ જ થાય છે અને સ્ટ્રેસ હોરમોન્સ તથા સ્ટ્રેસ રસાયણોનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જેની નકારાત્મક અસર શરીરના અવયવો ઉપર થાય છે.

● સ્ટ્રેસ હોરમોન્સની અસર લાંબા સમય સુધી :

૧. આધુનિક જીવનશૈલી તથા સંજોગોને લીધે મનની ધવાયેલી લાગણીઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.
૨. આ ધવાયેલી લાગણીઓ દ્વારા ઉત્પન્ન થયેલ સ્ટ્રેસ હોરમોન્સ અને રસાયણોનું યોગ્ય કાર્ય (શારીરિક શક્તિ વપરાતી નથી) ન થતાં સ્ટ્રેસ હોરમોન્સ તથા રસાયણોની માત્રા શરીરમાં લાંબો સમય સુધી રહે છે.
૩. આ સ્ટ્રેસ હોરમોન્સનું ટોક્સિનમાં પરિવર્તન થાય છે જે શરીરના અવયવો માટે નુકસાનકારક છે. આ ટોક્સીન શારીરિક બીમારીનું કારણ બને છે તથા શારીરિક બીમારી હોય તો આ શારીરિક બીમારીનું પ્રમાણ વધારે છે.

સ્ટ્રેસની બીમારી, લક્ષણો તથા સારવાર વિશે હવે પછીના લેખોમાં ગ્રાફકારી મેળવીશું.

(કમશા :)

રાગ-દ્રેષ્ણની ગાંઠો તોડીએ

અંગ્રેજીમાં એક સુંદર વાક્ય છે : ‘A great conqueror never fights on small issues.’ તરદન નાખી દેવા જેવી નાની નાની બાબતોમાં રજનું ગજ કરીને અનેક લોકો ગામ આખા સાથે જીવનભર (માત્ર જીવનભર નહીં પણ જનમોજનમ) ચાલે તેવી વેરની – દ્રેષ્ણની ગાંઠો ઊભી કરી દે છે. ભવ અટવીમાં ભમતા ભમતા માંડમાંડ હાથ લાગેલ દુલ્લબ એવા આ મનુષ્ય જન્મનો આનાથી મોટો વેડ્ફાટ શું હોઈ શકે? શાસ્ત્રકારો કહે છે : ‘ખાંડો હુલ્લબે.’ આવી વિરલ તકનો શ્રેષ્ઠતમ ઉપયોગ છે, આંતરશત્રુઓ સામે જંગે ચઢીને તેમાંથી બને તેટલાનો સફાયો બોલાવી દેવો તે! ફન્ટિયર મેઇટ ફ્લેન સ્ટેશને ઊભો નથી રહેતો. ‘ઈચા વિચ્છેદ’ની મંજીલ તરફ પુરપાટ દોડતી ગાડીને પાટા ઉપરથી ઉથલાવવા કેશિશા કરે છે તે) નિમિત્તો સામે નજર પણ ન કરાય. કરોડોના ટર્નઓવરવાળો પરચુરાણ સોદામાં મોં ન ઘાલે. આપણે આત્માના અનંત ઐશ્વર્યને પ્રામ કરવા આવ્યા છીએ. માન-અપમાનના પરચુરાણ સોદામાં સમય ન વેડફીએ તો ક્ષમાપના – અવૈર સહજ બની જાય.

પ્રેરક : યંકરાંત દામજી શાહ (કે.ડી. શાહ) - અમદાવાદ

ડોક્ટરનો ઇલાજ કરનારા બાળદર્દીઓ

આરોગ્ય

રઘશ મનીઆર

‘સંબંધ’ શબ્દ ગ્રાત્યે મને હંમેશાં કૌતુક રહ્યું છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના અનેકવિધ વ્યવહારોને સંબંધનું લેબલ લગાડવામાં આવે છે. પરંતુ ધ્યાનીવાર મને થાય છે કે આવા દરેક વ્યવહારને સંબંધનું નામ આપી શકાય ખરું? સંબંધ શબ્દ સકારાત્મક છે. બંધન જે બંને તરફથી સરખું છે તે સંબંધ. જે નિર્ભેણ ન હોય, નિર્મળ ન હોય એને સંબંધ કહેવાય? આપણા તમામ સંબંધો જો આપણો પરિચય, વ્યવહાર, સગપણ, સ્વાર્થ, ગરજ, માલિકીભાવ કે ચાંપલૂસીના ખાતામાં વહેંચી નાખીએ તો શેષ ભાગ્યે જ કશું બચે.

સંબંધ વિશે એટલે જ કવિઓની કલમમાંથી આવી પંક્તિઓ ટપકી હશે.

મૂળથી વધતા નખો છોડેથી મરતા હોય છે,
એ રીતે સંબંધ બીજરતા ને ખરતા હોય છે.
— રમેશ પારેંદ્ર
દૂરતા કોઈ વખત મોંધી પડી,
પણ નિકટતા તો સતત મોંધી પડી.
— જવાહર બન્દી

સંબંધો વિશે આશા હોય તો નિરાશા જન્મે. હરીન્દ્રભાઈએ તો કહ્યું જ હતું કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષા જ વધુ હોય છે. પરંતુ આશા-અપેક્ષા આપણા પક્ષે ન હોય અને સામે પક્ષે હોય તો? આ સંજોગોમાં નિર્દેખતા જન્મે... ના! નિર્દેખતા શબ્દ બરાબર નથી, ઉદાસીનતા જન્મે. જોકે કોઈ આપણી સાથે કશી અપેક્ષા વગર સંબંધ રાખે, એ પણ આપણી એક અપેક્ષા જ થઈને!

સંબંધો વિશે હું નિરુત્સાહી અને ઉદાસીન જ રહ્યો હોત, જો હું બાળરોગ નિષ્ણાત તબીબ ન હોત અને જો રોજ મારે સંખ્યાબંધ ભૂલકાંઓ સાથે સંવાદ સાધવાના પ્રસંગો ન આવ્યા હોત. નિર્ભેણ અને નિર્મળ છતાં પ્રસંગતા અને પ્રહૃત્યાતાથી ભરેલા સંબંધો કેવા હોઈ શકે એનું દર્શન મને મારા આ બાળદોસ્તોએ કરાયું.

મારી પાસે મુખ્યત્વે બે વર્ષથી નાનાં બાળકો આવે. ગણ્યાંગાંઠચાં બાળકો બે વર્ષથી મોટાં હોય. આ બે વર્ષથી બાર વર્ષની ઉમર સુધીનાં તમામ બાળકો મારા ખાસમખાસ દોસ્તો! (હું એવું માનું કે ન માનું, એ લોકો તો એમ જ માનવાનાં). મારા કન્સલિંગ રૂમની બહાર વેઠાંગ રૂમમાં એમનો નંબર લાગે ત્યાં

સુધી થોભાય નહીં. સહેજ દરવાજે ખોલી સ્મિત ફરકાવે. એમનાં મા-બાપ તરે કે ડોક્ટર બિજાશે, પણ ડોક્ટર સામું સ્મિત ફરકાવે કે હાથ હલાવે એટલે એમને રાહત રહે અને મારો બાળદોસ્ત ખુશખુશાલ. મમ્મી-પાપા સાથે બહારથી જ શરત કરે કે મારી બધી વાત, ફરિયાદ હું જ કરીશ. કેટલાક શરમાળ દોસ્તો બહાર આ શરત કરે પણ અંદર આવી મુંગમંતર થઈ જાય. પરંતુ મોટાભાગના દોસ્તોનો વાક્ફ્રવાહ એવો ચાલે કે એમને અટકાવવા મુશ્કેલ!

બીમારીની વાત પતે એટલે ‘નવા-જૂની’ની વાતો થાય. બર્થ તે કેવી રીતે ઊજવી? ફરવા ક્યાં ગયા? સ્કૂલમાં કેમ ચાલે?... આ મારા સવાલો. એની સામે ‘ડોક્ટર અંકલ! તમે કયા ધોરણમાં ભણો છો?’ એવા સવાલ કરી આવી જાય. કામનું દબાશ ન હોય તો હુંય નવા નવા વિષય કાઢું અને સામે ફાઈલનો ઢગલો હોય તોય મારો બાળદોસ્ત નિરાશ થાય એટલી ઉતાવળ હું કરી ન કરું. એ પણ મારી વસ્તતા સમજે. જલદી જલદી પોતાની મુલાકાત પતાવી બહાર નીકળે. બહાર નીકળતી વખતે ‘મારી ફાઈલ મારા હાથમાં’ અને ‘દરવાજો હું જ ખોલીશ’ આ બે એના દુરાગઢો. બંધ થતા દરવાજાની વચ્ચેથી છેલ્લી વાર દરેક ભાષામાં ‘ટા...ટા... બાય... બાય... આવજો... સી...યુ...’ કરી લે. બહાર નીકળ્યા પછી સાહિલ નામનો મારો બાળદોસ્ત તો અચૂક બીજા દર્દિને કહે, ‘જાઓ, હવે તમારો વારો!’ અને પછી વગર દવાએ સાસું થઈ ગયું હોય એમ ઉછળતો-કૂદતો ભાગી જાય. ભોળપણ અને ઉસાહથી ભર્યા ભર્યા મારા આ બાળદોસ્તો મારો ગમે તેવો થાક ઉતારી નાખે. એમની તાજગી અને એમનો તરવરાટ એક તરફ અને દુનિયાના તમામ હુંખો બીજી તરફ! તોય પલ્લું એમનું ભારે થાય.

ડોક્ટર - દર્દીનો અમારો આ વિશીષ્ટ સંબંધ ભય, આશાંકા અને અશ્વદ્ધાથી શરૂ થાય. મા-બાપે બાળકના મનોપટ પર ડોક્ટરનું ભયાવહ ચિત્ર દોર્યું હોય. તોફાન કરશે તો ડોક્ટર ઈન્જેક્શન મૂકી દેશે. જમશે નહીં તો ડોક્ટર બાટલો ચઢાવી દેશે. આવી ભયગ્રસ્ત માનસિકતા સાથે બાળક મારે લ્યા આવે. હું સ્વભાવવશ એને આવકાણું, એની સાથે હાથ મિલાવું. ખુરશી પર અઢેલીને, અક્કડ બેસીને મા-બાપ સાથે વાત કરવાને બદલે સહેજ ઝૂકીને, વાંકા વળીને, એની ઊંચાઈએ પહોંચીને આંખમાં આંખ મેળવી વાત કરું. એ મારી અંદર રહેલ બાળકનાં દર્શન કરે, હું એની અંદર રહેલી ‘મોટાઈ’ નિહાળું. આ અમારો ‘વન-ટુ-વન’ સંબંધ! બેથી બાર

વર્ષના તમામ દર્દીઓ મારા મિત્રો થઈ જાય. પછી તો છીક આવે કે સાધારણ શરદી થાય તો પણ ફાઈલ શોધી લાવી મમ્મી-પણાને કહે, ‘ડોક્ટર અંકલ પાસે જવું છે.’ એને બિચારાને ક્યાં ખબર છે કે ડોક્ટર અંકલને મળવાની કિંમત ચૂકવવી પડે છે!

ચાર વર્ષના ટાબરિયાને શ્રદ્ધા એવી કે આજુબાજુના કોઈ બીમાર પડે તો ‘મારા ડોક્ટરને બતાવો!’ એવી સલાહ આપે. મારા આ અવેતન પ્રચારકો પોતાના અડોશી-પડોશી કે નાના ભાઈ-ભાંડુની સાથે મારે ત્યાં આવવાનો આગ્રહ રાખે. બાળકને તપાસવાની મારી કિયાનું જીણવટભર્યું અવલોકન કરે. (ઘરે જઈને નકલ કરવા જ તો!) નાના ભાઈ-ભાંડુને ઇન્જેક્શન મૂકવાનું હોય તો એને માથે હાથ ફેરવે, આશાસનના બે શાંદો કહે, એની હિંમત વધારે. તે છતાંય જો એ ભૂલહું રહે તો ‘ચૂ...પ’ કહી બરાડોય પાડે.

ક્યારેક મારા તબીબ ધર્મ અને મિત્ર ધર્મ પરસ્પર ટકરાય. તબીબ ધર્મ કહે એનો રિપોર્ટ કરવો પડશે, એને ઇન્જેક્શન મૂકવું પડશે, બોટલ ચડાવવી પડશે. મિત્ર ધર્મ કહે કે બિચારાને કેટલું દુઃખ થશે! તબીબ ધર્મ વિજયી થાય ત્યારે મારા બાળદોસ્ત નારાજ થાય, પણ એમની એ નારાજગી કેટલા દિવસ ટકે? મને યાદ આવે છે કે મારો એક મુલ્લિમ બાળમિત્ર જેણ! એને રિપોર્ટ કરવા માટે લોહી લેવાનું હતું. એને ખબર પડી કે તરત હિંદી ફિલ્મોની અદામાં બે કાન પર બે હાથ મૂકી ‘નહીં...!’ કહીને ચીસ પાડી. છતાંય લોહી તો લેવું જ પડ્યું. પછી એ બોલ્યો : ‘દાક્ટર-સા’બ! તુમ તો મેરા ખૂ...ઢ...ન પીતે હો!’ બિલકુલ ફિલ્મી સ્ટાર્ટલ. પરંતુ એ ખૂન પીનારા ડોક્ટર સામેનો એનો રોષ અઠવાડિયામાં ઓગળી જાય અને મિત્રતા ફરી મોરી ઊઠે.

સાજીયા ચાર વર્ષની બાલિકા. મગજનો ટી.બી. થયો. એમાં વીસ દિવસ બેહોશ રહી. માંડ-માંડ જીવ બચ્યો. આશા નહોતી છતાં બોલતી ચાલતી થઈ. નેવું દિવસ થાપા પર ઇન્જેક્શનનો કોર્સ કરવાનો હતો. રોજ આ દર્દનાક પરિસ્થિતિમાંથી પસાર થવા માટે એ મારા કિલિનિકમાં આવે. ‘જુડ મોર્નિંગ’ બોલવા જાય પરંતુ એની જીબ એને સાથ ન આપે એટલે એ બોલે ‘દુ...ક મોર્નિંગ.’ કોઈ દિવસ ઇન્જેક્શન મુકાવવા સવારે આવે, કોઈ વાર સાંજે આવે. સાંજે આવે તોથી પેલું ‘દુ...ક મોર્નિંગ.’ મેં એને ‘દુ...ક ઇવનિંગ.’ શીખવાડવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ! કહી હું ન હોઉં તો અમી (મારા સહકાર્યકર ડોક્ટર પત્ની)ને પૂછે : ‘અંકલ કહાં ગયે?’ અમી ન હોય તો મને પૂછે : ‘આન્ટી કહાં ગઈ?’ અને બીજા દિવસે ‘ફોલો-અપ’ કરે, ‘કલ કહાં ગયે થે?’ ઇન્જેક્શન મુકાવતાં પહેલાં મને આશાસન આપે. ‘આજે નહીં રોઉંગી.’

ઇન્જેક્શનની પીડાથી આંખમાં આંસુ આવી જાય, સહેજ રડાઈ જાય. પણ પછી તરત હસ્તી થઈ જાય.

મારા આ બાળદોસ્તો મને રસ્તે, કોઈ રેસ્ટોરાંમાં કે નાટ્યગૃહમાં મળી જાય તો એમના આનંદની અવધિ ન રહે. એમનાં મા-બાપ જરા સંકોચ અનુભવે, પણ આ બાળકો! દોસ્તીમાં વળી સંકોચ શાનો? તરત દોડી આવે. એક-બે વાત કરીને પોતાની મસ્તીમાં પરોવાઈ જાય. કદીક કન્સાંટિંગ રૂમમાં આવે ત્યારે ‘ડોક્ટર અંકલ, કાલે તમે અમારા ટી.વી.માં આવેલાને!’ ડોક્ટર અંકલને ટી.વી. પર મળવાનો આનંદ વિશેષ! (એમાં ઇન્જેક્શનનો ડર નહીં) પડોશીઓને, મિત્રોને સહુને ટી.વી. પાસે એકઢા કરી દે અને જ્યાં સુધી એમના ડોક્ટર અંકલનું થોબહું ટી.વી. પર હોય ત્યાં સુધી કોઈની મજાલ છે કે ચેનલ બદલે!

મારી સાથેના સંબંધથી આ બાળકોએ શું મેળવ્યું હશે, એ તો બાળકો જ જાણો, પરંતુ મને તો જીવનના અમૃત્ય બોધપાઠો એમની પાસેથી શીખવા મળ્યા. આ પહેલાં મેં ‘કુતૂહલ’, ‘ભોળપણ’ વગેરે શાંદો સાંભળ્યા જ હતા. આ બાળકોએ મને એનો સીધો પરિયે કરાવ્યો. પુખ્ય વ્યક્તિઓ સાથેના સંબંધોમાંથી તો તરત મલીનતા, મતલબ, બ્રષ્ટતા અને ખટપટની વાસ આવવા માંડે છે. આ કહેવાતા (અને કહોવાતા) સંબંધોના જાબોચિયામાં એ તાજગી, એ તરવારાટ, એ ઉમળકો ક્યાં? આપણે બાળસહજ વિસ્મય અને નિર્દોષતાનો ભોગ આપી પુખ્યતા અને પાકતા પહેલી લઈએ છીએ અને આપણાં બાળકો પણ વહેલી તકે એમ ન કરે ત્યાં સુધી આપણને ચેન પડતું નથી.

મારા આ વહાલા બાળદોસ્તોની સસલાં જેવી નિર્દોષતા સ્કૂલ-ટ્યુશન હોમવર્કના ભાર નીચે, કદક શિક્ષકો અને અક્કડ મા-બાપની છત્રાધ્યા તળે કયાડાઈ જતી હું જોતો રહું હું. એમને કંઈક બનાવવાના પ્રયાસમાં, ‘તેઓ શું છે’ એ વાત વીસરાઈ જતી હું જોઈ રહ્યો હું. મારા દરેક બાળદોસ્ત માટે સમાજ એક સોનાનું પીજું તૈયાર કરી બેઠો હોય છે અને એની પાંખોનો શમી રહેલો ફડ્ફડાટ જોતાં મને ખૂબ દુઃખ થાય છે. છતાં એક વાતનું મને વિસ્મય પણ છે અને એ જ વાતનો મને સંતોષ પણ છે કે નવું જન્મતું બાળક હમેશાં ભોળપણ અને કુતૂહલનો સંદેશ લઈને આવે છે. કુદરત કદી એમને મલીન કે પાકટ બનાવી નહીં મોકલે, માણસે-સમાજે એ માટે મહેનત કરવી પડે છે.

મારે મારા બાળદોસ્તોને એટલું જ કહેવાનું છે કે બાળદોસ્તો! તમે દર્દના સ્વાંગમાં એક ડોક્ટર પાસે આવતા રહ્યા અને ડોક્ટરના દર્દનો તમારા થડી ઈલાજ થતો રહ્યો, એની કન્સાંટિંગ ફી તમે માગો ત્યારે અને તેટલી ચૂકવવા હું તૈયાર હું.

Corporate Office :
D 6-2, Road No. 34,
Wagle Estate, Thane 400 604. India.

સ્વ. પ્રે. માતુશ્રી રત્નભાઈ નરશી દેવાણાંધ ધરમશી (સુથરી)ના સ્મરાણાર્થે....



HD FIRE PROTECT PVT. LTD.

Protecting What Matters Most to You

કોધ : નિવારણ

આરોગ્ય

રોહન પટેલ

મનુષ્ય જીવન કોધ મુક્ત કરવાના પ્રયત્ન અંગે સહચિંતન

એક બાળક ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો. બાળકને તેના પિતાજીએ ઠપકો આપતાં કહ્યું કે તને કંઈ ખ્યાલ છે તને કંઈ સમજ પડે છે? મેં તારા અભ્યાસ પાછળ કેટલા બધા પૈસાનો ખર્ચ કર્યો, પૈસાનું પાણી કરી નાખ્યું અને તું નાપાસ થયો? બાળક નાપાસ નાપાસ થયો તેનો ગુસ્સો ન હતો, પરંતુ બાળક પિતાની ઈચ્છા પૂરી ના કરી શક્યો તેનો કોધ હતો. પિતાને એમ હતું કે બાળક ખૂબ સારા માર્ક્સ લાવીને પોતાની પ્રતિષ્ઠા વધારશે, ખૂબ સારી નોકરી મેળવશે અને પિતાની તમામ ઈચ્છા અધૂરી રહી ગઈ તેનો કોધ હતો.

કોધ એટલે સહનશીલતા, ધીરજ, સ્વસ્થતાનો સંપૂર્ણ અભાવ, જેમાં વ્યક્તિ પોતાના મનમાં એક જાતનો ઉદ્ઘેગ અનુભવે છે.

મનુષ્યના જીવનમાં પ્રેમ અને કોધ બંને આવે છે. આપણા જીવનમાં આપણો જે કંઈ ઈચ્છાએ છીએ અને આપણા વિચાર અનુસાર સંપૂર્ણ કામ થાય તો આનંદ થાય છે. પરંતુ આપણું ધારેલું ના થાય કે આપણા વિચાર અનુસાર કોઈ કાર્ય ના કરે ત્યારે કોધ આવે છે. જ્યારે મનુષ્યને કોધ આવે એટલે એના મગજ પરનો કાબૂ ગુમાવે છે અને જે કાર્ય ના કરવાનું હોય તે કાર્ય કરી બેસે છે.

મોહ ઈચ્છા શક્તિનું કારણ છે અને કોધ અધોગતિનું કારણ છે. એટલે પ્રથમ કોધ ઉપર કાબૂ મેળવવા મોહ અને ઈચ્છાને બાંધીને રાખવા જરૂરી છે. કારણકે મોહ અને ઈચ્છાના કારણે કોધ આવે છે અને અધોગતિનું નિર્મિશ થાય છે.

‘જરૂરિયાત ફરીરની પણ પૂરી થાય છે, પણ ઈચ્છા તો બાદશાહની પણ અધૂરી રહી જાય છે.’

રામાયણનો એક પ્રસંગ છે કે રામ, સીતા, લક્ષ્મણનો ચૌદ વર્ષ વનવાસ હોય છે. રાવણના કહેવાથી મરીચિ એક સુંદર મૃગનું રૂપ ધારણ કરે છે. સીતાજી મૃગને જોઈને તેના પ્રેમમાં મોહિત થઈ જાય છે અને સીતાજી મૃગના ચામડાની માંગ રામ પાસે કરે છે અને કહે છે આ મૃગનું ચામડું સુંદર છે. તેને મારે શરીર ઉપર ધારણ કરવું છે. રામ એ સમયે સીતાને સમજાવે છે કે આ કોઈ સુંદર મૃગ નથી, આ માયાવી મૃગ છે. છતાં પણ સીતાજી માનતા નથી. રામ સીતાને ના પાડે છે ત્યારે સીતા રામ ઉપર કોધિત થઈ જાય છે અને પછી રામાયણમાં રાવણની યુદ્ધગાથા જોવા મળી. તો કહી શકાય

કે : ‘કોધ અધોગતિનું કારણ છે.’

લોભ અને અહંકારથી કોધ આવે છે. કોધની નાનકડી બહેન જીદ છે. આપણા જીવનમાં અનેક જીદ હોય છે અને એ જીદ પૂરી ના થાય ત્યારે આપણાને હંમેશાં કોધ આવે છે અને જીદમાં આપણી માંગણી હોય છે તે માંગની અવગણના થાય છે ત્યારે કોધ આપણા મગજ ઉપર અસર કરે છે અને આપણે મગજ ઉપરનો કાબૂ ગુમાવી બેસીએ છીએ અને તે સમયે હિત અહિતનો વિચાર નથી આવતો. તેમાં આપણું અને બીજાનું અહિત થાય છે તે સમયે સાચા ખોટાનું આપણાને ભાન રહેતું નથી. કોધમાં માણસની માણસાઈ પણ ભૂલાઈ જાય છે, સાહેબ!

ધારા સમયે માનવીના મનમાં સંશય થાય છે ત્યારે પણ કોધ આવે છે. સંશય (શંકા) એ માણસના મનમાં અનેક પ્રશ્નોનો જન્મ કરે છે. એમાં ખોટા પ્રશ્નો વધુ જન્મ લે છે અને એ ખોટા પ્રશ્નો જ કોધનું મૂળ હોય છે.

આપણા કોધને અહંકાર પાળી પોષીને મોટો કરે છે. અહંકારથી કોધ વધે છે. કોધનો ભાઈ અહંકાર છે. જીવનમાં જે પણ કંઈ કામ થાય છે તે કંઈ અપેક્ષાથી થાય છે. અપેક્ષા પૂર્ણ ન થતાં અથવા કોઈ વ્યક્તિ આપણા વખાણ ના કરે તો આપણો અહંકાર ધવાય છે. મનમાં એ પ્રશ્ન થાય કે કોઈએ મને એમ ન કહ્યું કે ધારું સરસ કામ કર્યું, ધર્ષી સારી સફળતા મેળવી, બહુ જ સરસ કામ કર્યું કે મહેનત કરી અને કોઈએ ન કહ્યું એટલે કોધ આવે છે.

પણ કોઈક સમયે સાંભળ્યું છે કે કોધને પણ ડર લાગે છે? ના, આપણે ક્યારેય પણ સાંભળ્યું ના હોય કે કોધને ડર લાગે છે, પરંતુ કોધને ડર લાગે છે એ સાચી વાત છે. કોધને કોનાથી ડર લાગે છે? કોધને તેના પિતાથી ડર લાગે છે. પણ કોધનો પિતા કોણા? કોધનો પિતા છે ‘ભય.’ આપણે હંમેશાં ભયભીત હોઈએ ત્યારે આપણાને કોધ નથી આવતો. સાચી વાત ને? પરંતુ એ ભયને દૂર કરવાના ઉપાય આપણે શોધીએ છીએ કારણકે જ્યારે ડર લાગે ત્યારે કોધ શાંત થઈ જાય છે.

કોધની માતા એ ‘પ્રેમ’ છે. માતા જેમ પોતાના બાળકને પાલન પોષણ કરે છે, ભલે બાળક ગમે તેટલો કોધ કરે તેના

(અનુ. જુઓ : પાના નં.-૪૧ ઉપર)

સરગવો

ઓષધ

વૈદ નિપુણ પી. બુય

આજનો યુગ સ્પર્ધાત્મક જીવનનો છે અને બાળપણથી જ આ માટેની ‘રેટ રેસ’ શરૂ થઈ જાય છે. એટલે તરુણાવસ્થા અને યુવાની આવતા આવતા જીવનની આવી કૃત્રિમ દોડધામને કારણે વ્યક્તિ થાકીને લગભગ બેહાલ થઈ જાય છે. તેથી બાળકો - યુવાન - તરુણો - ગૃહિણીઓ અને વ્યવસાયી લોકોને આજના યુગની આ સંઘર્ષમય જિંદગીમાં ટકી રહેવાની સાથોસાથ નિરંતર કાર્યકુશણતા જાળવવા માટે ખૂબ જ ઉપયોગી અને જાણીતું એવું વૃક્ષ એટલે ‘સરગવો.’ પોષક આહારની સાથોસાથ ઉપયોગી ઔષધ એવું આ વૃક્ષ શિયાળના ઉત્તરાર્ધમાં તેનાં સર્કેદ ફૂલો અને લીલી શિંગોની શોભાથી ખૂબ ખીલી રહે છે ત્યારે આપણાં આંગણા - માર્ગો - ગામ - વાડી શહેરોની શોભા પણ વધારી દે છે. તેથી દવા-ખોરાક અને શોભા એવાં ગ્રાસ કામ એકસાથે જ સાર્થક કરતું ઘરાંગણે ઉગી શકે તેવું હાથવગું ઔષધ ખાસ શિયાળામાં જાણવા - ઓળખવા જેવું છે.

ઉત્તર - પશ્ચિમ હિમાલયના ઢોળાવોનું મૂળવતની અને કંઠાળ ભારતના વિસ્તારો અને દક્ષિણ ભારતના પ્રદેશમાં તે સર્વત્ર ઉગે છે. આપણા આયુર્વેદની સંહિતા - ચરક સંહિતા અને સુશ્રૂત સંહિતાના સમયથી તે ભારતમાં ઊગતું હોવાથી તેના ઉપયોગો આ બંને સંહિતામાં વિસ્તારપૂર્વક વર્ણવામાં આવ્યા છે. તો વળી બાદશાહ અકબરના સમયના ભારતીય સમાજ જીવનને ખૂબ સારી રીતે વર્ણવતા એવા જાણીતા ગ્રંથ ‘આઈને અકબરી’માં પણ આજથી ચારસો-પાંચસો વર્ષ પૂર્વે ઉત્તર ભારતમાં લોકો સરગવાની શિંગોમાંથી અથાણું બનાવીને રોજિંદા વપરાશમાં તેનો આહાર સ્વરૂપે લેવાતા ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા તેવી ખાસ નોંધ લેવામાં આવી છે. હવે તો તેના ઔષધિય ગુણો અને સ્વાદને કારણે સરગવાને છેક ફિલિપાઈન્સ, મલેશિયા, ઇન્ડોનેશિય, કંબોડિયા, શ્રીલંકા, આફ્રિકા, મેક્સિકો, મધ્ય દક્ષિણ અમેરિકા ખંડના દેશોમાં રોજિંદા આહાર તથા તેમાંથી વિશિષ્ટ ઔષધ બનાવવા માટે ઉગાડવામાં આવે છે.

સરગવો જ્યાં પણ ઊગે છે તે સ્થળની શોભા વધારે છે. તેથી તેનું એક નામ સંસ્કૃતમાં ‘શોભાંજન’ છે. તો વળી તીક્ષ્ણ ગુણયુક્ત હોવાથી તેને ‘શિશ્રુ’ કહેવામાં પણ આવે છે. તેના પરથી જ ગુજરાતીમાં આપણે તેને સરગવો કહીએ છીએ. હિંદીમાં તેને ‘સહિજન’ તરીકે ઓળખવામાં આવે છે તો મરાಠીમાં તેને ‘શેવગા’ કે ‘શેંગટા’ કહે છે. તેથી ગુજરાતમાં પણ ક્યાંક-ક્યાંક

તે ‘શેંકટા’ તરીકે પણ જાણીતો છે. તેની શિંગો કે ફળીઓ ‘ડ્રમ’ એટલે કે નગારું વગાડવાની લાકડીઓ - ‘સ્ટીક’ જેવી હોવાથી તેનું અંગ્રેજ નામ ‘ડ્રમ સ્ટીક પ્લાન્ટ’ (Drum Stick Plant) છે. જે જગતમાં વિશેષ જાણીતું છે. સરગવાનું આંતરરાષ્ટ્રીય બોટેનિકલ નામ ‘મોરિંગા ટેરીગોસ્પર્મા’ (Moringa Pterygo Sperma) છે.

આપણે કાર્યક્રમ તો સરગવાનાં જાડ જોયાં તો હશે છતાં પણ તેનો થોડો પરિચય મેળવીએ. તેનું મધ્યમ પ્રમાણનું ૨૫-૩૦ ફૂટ સુધીની ઊંચાઈવાળું વૃક્ષ થાય છે. તેનાં પાંદડાં સંયુક્ત પ્રકારના ૧થી ૨ ફૂટ લાંબાં પક્ષાકાર ધરાવતાં હથી ૮ની જોડીમાં નાનાં-નાનાં પત્રકો સ્વરૂપે જોવા મળે છે. આ બારીક પાંદડાં અંડાકાર તથા એકબીજાની સામસામે લાગેલ હોય છે જે બધાં મળીને એક પાંદડું ‘સંયુક્ત પત્ર’ ગણાય છે. સરગવા પર સહેજ નીલવર્ષ સાથેનાં સર્કેદ ફૂલો સુંદર ગુચ્છા સ્વરૂપે શિયાળામાં ખાસ કરીને જાન્યુઆરી માસથી માર્ચ માસ દરમિયાન આવે છે અને તેમાંથી મધ્ય જેવી સુગંધ આવે છે. આ ફૂલો વૃક્ષને અનેરી શોભા બક્ષે છે. તેનાં ફળ એટલે કે શિંગો શિયાળાના ઉત્તરાર્ધથી જ આવવી શરૂ થાય છે અને એપ્રિલથી જૂન સુધી આવતી રહે છે. આ શિંગો હથી ૧૮ હિય લંબાઈવાળી તો કાર્યક્રમ તેનાથી પણ લાંબી થતી જોવા મળે છે. જેના પર ૭થી ૧૦ ધારીઓ કે ખાંચાઓ જોવા મળે છે. આ ફળીઓ કે શિંગોમાં રહેલ સર્કેદ મજજાની અંદર નિકોણાકાર - તીક્ષ્ણ તીખાશયુક્ત સર્કેદ બીજ રહેલ હોય છે અને તેનો સ્વાદ મરી જોવો જીબ પર ચમચમે તેવો હોય છે. તેથી જ તેનાં બીજ કેટલીક જગ્યાએ ‘શેત મરીય’ તરીકે પણ ઓળખાય છે.

ફૂલોના રંગને કારણે સરગવાની બે પ્રજાતિ કે પ્રકાર માનવામાં આવે છે. સર્કેદ ફૂલોવાળો ‘શેત શિશ્રુ’ અને રાતાં ફૂલોવાળો ‘રક્ત શિશ્રુ’ ગણવામાં આવે છે. તો રાજનિધિંદુ નામના ગ્રંથમાં નીલરંગનાં ફૂલોવાળા ‘નીલ શિશ્રુ’નો પણ ઉત્તેખ કરવામાં આવ્યો છે. વળી સ્વાદના આધારે પણ સરગવાના ‘કડવો’ અને ‘મીઠો’ એવા પણ બેદ બતાવવામાં આવેલ છે. પરંતુ આપણે વ્યવહારમાં, રોજિંદા જીવનમાં બધે જ વપરાતા એવા સર્કેદ ફૂલોવાળા અને મીઠા ગણાતા સરગવાની જ ઓળખાણ કરીશું.

સરગવાના ગુણધર્મો જોઈએ તો તે પચવામાં હલકો - રૂક્ષ અને તીક્ષ્ણ છે. સ્વાદ ખારાશ લેતો તીખો એટલે કે ‘ક્ષારીયક્ટુ’

અને સહેજ કડવાશ લેતો હોય છે. તેથી જ પણિમના દેશોમાં મસાલા તરીકે આહારમાં લેવાતી એક વનસ્પતિ ‘હોર્સ રેડિશ’ને તેનો સ્વાદ મળતો આવે છે. તેથી તેનું એક અંગ્રેજ નામ ‘હોર્સ રેડિશ ટ્રી’ પણ છે. સરગવો પચ્ચા પછી તીખો એટલે કે કટુવિપાકી છે અને તાસીરમાં ગરમ એટલે કે ઉષાવીર્ય છે. તેથી સરગવો વાયુદોષ અને કફદોષનું શમન કરે છે. સરગવાની શિંગો તથા પાન આહાર તથા ઔષધ એમ બંને રીતે વપરાય છે. તો તેના મૂળ અને મૂળની છાલ તથા વૃક્ષની છાલ માત્ર ઔષધ તરીકે જ વપરાય છે. આધુનિક રીતે થયેલ અભ્યાસ મુજબ સરગવાના ઔષધ તરીકેના ‘થેરાપ્યુટિક એક્ઝશન’ જાણીએ તો ઇવિચાભિસરણ તંત્ર માટે તે ઉતેજક એટલે કે કાર્ડિયાક અને સરક્યુલેટરી સ્ટીમ્યુલન્ટ દ્રવ્ય તરીકે ઉપયોગ છે. તેની શિંગો તાવ માટે - એન્ટીપાયરેટીક તરીકે અને કુમિન દ્રવ્ય ‘એન્થેલ્મન્ટીક’ તરીકે ઉપયોગી છે. તો વળી બાંદેલ કે શાક તરીકે શિંગો ‘ડાયાબિટીસ’માં પણ ઉપયોગી છે. ફૂલો, પિતાનો આવ કરનાર ‘કોલેગોગ’ છે તો સાથોસાથ પાચનકિયાને ઉતેજન આપનાર અને પેશાબ છૂટથી લાવનાર ‘ડાયયુરેટીક’ દ્રવ્ય તરીકે પણ તે ઉપયોગી છે. મૂળનો રસ હદ્યને બળ દેનાર ‘કાર્ડિયાક ટોનિક’ છે અને વાઈ કે ખેંચમાં ઉપયોગી એવું ‘એન્ટી એપિલેપ્ટીક’ કાર્ય પણ કરી શકે છે. સાથોસાથ ચેતાતંતુઓની દુર્બળતા - શાસ - દમ, બરોળ અને યકૃતની તકલીફો કે તેના કદમાં વધારો થવો, શરીરમાં થયેલ આંતરિક સોજા - ડિસ્ટ્રીટ ઇન્ફ્લેમેશન તથા પથરીના નિકાલ કરવા મૂત્ર છૂટથી લાવનાર તરીકે પણ ઉપયોગી છે. તેનો ઉકાળો બેસી ગયેલ અવાજ તથા ગળાના સોજામાં ઉપયોગી છે. પદ્ધતિશાલમાં તેનાં મૂળ અને શિંગો ઉપયોગી છે. તો પાનનો રસ થોડી માત્રામાં હેડકીને મટાડનાર છે. રાંધેલ પાનનું શાક ‘એન્ફલ્યુઅન્જા’ અને શરદીમાં ઉપયોગી છે. મૂળની છાલ ખાસ કરીને ‘એન્ટી વાઈરલ્સ’, ‘એન્ટી ઇન્ફ્લેમેટરી - સોજો ઉતારનાર’, દુખાવા માટે ઉપયોગી એનાલજેસિક છે. આયુર્વેદિક દ્રવ્યગુણ વિજ્ઞાનમાં તેને પરસેવો લાવનાર દ્રવ્યો - ‘સ્વેદોપગ’ દ્રવ્યોમાં પ્રથમ સ્થાન આપેલ છે. તેની છાલ ‘એન્ટી ફિગલ’ એટલે કે ફૂગરોધી, જીવાણુરોધી - એન્ટી બેક્ટેરિયલ, ફૂલો તથા નાની ડાયીઓની છાલ લોહીમાંની શર્કરાનું પ્રમાણ ઘટાડનાર, હાઈપોગ્લાયસેમિક છે તો બીજનો ઉકાળો કે સૂપ સોજો ઉતારનાર - એન્ટી ઇન્ફ્લેમેટરી પેટના સ્નાયુઓનો દુખાવો દૂર કરનાર ‘સ્પાઇમોલાઈટિક’ કે ‘એન્ટીસ્પાઇમોટિક’ તથા પેશાબ છૂટથી લાવનાર - ડાયયુરેટીક છે. શિંગો અને પાન ખાસ કરીને પ્રોટીનના પાચન માટે વિશેષ ઉપયોગી હોવાથી ‘ગાઉટ’ નામના વા માં ખાસ ફાયદો કરે છે.

● સરગવાના ઔષધિય ઉપયોગો અને આહાર તરીકેની ઉપયોગીતા :

★ રોજિંદા ખોરાકને પોષક બનાવવા તથા આહારને જ ઔષધ બનાવવા માટે ભારતમાં તો હજારો વર્ષથી લોકો સરગવાની

શિંગનું કે તેનાં પાનનું શાક ખાય છે તથા શિંગોને દાળ કે કઢીમાં નાખીને જાતુ અનુસાર લેવાનું એક ‘પરંપરાગત જ્ઞાન’ આપણી ગૃહિણીઓ ધરાવે જ છે. તો ઘણી જગ્યાએ લોકો શિંગોનું ચણાના લોટવાનું શાક વિશેષ રૂપથી ખાય છે. તેના પાનમાં બીટા કેરોટીન વધારે પ્રમાણમાં હોવાથી તેનું શાક આંખો માટે - દણ્ણની તકલીફો માટે ખૂબ ઉપયોગી ગણધાર છે. વળી દક્ષિણ ભારતના પ્રખ્યાત ‘સાંભાર’ અને ‘રસમ’માં તો સરગવો ખાસ એક અનિવાર્ય ઘટક છે. તે પ્રોટીન ખાસ કરીને દાળ - ચણાનો લોટ કે બેસન - અડદના ઢોસા કે ઈડલી વગેરે સાથે એટલા માટે ખાવામાં આવે છે કે તે પ્રોટીનનું પાચન આસાનીથી કરે છે અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. જેથી શરીરમાં પ્રોટીનના અપચાથી પેદા થતું શરીરમાં વધતું એવું ‘યુરિક એસિડ’ નિયંત્રણમાં રહે છે અને શરીર માટે હાનિકારક નથી બનતું.

★ વિશિષ્ટ ઔષધની દણ્ણાએ જોઈએ તો સરગવામાં રહેલાં કુદરતી તત્ત્વોને કારણે ખાસ કરીને મૂળની છાલની રાસાયણિક ક્રિયા આપણા શરીરના સંવેદક ચેતાતંત્ર દ્વારા શરીરના બધા જ અંગો પર થાય છે જેને ‘એટ્રિનાલિન’ અને ‘ઈઝેટિન’ નામના રસાયણોની શરીર પર થતી અસરો સાથે સરખાવી શકાય. જેમ કે લોહીના દબાણમાં જરૂરી વધારો, યોગ્ય સમયે હદ્ય ગતિની તીવ્રતા, રક્તવાહિનીઓનો સંકોચ કરવો, આંખની કીકી પહોળી થવી, પાચનતંત્ર અને શ્વસનતંત્રની સ્વતંત્ર માંસપેશીઓની ગતિને યોગ્ય રીતે નિયંત્રિત કરવી વગેરે અસરો જોવા મળે છે. આ બધી સામૂહિક અસરોથી વ્યક્તિમાં કાર્ય કરવાની કે સ્પર્ધાત્મકતાની દણ્ણાએ ટકી રહેવાની અને ક્ષમતાવૃદ્ધિની શક્તિમાં વધારો થાય છે. વળી તે કુદરતી રીતે જ અને જરૂરી હોય ત્યારે જ અને યોગ્ય સમયાવધિ માટે જ થતી હોવાથી વ્યક્તિના શરીર અને મન પર ‘કુગ્રભાવ’ કે ‘આડઅસ્સરો’ દર્શાવતી નથી તેથી વ્યક્તિ સતત કાર્યશીલ રહી સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં પણ એકધારી ગુણવત્તા સાથે લાંબો સમય થાક્યા વગર સક્રિય રહી શકે છે. જે આજના યુગની ખાસ જરૂરિયાત માટે ઉપયોગી છે.

★ સરગવાનો આહારમાં કે ઔષધમાં ઉપયોગ કરવાથી તે પ્રોટીનનું તો પાચન કરે જ છે પણ સાથોસાથ મેન્દુનું-ચરબીનું યોગ્ય પાચન પણ કરે છે. તેથી સ્થૂળતાને નિયંત્રણમાં રાખવા, કોલેસ્ટોરોલને કાબૂમાં રાખવા કે વૈજ્ઞાનિક રીતે ડાયેટીંગ કરવા માટે સરગવો ખૂબ જ ઉપયોગી બને છે.

★ સરગવાના આહારમાં ઉપયોગ કરવાથી તે પ્રોટીનનું તો પાચન કરે જ છે પણ સાથોસાથ મેન્દુનું-ચરબીનું યોગ્ય પાચન પણ કરે છે. તેથી સ્થૂળતાને નિયંત્રણમાં રાખવા, કોલેસ્ટોરોલને કાબૂમાં રાખવા કે વૈજ્ઞાનિક રીતે ડાયેટીંગ કરવા માટે સરગવો ખૂબ જ ઉપયોગી બને છે.

★ સરગવાના પાનના રસને ગાળી યોગ્ય માત્રામાં દૂધ સાથે

મેળવી ચિકિત્સકની દેખરેખ નીચે બાળકોને આપવાથી તેમના ‘વૃદ્ધિ’ અને ‘વિકાસ’ - ગ્રોથ એન્ડ ટેવલપમેન્ટ માટેના એક ટોનિક તરીકે ખૂબ ઉપયોગી છે. જેથી બાળકોનાં હાડકાંની મજબૂતી - આંખો, દણ્ણ અને શરીર માટે જરૂરી પોષણ સરળ રીતે મળી રહે છે.

★ સગર્ભાવસ્થાના છેલ્લા સમયમાં તેનું યોગ્ય રીતે સેવન

કરવાથી કેલ્લિયમ, વિટામિન કે લોહતત્ત્વ આયર્નનું પ્રમાણ જરૂરી સ્તરે જળવાઈ રહે છે તથા ગર્ભિશયની દુર્બળતા કે શિથિલતા દૂર થાય છે એટલે સરળ પ્રસૂતિ થાય છે અને પ્રસૂતિ પણીની મુશ્કેલીઓ પણ નિવારી શકાય છે. તો વળી પેટ પર બહેનોને મેદ પણ જમતો નથી અને ધાવણ વધારવામાં પણ મદદરૂપ થાય છે.

★ જે લોકોને મધુપ્રમેહ કે પ્રોસ્ટેટની તકલીફ નથી છીતાં વારંવાર વધુ પેશાબ થતો હોય તો સરગવાના રસ કે સૂપ સાથે જરૂરી સિંધાલૂણ મેળવીને ચિકિત્સકની સલાહ મુજબ લેવાથી સારો ફાયદો થાય છે.

★ દમ - શાસનળીનો સોજો, ટી.બી. વગેરે જેવા ફેફસાંના રોગોમાં તેનો સૂપ ઉપયોગી પુરવાર થાય છે. અભ્યાસ મુજબ સરગવામાંના જીવાશુરોધી - એન્ટીબાયોટિક તત્ત્વની સરખામણીમાં કૃત્રિમ રાસાયણિક રૂપે બનતી આજની 'એન્ટીબાયોટિક' દવાઓ સાથે કરતાં તે પણ અસરકારક જણાયું હતું તેથી શરીરમાંના વિવિધ પ્રકારના જીવાશુજન્ય કે ફૂગજન્ય ચેપી રોગો કે જુદા જુદા બાધ અને આભ્યંતર સોજો, કે વિદ્રિષ્ટિ-એબ્સેસમાં સરગવો આહાર-ઔષધ સ્વરૂપે ખૂબ જ સફળતાપૂર્વક વપરાય છે. વળી આ ખોરાક રૂપે લેવાતું હોવાથ જીવાશુના 'રેજિસ્ટન્ટ' બની 'સુપર-બગ' બની જવાનો પણ સંભવ નથી રહેતો.

★ કમળો - ઝડા - મરડો - ફૂડ પોર્ટિઝનિંગ - ગેસ્ટ્રો એન્ટ્રાઇટીસ જેવી પરિસ્થિતિમાં પાંદડાના રસને મધ તથા જરૂરી નાળિયેરપાણી સાથે આપવાથી સારો ફાયદો મળે છે.

★ બળતરા સાથે થોડો થોડો પેશાબ વારંવાર થતો હોય તો ગાજર-કાકડી અને સરગવાનો સૂપ બનાવીને લેવાથી તરત ફાયદો જોવા મળે છે. તો વળી સરગવાના મૂળના ઉકાળા કે ફાંટ સાથે ખાવાના સોડા કે યવક્ષાર મેળવીને લેવાથી મૂત્રમાર્ગમાં થતી પથરી ઓગળીને નીકળી જાય છે.

★ માથાના ખોડામાં પાંદડાનો રસ વાપરવાથી ખોડો દૂર થાય છે તથા ખીલ-બ્લેક હેસ વગેરેને ચહેરા પરથી દૂર કરવા લીધુના રસ અને મધ સાથે પાંદડાનો રસ મેળવવાથી સારું પરિણામ મળે છે.

★ વૈશ્વિક સ્તરે ફૂપોખણ માટે કામ કરતી ચાર સ્વૈચ્છિક સંસ્થાઓએ તાજા જન્મેલ બાળકો - શિશુ અને તેને ધાવણ આપતી માતા માટે સરગવો ખૂબ જ ઉપયોગી ગણાવ્યો છે અને 'ટ્રીઝ ફોર લાઈફ ઇન્ટરનેશનલ', 'ચર્ચ વર્લ્ડ સર્વિસ', 'એજયુકેશનલ કન્સર્ન ફોર હંગર ઓર્ગનાઇઝેશન' તથા 'વોલન્ટિયર પાર્ટનરશિપ ફોર વેસ્ટ આફિકા' નામ ધરાવતી આ ચારેય સંસ્થાઓએ તો સરગવાને 'નેચરલ ન્યુટ્રીશન ફોર ટ્રોપિક્સ'

એટલે કે વિષુવવૃત્તીય પ્રદેશનો કુદરતી પોષક આહાર ગણાવ્યો છે અને તેમણે તો સરગવાનાં પાંદડાના પાઉડરને ભૂખમરાની સ્થિતિમાં ખાસ ઉપયોગી ગણાવ્યો છે.

★ તો વળી ગરીબી ઉન્મૂલન અને ફૂપોખણ દૂર કરવા માટે ગીજ વિશ્વ અને વિકાસશીલ દેશોમાં ખાસ મિશન સાથે કામ કરતી તાઈવાનની સંસ્થા 'વર્લ્ડ વેજિટેબલ સેન્ટર' તથા 'સેન્ટર ફોર વેજિટેબલ રિસર્ચ' શાકના યોગ્ય વપરાશ દ્વારા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કરે છે. તેમના અભ્યાસ મુજબ સરગવો આ બધા દેશો માટે ગરીબી અને ફૂપોખણ એમ બંનેને દૂર કરવા એક 'કલ્પવૃક્ષ' સાબિત થઈ શકે છે.

★ બીજનું ચૂર્ઝ નદીના પાણીને પણ જંતુરહિત અને જળમદૂખણ રહિત બનાવી પીવાલાયક બનાવે છે. તેથી ઘરનાં પાણીને પણ સરગવાનાં બીજનું ચૂર્ઝ શુદ્ધ કરી પીવાલાયક બનાવે છે. એટલે તે ઘરનું હાથવગું 'હર્બલ કે વેજિટેબલ વોટર ઘુરિફાયર' પણ બની શકે તેમ છે.

★ ઔષધ કે આહાર સિવાયના ઉપયોગમાં જોઈએ તો સરગવાનાં બીજમાંથી એક સ્થિર - ઘડું સ્વચ્છ અને કિંમતી એવું તેલ મળી આવે છે જેને 'બેન તેલ - Ben Oil' કે 'બેહન' તેલ તરીકે ઓળખવામાં આવે છે. જે નાના મોટા ઘડિયાળો અને સૂક્ષ્મ યંત્રોને સાફ કરવા તથા તેના ઊંઝા એટલે કે લુબ્રિકેશન માટે વપરાય છે. જેની પદ્ધતિમાં દેશોમાં ઘડી માંગ છે. તો સરગવાનો ગુંદર કપડાં પર છાપકામ કરવા માટેના રંગ બનાવવામાં પણ વપરાય છે.

આમ દુષ્કાળમાં પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવતા પણ ફૂપોખણ અને ગરીબી દૂર કરવા માટે કલ્પવૃક્ષ ગણાતા એવા આ વૃક્ષ સરગવાને આપણા શાણા અને અજ્ઞાતી પૂર્વજીએ સમજપૂર્વક રોજિદી રોસોઈમાં આહાર સ્વરૂપે ઔષધના રૂપમાં લેવાનું આયોજન ગોઠવેલ છે. તો આવા આપણા આંગણાની શોભા વધારનાર ઉપયોગી ઔષધરૂપ વૃક્ષને ઓળખીએ - પોંખીએ.

**શુશ્રૂષા કલિનિક, મોડન ટોકિની બાજુમાં,
નાગરવંડી પાસે, મુજ, કચ્છ.
ફોન : (૦૨૮૩૨) ૨૨૫૩૭૫**

લડાખનો ચુંબકીય પહાડ

લડાખમાં ચુંબકીય શક્તિ ધરાવતો એક પહાડ છે. તેની ગણતરી ગ્રેવિટી હિલ્સમાં કરવામાં આવે છે. અહીં ગાડીઓનું એન્જિન બંધ કરી દેવાય છતાં ગાડીઓ પહાડ તરફ ચાલે છે.

JAYANT STEELS

179-A, Kandori Building, Opp. Sarvoday Nagar,
Panjarapole Road, Bhuleshwar, Mumbai-400 004.
Ph. : (022) 2242 2463 • 2242 7263

જયંત સ્ટીલ્સ

૧૭૯/એ, પંજરાપોલે રોડ, સર્વોદય નગરની સામે,
મુંબઈ-૪૦૦ ૦૦૪. ★ ફોન : ૨૨૪૨૨૪૬૬૩ / ૭૨૬૩ / ૭૩૬૦
સુંદર - સુધા રસોડાના રાયરચીલાનું પ્રાસિનું પ્રેરણા સ્થાન

ગુંડાલાનું 'વડીલ વંદના' : પરિચય અને અનુભવ

સંસ્કૃત સૌરભ

જેઠાલાલ વી. ગંગાર 'મંગલમ'

મુંબઈમાં રહેતા ક.વિ.ઓ. સમાજના લોકોને મહિનો માસ ફરવા જવાનું હોય ત્યારે મોટેભાગે દેવલાલી કે તીથલ (વલસાડ) પર પસંદગી ઉત્તરે છે. હા, આ બંને સ્થળે હવાપાણી સારા છે અને રહેવા માટે સેનેટોરિયમની વ્યવસ્થા પણ છે, પણ કોઈ મોટી વયની વ્યક્તિઓને આરામ માટે જવું હોય ત્યારે શું? રસોડાનું કામ થઈ શકતું ન હોય અને રોજરોજ બોજનશાળાનું જમવાનું ફાવે નહીં. આ સમસ્યા સૌને છે.

ક.વિ.ઓ. સમાજની ખબર પત્રિકામાં વાંચ્યું હતું કે ૬૦ વર્ષ કે તેતી વધુ વયના વડીલો માટે ગુંડાલા ગામે 'વડીલ વંદના' નામે સેનેટોરિયમ શરૂ થઈ છે જ્યાં રહેવા - જમવાની સર્વ વ્યવસ્થા છે. કપડા પણ ધોઈ આપવામાં આવે છે. ત્યાં જઈ આવેલાને મોઢે એની પ્રસંશા પણ સાંભળી હતી. એટલે થયું, ચાલો આપણે પણ અનુભવ લઈ આવીએ અને સંસ્થાની મુંબઈ ઓફિસે ફોન કરી પૂછ્યું તો જવાબ મળ્યો કે જૂન મહિનામાં જગ્યા મળશે.

સંસ્થાના નિયમ પ્રમાણે દરેક વ્યક્તિ માટે જુદું ફોર્મ ભરવું પડે છે અને ફોર્મની સાથે વ્યક્તિ દીઠ રૂ. ૨૫૦૦/- ચેકથી આપવાના હોય છે. હું અને મારી પત્ની જ્યા બે જણા માટે બે ફોર્મ લઈ આવ્યો અને રૂ. ૫,૦૦૦/-ના ચેક સાથે સંસ્થાની ઘાટકોપર (વેસ્ટ) ખાતે આવેલી ઓફિસે ફોર્મ આપવા ગયો. ત્યાં હાજર ભાઈએ ફોર્મ તપાસી, ચેક લઈ તરત જ મને જૂન મહિના માટે રજા ચિહ્ની આપી દીવી.

અમે મુંબઈથી ટ્રેન દ્વારા ગાંધીધામ પહોંચી ત્યાંથી વાહનમાં એક કલાકની મુસાફરી કરી તા. ૧લી જૂન સવારના ગુંડાલા 'વડીલ વંદના'ના દ્વારે જઈ ઉભા. સંસ્થાના મેનેજર શ્રી હરેશભાઈ વીરાએ આવકાર આપ્યો અને પ્રથમ ચા-નાસ્તો કરી લેવા જણાયું. ચા-પાણી કર્યા બાદ મેનેજરશ્રી પાસે પ્રવેશ માટેના પેપર તથા રજા ચિહ્ની રજૂ કરી. પ્રવેશ વખતે ત્યાં વ્યક્તિ દીઠ રૂ. ૨,૦૦૦/- ડિપોઝિટના આપવાના હોય છે. અમે બે જણાના રૂ. ૪,૦૦૦/- રોકડા આપ્યા. પેપર વિધિ પૂરી થતાં હરેશભાઈએ કર્મચારીને રૂમ ખોલી આપવા કર્યું અને અમને વાપરવા માટે ટુથપેસ્ટ, ડેર ઓઇલ બોટલ, નહાવા તથા કપડા ધોવાના સાબુ વગેરે આપ્યા (આ બધું પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે). ટોઇલેટ, બાથરૂમ, વોશ બેસીન સાથેના સ્વચ્છ - સુંદર રૂમમાં બે બેડ, બે કબાટ, ઇન્ટરકોમ ફોન, લાઇટ-પંખા, અરીસા

વગેરેની સગવડ હતી.

અમે પ્રથમ વખત જ અહીં આવ્યા હતા એટલે નહાઈધોઈ કેશ થઈ પ્રથમ અહીંના ટાઈમ ટેબ્લની જાણકારી મેળવી. સાધારણ રીતે રોજની અહીંની દિનચર્યા આ પ્રમાણે હોય છે.

સવારના વહેલા ઉઠી જેમને મોર્નિંગ વોક પર જવું હોય તે જઈ શકે છે. બરાબર ૭ વાગે સમૂહ પ્રાર્થના થાય છે જેમાં સૌની હાજરી અનિવાર્ય છે. ૭.૩૦ વાગે ચા-નાસ્તો હોય છે. જેમાં દૂધ, ચા, મીઠાઈ, ફરસાણા, ગરમ નાસ્તો, ખાખરા વગેરે હોય છે. ૧૦ વાગે કુટ કે જ્યુસ આપવામાં આવે છે. બપોરે જમવાનો સમય ૧૨ વાગ્યાનો હોય છે. બોજનમાં દાળ, ભાત, રોટલી, શાક, કઠોળ, દહી, છાશ - તો ક્યારેક મિષ્ટન - ફરસાણા પણ હોય છે. સવારની ચા અને બપોરના બોજનની વચ્ચેના સમયમાં દર્શન, પૂજા, વ્યાખ્યાન અથવા ફરવા જવું સૌ પોતપોતાની ભરજી મુજબ ગોઠવી શકે છે. બપોરના બોજન બાદ આરામનો સમય હોય છે અને ત વાગે ઘંટ વાગે ત્યારે સૌને ચા અને હળવો નાસ્તો અપાય છે. ત્યારબાદ ૪ થી ૫ વાગ્યા દરમિયાન નવકાર મંત્રના જાપ હોય છે. જેમાં સૌની હાજરી અનિવાર્ય છએ. સાંજનું બોજન લગભગ ૬ વાગે શરૂ થાય છે જેમાં જુદી જુદી વાનગીઓ પીરસવામાં આવે છે. ખીચડી, કઠી અને રોટલા પણ હોય છે. ત્યારબાદ પ્રતિકમણ અથવા ફરવા જવું પોતાની ભરજી મુજબ કરી શકે છે. રાતના ૮.૩૦ વાગે પ્રભુભક્તિ (ભાવના) થાય છે. જેમાં સૌની હાજરી જરૂરી છે. એક કલાકની ભાવના બાદ સૌ નિદ્રાવીન થાય છે.

અહીં સંસ્થાનું પોતાનું મેડિકલ સેન્ટર છે જેમાં ડોક્ટરની, દવાની વ્યવસ્થા છે. ફિઝિયોથેરાપી ફી કરી આપવામાં આવે છે. આંખ તથા દાંતની ટ્રીટમેન્ટ વ્યાજબી દરે થાય છે. આ મેડિકલ સેન્ટરનો વ્યાજબી દરે ગામલોકો પણ લાભ લે છે.

સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી શ્રી ચીમનભાઈ શિવજી રાયશી રાંભિયા અને તેમના ધર્મપત્ની શ્રીમતી હેમલતાબેન રાંભિયા મુંબઈની માયા છોડી વડીલોની સેવા માટે મોટેભાગે કચ્છમાં જ રહે છે અને સંસ્થાના સંચાલન પર દેખરેખ રાખે છે. તેમના સુચારુ સંચાલનને કારણે જ સંસ્થાની સેવાની સુગંધ સમાજમાં પ્રસરી રહી છે. સંસ્થાના મેનેજર શ્રી હરેશભાઈ વીરા (મેરા(૩)) અને તેમના ધર્મપત્ની શ્રીમતી હંસાબેન વીરા તથા બીજા મેનેજર શ્રી લિલેશભાઈ પણ ખૂબ સેવાભાવી છે. સંસ્થામાં કામ કરતા

દરેક કર્મચારી પણ વિનયી - વિવેકી છે. આ બધાના કારણે અહીં આવનાર દરેક વડીલને પોતાના ઘર જેવું - પરિવાર જેવું વાતાવરણ મળી રહે છે.

અમે એક મહિનો વડીલ વંદનામાં રહ્યા તે દરખ્યાન અમારો અનુભવ ખૂબ જ સુખદ રહ્યો. મહિના દિવસના સહવાસમાં અમે સૌ જાણે એક પરિવારના બની ગયા હતા. ટ્રસ્ટી શ્રી ચીમનભાઈએ એક મહિનામાં અમારા માટે અનેક કાર્યક્રમો ગોઠવ્યા હતા અને અમને અમારું બચપણ યાદ કરાવી દીધું હતું.

એક દિવસ અંતાક્ષરી રમાડી હતી, એક દિવસ ખુરથીની રમત તો એક દિવસ હાઉસી રમાડી. આ બંને રમતોમાં વિજેતાઓને ઈનામો પણ આય્યા હતા. એક દિવસ કાંડાગરા ગામેથી આવેલ શ્રુપમાંના કેટલાક આરાધક વડીલોનું બહુમાન કરવામાં આવ્યું હતું તો એક દિવસ ગામમાં બિરાજમાન પૂજયશ્રી તારાચંદ મુનિનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. અચલગઢીય આચાર્ય શ્રી કલાપ્રભસાગર સૂરિ આદિ મુનિવરો ગામમાં પધારતાં ગામલોકો સાથે સૌ સામૈયામાં જોડાયા હતા અને વડીલ વંદનામાં પગલા કરાવી માંગલિક - પ્રવચનનો લાભ મળ્યો હતો. એક દિવસ ચીમનભાઈ સૌ વડીલોને સાંજના વખતે પોતાની વાડીએ તેડી ગયા હતા જ્યાં પોતાની વાડીની મીઠી ખારેક ખવડાવી હતી અને સાંજના ચોવિહારની વ્યવસ્થા પણ ત્યાં જ કરી હતી. એક દિવસ તીર્થયાત્રા પ્રવાસ ગોઠવેલ હતો જેમાં જેઓ ચાલવા ઈચ્છતા હતા તેમને બે તુફાન ગાડીમાં વાંકી તીર્થ, એન્કરવાલા અહિસા ધામ, માનવ મંદિર (બિદા), ૭૨ જિનાલય, શિવમસ્તુ, ગોધરા, ડોષ વગેરે સ્થળે દર્શન કરાવી સાંજના માંડવી દરિયા કિનારે બીચ પર લઈ ગયા હતા. જ્યાં રમવા - ફરવાનો સૌઅનંદ માઝ્યો હતો. સાંજની ચોવિહારની વ્યવસ્થા પણ ત્યાં જ કરી હતી. રાતના ૮ વાગે વડીલ વંદનામાં પાછા ફર્યા હતી.

એક મહિનામાં આવા અને આટલા સરસ આયોજન વડીલ વંદનામાં જ સંભવી શકે. ખૂબ ખૂબ આભાર ચીમનભાઈ - હેમલતાબેન.

વડીલ વંદનાની સ્થાપના વિશે ટૂંકમાં જાણકારી આપું તો : ગુંડાલાના શ્રી ચીમનભાઈ શિવજી રાયશી રાંભિયાને અનુભવે ધ્યાનમાં આવ્યું કે સમાજના ઘણા વડીલો કચ્છમાં જવા અને રહેવા ઈચ્છે છે પણ યોગ્ય સગવડના અભાવે એકલા તેઓ કચ્છમાં રહી શકતા નથી. આથી આવા વડીલો માટે સર્વ સુવિધા સાથેનું સંકુલ ઊભું કરવાનું નક્કી કર્યું. જેમાં તેમના કુંભબીજનોએ સાથ આય્યો. આ કામ માટે તેઓએ એક ટ્રસ્ટ બનાવ્યું જેનું

નામ તેમના પરિવારના ૪૨ દિવસના અનશનત્રતધારી “હુંવામા”ની સ્મૃતિમાં “માતુશ્રી હુંવરબેન નાનજી કુરપાર રાંભિયા ટ્રસ્ટ” રાખ્યું. આ ટ્રસ્ટ દ્વારા તેમણે વડીલ વંદનાનું ગ્રથમ (પાર્ટ-૧) મકાન તૈયાર કર્યું જેનું ઉદ્ઘાટન તા. ૭-૭-૨૦૦૮ના રોજ થયું. ખૂબ ટુંક સમયમાં આની લોકપ્રિયતા એટલી વધી કે ટ્રસ્ટે સંસ્થા માટે બીજું મકાન (પાર્ટ-૨) બનાવવું પડ્યું. જેનું ઉદ્ઘાટન તા. ૭-૭-૨૦૧૨ના રોજ થયું. હવે બંને જગ્યાએ મળીને એકસો વીસ વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે છે. અહીં એક મહિનો, બે મહિના કે વધુ સમય રહેવું હોય તેઓ સંસ્થાના નિયમને આધીન રહી શકે છે.

આ વર્ષે વડીલ વંદના પાર્ટ-૧ની બાજુમાં ‘માતુશ્રી મણિબેન દેવજી ગાંગજી રાંભિયા મેડિકલ સેન્ટર’ બનાવવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક સર્વ સુવિધા છે. ફિઝિયોથેરાપીની વ્યવસ્થા પણ છે. વડીલ વંદનાની બાજુમાં જ દેરાસર, સ્થાનક, ઉપાશ્રય વગેરે છે અને ગામમાં મહાત્માઓ, સાધુસંતોની અવરજવર સતત રહેતી હોય છે.

વડીલ વંદનાની પ્રવૃત્તિઓ વિશે આપણી ખબર પત્રિકામાં અવારનવાર જાહેરાતો અપાતી જ હોય છે. ફોર્મ માટે મુંબઈમાં દાદર, મુલુંડ, ડોંબીવલી, મલાડ, દહંસર, નાલાસોપારા વગેરે ઠેકાણે કેન્દ્ર રાખવામાં આવ્યા છે.

સંસ્થાની ઓફિસરું સરનામું : ડી-૪, આશાપુરા એસ્ટેટ, જંગલેશ્વર મંદિર રોડ, સુભાષ નગર, અસલ્લા, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૪.

મો. ૯૮૨૨૨ ૩૧૭૩૦

મોટી વયના વડીલો માટે આવી સુવિધા સાથેની સંસ્થા ઊભી કરવા અને તેનું ઉત્તમ રીતે સંચાલન કરવા બદલ સૌ ટ્રસ્ટીગણ અભિનંદનના અધિકારી છે અને અહીં સંસ્થામાં દાન આપનાર સૌ દાતાશ્રીઓ પણ ધન્યવાદને પાત્ર છે. આ સંસ્થાને સમાજનો વધુને વધુ સહયોગ મળતો રહે એ જ શુભ કામના.

ની/૧૦૭, હેટ્ક્ષ્યા નિવાસ, પાંડુરંગ હાઇસ્કુલ પાસે,
માનપાડા રોડ, ડોંબીવલી (કસ્ટ)-૪૨૧ ૨૦૨.
મો. ૯૮૨૬૬ ૨૬૨૩૪

ગોમટેશ્વર મૂર્તિ - કણાટક

ગોમટેશ્વર બાહુબલી મૂર્તિ શ્રેનાઈટની એક વિશાળ શિલાને કાપીને બનાવવામાં આવી છે. આ વિશની સૌથી જિંચી મૂર્તિઓમાંથી એક છે. તેને ગંગ રાજવંશના શાસકે બનાવી હતી.



Mfrs. of Aristo Brand Stainless Steel Utensils

ARISTO PLUS

177/A, Panjrapole Road, Opp. Sarvoday Nagar, Mumbai-400 004.

Tel. : 2242 6555 / 2242 2666 • Fax : 2242 7324

E-mail : aristo_stee@yahoo.co.in • www.aristosteel.com



બાલુડેં જ્યુ ગાલીંયું

સંકલન : ગુલાબચંદ ધારશી રંભિયા

બચુડો

અધા : પુતર બચુડા?

બચુડો : કો અધા કુરો કમ આય?

અધા : અજ પાંછ ઘરમેં જરાપણ ધાંધલ ધમાલ રાડારાડ થીએ નતી ને તોશ બાઈજે મોંમેજા ત જરાપણ અવાજ નકરે નતો. સે જરા તપાસ ત કર હેડી મહે શાંતિ ઘરમેં કી થે વઈ આય?

બચુડો : અધા મુંજુ હક્કી ભૂલ સે ઘરમેં શાંતિ થે વઈ આય. અજ ઉગેજો બાઈકે કોઈક પ્રોગ્રામમેં વેનેજો વો સે બાઈ મુંગીયા લીપસ્ટિક મંગ્યા ને આંઊ પણ હથવગી ફેવિસ્ટિક પઈ વી સે તે લાથી. બાઈ પણ ખોલે ને તેરંઈ ચપતે ફેરેને ટેબલ તે રખેલાથે. પણ ચપતે ભરોભર પ્રસરે તેલા કે બ ચપ ભેરા કે તહુંણા ચપ ચોટે વ્યા અંઈ ને ઘરમેં અવાજ બંધ થે વ્યો આય.

અધા : ભગવાન તોજો ભલો કંઈયે.

રમીલા : (પતિ રમેશને) જ્યારે આપણા લગ્ન થયા ત્યારે તમે મને કેટલા બધા જુદા જુદા નામથી બોલાવતા હતા જેવા કે બરકી, રખડી, રસમલાઈ, મીઠો માવો વગેર... પણ હવે કેમ આવું બોલવાનું બંધ કરી દીધું?

રમેશ : તને તો ખબર હશે, દૂધની મીઠાઈઓ કેટલા દિવસ તાજી રહે? ☺ ☺ ☺ ☺ ☺

બંક કેશિયર : (ગ્રાહકને) અરે ભાઈ, તમારી તો બધી નોટો જે ખાતામાં ભરવા લાવ્યા છો તે નકલી છે.

ગ્રાહક : પણ એમાં તમને શું વાંધો છે. તમારે જમા તો મારા ખાતામાં જ કરવાના છે ને... ☺ ☺ ☺ ☺ ☺

બિખારી : શેઠ, કાંઈક આપો. ભૂખ લાગી છે.

શેઠ : ભીખ માંગવા કરતા કાંઈક કામ કરો.

બિખારી : સાહેબ, મેં રૂપિયા કમાવાના ૧૦૦ ઉપાયો વિષે પુસ્તક લખ્યું છે.

શેઠ : તો પછી ભીખ માંગવાની શું જરૂર છે?

બિખારી : પૈસા કમાવાનો એ સૌથી આસાન ઉપાય છે. ☺ ☺ ☺ ☺ ☺

ચમન : (સરકારી સ્કૂલના શિક્ષકને) શું કરે છે?

ગમન : જીએસટી

ચમન : શું બકવાસ કરે છે? આમાં જીએસટી ક્યાંથી આવ્યો?

ગમન : બકવાસ નથી કરતો સાવ સાચું છે. જીએસટી એટલે ગવર્નર્નેન્ટ સ્કૂલ ટીચર.

☺ ☺ ☺ ☺ ☺

ડોક્ટર : (દર્દી જમનાજને) તમને હતાશા ફસ્ટ્રેશનની બીમારી છે. આ પહેલા તમે હતાશા માટે શું ઉપાય કરતા હતા?

જમનાજ : મંદિરે જઈને ઓટલા પર બેસતો હતો.

ડોક્ટર : ત્યાં બેસિને શાંતિથી ધ્યાન ધરતા હશો ને...

જમનાજ : ના રે... મંદિરે જઈ જે મંદિરે આવ્યા હોય તેમના બૂટ-ચંપલ આધાપાછા કરી મિક્ષ કરી નાખતો ને પછી શાંતિથી બેઠા બેઠા જોયા કરતો.

☺ ☺ ☺ ☺ ☺

ડોક્ટર : કેમ મગનભાઈ, આ કોને લઈને આવ્યા છો?

મગનભાઈ : સાહેબ, મારા મિત્ર છે. તેમની ડોક જકડાઈ ગઈ છે.

ડોક્ટર : કઈ રીતે આમ થયું?

મગનભાઈ : મારો મિત્ર પચાસ માળ ઊંચી બિલ્ડિંગના માળ ગણવાની કોશિશ કરતો હતો.

☺ ☺ ☺ ☺ ☺

જસ્વીનભાઈ : અરે અધ્યિનભાઈ, તમારી ફેક્ટરી આગમાં બળીને ખતમ થઈ ગઈ એ જાણી મને ખૂબ દુઃખ થયું. પણ એ પહેલા તમે ફેક્ટરીમાં શું બનાવતા હતા?

અધ્યિનભાઈ : આગ હોલવવાના સાધનો બનાવતો હતો.

| ૭ NanoNine® શાખા રમત-૧૪૪ સંકલન : રજનીકાંત પાટેણ | | | | | | | | | | | |
|---|----|----|----|----|----|----|--|----|----|----|----|
| ૧ | ૨ | | | ૩ | | ૪ | | | | | ૬ |
| ૭ | | | | ૮ | ૯ | | | | | ૧૦ | |
| ૧૧ | | | | ૧૨ | ૧૩ | | | | ૧૪ | | |
| | | | | | | | | | ૧૫ | | |
| | | | | | | | | | ૧૬ | | |
| | | | | | | | | | ૧૭ | | |
| | | | | | | | | | ૧૮ | | |
| | | | | | | | | | ૧૯ | | |
| | | | | | | | | | ૨૦ | | |
| ૨૧ | ૨૨ | | | ૨૩ | | ૨૪ | | | ૨૫ | | |
| ૨૫ | ૨૬ | | | | | ૨૮ | | ૨૯ | | | ૩૦ |
| ૩૧ | | ૩૨ | ૩૩ | | | ૩૪ | | | | | |
| | | ૩૪ | | | ૩૬ | | | ૩૭ | | | |
| | | ૩૮ | | | ૩૯ | | | ૪૦ | | | |
| | | ૪૧ | | | | | | ૪૨ | | | |

૧૪૪ રમત ભરનારનું નામ :

સરનામું :

ફોન/મો.

આપણીના જવાબો શ્રી કંઠી કેન ભવન - પાલડીના સરનામે મોકલવા વિનંતી. (૧૪૪ રમતના જવાબ મોકલવાની અંતિમ તારીખ : ૩૦-૯-૨૦૧૮)

આડી ચાવીઓ

- રેકેટ વડે રમવામાં આવતી એક રમત (૫)
- પરદેશ, યુરોપના લોકોનો દેશ (૪)
- ગુલાબનું અંગેજ (૨)
- ભારતનું સુરક્ષા કવચ : _____ પર્વત (૪)
- યશ, જગ્યા, _____ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા (૨)
- માછલી, બારમી રાશિ (૨)
- શીતળા _____ (૩)
- અંધારું, તમે (૨)
- કેરી, સામાન્ય, કાચો મળ (૨)
- કલરવ શબ્દ આડો અવળો છે (૪)
- નેલ બી ની એક સીંગ (૪)
- તક સાધી લેવાની વૃત્તિવાં (૪)
- છોકરીનું ઓફ્વા પહેરવાનું વસ્ત્ર (૩)

- મક્કમ, ડગે નઈ તેવું (૩)
- પગાંનું (૨)
- પાટલો, એક બેઠક જેમાં એક સંખ્યા ધૂપાયેલી છે (૪)
- તાંબાનો એક જૂનો સિક્કો (૨)
- નામ સ્મરણા, ભક્તિ, સ્તુતિ, પ્રાર્થના (૩)
- અહીં કાર ઊલી થઈ ગઈ છે (૨)
- પરોણી, કંઝ, આહાર (૨)
- દલાલ, આડતિયો (૫)
- પગથી માથા સુધી (૪)
- ક્રાઇ જવું, આખરૂ જવી (૨)
- કંટાળવું, કાયર થઈ જવું (૨)
- પણી (૩)
- એક પ્રખ્યાત સખાવતી આરબ (૫)
- બકબક, લવારો (૪)

ઓની ચાવીઓ

- હવાનું દબાણ માપવાનું યંત્ર (૫)
- બારનો સમૂહ (૩)
- નહિં તો, ધમકી પત્રમાં વપરાતો શબ્દ (૪)
- વસિયતનામું (૨)
- યોગ્ય પાત્ર, બંધ બેસવું (૩)
- અન્જિ દેવતા, બળતરા, લાય (૨)
- વહીવટાર, તાલુકા અમલદાર (૫)
- જમરૂખ (૪)
- સફાઈ કરવાનું એક સાધન (૪)
- દૂધ કે દીણી મલાઈ (૨)
- બળતરા, લાય (૨)
- ગળ્યું, પ્રિય, સુંદર, મીહું (૩)
- અથ તેવો _____ (૪)
- ઢગલો, ગંજ (૨)
- મનને મોઢી લે તેવું (૫)
- અભિલાષા, ઈચ્છા (૪)
- ખેતરમાં પશુ પક્ષીઓને બીવડાવવા કરેલો એક આકાર (૩)
- પવિત્ર, શુદ્ધ (૩)
- ખાંબું, કરડવું (૪)
- ગાડી (૬) (૨)
- જંગલ, અરણ્ય (૨)
- દેવદેવીની આરતી ભસ્મ વગેરે લેવા તે (૩)
- મોહ પમાડનાંનું, આકર્ષક (૩)
- આબરુ, આદર (૨)
- પાયમાલ, નાશ પામેણું (૨)
- નિયમ વગેરેમાંથી છટકવાની યુક્તિ (૪)
- તરંગી, કાલ્પનિક, હવામાં ઉનાંનું એક દારૂખાનું (૩)
- આશ્રય દુઃખ વગેરેમાં દર્શાવાતો ઉદ્ગાર (૨)
- હસતા _____ માં ખાડા પડે તેને ખંજન કહેવાય (૨)

આપણે સામાન્ય રીતે મનની શક્તિનો ફક્ત ૧૦ ટકા જ ઉપયોગ કરીએ છીએ અને બાકીની ૬૦ ટકા શક્તિ તો વણવપરાયેલી જ પડી રહે છે. આ ૬૦ ટકા શક્તિને જગાવવાની જરૂર છે. આપણે મનની શક્તિ જોટલી વધુ વિકસાવી શકીએ તેટલી આપણા સંકલ્પોને જલ્દીથી સિધ્ય કરી શકીએ છીએ.

NanoNine® શાબ્દ રમત-૧૪૩નો ઉકેલ

| | | | | | | | | | | | |
|-----|----|----|----|----|----|-----|----|----|----|----|----|
| આ | પ | વ | સા | ઇ | ખ | ખ | જ | ન | ખ | વ | દિ |
| વ | ટ | ખ | મ | મ | તા | ખ | ગા | જ | ખ | નિ | શા |
| ર | ખ | જ | લો | ક | લ | ખ | ર | ખ | તા | ખ | શ |
| દા | દા | ગી | રી | દે | ખ | ત્વ | ખ | ખ | ખ | ના | ના |
| શ | સ | ર | ક | ખ | વ | રા | દુ | ખ | આ | ગ | ગ |
| મ્ર | મ | અ | ર | મા | ન | ખ | શ | ખ | મ | દ | દ |
| મ | અ | નુ | ચ | ર | ખ | અ | મી | ખ | મ | ખ | મ |
| જી | પ | રા | જુ | ડી | ખ | સ | દ | ન | ખ | ન | ન |
| વી | ત | રા | ગ | સ | ખ | બ | ર | ખ | ખ | ખ | ખ |
| ન | ન | ગ | ગ | ખ | મ | ક | બ | રો | ખ | ખ | ખ |
| રિ | છે | મા | ન | તા | ખ | મ | ખ | જ | ગ | ખ | ગ |
| પુ | કુ | ખ | ર | દી | ખ | પ | ર | બ | ખ | મ | મ |

માસ જુલાઈ-૨૦૧૮ના અંકમાં છયાયેલ નેનો શાબ્દ રમત-૧૪૨ના
બધા સાચા ઉકેલ મોકલાવનારના નામ

- નવલ નીસર
- સરોજ ચંહુરા
- પ્રભા શેઠિયા
- હસમુખ દેઠિયા
- હસ્તી ઠાકર
- કંચનબેન મોરબિયા
- પ્રવીષા ખંડોર
- સાવિત્રી જેસરાણી
- જગૃતી પારેખ
- ચેતના મહેશરી
- ફાલ્ગુની શાહ
- તારાયંદ મહેતા
- નેહલ મહેતા
- હસમુખ મહેતા
- ઉપા સંઘર્ષી
- આસુ મહેતા
- આસુ મહેતા

- સુરત
- સુરત
- વલસાડ
- અડાલજ
- ભુજ
- ભુજ
- મુદ્રા
- મુંબઈ
- સિર્કિટ્રાબાદ
- આદિપુર
- આદિપુર
- ગાંધીધામ
- ગાંધીધામ
- ગાંધીધામ
- રાઉરકેલા
- આણંદ
- આણંદ

- શોભના દંડ
- તારામેન શાહ
- પૂજા પારેખ
- સરલા શાહ
- મહેન્દ મહેતા
- રંજન શાહ
- ઈન્દુભેન પટેલ
- ચંહુભાઈ કુબડિયા
- ચેતન શાહ
- જ્યોતિ શાહ
- જરણા પારેખ
- નવલ શાહ
- લક્ષ્મી ખગી
- પ્રતિમા શાહ
- કશિશ શાહ
- મૃકુશ મેશેરી
- ગીતા મહેતા
- ડૉ. અતુલ ધરોડ
- પ્રવીષા છેડા
- ચેતના વોરા
- અરવિંદ ભડ્ય
- દમયંતી દંડ
- શ્રિયંકા શાહ
- તૃતીસ સાવલા
- ડૉ. એ.કે. ગણેશ્રા
- મેહુલ મહેતા
- કુસુમ ત્રેવાડિયા
- દર્શના શાહ
- વર્ષા પારેખ
- સિમતા શાહ
- ચંદ્રા શાહ
- નિવિતા શાહ

ઉપર્યુક્ત સાચા જવાબ મોકલનારાઓમાંથી લક્કી ડ્રો કરતાં, તજા વિજેતાઓનાં નામ નીચે પ્રમાણે છે. તેઓએ પોતાના ઈનામો સમાજના પાલકી ખાતેના કાર્યાલયમાંથી મોબાઇલ નંબર : ૮૮૮૮૮૦ ૫૩૪૨૧ (સમય : સવારે ૮ થી ૧૨, સાંજે ૪ થી ૫) પર જાણ કરી મેળવી લેવા વિનંતી છે.

- (૧) ચેતન શાહ — અમદાવાદ
- (૨) આસુ મહેતા — આણંદ
- (૩) પૂજા પારેખ — અંજાર (કચ્છ)

માનવીના આરોગ્ય માટે ઓષ્ઠ્ય આપ્યાં ખાવા માટે ફળ આપ્યાં. તોરણ માટે પાન આપ્યાં ને વિસામો દેવા શીળી મીઠી છાયા આપી. એટલું જ નહીં, દંડો વાયુ પણ હોળ્યો. ઝૂલવા માટે પારણું આપ્યું, ઘર બાંધવા માટે લાક્કું આપ્યું, રસોઈ માટે ઈંધણ આપ્યા, તરવા માટે નાવડાં ને તરાપા આપ્યાં ને આંતરડામાંથી દોરડાં આપ્યાં.

એને કુહાડો કે કરવત મારી વૃક્ષને ખતમ કરવા મથનારો માનવ પોતાની મોતે મરીને ખતમ થઈ ગયો ત્યારે પણ “એકો જ મને વાયું હતું ને સીંચ્યું હતું” એમ વિચારી નનામી બની, એના મૂતદેહને જીવી લીધો ને સ્મરણ સુધી પહોંચાડી દીધો.

પણ સ્મરણમાં તો એનું સમર્પણ પરાકાણાએ પહોંચી ગયું. ને માનવી સાથે એ પોતે પણ જલીને રાખ થઈ ગયું. લીલા તોરણથી ભસ્મ સુધી અને ભર્મથી ફરી લીલા અંકુર સુધીની તારી સમર્પણ યાત્રાને ધન્ય છે!!!

જાળવા જીવું

સંકલન : રજનીકાંત પારેલ

વરિયાળી

તમે રોજ સાછુ દૂધ પીવો છો તો તેના બદલે જો તમે દૂધમાં અડધી ચમચી વરિયાળી નાખીને પીશો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. હેલ્થ એક્સપર્ટ મુજબ દૂધ અને વરિયાળી આ બંનેમાં એવા ન્યુટ્રીએન્ટ્રસ હોય છે જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. વરિયાળી એક ખૂબ સુંગઘિત મસાલો છે અને તેમાં ઉનશીલ તેલ મળી આવે છે જે તેના ઔષધીય ગુણો માટેનું કારણ છે. તે ભોજનમાં એક વિશિષ્ટ સુગંધ આપે છે જેના લીધે ભારતીય ભોજન બનાવવામાં હંમેશાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતનું ઊંઝા છે વરિયાળીનું મોટું માર્કેટ.

વરિયાળી સ્વાદમાં મધુર કડ્છી, કડવી અને તીખી છે. તેમાં ઘણા પોષક તત્ત્વો, ખનીજ અને વિટામિન છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે અપચાને દૂર કરે છે અને તેનો ઉપયોગ દસ્ત, પેટના રોગ અને શાસની બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. તે આંખોની તકલીફમાં ફાયદાકારક છે. સૌથી ઉત્તમ રીત વરિયાળીને દૂધ સાથે લો કે પછી ભોજન કર્યા પછી સેવન કરો.

● વરિયાળીવાળું દૂધ બનાવવાની રીત :

વરિયાળીવાળું દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી વરિયાળી ભેણવીને દૂધને ઉકાળી લો. પછી તેને બરોબર ગાળીને પીવો. તેનાથી વરિયાળીનો અર્ક દૂધમાં ઉત્તરી જશે. તો આવો જાણીએ, રોજ દૂધમાં વરિયાળી ભેણવીને પીવાથી થતા ફાયદા વિશે.

● વરિયાળીવાળું દૂધ પીવાના ફાયદા :

તેમાં કેલ્વિયમ હોય છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેનાથી શરીરમાં મોટાબોલીજમ વધે છે. આ પીણું વજન નિયંત્રિત કરે છે અને મોટાપાથી બચાવે છે. આ પીણામાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. તેનાથી ખીલ ઠીક થાય છે અને ચહેરા ઉપરની ચમક વધે છે.

તેમાં એસ્પાર્ટિક એસિડ હોય છે. તેનાથી કબજિયાત, એસિડિટી જેવી તકલીફ દૂર થાય છે અને ડાઈજેશન ઠીક રહે છે. તેનાથી આંખો હેલ્થી રહે છે. તે મોતિયાનિંદ જેવી આંખોની તકલીફથી બચાવે છે. તેનાથી કોલેસ્ટેરોલનું લેવલ જણવાઈ રહે છે અને હાર્ટની બીમારીથી બચાવે છે.

તેનાથી શરીરનું ટોક્સિન દૂર થાય છે અને યુરીન

ઈન્ફેક્શનથી બચાવે છે. આ પીણામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. તેનાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તેમાં આર્થન હોય છે, તે એનીમિયા એટલે કે લોહીની ઉણપથી બચાવે છે.

● વરિયાળીના ફાયદા :

- ગેસ અને કબજિયાત :** વરિયાળી ખાવાથી પેટ અને કબજિયાતની તકલીફ થતી નથી. વરિયાળીને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો. રાત્રે સૂતા સમયે લગભગ ૫ ગ્રામ ચૂર્ણને હળવા હુંફણા પાણી સાથે સેવન કરો. પેટની તકલીફ થશે નહીં અને ગેસ અને કબજિયાત દૂર થશે.
- આંખોની દાઢિ :** આંખોની દાઢિ વરિયાળીના સેવન કરવાથી વધારી શકાય છે. વરિયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દાઢિ વધે છે.
- અજીર્ણ :** ડાયેરિયા થાય તો વરિયાળી ખાવી જોઈએ. વરિયાળીને બેલના ગરબ સાથે સવાર સાંજ ચાવવાથી અજીર્ણ દૂર થાય છે અને અતિસારમાં ફાયદો થાય છે.
- ઉત્તમ પાયક :** ખાધા પછી વરિયાળીનું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચે છે અને તે કુદરતી માઉથ ફેશનર છે. વરિયાળી, જરું અને કાળું મીઠું ભેણવીને ચૂર્ણ બનાવી લો. ખાધા પછી હુંફણા પાણી સાથે આ ચૂર્ણ લઈ લો. તે ઉત્તમ પાયક ચૂર્ણ છે.
- ખાંસી :** ખાંસી થાય તો વરિયાળી ખૂબ ફાયદો કરે છે. વરિયાળીના ૧૦ ગ્રામ અર્કને મધ્ય સાતે ભેણવી લો. તેનાથી ખાંસી આવવાની બંધ થઈ જશે.
- પેટમાં દુઃખાવો :** જો તમને પેટમાં દુઃખાવો રહે છે તો શેકેલી વરિયાળી ચાવવી. તેનાથી તમને રાહત થશે. વરિયાળીની ઠંડાઈ બનાવીને પીવો. તેનાથી ગરમી શાંત થશે અને જવ ગભરાવાનું બંધ થઈ જશે.
- ખાટા ઓડકાર :** જો તમને ખાટા ઓડકાર આવી રહ્યા હોય તો થોડી વરિયાલી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો. બે-ત્રાણ વખત ઉપયોગ કરવાથી રાહત મળી જશે.
- છાથ-પગમાં બળતરા :** છાથ-પગમાં બળતરા થવાની ફરિયાદ થાય તો વરિયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી, ગાળીને, સાકર ભેણવીને ભોજન પછી પથી ૬ ગ્રામના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.
- ગળામાં ખારાશ :** જો ગળામાં ખારાશ થઈ જાય તો વરિયાળી ચાવવી જોઈએ. વરિયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઈ જાય છે.

૧૦. તવચામાં ચમક : રોજ સવાર સાંજ ખાલી પેટે વરિયાળી ખાવાથી લોહી ચોખ્યું બને છે અને તવચા માટે ખૂબ ફાયદાકારક છે. તવચામાં ચમક આવે છે.

૧૧. પેટનો સોજો : વરિયાળી પેટના સોજાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વરિયાળીના બીજ ખાસ કરીને જરદરશોથ લક્ષણના ઉપયાર માટે કરવામાં આવે છે. તે ગેસ્ટ્રીક એસિડનો ખાવ વ્યવસ્થિત કરે છે અને શ્વેચ્છિક કલાના શોથમાં કામ કરે છે.

૧૨. અપયો, અમલપિત, ખાટા ઓડકાર, ગેસ : અપયો, અલ્સર, અમલપિત, ખાટા ઓડકાર, ગેસ અને બીજા રોગોના ઉપચાર માટે વારિયાળીનો ઉપયોગ ઉત્તમ માનવામાં આવે છે. તે પેટમાં તેજાભનો ખાવ વ્યવસ્થિત કરે છે. તેની તીવ્રતા ઓછી કરે છે, આમાશય શોથને દૂર કરે છે અને આમાશય રોગ દૂર કરે છે.

૧૩. ઉબકા અને ઉલટી : વરિયાળી વમનરોધી હોવાને કારણ ઉબકા અને ઉલટીની સારવારમાં મદદ કરે છે. તે ગેસ્ટ્રીક ખ્રાવને વ્યવસ્થિત કરીને અભ્યાસ સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દૂર કરવામાં મદદ કરે છે.

૧૪. વજન ઘટવું : વરિયાળી ચયાપચન કિયા વધારવામાં ઉપયોગી છે. વરિયાળી ચરબીના ચયાપચનને વધારી દે છે અને ચરબી વધવાના ભયથી બચાવે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

સાફિગતા માટે જરૂરી સર્જન

સફળતા ને નિષ્ફળતા, નિષેધાત્મક અને વિધેયાત્મક, સર્જન અને વિસર્જન – આમ દરેક વસ્તુના, વિચારના બે પ્રવાહ હોય છે. કોઈપણ વસ્તુનો જ્યારે નકાર, નિષેધ કરવામાં આવે છે ત્યારે તેની પાછળ ઈર્ઝા રહેલી હોય છે. જ્યારે વિધેયમાં કોઈને કોઈ પ્રેરણા રહેલી હોય છે.

સફળતા માટે કોઈ ને કોઈ સર્જન જરૂરી છે પણ બીજાનું વિસર્જન નહીં. જેના મનમાં વિસર્જનની વિચારશૈલી હોય તે કદી બીજાને હલકો પાડ્યા વિના અને નાનો ચીતર્પા વિના મોટો બની શકતો નથી.

ઈતિહાસમાં આ જ વાતની પુષ્ટી કરતું દાખાત છે. બાદશાહ અકબરે એક વખત સભામાં એક લીટી દોરી અને જાહેર કર્યું કે અડ્યા કે ભૂસ્યા વિના આ લીટીને કોઈ નાની કરી શકે એમ છે?

બાદશાહના સવાલથી સભાજનો વિચારમાં પડી ગયા. અડ્યા
કે ભૂંસ્યા વિના લીટી નાની થાય જ કેમ? અંતે બીરબલે આ કામ
કરવાનું બીંબું જરૂર્યું. બાદશાહે ફરીથી પોતાની શરત જણાવી. પણ
આ તો બીરબલ હતો. તેણે પાટિયા પાસે જઈને બાદશાહે દોરેલી
લીટીની નીચે જ એક મોટી લીટી દોરી. સભાજનો દંગ થઈ ગયા
કારણ કે હવે બીરબલની લીટી આગળ બાદશાહની લીટી નાની
લાગતી હતી.

જોયું ને.... સફળતા બીજાનું વિસર્જન કરવામાં નહીં પડા
પોતાનું સર્જન કરવામાં રહેલી છે. ■

 NanoNine *Sudoku*

જુલાઈ-૨૦૧૮ના અંકમાં છપાવેલ

સુડોકુ-૧૦૮૮ના બધા સાચા ઉકેલ મોકલનારના નામ

- | | | | |
|-----|-----------------|---|---------|
| ૧. | સરલા શાહ | - | અમદાવાદ |
| ૨. | મહેન્દ્ર મહેતા | - | અમદાવાદ |
| ૩. | ઈંદ્રભેન પટેલ | - | અમદાવાદ |
| ૪. | ચંદુભાઈ કુબડિયા | - | અમદાવાદ |
| ૫. | યોગીની શાહ | - | અમદાવાદ |
| ૬. | અવંતી દંડ | - | અમદાવાદ |
| ૭. | ધૂવ ગાલા | - | અમદાવાદ |
| ૮. | શાંતિલાલ શાહ | - | અમદાવાદ |
| ૯. | જ્યોતિ શાહ | - | અમદાવાદ |
| ૧૦. | ગીતા મહેતા | - | અમદાવાદ |
| ૧૧. | કશિશ શાહ | - | અમદાવાદ |
| ૧૨. | પ્રતિમા શાહ | - | અમદાવાદ |
| ૧૩. | ડૉ. અતુલ ધરોડ | - | અમદાવાદ |
| ૧૪. | નિહાર મહેતા | - | અમદાવાદ |
| ૧૫. | પ્રતીષ્ણ છેડા | - | અમદાવાદ |
| ૧૬. | ધરા વોરા | - | અમદાવાદ |
| ૧૭. | ડૉ. મૈત્રી જૈન | - | અમદાવાદ |

૧૮. પ્રીત ઠેડા
 ૧૯. અરવિંદ ભડ્ય
 ૨૦. પ્રિયંકા શાહ
 ૨૧. પાર્થ દંડ
 ૨૨. ખુશી વોરા
 ૨૩. દર્શના શાહ
 ૨૪. કુશાલ નેવાડિયા
 ૨૫. ખુશ્યુ ખુલ્લા
 ૨૬. નિવિતા શાહ
 ૨૭. સ્મિતા શાહ
 ૨૮. ઉભા શાહ
 ૨૯. ચંદા શાહ
 ૩૦. મિલન ગોસર
 ૩૧. ફેનલ શાહ
 ૩૨. પ્રભા શેઠિયા
 ૩૩. હેમલતા દેઠિયા
 ૩૪. પૂજા પારેખ
 ૩૫. હસ્તી ઠાકર
 ૩૬. સંકેત મહેતા
 ૩૭. પ્રવીષ બંડોર
 ૩૮. પ્રીતિક પારેખ

- અમદાવાદ
 - વલસાડ
 - અડાલજ
 - અંજાર
 - ભુજ
 - ભુજ
 - મુંદ્રા
 - સિક્કન્ડાબાદ

- | | |
|--------------------|------------|
| ૩૮. તારાંદ મહેતા | - ગાંધીયામ |
| ૪૦. રીશા મહેતા | - ગાંધીયામ |
| ૪૧. ચેતના મહેશ્વરી | - આદિપુર |
| ૪૨. ઉધા સંધ્યા | - રાજકોટલા |

- | | |
|------------------|------------|
| ૪૩. ચંદ્રિકા શાહ | - રાઉરકેલા |
| ૪૪. દિયા કુભડિયા | - મુંબઈ |
| ૪૫. આસુ મહેતા | - આણંદ |
| ૪૬. મન શાહ | - વડોદરા |
| ૪૭. સોનલ શાહ | - નાગપુર |
| ૪૮. ફેનલ શાહ | - અમદાવાદ |
| ૪૯. અગોંગ ચંદ્રા | - સરત |

ઉપયુક્ત સાચા જવાબ મોકલાવનારાઓમાંથી લક્ષી દ્રો
અનુસાર ત્રણ વિશેતાઓ નીચે પ્રમાણે છે. તેઓએ પોતાના
ઈનામો પાલકી ભવન ખાતેના કાર્યાલયમાંથી મોખાઈલ નંબર
: ૮૮૮૮૦ ૫૩૫૨૧ (સમય : સવારે લ્યી ૧૨, સાંજે ૪ થી
૫) ફોન પર જાણ કરી મેળવી લેવા વિનંતી.

વિજેતાઓ :

- | | |
|-----------------|-----------|
| १. ફેનલ શાહ | — અમદાવાદ |
| ૨. યોગીની શાહ | — અમદાવાદ |
| ૩. પ્રવીણ હંડોર | — મુંદ્રા |



સંકલન : દિનેશચંદ્ર જગજીવન શાહ

★ કચ્છમાં મરીન કેમિકલ ઉદ્યોગ માટે ભરપૂર તક : ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલ ભયાનક ભૂકુંપ બાદ ગુજરાત તથા કેન્દ્ર સરકારે કચ્છને બેંકું કરવા માટે ઉદ્યોગપતિઓને કચ્છમાં ઉદ્યોગો સ્થાપવાની હાકલ કરી. તેમજ આ અંગે સારી એવી કર રાહતની ભેટ ધરી તથા જમીન અને પાણીની સગવડ પણ આપવા અંગે જણાવ્યું. જેના પગલે કચ્છમાં ઘણા મોટા ઉદ્યોગો કાર્યરત થઈ ગયા. જ્યારે મરીન કેમિકલ ક્ષેત્રે માત્ર બે ટકા ઉદ્યોગો જ અહીં આવ્યા. તેમાં આર્થિકન, એગ્રોસેલ અને સોલારીસ એમ માત્ર ગ્રાણ જ કંપની મરીન કેમિકલ ક્ષેત્રે કાર્યરત છે. નજીકના ભવિષ્યમાં ચોથી કંપની પણ આવી રહી છે. ઉપરાંત કચ્છમાં ખનીજનો વિપુલ જથ્થો હોવાથી સિમેન્ટ ઉદ્યોગો માટે પણ ભરપૂર તક છે. અદાણી પોર્ટ તથા કંલા પોર્ટની જેમ બંદરીય વિસ્તારમાં બંદરીય ઉદ્યોગોની પણ વિપુલ તક છે.

★ કચ્છની તરસ છીપાવશે દરિયાના નીર : તાજેતરમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ભુજ નજીક રૂડમાતા તેમના કાંઠે અંદાજિત રૂપિયા ૧૦ કરોડના ખર્ચ નિર્માણ પામેલા રાજ્યના ૧૮મા રક્ષક વનના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ચાલુ વરસે અંજરનો ટપ્પર તેમ નર્મદાના નીરથી છલકાવશે. ઉપરાંત કચ્છમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવા મહાકાય ડી-સેલિનેશન પ્લાન્ટ નાખવાની જાહેરાતનો પુનરોચ્ચાર કર્યો હતો. જે માટે ઈજરાયેલી પધ્યતિનો ઉપયોગ કરી કચ્છને પાણી માટે સ્વનિર્ભર કરવામાં આવશે. ૧૮૭૨ના પાકિસ્તાન સામેના યુધમાં માધ્યાપરની વીરાંગના બહેનોએ યુદ્ધના ધોરણે તૈયાર કરેલ હવાઈ પર્ચી અંગેની બહાદુરી બદલ આ રક્ષક વન તેમને સમર્પણ કરેલ છે. આ રક્ષક વનને પ્રવાસન સરકીટ સાથે જોડી દેવાથી કચ્છના પ્રવાસન સ્થળમાં તેનો ઉમેરો થશે.

★ માઈનિંગ વિદ્યાશાખા માટે ગૌરવ - ગેસ ટેસ્ટિંગ લેબોરેટરી : ભુજની સરકારી પોલીટેકનિક કોલેજમાં માઈનિંગ વિદ્યા શાખાને લગતા વિવિધ વિષયોનું થીયરી તેમજ પ્રાયોગિક કાર્ય કરવામાં આવે છે. આ માઈનિંગ ઈજનેરી શાખાને ગૌરવ અપાવે તેવી ઘટના સૌ પ્રથમ ગેસ ટેસ્ટિંગ લેબોરેટરી નિર્માણ પામી છે. જે સમગ્ર રાજ્યમાં માઈનિંગ વિદ્યા શાખામાં અભ્યાસ કરાવતી શિક્ષક સંસ્થાઓને ઉપયોગી થશે.


★ રાજ્યમાં સંભવતઃ પ્રથમ આઠ માર્ગીય રસ્તો કચ્છમાં : સરકારશીએ કચ્છના સામબિયાળીથી રાધનપુર સુધીના રસ્તાને આઠ માર્ગીય બનાવવા અંગે વિચારેલ છે. કચ્છમાં કંલા પોર્ટ અને મુંદ્રા અદાણી પોર્ટ દ્વારા માલની મોટાપાયે વાહન વ્યવહાર દ્વારા આયાત નિકાસ થવાથી ભરચક ટ્રાફિક રહે છે તેમજ કચ્છમાં પ્રવાસન ક્ષેત્ર વેગવંતો બનતા પ્રવાસીઓની અવરજવર ખૂબ રહે છે. આમ ટ્રાફિકના ભરાવાના કારણે સમય તથા ઉર્જાનો વ્યથાપન થાય છે. તેના નિવારણ અને ઝડપી સેવા માટે રાજ્ય સરકારે સામબિયાળીથી રાધનપુર આઠ માર્ગીય લેન બનાવવા પ્રક્રિયા ચાલુ કરી દીખેલ છે. જેથી કચ્છ આવતા જતા વાહનોને સલામતી અને સગવડતા મળશે તેમજ સમય અને ઉર્જાનો બચાવ થશે.

★ ટપ્પર ડેમમાંથી કચ્છને રોજ પાણી : રાજ્ય સરકાર દ્વારા અંજાર તાલુકાના ટપ્પર તેમને ૫૦૦ એમ.સી.એફ.ડી. જેટલો નર્મદાના પેયજળથી ભરવાનો નિર્ણય લેવાયો છે. આગામી ૮૦થી ૧૦૦ દિવસ સુધી વરસાદ નહીં આવે તો યે કચ્છ જિલ્લાને દૈનિક ૧૦૦ એમ.એલ.ડી. પીવાનું પાણી કચ્છ જિલ્લાને આપવા અંગે વહીવટી તંત્ર દ્વારા આયોજન થઈ રહ્યું છે. ટપ્પર તેમની ક્ષમતા ૧૭૨૫ એમ.સી.એફ.ડી. સંગ્રહ શક્તિ છે.

★ અમેરિકામાં કચ્છી ચુવા સર્જકની ડોક્યુમેન્ટરી બહેઝીપી શ્રેષ્ઠ : કચ્છના અને મુંબઈમાં ફિલ્મ વ્યવસાય કરતા વિશાળ તત્ત્વાએ મનોરંજનના સાધનો વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા જંખતા બહેઝીપી કલાકારોની વ્યથાને વાચા અને માહિતી આપતી ૪૦ મિનિટની ડોક્યુમેન્ટરી બનાવેલ જેને અમેરિકામાં યોજાયેલ ફિલ્મ ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી જાહેર કરવામાં આવી.

★ કચ્છનો પોસ્ટ વિભાગ બેન્ડિંગ ચુગમાં : પોસ્ટ વિભાગ કોર સિસ્ટમ ઇન્ટીગ્રેટર (સી.એસ.આઈ.)માં અપેક્ષે થયા બાદ કચ્છના પોસ્ટ વિભાગમાં તા. ૨૧ ઓગસ્ટથી પોસ્ટલ પેમેન્ટ બેંકનો પ્રારંભ થશે. પ્રારંભિક તબક્કે ભુજ, માનકુવા, મિરજાપર, કુનરિયા અને મંગવાણામાં પ્રારંભ થશે. ડિસેમ્બર સુધીમાં બાકીના કેન્દ્રોને આવરી લેવાશે. જેથી કચ્છની પોસ્ટ ઓફિસમાં બેન્કો જેવી સુવિધાઓ મળશે.

★ આદિપુરની તોલાણી કોલેજમાં બી.વોક. કોર્સ શરીર : બેચલર ઓફ વોકેશનલ ડિગ્રી કોર્સમાં યુ.જી.સી. દ્વારા ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાઇડ મેથેમેટીકસ વિષયના ડિગ્રી કોર્સને મંજૂરી આપવામાં આવી છે. જેને લીધે ગણિત વિષય સાથે સાતક કે અનુસાતક થયેલ વિદ્યાર્થી શિક્ષક સિવાય ઉદ્યોગગૃહમાં પણ નોકરીની તક મેળવી શકશે. આ ડિગ્રી કોર્સની વિશેષતા એ છે કે તે ત્રણ વર્ષના કોર્સમાં વિદ્યાર્થી એક વર્ષ પૂરું કરે તો ડિપ્લોમા, બે વર્ષ પૂર્ણ કરે તો અડવાન્સ ડિપ્લોમા અને ત્રણ વર્ષ પૂર્ણ કરે તો ગ્રેજ્યુઅશેનની ડિગ્રી આપવામાં આવશે. ધોરણ-૧૨ના કોઈ પણ પ્રવાસના વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. યુ.જી.સી. દ્વારા આ અંગે માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી અભ્યાસક્રમની ફી ઓછી રહેશે તેવી સંભાવના છે. આમ ગણિત આધારીત આ અભ્યાસક્રમથી નોકરીની વધુ તકો પ્રાપ્ત થશે. ■



અવસાન નોંધ

- રવિવાર, તા. ૧૫-૭-૨૦૧૮
શ્રી શાંતિલાલ મોતીચંદ સંઘવી (ઉ.વ. ૮૮) (મુંડા - અમદાવાદ)
- રવિવાર, તા. ૮-૮-૨૦૧૮
શ્રી રમેશ ઉમરશી સાવલા (ઉ.વ. ૮૦) (વાંકી - અમદાવાદ)
સદ્ગતશ્રીઓના આત્માના શ્રેયથી પ્રાર્થના...

સાભાર સ્વીકાર

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની વિવિધ સેવકીય યોજનાઓ માટે નીચે મુજબ દાતાશ્રીઓ તરફથી દાન / લેટ ગ્રામ થયેલ છે.

શ્રી જલારામ અન્નકોત્ર ખાતે

રૂ. ૧૧,૧૧૧/- શ્રી લુમખલાલ શિવરામભાઈ શાહ

જનરલ ડોનેશન ખાતે

રૂ. ૧૧,૧૧૧/- શ્રી લુમખલાલ શિવરામભાઈ શાહ

તનીની સહાય ખાતે

રૂ. ૧૫,૦૦૦/- શ્રી ભાવિક એસ. વાવવાલા - અમદાવાદ
સંસ્થા ઉપરોક્ત તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માને છે.

સફળતાની ઊંચાઈ પર હો તો સાવયેત રહેશે,
પણ પણ જાણે છે કે આસમાનમાં બેસવાની જગ્યા નથી હોતી.

સાભાર સ્વીકાર

શ્રી કચ્છી વિશ્રામગૃહ - શાહીબાગ ખાતે ચાલતા ડાયાલિસિસ સેન્ટર ખાતે માસ સપ્ટેમ્બર-૨૦૧૮ દરમિયાન નીચે મુજબ દાતાશ્રીઓ તરફથી કાયમી / દેનિક તિથિનું સૌઝન્ય પ્રાપ્ત થયેલ છે.

| ક્રમ દાતાશ્રીનું નામ | કાયમી તિથિ | દેનિક તિથિ |
|---|------------|------------|
| ૧. શ્રીમતી વર્ષાબેન અનિલ રામજી હરિયા (બાડા - અમદાવાદ) | તા. ૮-૮ | |

સંસ્થાની આ યોજનામાં આપના ઘરે આવતા પ્રસંગો જેવા કે - જન્મ તિથિ, લગ્ન તિથિ, પુષ્ય તિથિ વગેરેમાં આપના તરફથી આર્થિક યોગદાન આપું નામ નોંધાવવા નમ વિનંતી છે. કાયમી તિથિનો નકરો રૂ. ૧,૧૧,૦૦૦/- છે. જે નામ કાયમી ધોરણે ડાયાલિસિસ સેન્ટરમાં લખવામાં આવશે. દેનિક તિથિનો નકરો રૂ. ૧૧,૧૧૧/- છે જે નામ દાતાશ્રી તરફથી જણાવેલ તિથિના દિવસે ડાયાલિસિસ સેન્ટરમાં લખવામાં આવશે.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ : સ્વતંત્રતા દિવસની ઉજવણી

તા. ૧૫-૮-૨૦૧૮ના રોજ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ ભારત દેશના ૭૨મા સ્વતંત્ર દિવસની ઉજવણી વિખ્યાત વૈજ્ઞાનિક તથા કચ્છનાં સપૂત્ર શ્રી શિવજીભાઈ દૂર્ઘૈયાના વરદ્દ હસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવી હતી.

સવારે ૮.૩૦ વાગે સંસ્થાના પટાંગણમાં શ્રી શિવજીભાઈ દૂર્ઘૈયાએ રાખ્યીય ધ્વજને લહેરાવ્યો હતો. ત્યારબાદ હાજર રહેલા સૌ સભ્યોએ સમૂહમાં રાખ્યીય ગીત ગાઈ રાખ્યું ધ્વજવંદન બાદ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રતાપ નારાણજી દેં ટૂંકમાં સ્વતંત્ર દિવસને અનુલક્ષીને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તથા આજના અતિથિ વિશેષ શ્રી શિવજીભાઈ દૂર્ઘૈયાનો ટૂંકમાં પરિચય આપ્યો હતો.

ધ્વજવંદન બાદ સૌ અલ્યાહાર લઈ શ્રી કચ્છી જૈન ભવનના સાંસ્કૃતિક હોલમાં સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખશ્રી તથા મે.ટ્રસ્ટી શ્રી પ્રતાપ નારાણજી દેં સૌને આજના શુભ દિવસે આવકાર્ય હતા તથા શ્રી શિવજીભાઈ દૂર્ઘૈયાને તેઓનું વક્તવ્ય આપવા માટે આમંત્રિત કર્યા હતા. શ્રી શિવજીભાઈ દૂર્ઘૈયાએ પોતાના વક્તવ્યમાં વિસ્તૃત રીતે દેશના સંરક્ષણની વ્યવસ્થા, ભારતીય સેનાની ત્રણે પાંખોની વિસ્તૃત માહિતી તથા એ સંરક્ષણ વ્યવસ્થામાં પોતાની કાર્યવાહી અંગે સંપૂર્ણ માહિતી આપેલ હતી. અંતમાં તેઓએ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદને તેઓ સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કરવાવા માટે જે તક આપી તથા આવા સમૃધ્ય સમાજને મળવાની તક આપી તે બદલ સંસ્થાનો આભાર માન્યો હતો.

શ્રી કાચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

વार्षिक स्नेह मिलन, क्षमापना तथा स्वामिवाटसत्यनो कार्यक्रम

નિમંકણ

તા. શ્રી કચ્છી જેન સેવા સમાજ - અમદાવાદનો ૫૫ (પંચાવન) મો વાર્ષિક સ્નેહમિલન તથા ક્ષમાપના સમારંભ રવિવાર,
૨૩-૦૬-૨૦૧૮ના રોજ સવારે ૮.૩૦ કલાકે ટાગોર હોલ, પાલડી ખાતે યોજવામાં આવેલ છે.

અમદાવાદ - ગાંધીનગર સ્થિત સર્વે કચ્છી જૈન પરિવારજનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. સમાજની નિયાઝી બહેનોને પણ તેમના પતિ તથા બાળકો સહિત પધારવાનું ભાવભર્યું નિમંત્રણ છે.

આ પ્રસંગે સ્વામિવાત્સલ્ય માતુશ્રી પાનભાઈ ધારશી ફુરિયા (મેરાઉ), માતુશ્રી વાલભાઈ વાલજી નાગડા (ચાંગડાઈ - અમદાવાદ), શ્રીમતી લક્ષ્મીબહેન માવજી ધારશી ફુરિયા (મેરાઉ - અમદાવાદ) તથા શ્રીમતી સુશીલાબહેન બાબુભાઈ નાગડા (ચાંગડાઈ - મુંબઈ)ના પરિવારોના સંયુક્ત સૌજન્યથી રાખવામાં આવેલ છે કે જેનો પધારેલા સર્વે સભ્યોએ લાભ આપવા વિનંતી.

વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ યોજવામાં આવેલ છે.

- સવારના 06.30 થી 10.00 : ❖ ટાગોર હોલ ખાતે પ્રવેશ અને રજિસ્ટ્રેશન
 - સવારના 10.00 થી 10.30 : ❖ આવકાર પ્રવચન અને સંસ્થાનો વાર્ષિક અહેવાલ - પ્રમુખશી ફોટો
❖ સામૂહિક ક્ષમાપના
❖ વિવિધ મહાનુભાવોનું બહુમાન
 - સવારના 10.30 થી : ❖ હાઉસી તથા મનોરંજન કાર્યક્રમ
સાથે પુરસ્કાર સમિતિ દ્વારા વિવિધ વિદ્યાર્થીઓને પુરસ્કાર.

કાર્યક્રમમાં સમયસર પદારવા ખાસ આગ્રહભરી વિનંતી છે.

શ્રી કાચ્છી લૈન સેવા સમાજ - અમદાવાદ

એસમુખ બાબુભાઈ શાહ માનદ મંત્રી

ਪ੍ਰਤਾਪ ਨਾਰਾਣਯੁ ਦੰਡ

ખાસ નોંધ : કાર્યક્રમમાં સવારે દશાંતિરી આવનાર પ્રથમ 100 કુદુંબોને જ લક્ષી રોક્ઝ્પન આપવામાં આવશે. તથા તેનો લક્ષી રોક્ઝ્પન આવશે. મ્યુઝીકલ હાઉસીની ફક્ત 400 ટિકિટો વહેલા તે પહેલાના ધોરણે દશાંતિરી સમ્ભ્ય દીઠ એક ટિકિટ રૂ. 20/-નો ચાર્જ લઈને આપવામાં આવશે.

સ્વામિવાત્સત્ય જમણવાર સવારે ૧૧.૦૦થી ૨.૦૦ વાગ્યા સુધી ટાગોર હોલ, પાલડી ખાતે રાખવામાં આવેલ છે. જમણવારની વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે જુદા જુદા સમયના પાસ રાખવામાં આવેલ છે. સલભ્યાઓએ તા. ૧૦-૦૮-૨૦૧૮થી તા. ૨૦-૦૮-૨૦૧૮ સુધીમાં નીચે મુજબના સ્થળોએથી પાસ મેળવી લેવા વિનંતિ.

(૧) શ્રી કર્ચદી જૈન ભવન - પાલડી, (૨) શ્રી કર્ચદી વિશ્રામ ગૃહ - શાહીબાગ, (૩) શ્રી કર્ચદી જૈન સેવા ભવન - ગીતા મંદિર.

વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ

શ્રી કચ્છી ઐન સેવા સમાજ — આમદાવાદ

ટ્રસ્ટ મંડળના સભ્યોની યાદી : વર્ષ ૨૦૧૮-૨૦૧૯

| ક્રમ | નામ | કચ્છમાં ગામ | હોદ્દો | ધર | ઓફિસ | મોબાઇલ |
|------|--|-----------------|-----------------------------|------------------------|------------------------|----------------------------|
| ૧. | શ્રી પ્રતાપ નારાણજી દંડ | તેરા | મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ | ૨૬૪૦ ૫૦૪૭ | — | ૫૪૨૬૭ ૨૫૬૧૮ |
| ૨. | શ્રી જગશી જેઠાભાઈ છેડા | લાયજા - મુંબઈ | કાયમી ટ્રસ્ટી | ૨૪૧૬ ૭૨૭૧ ૨૪૧૪ ૧૮૭૯ | ૨૪૧૮ ૧૦૮૬ ૨૪૧૪ ૨૦૩૧ | ૦૯૮૨૦૮ ૦૦૪૫૬ |
| ૩. | શ્રી બિપિનચંદ્ર કાનનજી જૈન | નાની ખાખર-મુંબઈ | કાયમી ટ્રસ્ટી | ૨૨૬૨ ૪૭૨૧ ૨૩૬૧ ૧૦૬૬ | ૨૨૦૧ ૭૪૭૬ | ૦૯૮૮૨૨ ૮૮૦૦૧ |
| ૪. | શ્રી રૂપેશ કાંતિલાલ સાવલા | તુંબડી | કાયમી ટ્રસ્ટી | ૨૬૪૫ ૩૩૩૩ ૨૬૪૪ ૮૫૪૪ | ૨૬૮૬ ૨૦૭૬ ૨૬૮૬ ૨૦૭૮ | ૫૮૨૪૦ ૩૩૨૧૧ |
| ૫. | શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહ | ફિલેહગઢ | ટ્રસ્ટી | ૨૬૪૪ ૬૪૧૩ ૨૬૪૦ ૧૧૪૦ | ૨૨૧૪ ૪૬૬૩ | ૫૮૨૪૦ ૩૧૪૨૮ |
| ૬. | શ્રી શાંતિલાલ મૂળજી સાવલા | તુંબડી | ટ્રસ્ટી | ૦૨૭૧૭-૨૩૪૪૫૫ | ૨૭૫૦ ૨૪૬૧ | ૫૮૨૪૦ ૪૮૬૪૫ |
| ૭. | શ્રી હસમુખ બાબુભાઈ શાહ (ખાંડવાલા) | અંજાર | ટ્રસ્ટી | ૨૬૬૦ ૩૪૫૮ | ૨૬૬૦ ૫૪૫૩ ૨૬૬૦ ૮૫૮૮ | ૫૮૨૪૦ ૪૦૬૬૬ |
| ૮. | શ્રી કે.ડી. શાહ | કુમરા | ટ્રસ્ટી | ૨૬૬૦ ૫૨૨૫ | — | ૫૪૨૭૩ ૫૦૦૦૭ |
| ૯. | શ્રી રમણિકલાલ કુંવરજી ગોસર | ગોધરા | ટ્રસ્ટી | ૨૬૬૫ ૦૨૮૮ | — | ૫૮૨૮૩ ૪૧૩૦૦ |
| ૧૦. | શ્રી રજુભાઈ હરખચંદ ગાલા | રાયથ મોટી | ટ્રસ્ટી | ૦૨૭૧૭-૨૩૪૮૫૮ | — | ૫૮૭૮૧ ૫૦૦૦૦ |
| ૧૧. | શ્રી હસમુખ ઉગરચંદ ગઢેચા | ફિલેહગઢ | ટ્રસ્ટી | ૨૬૪૬ ૨૫૩૬ | ૨૬૪૨ ૭૦૦૧ | ૫૮૨૪૦ ૧૫૩૭૨ |
| ૧૨. | શ્રી કે. આર. શાહ | રામાણિયા | ટ્રસ્ટી | ૨૬૪૨ ૩૮૮૫ | ૨૪૮૮ ૪૫૫૬ ૨૪૮૩ ૩૬૮૮ | ૫૩૨૮૦ ૦૧૧૪૦ |
| ૧૩. | શ્રી અશોકકુમાર સાકરચંદ મહેતા | ભુજપુર | ટ્રસ્ટી | ૪૦૦૦ ૮૨૧૦ | — | ૫૮૨૪૦ ૨૨૬૮૮ ૫૮૭૮૦ ૬૩૧૦૦ |
| ૧૪. | શ્રી આણંદજી વેલજી વીરા | મેરાઉ | ટ્રસ્ટી | ૨૬૫૭ ૫૩૪૨ | ૨૬૫૭ ૫૩૮૪ | — |
| ૧૫. | શ્રી હીરેન કુંવરજી શાહ | નલિયા | ટ્રસ્ટી | ૨૬૭૪ ૭૫૨૫ | ૨૬૪૨ ૨૪૫૫ | ૫૮૨૪૦ ૧૩૭૧૪ |
| ૧૬. | શ્રી મૂકેશ મૂળજી સાવલા | નાની તુંબડી | ટ્રસ્ટી | ૨૬૬૨ ૪૩૨૩ | ૦૨૬૮૪-૨૨૪૪૪૩ | ૫૮૨૪૦ ૩૪૫૬૮ |
| ૧૭. | શ્રી અધિન હીરજી સાવલા | દેશલપુર | ટ્રસ્ટી | ૨૭૬૧ ૧૭૬૧ | ૨૬૪૦ ૨૫૫૦ | ૫૮૨૪૮ ૩૮૭૭૧ |
| ૧૮. | શ્રી નવીનચંદ વેરશી હરિયા | બાડા | ટ્રસ્ટી | ૨૬૭૫ ૧૪૧૫ | ૬૪૪૨ ૩૩૬૬ | ૫૮૨૪૦ ૦૭૨૪૪ |
| ૧૯. | શ્રી પીયુષ રવિલાલ પારેખ | મુંદ્રા | ટ્રસ્ટી | — | — | ૫૨૨૭૨ ૫૬૫૬૮ |
| ૨૦. | શ્રી દિલીપ કુંવરજી દંડ | વરાડિયા | ટ્રસ્ટી | ૨૭૪૭ ૩૬૭૪ | ૩૨૫૫ ૬૨૬૧ | ૫૩૨૭૦ ૦૬૭૦૧ |
| ૨૧. | શ્રીમતી ફાલ્ગુની હીરેન શાહ | નલિયા | ટ્રસ્ટી | ૨૬૭૪ ૭૫૨૫ | — | ૫૮૨૪૦ ૧૬૬૭૭ |
| ૨૨. | ડૉ. હિતેન્દ્ર મોહનલાલ શાહ | અંજાર | કો-ઓપ્ટ ટ્રસ્ટી | — | ૨૬૬૦ ૫૧૪૬ | ૫૮૮૮૧ ૫૮૬૧૬ |
| ૨૩. | શ્રી અનિલ રામજી હરિયા | બાડા | કો-ઓપ્ટ ટ્રસ્ટી | ૨૬૬૨ ૩૫૫૧ | ૦૨૭૭૨-૨૨૮૦૩૬ | ૫૮૭૯૫ ૨૮૦૧૮ |
| ૨૪. | શ્રી પ્રદીપ સૂરજલાલ મહેતા - હોદાની રમે | માંડવી | કો-ઓપ્ટ ટ્રસ્ટી | ૨૬૬૧ ૨૦૮૮ | — | ૫૮૨૪૦ ૬૧૧૬૦ |
| ૨૫. | શ્રી હીરજી પાસુભાઈ શાહ | શેરડી | કાયમી આમંત્રિત | ૨૬૬૦ ૧૦૭૦ | — | ૫૮૨૪૩ ૮૦૮૬૬ |
| ૨૬. | શ્રી મગનલાલ મોતીચંદ સંઘવી | મુંદ્રા | કાયમી આમંત્રિત | ૨૬૮૭ ૧૫૨૫ | ૨૫૬૨ ૦૦૫૧ ૨૫૫૦ ૧૫૫૫ | — |
| ૨૭. | ડૉ. ચંદ્રકાંત કાનનજી દેઠિયા | નાની ખાખર | કાયમી આમંત્રિત | ૨૬૮૫ ૮૭૦૭ | — | ૫૭૨૬૮ ૨૦૧૮૪ |
| ૨૮. | શ્રી આશિષ ધીરભાઈ શાહ | ગાંધીધામ | આમંત્રિત | ૨૬૬૫ ૦૦૫૬ | — | ૫૮૨૪૦ ૨૧૧૪૩ |
| ૨૯. | શ્રી દક્ષેસ નવીનચંદ સંઘવી | સાંતલપુર | આમંત્રિત | ૨૬૮૩ ૭૨૨૨ | — | ૫૮૨૪૨ ૨૬૧૭૦ |

શ્રી કચ્છી ઐન સેવા સમાજ — અમદાવાદ

કારોબારી સમિતિના સભ્યોની યાદી : વર્ષ ૨૦૧૮-૨૦૧૯

| ક્રમ | નામ | કચ્છમાં ગામ | હોદ્દો | ધર | ઓફિસ | મોબાઈલ |
|------|----------------------------------|-------------|-----------------------------|------------------------|------------------------|----------------------------|
| ૧. | શ્રી પ્રતાપ નારાણજી દંડ | તેરા | મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ | ૨૬૪૦ ૫૦૪૭ | — | ૮૪૨૬૭ ૨૫૬૧૯ |
| ૨. | શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહ | ફિલેગઢ | પ્રથમ ઉપપ્રમુખ | ૨૬૪૪ ૬૪૧૩ ૨૬૪૦ ૧૧૪૦ | ૨૨૧૪ ૪૬૬૩ | ૮૮૨૫૦ ૩૧૫૨૮ |
| ૩. | શ્રી શાંતિલાલ મૂળજી સાવલા | નાની તુંબડી | દ્વિતીય ઉપપ્રમુખ | ૦૨૭૧૭-૨૩૪૪૫૫ | ૨૭૫૦ ૨૪૬૧ | ૮૮૨૫૦ ૪૮૬૪૫ |
| ૪. | શ્રી હસમુખ બાબુભાઈ શાહ (ખાડવાલા) | અંજાર | માનદ મંત્રી | ૨૬૬૦ ૩૪૫૮ ૨૬૬૦ ૮૬૮૮ | ૨૬૬૦ ૪૪૫૩ ૨૬૬૦ ૮૬૮૮ | ૮૮૨૫૦ ૪૦૬૬૬ |
| ૫. | શ્રી પ્રદીપ સૂરજલાલ મહેતા | માંડવી | સહ મંત્રી | ૨૬૬૧ ૨૦૮૮ | — | ૮૮૨૫૦ ૬૧૧૬૦ |
| ૬. | શ્રી કે.ડી. શાહ | કુમરા | ખજાનચી | ૨૬૬૦ ૫૨૨૫ | — | ૮૪૨૭૩ ૬૦૦૦૭ |
| ૭. | શ્રી રમણિકલાલ કુંવરજી ગોસર | ગોધરા | સહ ખજાનચી | ૨૬૬૫ ૦૨૬૮ | — | ૮૪૨૮૩ ૪૧૩૭૦ |
| ૮. | શ્રી હસમુખ ઉગરચંદ ગઢેચા | ફિલેગઢ | સભ્ય | ૨૬૪૬ ૨૫૩૬ | ૨૬૪૨ ૭૦૦૧ | ૮૮૨૫૦ ૧૪૩૭૨ |
| ૯. | શ્રી નીતિન ધનજી ગાલા | કોટડા રોહા | સભ્ય | ૨૨૮૬ ૪૪૩૧ ૨૨૮૬ ૭૦૬૪ | ૨૨૧૨ ૩૨૧૦ ૨૨૧૨ ૪૪૭૪ | ૮૩૭૬૧ ૧૪૦૨૪ ૮૩૭૭૨ ૦૮૫૩૦ |
| ૧૦. | શ્રી બચુભાઈ હીરજી રાંભિયા | રામાણિયા | સભ્ય | ૨૨૧૪ ૧૧૬૭ ૨૨૧૪ ૮૫૪૦ | ૩૨૬૩ ૫૭૭૨ | ૮૨૨૭૨ ૧૩૩૪૧ ૮૮૨૮૧ ૧૩૧૮૧ |
| ૧૧. | શ્રી વિશાલ મહેન્દ્ર શાહ | ભુજ | સભ્ય | ૨૬૭૬ ૩૬૪૮ | ૨૬૩૧ ૪૬૦૪ | ૮૮૨૮૩ ૫૦૦૩૮ |
| ૧૨. | શ્રી રજનીકાંત ધરમશી પારેખ | અંજાર | સભ્ય | ૨૬૬૩ ૪૩૮૮ | — | ૮૮૮૮૦ ૫૩૫૨૧ |
| ૧૩. | શ્રી જશવંતકુમાર જયંતીલાલ કોઠારી | પલાંસવા | સભ્ય | ૨૬૬૩ ૩૩૨૪ | ૨૬૪૬ ૦૨૩૬ | ૮૮૨૫૧ ૪૨૩૮૭ |
| ૧૪. | શ્રી નિરંજન પૂતુમચંદ મેશેરી | લાલા | સભ્ય | ૨૭૬૮ ૦૭૬૧ | — | ૮૮૨૪૩ ૮૮૪૪૧ |
| ૧૫. | શ્રી પંકજ મેધજી ગોગરી | ડોંણ | સભ્ય | ૨૬૬૪ ૧૬૬૦ | — | ૮૧૬૦૧ ૮૫૫૩૦ |
| ૧૬. | શ્રી ગિરીશ હીરજી ટેઠિયા (શાહ) | શેરડી | સભ્ય | ૨૬૬૦ ૧૦૭૦ | — | ૮૪૨૮૨ ૦૮૭૨૩ ૮૮૨૪૩ ૧૬૮૬૮ |
| ૧૭. | શ્રી દિનેશ રત્નિલાલ મહેતા | ભુજ | સભ્ય | ૨૬૬૭ ૦૨૪૬ | — | ૮૫૨૪૩ ૪૨૬૨૮ |
| ૧૮. | શ્રીમતી સુલુબહેન જલદીપ શાહ | નલિયા | સભ્ય | ૨૬૬૦ ૭૫૫૦ | — | ૮૭૧૨૮ ૮૮૫૩૪ |
| ૧૯. | શ્રીમતી શિલ્પીબેન પ્રકાશ શાહ | ફિલેગઢ | સભ્ય | ૨૬૬૨ ૦૧૬૮ | — | ૮૩૨૭૦ ૧૪૬૨૫ |
| ૨૦. | શ્રીમતી અમીનેન નીતિનકુમાર શાહ | અંજાર | સભ્ય | ૨૭૪૮ ૮૨૮૮ | — | — |
| ૨૧. | શ્રી લક્ષ્મીચંદ શામજી વીરા | ફિરાઠી | સભ્ય | ૨૬૭૬ ૬૨૮૦ | — | ૮૩૨૮૮ ૨૫૬૬૮ |
| ૨૨. | શ્રી નવીન જેઠાભાઈ લાલકા | બાંદ્ખિયા | સભ્ય | — | ૨૨૧૨ ૦૪૦૪ | ૮૩૭૭૭ ૪૨૪૨૧ |
| ૨૩. | શ્રી પીયુષ હીરજી સાવલા | ભોજાય | સભ્ય | — | — | ૮૨૭૬૮ ૭૫૩૫૦ ૮૮૭૮૪ ૮૬૧૩૮ |
| ૨૪. | ડૉ. કેતન ઈન્ફ્રાજિત શાહ | મુંદ્રા | સભ્ય | ૨૨૮૨ ૫૮૧૨ | ૨૨૮૨ ૦૧૬૮ | ૮૮૨૪૬ ૮૭૭૪૧ |
| ૨૫. | શ્રી રોહિત શાંતિલાલ સંઘવી | મુંદ્રા | સભ્ય | ૨૬૮૨ ૨૧૮૮ | ૬૬૩૦ ૧૫૩૪ | ૮૮૨૪૦ ૦૬૬૪૮ |
| ૨૬. | શ્રી દિનેશચંદ જગજીવન શાહ | ભુજ | કો-ઓપ સભ્ય | ૨૬૫૬ ૫૭૩૦ | — | ૮૪૨૬૫ ૭૭૬૭૮ |
| ૨૭. | શ્રી લહેરચંદ પુનશી મેશેરી | માંડવી | કો-ઓપ સભ્ય | ૨૭૬૦ ૨૩૭૪ | — | ૮૭૨૨૦ ૫૨૧૦૫ ૮૮૨૪૩ ૪૨૧૦૫ |
| ૨૮. | શ્રી આશિષ દિનેશ મહેતા | ભુવડ | આમંત્રિત સભ્ય | — | — | ૮૩૭૪૧ ૩૧૧૧૫ |
| ૨૯. | શ્રી નરેન્દ્ર જયંતીલાલ કોઠારી | પલાંસવા | આમંત્રિત સભ્ય | ૨૬૫૮ ૪૦૦૪ | — | ૮૫૨૪૬ ૩૩૮૪૫ |

મહિલા ઉત્કર્ષ સમિતિ

આગામી કાર્યક્રમો

તંદુરસ્તી માટે જાગૃત બહેનો માટેના બે સ્પેશિયલ કાર્યક્રમો

કાર્યક્રમ-૧ : મેમોગ્રાફી ટેસ્ટ રજિસ્ટ્રેશન કેમ્પ.

કાર્યક્રમ-૨ : લેટેસ્ટ બેકરી વાનગીઓના ડેમોન્સ્ટ્રેશન માટેનું રજિસ્ટ્રેશન

સ્વામિવાત્સલ્યના દિવસે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણકેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત મેમોગ્રાફી રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરેલ છે. આ મેમોગ્રાફી ટેસ્ટ સ્ટન કેન્સર માટેનો છે.

ભારતમાં સ્ટનનું કેન્સર, શહેરી બહેનોમાં જોવા મળતાં મુખ્ય કેન્સરોમાંનું એક છે. આ કેન્સરમાં જો વહેલું નિદાન થાય તો સારવાર સરળ બની રહે છે અને ગુણવત્તાસભર લાંબુ જીવન જીવી શકાય છે. તે માટે નિયમિત મેમોગ્રાફી ટેસ્ટની હિમાયત કરવામાં આવે છે. દર બે વર્ષે મેમોગ્રાફી કરાવવાથી સ્ટન કેન્સર થતું અટકાવી શકાય છે.

આ માટેનું રજિસ્ટ્રેશન માત્ર ને માત્ર સ્વામિવાત્સલ્યના દિવસે જ કરાવી શકાશે. બહેનો પોતાના અનુકૂળ દિવસની એપોઇન્ટમેન્ટ લઈને કરાવી શકશે.

કાર્યક્રમ : મેમોગ્રાફી રજિસ્ટ્રેશન કેમ્પ.

તારીખ : રવિવાર, તા. ૨૩-૯-૨૦૧૮ (સ્વામિવાત્સલ્ય)

સમય : સવારના ૮.૩૦ થી ૧૨.૦૦

સ્થળ : ટાગોર હોલ, પાલડી, અમદાવાદ.

રજિસ્ટ્રેશન ફી : ફક્ત રૂ. ૨૫૦/-

ટેસ્ટ કરાવવા માટેનું સ્થળ : સાયન્ટીફિક લેબ, પંચવટી સેન્ટર પોઇન્ટ કોર્નર.

● ખાસ નોંધ :

- આ ટેસ્ટ ૪૦ વર્ષથી ઉપરની દરેક બહેનો માટે જરૂરી.
- ટેસ્ટ માટેનું તથા રજિસ્ટ્રેશન કરાવવાના – બંને સ્થળ અલગ છે જેની નોંધ લેવા વિનંતી.
- આ ટેસ્ટનો ખર્ચ અન્યત્ર કરાવીએ તો લગભગ રૂ. ૨૫૦૦/-થી રૂ. ૩,૦૦૦/- થાય છે.
- દર બે વર્ષે મેમોગ્રાફી ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે.
- વધુ માહિતી રજિસ્ટ્રેશન વખતે મળી રહેશે.

આટલો ખર્ચાળી ટેસ્ટ : માત્ર રૂ. ૨૫૦/-માં

એ જ સંબંધ કાયમી જળવાય છે કે જેની શરૂઆત જરૂરિયાતથી નહીં પરંતુ દિલથી થયેલ હોય.

કાર્યક્રમ-૨

લેટેસ્ટ બેકરી વાનગીઓનું ડેમોન્સ્ટ્રેશન

Health conscious બહેનો માટે ખાસ આ કાર્યક્રમ નક્કી કરેલ છે. આ વખતે “Healthy Baking” વિષય પરસ્નંદ કરાયો છે. જે અંતર્ગત રાગી, ઓટ્ટસ, હુંટ્સ, પ્રાયહુંટ્સ, જવનો લોટ, ઘઉનો લોટ, રવો વગેરે સાચ્ચિક ચીજવસ્તુઓ વાપરીને નીચે પ્રમાણેની પૌણ્યિક વાનગીઓ શીખવવામાં આવશે.

1. Ragi Chocolate Almond Cake
2. Oats & Sooji Cake with Fresh Fruits.
3. Protein filled Chocolate Delight.
4. No sugar Rum and Raisin + Dates + Carrot Cake
5. Vanilla & Cinnamon Jav Cake.
6. Soji Cake.
7. Jaggery Wheat Cake.
8. Whole wheat Granola Tarts.
9. Oats Brownie.

વગેરે વગેરે....

ઓહોલો... આટલી બધી લેટેસ્ટ આઈટમ,
અને ફી ફક્ત રૂ. ૫૦/-

તો આવો બહેનો, વહેલા તે પહેલાના ધોરણો રજિસ્ટ્રેશન કરાવો.

કાર્યક્રમ : લેટેસ્ટ વાનગીઓનું ડેમોન્સ્ટ્રેશન

વિષય : હેલ્થી બેકિંગ (Healthy Baking)

તારીખ : બુધવાર, તા. ૩-૧૦-૨૦૧૮ અને
ગુરુવાર, તા. ૪-૧૦-૨૦૧૮ (બે બેચ)

રજિસ્ટ્રેશન ફી : ફક્ત રૂ. ૫૦/-

રજિસ્ટ્રેશનનું સ્થળ : સ્વામિવાત્સલ્યના દિવસે.

રવિવાર, તા. ૨૩-૯-૨૦૧૮.

ટાગોર હોલ, પાલડી.

ડેમોન્સ્ટ્રેશનનું સ્થળ : બેકસ સ્ટુડિયો By હેના શાહ

૫, કેમ્પસ કોર્નર-૧,

સેલ્સ ઇન્ડિયાની સામે, પ્રહલાદ નગર,

અમદાવાદ.

**ઉપરોક્ત બંને કાર્યક્રમો માટેનું રજિસ્ટ્રેશન માત્ર ને માત્ર
સ્વામિવાત્સલ્યના દિવસે જ કરાવી શકાશે. તે પછી ક્ષમા.**

સુલુ જલદીય શાહ, કન્વીનર - મહિલા ઉત્કર્ષ સમિતિ

સભ્યપદ - મેડિકલ કાર્ડ સમિતિ

મેડિકલ કાર્ડ માટેની સુચના

નીચે મુજબ આપેલ સમાજના સભ્યોના / નિયાણી બહેનોના મેડિકલ કાર્ડ ઘણા લાંબા સમયથી સમાજના કાર્યાલયમાં પડી રહ્યા છે. આ અગાઉ બે વખત 'મંગલ મંદિર'માં જ્ઞાન કર્યા છીતા તથા તેઓના લાગતા વળગતા સગાઓને જ્ઞાન કરવા છતાં નીચે મુજબના સભ્યો પોતાના કાર્ડ અનેથી લઈ ગયા નથી. આથી જે તે સભ્યોને ખાસ જ્ઞાનવાનું કે તા. ૧-૧૦-૨૦૧૮ સુધી જે પોતાના કાર્ડ લઈ નહીં જાય તો ઉપર મુજબ તારીખથી મેડિકલ કાર્ડ રદ કરવામાં આવશે અને સંસ્થા તરફથી મળતી મેડિકલ સેવા (ડિસ્કાઉન્ટ) મળશે નહીં. તથા સૂચિત કરેલ તારીખ પછી લેવા આવનાર સભ્યોએ નવા મેડિકલ કાર્ડના ફોર્મ ભરવા પડશે (રૂ. ૫૦/- ભરીને) અને રૂ. ૫૦/- દંડ - અભે કરીને રૂ. ૧૦૦/- ભર્યા બાદ નવું કાર્ડ મળી શકશે.

આથી નીચે મુજબના સભ્યોએ તા. ૧-૧૦-૨૦૧૮ સુધી પોતાના કાર્ડ લઈ જવા ભલામણ કરવામાં આવે છે.

કન્વીનર, સભ્યપદ - મેડિકલ કાર્ડ સમિતિ

| | | |
|------------------------------------|--------------------------------------|------------------------------------|
| ૧. અમી દર્પિત દવે (નિયાણી) | ૨૪. જયેશ નાગજીભાઈ શાહ | ૪૭. પ્રભુલાલ કેશવલાલ શાહ |
| ૨. ભરતકુમાર તારાચંદ શાહ | ૨૫. જયંતી જગજીવનદાસ સંધ્યવી | ૪૮. પ્રભુલાલ રાધવજી વોરા |
| ૩. ભારતીબેન દુધાભાઈ અદાણી (નિયાણી) | ૨૬. જાગૃતિ ચંદ્રશીલ મહેતા (નિયાણી) | ૪૯. પ્રદુલ્લભભાઈ કલ્યાણજી છેડા |
| ૪. ચિરાગ વીરેન્દ્ર મણિયાર | ૨૭. કેવલભાઈ કાંતિલાલ શાહ | ૫૦. પરીક ભોગીલાલ સાવલા |
| ૫. ચંદકાંતભાઈ મગનલાલ ઢીલા | ૨૮. કૈલાશ દલીચંદ મહેતા | ૫૧. પરેશ શાંતિલાલ મહેતા |
| ૬. દીપક દલીચંદ મહેતા | ૨૯. કાંતિલાલ નથુભાઈ સંધ્યવી | ૫૨. પૂજા ધ્રુવીન પરીખ (નિયાણી) |
| ૭. દીપાબેન ધીરજકુમાર શાહ (નિયાણી) | ૩૦. કિરણભાઈ ભોગીલાલ મહેતા | ૫૩. રસિકલાલ મોરારજી વોરા |
| ૮. દિપી માનવ શાહ (નિયાણી) | ૩૧. લલિત જયંતીલાલ રંભિયા | ૫૪. રાજેશ પોપટલાલ ધરોડ |
| ૯. દેવાંગ પ્રકુલ્લ શાહ | ૩૨. માનુસીબેન સમીર શાહ (નિયાણી) | ૫૫. રાહુલ નટવરલાલ શાહ |
| ૧૦. ધર્મશ રમણિકલાલ મહેતા | ૩૩. મીનલ પ્રતીક સંધ્યવી (નિયાણી) | ૫૬. રાગીણીબેન અમિત શાહ (નિયાણી) |
| ૧૧. દિક્ષિતા નફુલ ઠક્કર (નિયાણી) | ૩૪. મૂકેશ હીરજ કારાણી | ૫૭. રાજેન નરેન્દ્ર શાહ |
| ૧૨. દિલીપકુમાર જયંતીલાલ પટવા | ૩૫. મૂકેશભાઈ રમણલાલ ગાંધી | ૫૮. રણિમ કુમારપાળ શાહ (નિયાણી) |
| ૧૩. દિપીત સોમચંદ મોમાયા | ૩૬. નરેશ ટોકરશી લાલકા | ૫૯. રમેશચંદ્ર હેમચંદ્ર મહેતા |
| ૧૪. ફાલગુની કમલેશ શાહ (નિયાણી) | ૩૭. નવીનચંદ્ર વાડીલાલ મહેતા | ૬૦. રૂધ્યમ કીર્તિકુમાર શાહ |
| ૧૫. હરીશ પ્રેમજી સાવલા | ૩૮. નયના કમલ શાહ (નિયાણી) | ૬૧. રૂધીલ ભોગીલાલ શાહ |
| ૧૬. હેમલ પ્રવીષભાઈ દોશી | ૩૯. નીપેશ જયકુમાર શાહ | ૬૨. સંજયભાઈ લક્ષ્મીચંદ કારાણી |
| ૧૭. હેલી નીરવ વસા (નિયાણી) | ૪૦. નંદીપ હિંમતલાલ સંધ્યવી | ૬૩. વાસંતીબેન ગૌતમભાઈ શાહ (નિયાણી) |
| ૧૮. હિતેશ હસમુખલાલ મહેતા | ૪૧. મિતા મિલન શાહ (નિયાણી) | ૬૪. વિમલ મનસુખલાલ મહેતા |
| ૧૯. હીલેશ નગીન શાહ | ૪૨. મૃદુલા ચિંતન ભટ્ટ (નિયાણી) | ૬૫. વિરલ મહેન્દ્ર મહેતા |
| ૨૦. જીવીબેન નરપતલાલ મોથારિયા | ૪૩. પ્રવીષભાઈ કાંતિલાલ શાહ | ૬૬. વૈશાલી અજય ગાંધી (નિયાણી) |
| ૨૧. જિતેશભાઈ વિજયભાઈ મોતા | ૪૪. પ્રીતીબેન રમેશભાઈ અદાણી (નિયાણી) | ૬૭. વાડીલાલ છગનલાલ શાહ |
| ૨૨. જુલીબેન મનીષકુમાર શાહ (નિયાણી) | ૪૫. પ્રદીપભાઈ શાંતિલાલ શાહ | |
| ૨૩. જ્ય કીર્તિકુમાર મોમાયા | ૪૬. પ્રવીષ હરજીવનદાસ સંધ્યવી | |

જવનનું કરવું સત્ય

અનાથાશ્રમમાં ગરીબોના બાળકો મળે છે અને વૃદ્ધાશ્રમમાં અમીરોના બુઝુગ લોકો.

લાઇબ્રેરી સમિતિ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની લાઇબ્રેરી અંગે જ્ઞાનવાનું કે સમાજની લાઇબ્રેરી દ્વારા પુસ્તક લેવા તથા પરત આપવાનો સમય હવેથી દર શનિવારે સવારના ૮.૩૦ કલાકથી ૧૧.૦૦ કલાક સુધીનો રહેશે. જેની નોંધ લેવી વિનંતી.

કન્વીનર - લાઇબ્રેરી સમિતિ

**શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત
અને આદર્શ અમદાવાદના સહયોગથી
બહેનો માટે વિનામૂલ્યે સીલાઈ તાલીમ
(સર્ટિફિકેટ કોર્સ)**

| | |
|-------|---|
| તારીખ | : ૨-૧૦-૧૮થી શરૂ (ત્રણ મહિના માટે) |
| સમય | : બપોરે ૧.૩૦થી ૩.૩૦ (સોમથી શુક્ર) |
| સ્થળ | : શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત નવનીત ભવન, આણંદજ કલ્યાણજ 'સી' બ્લોક, બહેરામપુરા, અમદાવાદ. |

રીફરન્સ રિપોર્ટ : રૂ. ૨૦૦/- ભરી રજિસ્ટ્રેશન કરાવવું.

● વિશિષ્ટતા :

- લેડીજ તથા બાળકોના પોખાકનું કટીંગ તથા સીલાઈ શીખવવામાં આવશે.
- પરીક્ષામાં પાસ થનારને સર્ટિફિકેટ આપવામાં આવશે.
- ૮૫% હાજરી ફરજિયાત છે.

● સીલાઈ શીખનાર દરેકે પોતાની સાથે નીચે જણાવેલ વસ્તુઓ લાવવાની રહેશે

- ૧ મીટર સુતરાઉ કાપડ.
- સફેદ ઢોરાની કોકડી - હાથ સોય.
- મેઝર ટેપ.
- કાતર.
- સ્કેલ માપ - ડાયાગ્રામ ઢોરવા માટે.
- કોરા પાનાની નોટબુક.
- છાપા - ડાયાગ્રામ માટે

● વધુ વિગત માટે સંપર્ક :

આદર્શ અમદાવાદ

"નેહલ", સ્થા. જૈન ઉપાશ્રયની બાજુમાં, કોમર્સ કોલેજ છ રસ્તા
પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૮. ફોન: ૨૬૫૬૫૪૧૬

● નામ નોંધાવવા માટે સંપર્ક :

શ્રી કચ્છી જૈન ભવન - પાલડી.

ફોન: ૪૮૮૦ ૬૦૦૧ થી ૬૦૦૬

**શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના
સહયોગથી અને આદર્શ અમદાવાદ સંચાલિત**

વિના મૂલ્યે યોગ શિબિર

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના સહયોગથી
આદર્શ અમદાવાદ સંચાલિત એક યોગ શિબિરનું આયોજન
કરવામાં આવેલ છે. શિબિરમાં યોગસન, પ્રાણાયામ, ધ્યાન
વગેરેની તાલીમ આપવામાં આવશે. યોગ સાધના શરીરને
નીરોગી, મનને નિર્મળ અને આત્માને ઉત્ત્રત બનાવવાનું ઉત્તમ
સાધન છે. જીવનના સર્વાંગી વિકાસ માટે આપ, આપનાં મિત્ર
વર્તુણ, સગા-સંબંધીઓ સહિત યોગ સાધનામાં જોડાઈને અનેક
પ્રકારના ફાયદાઓ અનુભવો એ જ મંગલ કામના.

તારીખ : ૧-૧૦-૨૦૧૮થી તા. ૧૫-૧૦-૨૦૧૮

સમય : રોજ સવારે ૬.૩૦થી ૭.૩૦

શિબિરનું સ્થળ : શ્રી કચ્છી જૈન ભવન, પાલડી, અમદાવાદ.

● વધુ માહિતી માટે સંપર્ક :

આદર્શ અમદાવાદ

મો. ૬૦૩૩૦ ૧૫૨૫૪, ૨૬૫૬ ૫૪૧૬

● નામ નોંધાવવા માટે સંપર્ક :

શ્રી કચ્છી જૈન ભવન - પાલડી.

ફોન: ૪૮૮૦ ૬૦૦૧ થી ૬૦૦૬

તબીબી સાધનો વપરાશ માટે આપવાની યોજના

શ્રી કચ્છી જૈન ભવન - પાલડી પર નીચે મુજબના તબીબી સાધનો દૈનિક ભાડાના ધોરણે મળી શકશે. જેઓને આ સાધનોની
જરૂરિયાત હોય તેઓ શ્રી કચ્છી જૈન ભવન - પાલડી પર ફોન : ૨૬૫૭૮૮૬૨ / ૨૬૫૮૧૫૦૧ પર સંપર્ક સાધી શકશે.

| | | | | | |
|----------------------------|----------|-------------------|---------|-------------------------------|----------|
| ૧. એર બેડ | રૂ. ૧૦/- | ૫. વોકર | રૂ. ૨/- | ૯. બેડ પાન | રૂ. ૨/- |
| ૨. વીલ ચેર | રૂ. ૩/- | ૬. વોકિંગ સ્ટિક | રૂ. ૧/- | ૧૦. ફાઉલર બેડ | રૂ. ૧૦/- |
| ૩. ઓક્સિજન સિલિન્ડર (નાનો) | રૂ. ૫/- | ૭. ક્રોડ ચેર | રૂ. ૩/- | ૧૧. ટેબલ ટોપ (ફાઉલર બેડ માટે) | રૂ. ૨/- |
| ૪. નેફ્યુલાઇઝર | રૂ. ૫/- | ૮. સેલાઈન સ્ટેન્ડ | રૂ. ૨/- | ૧૨. ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન | રૂ. ૫૦/- |

નોંધ : (૧) સ્ટોકમાં હશે ત્યાં સુધી આ સાધનો રીપોર્ટ આપીને ભાડેથી મેળવી શકશે. (૨) સાધનો પાલડી ભવન પરથી લઈને ત્યાં જ પરત કરવાના
રહેશે.

દસ્તુભૂ બાનુભાઈ શાહ - માનદ મંત્રી, શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

ઓડતી નજરે....


માસ જુલાઈ-૨૦૧૮ દરમ્યાન શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની વિવિધ સેવાઓનો લાભ લેનાર વ્યક્તિઓ

| ક્રમ | સેવાઓ | લાભ લેનાર વ્યક્તિઓ |
|------|--|--------------------|
| ૧. | <p>(અ)</p> <p>માતુશ્રી સાકરલેન રવજી મોરારજી લાલન (કોડાય - સુધીમવાલા) શ્રી કચ્છી જૈન ભવન, પાલડી, અમદાવાદ</p> <p>શ્રી નવનીત મેડિકલ સેન્ટર તથા શ્રીમતી પ્રભાવતીભટેન કાંતિલાલ વેલજી સાવલા મેડિકલ ચેક-અપ સેન્ટર, પાલડી, અમદાવાદ.</p> <ul style="list-style-type: none"> ● કુલ લાભ લેનાર વ્યક્તિઓ ૧૪,૧૫૬ ● જેમાંથી - ● શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની વ્યક્તિઓ ૬૭૧ ● સાધુ-સાધ્વીજ મહારાજ સાહેબો ૫૫ ● મોતિયા - આંખનાં ઓપરેશન (સાપ્તાહિક બે દિવસ) ૧૧ ● સોનોગ્રાઝી ૧,૪૩૭ ● ટી.એમ.ટી. (માત્ર ડૉક્ટર દ્વારા ભલામણથી) ૨૬ ● બોડી ચેક-અપ ૪૮૫ ● અન્ય ૧૧,૩૬૧ <p>(બ)</p> <p>માતુશ્રી કંકુલેન કાનજીભાઈ રવજી (નાની ખાખરવાલા) સેવા ભવન, પાલડી, અમદાવાદ કુલ લાભ લેનાર વ્યક્તિઓ ૬૩૪ ૬૩૪</p> | |
| ૨. | <ul style="list-style-type: none"> ● જી.એમ.ડી.સી. પ્રાયોજિત શ્રી કચ્છી વિશ્રામ ગૃહ - શાહીભાગ, અમદાવાદ ● શ્રી કચ્છી વિશ્રામ ગૃહમાં લાભ લેનાર કુલ વ્યક્તિઓ ૧,૮૨૨ ● શ્રી જલારામ અન્નકોત્રમાં લાભ લેનાર કુલ વ્યક્તિઓ ૪૬૧ ● શ્રી ધીરજલાલ ટોકરશી કાપડિયા ડાયાલિસિસ સેન્ટરમાં લાભ લેનાર કુલ વ્યક્તિઓ ૪૫૨ | ૨,૭૩૪ |
| ૩. | માતુશ્રી કંકુલેન કાનજીભાઈ રવજી (નાની ખાખરવાલા) સેવા ભવન, ગીતા મંદિર, અમદાવાદ લાભ લેનાર કુલ વ્યક્તિઓ ૨૬૪ ૨૬૪ | |
| | માસ જુલાઈ-૨૦૧૮ દરમ્યાન વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લેનાર કુલ વ્યક્તિ ... | ૧૭,૮૧૮ |

જીવનમાં કઠળાઈઓ આપણને નુકસાન પહોંચાડવા નથી આવતી પરંતુ આપણી છૂપાયેલ શક્તિ અને જ્ઞાનથને ઉભરાવવા તે આપણી મદદ કરે છે.

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા ભારતની આગામીના ૭૨મા સ્વતંત્રતા દિવસની ઉજવણી



વિજયદન કરાવતા શ્રી શિવજુભાઈ દૂદેયા



તિરંગાને સલામી આપતા સંસ્થાના હોદેદારો તથા સભ્યો



તિરંગાને સલામી આપતું મહિલા વૃંદ



પ્રાસંગિક પ્રવચન આપતા સંસ્થાના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દંડ



દેશના સંરક્ષણ તથા સુપર કોમ્પ્યુટર વિશે માહિતી આપતા શ્રી શિવજુભાઈ દૂદેયા



શ્રી શિવજુભાઈ દૂદેયાનું ભહુમાન કરતા સંસ્થાના હોદેદારો



અનુભૂતિ વિશેષ શ્રી શિવજુભાઈ દૂદેયા સાથે સંસ્થાના કાર્યકરો

વર્ષ વિશેષયી આજા ભારતાં બોણુસ્ટીક સોલ્યુશન આપતી કંપની



આમારી વિશેષતાઓ - સિંગાળ વિન્ડો લોટફોર્મ

- VT/VX ની ક્રાંતિક શાખાઓ
- ISO 9001:2015 પ્રમાણિત કંપની
- Robust Systems & Processes પર કાચેરત
- Trace & Track Facility સાથે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ નેટવર્ક
- બુકિંગ થી ડિલીવરી સુધી સામાનને Complete Insurance Cover
- ૧૦ કિલોથી કુલ ટ્રક લોડ સુધીના પાર્સિલ ર્વીકારીએ છીએ
- ૧૦૦૦૦૦+ સંતુષ્ટ ગ્રાહકો
- Hard Freight Surface Transportation માં ક દાયકાનો અનુભવ
- ડોર્ડ, એર અને રૈલ દ્વારા Door to Door Express Cargo
- વિસ્તૃત થઈ શકતી Supply Chain & Inventory Management



Our other Divisions



Unit 6, Corporate Park, VN Purav Marg, Chembur, Mumbai, Maharashtra - 400071
Toll Free: 1800 220 180 / Website: vtransgroup.com / Email: info@vtransgroup.com
Download: V-Trans APP from Google/IOS

દરેક દર્દીને “ની રીપ્લેસમેન્ટ” ની જરૂર નથી

માઈક્રોપ્લાસ્ટી



આધુનિક અભિગમ

- ઓછી પીડા - ઓછો હોસ્પિટલ સ્ટે - ઓછો રક્તસ્વાવ - ઓછી ફીજીયોથેરાપી - ઓછો ખર્ચ
- વધુ કુદરતી અનુભવ - વધુ સલામત - વધુ સંતોષ - વધુ ફ્લેક્સિબીલીટી - વધુ સ્ટેબીલીટી



ડૉ. હેમાંગ બી. અંબાણી
M.B.M.S

જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન
નિષ્ણાંત, માઈક્રોપ્લાસ્ટી, પ્રાઈમરી એન્ડ રીવીગન
ની રીપ્લેસમેન્ટ સર્જરી
ફેલો એટલાન્ટા એન્ડ ઇન્ડીયાનાપોલીસ યુ.એસ.એ.,
વુગબર્ગ જર્મની, બ્રેશીયા ઈટાલી

ડૉ. અમીર સંઘવી

જોઇન્ટ રીપ્લેસમેન્ટ
ફેલો ઓસ્ટ્રેલીયા, યુ.એસ.એ. યુ.કે.

ડૉ. ચિરાગ પટેલ

જોઇન્ટ રીપ્લેસમેન્ટ
ફેલો ઓસ્ટ્રેલીયા સીડની

ડૉ. અતીત શર્મા

જોઇન્ટ રીપ્લેસમેન્ટ
ફેલો બેલ્જિયમ, સીગપુર, જર્મની. યુ.એસ.એ.



E-mail : h_amani@hotmail.com

Website : www.hemangambani.com | www.shivamhospitalinfo.co | www.shreeorthocare.com
અપોઇન્ટમેન્ટ : ૦૭૯-૨૬૩૦૧૯૮૯, ૨૬૩૦૮૯૭૯, ૦૯૪૨૮૫૬૫૩૦૨, ૯૮૨૪૦૩૩૩૬૦

"Mangal Mandir" - Regd. under Postal Registration No. GAMC-315/2018-2020 Valid upto 31st December, 2020
issued by the SSPO's Ahmedabad City Division, permitted to post at Ahmedabad PSO on 5th of Every Month.
R.N.I. No. of RNP is 33266/1978 • Published on 1st of Every Month

સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા અલિનીત સુપરહીટ નાટકો, ફિલ્મો,
કોમેડી સીન, હાસ્ય-કલાકારોના જોક્સ અને બીજું ઘણું બધું.

ગુજરાતી મનોરંજનનો ખજાનો

"Shemaroo Gujarati App"

FREE ડાઉનલોડ કરવા માટે

આજે જ 9222231242 પર મિસ્ટ કોલ આપો.



Also Available on



www.shemarooint.com

[YouTube /shemaroogujarati](https://www.youtube.com/shemaroogujarati)

[Facebook /shemaroogujarati](https://www.facebook.com/shemaroogujarati)

[Twitter /shemarooguj](https://twitter.com/shemarooguj)

“GUJ” on +91 7710042999

